



Saurashtra University

Re – Accredited Grade 'B' by NAAC
(CGPA 2.93)

Pandya, Dharmendra C., 2011, “ઘેતપુર શહેરના રણકલાકારોના માનસિક સ્વાસ્થ્ય સમાચોજન અને જીવન સંતોષનો મળોવૈશાખિક અભ્યાસ”, thesis PhD,
Saurashtra University

<http://etheses.saurashtrauniversity.edu/id/eprint/382>

Copyright and moral rights for this thesis are retained by the author

A copy can be downloaded for personal non-commercial research or study, without prior permission or charge.

This thesis cannot be reproduced or quoted extensively from without first obtaining permission in writing from the Author.

The content must not be changed in any way or sold commercially in any format or medium without the formal permission of the Author

When referring to this work, full bibliographic details including the author, title, awarding institution and date of the thesis must be given.

Saurashtra University Theses Service
<http://etheses.saurashtrauniversity.edu>
repository@sauuni.ernet.in

© The Author

" A PSYCHOLOGICAL STUDY OF
MENTAL HYGIENE, ADJUSTMENT
AND LIFE SATISFACTION OF
DIMOND WORKERS OF JETPUR CITY"

જેટપુર શહેરના રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય
સમાચોજન અને જીવન સંતોષનો
મનોવૈજ્ઞાનિક અભ્યાસ

THE THESIS
TO BE SUBMITTED TO
SAURASHTRA UNIVERSITY
RAJKOT

For The Degree of

DOCTOR OF PHILOSOPHY
IN
PSYCHOLOGY

Under the Faculty of Arts
BY

Dharmendra C. Pandya
M.A. Psychology
(Lecturer in Psychology)
P.S.H. Mahila College,
Jetpur.

Guided By

Dr. ANANT M. VASANI

Ph.D. Guide in Philosophy

Ph.D. Guide in Psychology

Ex. Lecturer in Psychology

Shree M.V.M. Arts College, **Rajkot**
January-2011

Registration No. 3591

Date 28-2-2007



DECLARATION

I hereby declare that the Research work presented in this thesis is prepared by me after studying various references. The descriptions and narrations found there in are entirely original. Therefore I declare them authentically as original. Moreover, I am responsible for the opinions and the other details found in this thesis.

I declare thesis to be my original work ;

Date :

Place : Jetpur

Dharmendra C. Pandya
M.A. Psychology
(Lecturer in Psychology)
P.S.H. Mahila College,
Jetpur.

A
H
H
H


This is to Certify that work embodied in this thesis

Entitled on "A PSYCHOLOGICAL STUDY OF MENTAL

HYGIENE, ADUJUSTMENT AND LIFE SATISFACTION

OF DIMOND WORKERS OF JETPUR CITY" has been

carried out by DHARMENDRA C. PANDYA under my

direct guidance and supervision. I also declare that the work

done and presented in this thesis is original and

Independent.

Date :

Dr. ANANT M. VASANI

Place : Rajkot

Ph.D. Guide in Philosophy

Ph.D. Guide in Psychology

Ex. Lecturer in Psychology

Shree M.V.M. Arts College

Rajkot

સંશોધનની પ્રક્રિયા ::

સંશોધનની પ્રક્રિયા જટિલ છે. આ પ્રક્રિયા પૂર્ણ કરતા ઘણો સમય લાગે છે. સંશોધન કાર્યને પૂર્ણ કરવા અનેક સોપાનોમાંથી પસાર થવું પડે છે. સંશોધન કાર્ય માત્ર સંશોધનકર્તા વડે પૂર્ણ થતું નથી. પરંતુ તેમાં ઘણી વ્યક્તિઓનો સાથ અને સહકાર ખૂબ જ મળેલ છે. આ તકે એ સર્વનો આભાર માનવાનું કેમ ભૂલાય ?

શ્રી કુળદેવી અંબે માતાજી અને પૂજય જલારામ બાપાનાં આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ કરી શક્યો છું. સર્વ પ્રથમ તો સંશોધન કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરનાર તેમજ સમગ્ર સંશોધન કાર્ય દરમ્યાન માર્ગદર્શન આપનાર અને મારો ઉત્સાહ વધારનાર તેમજ મારું સંશોધન કાર્ય પૂર્ણ કરાવવા ખૂબ જ જહેમત ઉઠાવનાર મારા ગુરુ અને માર્ગદર્શક ડૉ. શ્રી અનંત એમ. વસાણી સાહેબ અને તેમના પરિવારનો હું અણી છું. એ ઉપરાંત સંશોધન કાર્ય માટે સહયોગ આપનાર સૌરાષ્ટ્ર ચુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના હેડ ડૉ. કી.જે.ભંડ સાહેબ અને બોસમીયા કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. શ્રી આર.કે. ચોચા સાહેબ જેઓએ મને જરૂર પડ્યે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગદર્શન પુરુષ પાડ્યું છે. આ તકે તેમનો હું અણી છું.

પરિવારના સહકાર વિના તો આ કાર્ય શક્ય જ કેમ બને ? સંશોધન માટે પ્રેરણા રૂપ મારા પિતાશ્રી ચંદુભાઈ અને માતાશ્રી અરૂપાબેનના આશીર્વાદથી જ આ કાર્ય પૂર્ણ થઈ શક્યું છે. આ ઉપરાંત મારા મોટા ભાઈ પરેશભાઈ, મનિષભાઈ તેમનું ચોગઢાન ખૂબ જ રહ્યું છે. આ ઉપરાંત અન્ય સભ્યો પૂનભ ભાલી, સાધનાબેન, દક્ષાબેન, આરતીબેન, સ્વ. ગિરીશકુમાર, વિમલકુમાર, નિરંજનકુમાર અને સમગ્ર પંડ્યા પરિવારનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

જેતપુર શહેરનાં હીરા ઉધોગ સાથે સંકળાયેલ મનીષભાઈ મહેતા, શૈલેષભાઈ, ધીરુભાઈ અને જેઓનાં સહકારથી આ સંશોધન કાર્ય શક્ય બન્યું છે તેવા રટન કલાકારો કે જેઓએ પ્રચિનાવલી બરી આપવાની તત્પરતા દાખવી છે તેમનો આભાર માનવાનું કેમ ભૂલી શકાય ? એવા દરેક કર્મચારીનો હું આભાર માનું છું.

સાથે મહાશોધ નિબંધ તૈયાર કરવા સૈદ્ધાંતિક ભૂમિકા સંશોધનનાં તારણો લેવામાં તેમજ અન્ય પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે. તે સર્વે લેખકો, સંશોધકો અને માહિતી મેળવવામાં મદદરૂપ થનાર બોસમીયા કોલેજના લાઈબ્રેરીયન શ્રી પાઠક સાહેબ અને ડૉ. કિશોર એન. મહેતા, પ્રો. કુંભાણી સાહેબ, પ્રોફેસર ખુમાણા, ઉપેન્ડ્રભાઈ વ્યાસ, મનીષ વ્યાસ, ચશ ટાંક, નિલેશ ટગાર, કમલેશ જોખી તેમજ સાથી અદ્યાપક મિત્રોનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.

અને અંતમાં સંશોધનમાં સુંદર અને સુધ્યા તેમજ ઝડપી અને વ્યવર્ણિત ટાઇપીંગ કરનાર (ઓમ કોમ્પ્યુટર) નાં યોગેશભાઈ ઠાકર અને તેમનાં પરિવારનો આભાર માનું છું. આ ઉપરાંત મારા સમગ્ર સંશોધન કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મદદ કરનાર નામી-અનામી બધાનો હું આભારી છું.

– ડી. સી. પંડ્યા

:: સમયોજિત અનુક્રમણિકા ::

પ્રકરણ-1 (વિષય પ્રવેશ)

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
1.1	પ્રસ્તાવના	02
1.2	પ્રસ્તુત સંશોધનની સમસ્યા	03
1.3	ભારતમાં હીરા ઉદ્યોગની શરૂઆત	04
1.4	પ્રસ્તુત સંશોધનની ઐતિહાસિક ભૂમિકા	07
1.5	પ્રસ્તુત સંશોધનના અવલંબી પરિવત્યોની સમજૂતી.	08
	1.5.1 માનસિક સ્વાસ્થ્યની સમજૂતી	08
	1.5.2 સમાચોરણની સમજૂતી	23
	1.5.3 જીવન સંતોષની સમજૂતી	27
1.6	પ્રસ્તુત સંશોધનના અગત્યના પદોની વ્યાખ્યા	34
1.7	પ્રસ્તુત સંશોધનની અગત્યતા	36
1.8	પ્રસ્તુત સંશોધનની મર્યાદાઓ	38
1.9	પ્રસ્તુત સંશોધનનાં પ્રકરણોનું આચોરણ	39
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-1	42

પ્રકરણ-2 (સંશોધન સાહિત્યની સમીક્ષા)

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
2.1	પ્રસ્તાવના	44
2.2	પૂર્વે થયેલ સંશોધન સાહિત્યની તપાસનું મહારવ.	45
2.3	પૂર્વે થયેલ સંશોધનને પડકાર.	46
2.4	પૂર્વે થયેલ સંશોધન કાર્ય કરતી પ્રક્રિયાની વધુ સ્પષ્ટતા.	47
2.5	પૂર્વે થયેલા સંશોધનનું પુનરાવર્તન કરી તેનું સમર્થન મેળવવું.	47
2.6	માનસિક સ્વાસ્થ્યનું સૈદ્ધાંતિક મહારવ.	50
2.7	માનસિક સ્વાસ્થ્ય અંગેના પૂર્વીય અભ્યાસો.	52
2.8	સમાચોજનનું સૈદ્ધાંતિક મહારવ.	61
2.9	સમાચોજન અંગેના પૂર્વીય અભ્યાસો.	63
2.10	જીવન સંતોષનું સૈદ્ધાંતિક મહારવ.	70
2.11	જીવન સંતોષ અંગેના પૂર્વીય અભ્યાસો.	71
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-2	80

પ્રકરણ-3

(સંશોધન યોજના, પ્રક્રિયા અને પૃથ્વીકરણાની પદ્ધતિ)

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
3.1	પ્રસ્તાવના	82
3.2	પ્રસ્તુત સંશોધનની સમસ્યા	84
3.3	મનોવૈજ્ઞાનિક સંશોધનના પ્રકારો	87
3.4	પ્રસ્તુત સંશોધનના હેતુઓ	90
3.5	પ્રસ્તુત સંશોધનની ઉત્કૃષ્ટાત્મકતા	91
3.6	પ્રસ્તુત સંશોધનના પરિવત્યો	100
3.7	સંશોધન યોજના	103
3.8	પ્રસ્તુત સંશોધનની યોજના	107
3.9	પ્રસ્તુત સંશોધનની સમાજિક પરિવર્તન	108
3.10	પ્રસ્તુત સંશોધનનો નિર્દર્શા	112
3.11	પ્રસ્તુત સંશોધનના સાધનો	121
3.12	આંકડાશાસ્ત્રીય પ્રચુક્તિઓ	127
3.13	માહિતી એકત્રીકરણાની પ્રક્રિયા	133
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-3	135

પ્રકરણ-4

(સંશોધનનું પૃથ્વેકરણ, અર્થઘટન અને પરિણામની ચર્ચા)

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
4.1	પ્રસ્તાવના	141
4.2	સંશોધનની સામાન્ય માહિતી ટકાવારીમાં	143
4.3	F કસોટી એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ	164
	4.3.1 રટનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	165
	4.3.2 રટનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	166
	4.3.3 રટનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	167
	4.3.4 રટનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	168
	4.3.5 રટનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	169
	4.3.6 રટનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	170
	4.3.7 રટનકલાકારોની માસિક આવકના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	171
	4.3.8 રટનકલાકારોની માસિક આવકના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	172

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
	4.3.9 રટનકલાકારોની માનસિક આવકના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	173
	4.3.10 રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	174
	4.3.11 રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં રટનકલાકારોના સમાચોજનની શૂન્ય ઉત્કલ્પના ની ચકાસણી.	175
	4.3.12 રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં જીવન સંતોષની ચકાસણી.	176
	4.3.13 રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની ચકાસણી.	177
	4.3.14 રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં સમાચોજનની ચકાસણી.	178
	4.3.15 રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં જીવન સંતોષની ચકાસણી.	179
	4.3.16 રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની ચકાસણી.	180
	4.3.17 રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં સમાચોજનની ચકાસણી.	181
	4.3.18 રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં જીવન સંતોષની ચકાસણી.	182
4.4	સહસંબંધનું અર્થઘટન	183
	4.4.1 માનસિક સ્વાસ્થ્ય અને સમાચોજન વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	183
	4.4.2 માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષ વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	184

ક્રમ	વિગત	પૃ.ન.
4.4.3	સમાયોજન અને જીવન સંતોષ વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	185
4.5	t કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	186
4.5.1	લગ્ન દરજાના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	186
4.5.2	લગ્ન દરજાના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	187
4.5.3	લગ્ન દરજાના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	189
4.5.4	5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	190
4.5.5	5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	191
4.5.6	5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	192
4.5.7	પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	193
4.5.8	પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્નકલાકારોના સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	194
4.5.9	પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	195
4.5.10	માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	196
4.5.11	માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	197
4.5.12	માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	198

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
4.5	4.5.13 માતાના વ્યવસાયના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.14 માતાના વ્યવસાયના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.15 માતાના વ્યવસાયના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.16 રહેઠાણના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.17 રહેઠાણના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.18 રહેઠાણના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી. 4.5.19 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય. 4.5.20 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં સમાચોજન. 4.5.21 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં જીવન સંતોષ. 4.5.22 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય. 4.5.22 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં સમાચોજન. 4.5.23 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં જીવન સંતોષ.	199 200 201 202 203 204 205 206 207 208 209 210

પ્રકરણ-5 (સંશોધન સારાંશ, તારણો અને સૂચનો)

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
5.0	પ્રસ્તાવના	212
5.1	સંશોધનનો સારાંશ	212
5.2	પ્રસ્તુત સંશોધનના તારણો	215
	5.2.1 પિચરણ પૃથ્થકરણ (એકમાર્ગીય) ને આધારે મેળવેલા તારણો	216
	5.2.2 સહસંબંધ આધારે મેળવેલા તારણો	218
	5.2.3 't' કસોટીના આધારે મેળવેલા તારણો.	218
5.3	નબળા માનસિક સ્વાસ્થ્યના કારણો	222
5.4	માનસિક સ્વાસ્થ્ય સુધારવાના સૂચનો	222
5.5	નબળા સમાચોજનના કારણો	223
5.6	સમાચોજન સુધારવાના સૂચનો	223
5.7	નબળા જીવન સંતોષના કારણો	224
5.8	જીવન સંતોષ વધારવાના સૂચનો	225
5.9	સંશોધનના આધારે ભલામણ સૂચનો	226
5.10	આગામના સંશોધન માટેના સૂચનો	227

પ્રકરણ-1 (વિષય પ્રવેશ)

:: અનુકૂળાંકા ::

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
1.1	પ્રસ્તાવના	02
1.2	પ્રસ્તુત સંશોધનની સમસ્યા	03
1.3	ભારતમાં હીરા ઉધોગની શરૂઆત	04
1.4	પ્રસ્તુત સંશોધનની ઐતિહાસિક ભૂમિકા	07
1.5	પ્રસ્તુત સંશોધનના અવલંબી પરિવત્યોની સમજૂતી. 1.5.1 માનસિક રવારદ્દ્યની સમજૂતી 1.5.2 સમાચોરણની સમજૂતી 1.5.3 જીવન સંતોષની સમજૂતી	08 23 27
1.6	પ્રસ્તુત સંશોધનના અગત્યના પદોની વ્યાખ્યા	34
1.7	પ્રસ્તુત સંશોધનની અગત્યતા	36
1.8	પ્રસ્તુત સંશોધનની ભર્યાદિઓ	38
1.9	પ્રસ્તુત સંશોધનનાં પ્રકરણોનું આચોરણ	39
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-1	42

:: ਪ੍ਰਕਾਸ਼ਣ-੧ ::

विषय प्रवेश

1.1 प्रस्तावना :-

પ્રો. કલીફોર્ડ મુડી કહે છે કે “સંશોધન એ સ્વતઃ સત્યશોધનની એક પદ્ધતિ છે.”¹ આથી જ આજનો યુગ સંશોધનનો યુગ છે. હરપળે નવા નવા સંશોધનો થતા રહે છે. કેટલાક સંશોધકો આ યુગને માહિતી વિસ્ફોટનો યુગ કહે છે. સંશોધનની પ્રક્રિયા જ વૈજ્ઞાનિક છે. સંશોધનની વ્યાખ્યા આપતા કહી શકાય કે "To research is to search again. સંશોધન શબ્દનો અર્થ થાય છે, ફરીથી શોધવું. બીજા શબ્દોમાં સંશોધન એટલે વધુ મળવા માટે ફરીથી વધુ ચોકસાઈપૂર્વક જોવું."² માનવીના વિકાસની સાથે સાથે પોતાની જરૂરિયાતોના સાધનોનો વિકાસ પણ થતો રહ્યો છે. આધુનિક ચંત્રયુગમાં માનવી અનેક વસ્તુઓ ઉત્પન્ન કરતો રહ્યો છે. પરંતુ વર્તમાન કોમ્પ્યુટર યુગમાં તો આ ચીજ વસ્તુઓની ઉત્પત્તિ પણ અનેક ગણી વધતી રહી છે. સ્વયંસંચાલિત ચંત્રો દ્વારા અનેક ચીજ વસ્તુઓની ઉત્પત્તિ અને તેની લાખોની સંખ્યામાં વૃદ્ધિ એ આધુનિક યુગમાં માનવવૃદ્ધિનું મહત્વનું પ્રદાન છે.

માનવીને પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, અરમાનો સંતોષવા સતત શોધ કરવાની પ્રવૃત્તિ થાલુ રહી છે. આવી જરૂરિયાતોમાં પહેલા માનવીની શારીરિક જરૂરિયાતો સંતોષવા માટે જુદા-જુદા દેશ પ્રદેશમાં ઊગતા અનાજનો ઉપયોગ પણ વિવિધતામાં ફેરવાતા જાય છે. અનાજ, કઠોળ તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની ઉત્પત્તિ તેની જુદી-જુદી બનાવટોના ઔદ્ઘોરિક વિકાસને કારણે માનવી ખાદ્ય પદાર્થોના મોજ-શોખની સામગ્રી અસંખ્ય વિવિધતામાં કરતો રહ્યો છે. દા.ત. દૂધ જ માત્ર ખોરાક નથી પરંતુ દૂધની અનેક બનાવટો દહી, ધી, માખણા, આઈરકીમ જેવી ચીજ વસ્તુઓનો આનંદ લૂંટે છે. સલામતી અને સ્વરક્ષણ માટે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં શારીરિક રક્ષણ અને સલામતી માટેના સાધનો માનવી આજે વિકસાવી શકયો છે. હવા માટે પંખા, હંડક માટે ડેકીજરેટર-એરકન્ડીશનર અને હંડી સામે રક્ષણ મેળવવા માટે હીટરનો

ઉપયોગ કરે છે. ઝડપી વાહન વ્યવહાર માટે સાઈકલ, સ્કૂટર, કાર થી માંડીને એરોપ્લેન, હેલીકોપ્ટર જેવા સાધનો વિકસાવી આનંદ માણસને શરીર શાણગારવામાં પણ એટલો જ રસ પડતો હોવાથી સોના, ચાંદી, મોતીના ઘરેણાની સાથે હીરાનો ઉપયોગ પણ આજની સદીની મહત્વમાં જરૂરિયાત બની છે.

આ બધી બનાવટોમાં કુટીર ઉધોગ, લઘુ ઉધોગ, ગૃહ ઉધોગ અને વિરાટકાય ઉધોગોનો વ્યાપક ફેલાવો આજે જોવા મળે છે. હીરા ઉધોગ પણ આવો જ એક ઉધોગ છે. જે નાના-નાના શહેરો અને મોટા શહેરોમાં વિકસતો જ રહ્યો છે. હીરા ઉધોગમાં સ્ત્રી-પુરુષોના દાગીનાઓ માત્ર ભારતના પ્રદેશોમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ થતી રહે છે.

સંશોધક મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થી અને અદ્યાપક હોવાથી ઔદ્યોગિક મનોવિજ્ઞાનના પોતાના પ્રથમ પસંદગીના પેપરમાં આ વિષે Ph. D. કાર્ય કરવા તત્પર બન્યા છે. પોતાની માતૃભૂમિમાં જ કંઈક સંશોધન કરવું જોઈએ તેમજ હીરા ઉધોગનો વિકાસ જેતપુર શહેરમાં થતો રહ્યો છે. આથી તેમાં જોડાયેલા કારીગરો વિષે સંશોધન કરવા કટીબદ્ધ બન્યા છે. જુદા-જુદા મનોવિજ્ઞાનના નિષ્ઠાંતો અને માર્ગદર્શકો સાથે ચર્ચા-વિચારણા કરીને પોતાના માર્ગદર્શક સાથે અનેક બેઠકો કરીને પ્રસ્તુત સંશોધન હાથ ઘરેલ છે. હીરા ઉધોગના કારીગરોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષનું સંશોધન કરવા સમસ્યાને શર્જદ બદ્ધ કરી છે.

1.2 પ્રસ્તુત સંશોધનની સમસ્યા ::-

પહેલા આપણો તો સંશોધન સમસ્યાની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું, જે આ પ્રમાણે છે –

“સંશોધનની સમસ્યાની વ્યાખ્યા”

કર્લિંગર અને લી (2000) જણાવે છે કે “સમસ્યા એવું પ્રશ્નવાચક વાક્ય છે, કથન છે જેમાં બે કે બેથી વધુ પરિવત્યો વચ્ચેનો સંબંધ શોધી કાઢવાનો છે.”³ – અરયિંદ શાહ

પ્રસ્તુત સંશોધનની સમસ્યા આ પ્રમાણે છે –

“જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

"A Psychological study of mental hygiene, adjustment and life satisfaction of dimond workers of Jetpur city."

પ્રસ્તુત સમસ્યા હીરાઉધોગ અંગેની છે. આથી સર્વપ્રથમ ભારતમાં હીરા ઉધોગ વિષે માહિતી નીચે પ્રમાણે રજૂ કરવાનો નભ પ્રયાસ કરેલ છે.

1.3 ભારતમાં હીરા ઉધોગની શરૂઆત ::-

ભારતમાં જચારે મોગલોનું સામ્રાજ્ય હતું ત્યારે વિજાપુર-ગોલકોંડાને જીતી લીધા પછી એ વિસ્તારો મોગલોના હાથમાં આવ્યા. જે જમીનમાં હીરા પાકતા ત્યાં એક કલાક માટે હીરા ખોદવા માટે ભાડેથી જમીન આપવામાં આવતી. એ હીરા ખોદવા માટે બાદશાહે કાઠીયાવાડી મજૂરોને બોલાવ્યા. એટલા માટે કે આંધના મજૂરો પર બાદશાહના માણસોને વિશ્વાસ ન હતો. કાઠીયાવાડના ખેત મજૂરો એટલે કે મોટા ભાગના પટેલો હીરા ખોદવા માટે આંધમાં આવ્યા. આંધના મજૂરો તો ખાણ ખોટે અને મોટો હીરો જડે તો ગુદામાં ભરાવીને ચોરી લેતા કે દાંતના પોલાણમાં ભરાવી દેતા. આવો ઘંધો આપણા પટેલ મજૂરો કરતા નહિ. ૧૭ મી સદીમાં ગોલકોંડાથી ઘણા હીરા સૂરતમાં વેચાવા આવતા. એ પછી જચારે ઓસ્ટ્રેલિયાની ખાણમાંથી ઝીણા હીરા નીકળ્યા ત્યારે એ હીરા પર અંખ ફોડીને પોલીશ કરવાનું કામ માત્ર કાઠીયાવાડી પટેલ જ કરી શકતા. એ પછી વરાણ રોડમાં લેંઘો અને ગંજુ પહેરીને હીરા ઘસતા ગયા. આજની ઘડી અને કાલનો દિવસ આજે પટેલોની આ ઈમાનદારી કાઠીયાવાડને ફળી છે.

આજે એકલા સૂરતમાં દર વર્ષો સિતેર હજાર કરોડથી વધુ રકમના હીરાનું કામ થાય છે. પાંત્રીસ લાખથી વધુ વસ્તી ધરાવતા સુરતના સાત લાખથી વધુ કારીગર રટનકલાકાર તરીકે કામ કરે છે. પંદર લાખથી વધુ લોકો ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર નખે છે. દુનિયામાં થતા હીરાના કામકાજમાંથી નેવું ટકા કામ ભારતમાં થાય છે. એ નેવું ટકામાંથી (80) એંસી ટકા જેટલું કામ સુરતમાં થાય છે. સૂરતમાં કાચા હીરા – રફ હીરા આવે અને તેનું પોલીસીંગ અહીં થાય. આ રફ હીરા મોટા ભાગે વિદેશથી આવે છે.

આજે હીરા ઉધોગ સુરત એકલામાં જ નથી, પણ ગુજરાતના અનેક શહેરોમાં વિસ્તાર પામ્બો છે. ગુજરાતમાં આ બધી જગ્યાએ સૂરતથી હીરા વધુ પ્રમાણમાં આવે છે. અનેક શહેરોમાં નાના-નાના હીરાના કારખાનાઓ આવેલા છે જે કારીગરોને રોજુરોટી પૂરી પાડે છે.

આમ ગુજરાતના અનેક શહેરમાંનું એક શહેર જેતપુર જે સાડી ઉધોગ માટે ખૂબ જાણીતું છે, તેમાં આજે હીરા ઉધોગનો પણ વિકાસ થયો છે. આજે જેતપુરમાં સુરતમાંથી રફ હીરા આંગડીયા પેઢી મારફત રોજ હીરા આવે છે અને તેનું પોલીસીંગનું કાર્ય કરી પાછા સુરત મોકલી આપવામાં આવે છે. અહીં ૩૦ થી પણ વધુ હીરાના કારખાનાઓ આવેલા છે. જેમાં ૩૦ હજારથી પણ વધુ કારીગરો કાર્ય કરે છે. જેતપુર શહેરમાં આજુબાજુના ગામડાના કારીગરો રોજ અપ-ડાઉન કરી હીરા ઘસવાનું કાર્ય કરે છે. આ લોકો પોતાના ઘરે રહી કાર્ય કરે છે. જેથી સુરત કે બીજા શહેરોમાં તેને હીરા ઘસવા જવું પડે નહીં. આથી જેતપુર શહેર એ અનેક વ્યક્તિઓને હીરા ઉધોગ મારફત રોજગાર પૂરો પાડે છે.

આજે વિશ્વનો જેમ એન્ડ જ્યેલરી ઉધોગ આજે એક મોટા પરિવર્તનકાળના ઉંબરા પર આવીને ઉભો છે. છેલ્લા પાંચ વર્ષો દરમિયાન આ ઉધોગો અવનવા પરિવર્તનો અનુભવ્યા છે. આવનારા દશ વર્ષો આના કરતા પણ વધુ સધન અને દૂરગામી પરિવર્તનના બની રહેશે.

પરિવર્તનના આ ગાળા માટે અનેક પરિબળો જવાબદાર છે. સપ્લાયના સોર્ચિસનું વિભાજન, રો-મટિટિયલની સતત વધતી જતી કિંમતો, પોલીસીંગ ઉધોગમાં સ્પર્ધાત્મક વલણ અને ક્ષમતા બહારની સ્થિતિ, જવેલરી મેન્યુફેક્ચરરીંગ માં ઘટી રહેલું નફાનું પ્રમાણા, મુખ્ય માર્કેટોમાં વપરાશકારોની ઘટતી રહેલી ખરીદ શક્તિ, અવનવી જવેલરી બજારોની વધી રહેલી સંખ્યા, જેવા અનેક કારણોના લીધે વિશ્વનો જેમ એન્ડ જવેલરી ઉધોગનો તખ્તો બદલાઈ રહ્યો છે.

વર્ષ 2006 ના અંતમાં “ફોરેવર માર્ક” ભારતમાં અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ માર્કવાળા દરેક હીરા ઉધોગ ઉપર 1 નંબર પણ કોતરવામાં આવશે. જે માત્ર તે એક જ હીરા ઉપર હશે અને દુનિયાના બીજા કોઈ પણ હીરા ઉપર નહિ હોય. માત્ર તે જ હીરા જે 0.30 કેરેટ કે તેથી વધારે વજનના હોય તેના ઉપર જ “ફોરેવર માર્ક” લેઝર વડે કોતરવામાં આવશે.

આ માર્કની ઉંડાઈ માણસના માથાના વાળની જાડાઈના 1/500 જેટલી જ છે. હીરાની સાથે તેની પ્રમાણાભૂતતાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ “ફોરેવર માર્ક” ની માહિતીને આધારે કહી શકીએ કે આજે સમગ્ર ગુજરાતમાં હીરા ઉધોગ ખૂબ જ વિકાસ પામ્યો છે.

આમ અત્યારે હાલના સમયમાં જે મંદીનું વાતાવરण ફેલાયેલું છે તે માત્ર ભારતમાં જ નહી વિશ્વની હીરા બજારમાં અત્યારે મંદીનું વાતાવરણ છે. પરિણામે ભારતમાં અઢીથી ત્રણ ટકા જેટલો વેપાર ઘટી ગયો છે.

ભારતની હીરા બજારમાં મંદી હોય એવી આ પ્રથમ ઘટના નથી. 1965-66, 1978, 1995 અને 2000, 2007 માં પણ મંદી આવેલી. કહેવાય છે કે, 1978 ની મંદી એકદમ ભયાનક હતી. એ વખતે હીરા વેચવાનું અધડ બની ગયેલું. માલના ખરીદદાર જ મળતા નહીં, અનેક ઘંટીઓ બંધ પડી ગયેલી. કારખાના

વાળાઓ તો એમની ઘંટી વેચવા રહ્તા પર બેસી ગયાના દાખલા એ વખતે બનેલા. 1995 અને 2000 ની મંદીમાં ઘણી સારી અને સ્થાપિત પાર્ટીએ હાથ ઉંચા કરી દેવા પડ્યા હતા.

મંદીના માહોલમાં તાજેતરમાં અમેરિકાની સૌથી મોટી અને આશરે 110 વર્ષ જૂની એક પેઢી અભે. ફેબ્રિકન નામની સાઇટ હોલ્ડર કંપનીએ નાદારી નોંધાવી છે. આ કંપની સાથે આશરે 25-30 ભારતીય પેઢી સંકળાયેલી હતી અને એ પેઢીઓ પણ આર્થિક ભીસમાં આવી ગઈ હતી.

આજની આ મંદીને કારણે લાખો કારીગરો બેકાર બન્યા છે અને રોજ ન્યુઝ પેપરમાં વાંચવામાં આવે છે કે, કચાંક ને કચાંક હીરાના કારીગરની આત્મહત્યા કરે છે. આમ આ કારીગરોનું પહેલાથી જ આર્થિક રીતે શોષણ કરવામાં આવતું અને આજે આ મંદીએ તે લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું છે. આમ છતાં સંશોધકે હીરા ઉદ્યોગની ઐતિહાસિક ભૂમિકા નીચે મુજબ રજૂ કરીને સમજવા પ્રયત્નો કરેલ છે.

1.4 प्रस्तुत संशोधननी ऐतिहासिक भूमिका :-

પ્રસ્તુત અભ્યાસ સંશોધકે પોતાના વતનમાં વિકાસ પામેલ હીરા ઉદ્ઘોગની ઔદ્ઘોગિક સંસ્થાઓ વિષે મનોવૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરેલ છે. રટ્નકલાકારો વિષે અન્ય પ્રકારના અભ્યાસો થયા હોય તે સ્વાભાવિક છે, પરંતુ રટ્નકલાકારોના વર્તન પર અસર કરતા પરિબળો વિષે અગાઉ અભ્યાસ થયેલ નથી.

આવા મનોવિજ્ઞાનના અભ્યાસના નીચેના પરિબળો અહીં દ્યાનમાં લઈને
સમસ્યાની રચના કરી છે.

- (1) રનકલાકારોનું માનસિક રવારથ્ય
 - (2) રનકલાકારોનું સમાયોજન
 - (3) રનકલાકારોનો જીવન સંતોષ

આમ જેતપુર શહેરના હીરા ઉધોગમાં કામ કરતા કર્મચારીઓના વર્તનમાં ઉપરોક્ત મનોવૈજ્ઞાનિક પરિબળો કઈ રીતે જોવા મળે છે તેનો અભ્યાસ કરવાનો છે. આથી સર્વપ્રથમ ‘માનસિક સ્વાસ્થ્ય’ , ‘સમાયોજન’ અને ‘જીવન સંતોષ’ ની સમજૂતિ નીચે પ્રમાણે આપી શકાય. તે અભ્યાસનો મુખ્ય હેતુ સંશોધકનો છે. આથી પહેલા તો આ પરિબળો વિષે માહિતી જાણવી જરૂરી હોય તે અહીં દર્શાવી છે.

1.5 प्रस्तुत संशोधनना अवलंबी परिवर्त्योनी समझूती :-

પ્રસ્તુત સંશોધનમાં ઉપયોગમાં લીધેલા ત્રણોચ અવલંબી પરિવત્ત્યોને
નીચે પ્રમાણે સમજાવી શકાય :

1.5.1 માનસિક સ્વાસ્થ્યની સમજૂતી :-

ઇક્ષ્વરે માનવને શરીર અને મન આપ્યા છે. શરીરને સારુ રાખવા માટે માનવ સારો ખોરાક લે છે, તે સારુ પાણી પીએ છે અને કસરત કરે છે. તે જ રીતે માનવીએ મનને સારુ રાખવા માટે માનસિક કસરત કરવી જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારની ખામી આવે કે તરત જ માનવી ડોકટર પાસે જાય છે. પરંતુ મનમાં કોઈ ખામી દેખાય તો વ્યક્તિ તેની સંપૂર્ણ નોંધ લેતી નથી. તેથી માનસિક અસ્વસ્થતા અનુભવે છે. તેથી માનવીએ શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ.

જીવનમાં અનેક વિદ્યા પ્રશ્નો વ્યક્તિતને મુંજવે છે. આર્થિક સમસ્યા, સામાજિક સમસ્યા કે ધંધાકીય સમસ્યા વ્યક્તિતના મનને અર્સપરથ બનાવે છે. આ કારણે વ્યક્તિત માનસિક સ્વાસ્થ્ય ગુમાવે છે. ઘણી વ્યક્તિઓ આ માનસિક સ્વાસ્થ્ય શું છે ? તે જાણતી નથી. તેનો વૈજ્ઞાનિક અભ્યાસ થતો નથી. તેથી માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાચ ? માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું વગેરે પ્રશ્નોનો વ્યવસ્થિત અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે.

જે.સી. કોલમેન લખે છે કે 18 મી સદી અંધકાર ચુગ હતો, 19 મી સદી કાંતિનો ચુગ હતો, 20 મી સદી ચિંતાનો ચુગ હતો અને 21 મી સદી એ વિકૃતિનો ચુગ છે, જે યથાર્થ છે. ભૌતિક સુખ, સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિની સાથે માનવીના સુખ અને આનંદનો ક્ષય કરનારા ભયો અને ચિંતાઓ બિહામણા બનવા લાગ્યા છે. આજે આપણી ચારે બાજુ અજંપો, અશાંતિ, ઉતાવળ, વિષાદ અને અસંતોષના મોજાઓ ઘુઘવી રહ્યા છે. જગતના વિવિધ દેશોમાં માનસિક વિકૃતિઓના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે.

માનવ જાતની આસપાસ નિરાશાના વાદળો છવાચેલા છે. તેને દૂર કરવા માટે માનસિક સ્વાસ્થ્ય સહાયભૂત થાય એમ છે.

પાશ્ચાત્ય દેશોમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક પ્રયત્નો થતા રહ્યા છે અને તેના માટે રાષ્ટ્રીય સંસ્થાઓ પણ સ્થપાઈ છે. પણ આપણા દેશમાં માનસિક રોગોની સમજ, ઉપચાર તથા પ્રતિકારની દિશામાં વ્યવસ્થિત રૂપે ખૂબ જ થોડું સંશોધન થયું છે.

ડિપ્લોમા ઈન સાયકોલોજી (D.P.M.) અને ડિપ્લોમા ઈન મેડિકલ એન્ડ સોશિયલ સાયકોલોજી (D.M. & S.P.) માં માનસિક સ્વાસ્થ્યને લગતા અભ્યાસ કરું ચોજવામાં આવ્યો છે. આ બાબતમાં વ્યવસ્થિત અભ્યાસ અને સંશોધન માટે ઈ.સ. 1909 માં અમેરિકામાં “નેશનલ કમિટી ફોર મેન્ટલ હાઇજુન” નામની સંસ્થાની શરૂઆત થઈ. ઈ.સ. 1937 માં મુંબઈમાં “તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પેશિયલ સાયકોલોજી” નામની સંસ્થાની શરૂઆત થઈ. ઈ.સ. 1964 માં બેંગલોરમાં “ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ” નામની સંસ્થા શરૂ થઈ.

અમેરિકામાં માનસિક સ્વાસ્થ્યનું સૌથી પ્રથમ ચળવળ કિલફોર્ડ બિર્ચર્સ (1873-1943) નામની વ્યક્તિએ શરૂ કરેલ. બિર્ચર્સ ગ્રેજ્યુએટ થયા પછી ઉન્મત,

ભિત્રતા – મનોવિકૃત, બિમારી લાગુ પડી તેણે માનસિક અગણાત્મયમાં દાખલ થવું પડેલું. તેને ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓનું વર્તન એવું બેહુદું જોયું ને વેઠયું. સાજો થયા પછી હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી તેને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા અને તેના પરિણામ સ્વરૂપ 1908 માં “અ માઈન્ડ ફેટ ફાઉન્ડ ઈટ સેલ્ફ” નામના પુસ્તકમાં હોસ્પિટલનાં અધિકારી ઓ અને કર્મચારીઓનું બેહુદું અમાનુષી વર્તનનું વર્ણન કરેલું. રોક ફાઉન્ડેશને આર્થિક સહાયથી માનસિક સ્વાસ્થ્યની રાષ્ટ્રીય સમિતિ સ્થપાઈ. તેણે માનસિક રોગીઓને આપવામાં આવતી સંગવડોનો અભ્યાસ કર્યો. બિયર્સે પોતાની વિચાર ધારાને બળ આપવા “મેન્ટલ હાઇજન” નામની એક ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન કર્યું.

આજના આ ચુગમાં માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિત્વ કોને કહેવી તે જાણયા વિના અસ્વસ્થ વ્યક્તિત્વનો જ્યાલ મેળવવો મુશ્કેલ છે. કોઈપણ પ્રકારની પીડા, દુઃખ કે બીમારી વિના જે વ્યક્તિત્વ પોતાનું કાર્ય હાથ, પગ કે શરીરના અંગો વડે કાર્યો કરે છે તો તેને આપણે શારીરિક રીતે સ્વસ્થ માનીએ છીએ.

શારીરિક સ્વસ્થતા જેટલી ઝકપથી ઓળખી શકાય છે તેટલી ઝકપથી માનસિક સ્વસ્થતા ઓળખી શકાતી નથી. વ્યક્તિત્વ બાહ્ય દેખાવમાં સ્વસ્થ હોય છે. જ્યારે આંતરિક રીતે અસ્વસ્થ હોય છે. આજના આ સમયમાં સંપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય ઘરાવનારી વ્યક્તિત્વ ભાગ્યે જ જોવા મળે. પણ એનો અર્થ એમ નથી કે જગતની કોઈ વ્યક્તિત્વ માનસિક સ્વસ્થતા ઘરાવતી નથી.

માનસિક સ્વાસ્થ્યનો પ્રેરણ એ આજના ચુગમાં એક વિશાળ અને ખૂબ જ મુશ્કેલીભર્યો પ્રેરણ છે. જો વ્યક્તિત્વ માનસિક રીતે સ્વસ્થ રહેવા ઈચ્છાતો હશે તો તેને અલગ-અલગ સ્વસ્થ રહેવાની કળા કેળવવી પડશે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિત્વ પોતાની જાતની ઓળખ કરી શકે છે. સમજુ શકે છે. કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા પહેલા તે સાચા-ખોટાનો અર્થ જાણી શકે છે અને તેના પરિણામો કેવા આવશે તે સમજુ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંધ (WHO) જણાવે છે કે, પ્રત્યેક વ્યક્તિત્વ સુખમય અને શાંતિમય જીવન વ્યતિત કરવાની ઈરછા ધરાવે છે. આ લક્ષ્યપૂર્તિ માટે જે વિજ્ઞાન વ્યક્તિત્વનો વિકાસ કરે છે તેને માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાન કહેવાય છે. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાન વર્ચે તફાવત છે. માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિની એક અવસ્થા છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાન તે એ અવસ્થા અંગેનું વિજ્ઞાન છે.

ઃ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા ઃ

(1) “માનસિક આરોગ્યશાસ્ત્ર એટલે એવું વૈજ્ઞાનિક ક્ષેત્ર કે જે મુખ્યત્વે સ્વસ્થ વ્યક્તિવિકાસ અને મનોવિકૃતિને અટકાવવાનું કાર્ય કરે છે.”⁴

જે. સી. કોલેમન

(2) “માનસિક સ્વાસ્થ્યમાં માનસિક બિમારી અટકાવવાના અને વહેલાસર ની સારવારના પગલાનો સમાવેશ થાય છે અને તે દ્વારા માનસિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે.”⁵

વોલ્ટર જે. કોવિલ

ઃ માનસિક સ્વાસ્થ્યનો જ્યાલ ઃ

સર્વ પ્રથમ માનસિક સ્વાસ્થ્યનો જ્યાલ સ્પષ્ટ રીતે સમજવા માટે માનસિક રોગનો જ્યાલ મેળવવો જરૂરી છે. સામાન્ય રીતે જો કોઈ માણાસ પોતાના આજુ-બાજુના વાતાવરણમાં કુસમાયોજન વર્તન કરવાનું શીખી જાય તો આપણે તેને અસાધારણા, વિકૃત કે માનસિક રોગી કહીએ છીએ. માનસિક રોગ એ માત્ર શીખીને પ્રાપ્ત કરેલા કુસમાયોજન વર્તનનો નિર્દેશ કરવા માટે વપરાયેલો વર્ણનાત્મક શબ્દ છે. એવું વર્તન શા માટે કરે છે તેનું સ્પષ્ટીકરણ એ શબ્દ દ્વારા થતું નથી. આ રીતે માનસિક સ્વાસ્થ્ય એ પણ પોતાના સંજોગો સાથે સુસમા-યોજિત વર્તવાની પડેલી ટેવનું વર્ણન માત્ર છે. માનસિક સ્વાસ્થ્ય શબ્દ પણ તે વ્યક્તિત્વ માટે સમાયોજક રીતે વર્તે છે. તેનું સ્પષ્ટીકરણ આપતો શબ્દ નથી.

ભાનસિક સ્વાસ્થ્યની ચળવળ ::

માનસિક સ્વાસ્થ્યનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન જમાનામાં માનસિક રોગોને ટૈંપી પ્રકોપ, ભૂતપ્રેત અથવા દુષ્ટાત્માઓ દ્વારા ઉત્પત્ત થતો માનવામાં આવતો હતો. આજના સમયમાં પણ આપણા સમાજની ઘણી વ્યક્તિત્વો જે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે તેઓ માનસિક રોગોના ઉપચારો ધાર્મિક વિધિઓ દ્વારા જ કરે છે.

અમેરિકામાં માનસિક સ્વાસ્થ્યનું સૌથી પ્રથમ આંદોલન બિયર્સ (1876-1943) નામની વ્યક્તિત્વે શરૂ કર્યું. બિયર્સને ગ્રેજ્યુએટ થચા પછી “ઉનમત-ઝિન્ન તીવ્ર મનોવિકૃતિ” બિમારી લાગુ પડી, જેના કારણે તેને મેન્ટલ હોસ્પિટલ માં સારવાર લેવા માટે દાખલ થવું પડેલું. પણ તેણે હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીઓનું વર્તન એવું બેહુદુ જોયું તે હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી તેણે માનસિક સ્વાસ્થ્ય સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા અને તેમાં મૂળભૂત પરિવર્તન કરવાની અનિવાર્યતાઓ સૂચવીને પરિણામ સ્વરૂપ સને-1909 માં માનસિક સ્વાસ્થ્યની રાષ્ટ્રીય સમિતિ (National Committee for mental hygiene) ની સ્થાપના કરી.

આમ સને-1919 માં માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય સમિતિ (International Committee for mental hygiene) ની સ્થાપના થઈ. જેનું પ્રથમ અધિવેશન સને-1930 માં વોશિંગ્ટનમાં મળ્યું. જેમાં-53 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો.

સંચુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનાની સાથે સાથે સને-1948 માં માનસિક સ્વાસ્થ્ય માટે એક વિશ્વસંઘ (WFMH) ની સ્થાપના કરવામાં આવી છે.

જ્યારે આપણા દેશની વસ્તી અમેરિકાની વસ્તી કરતા લગભગ ત્રણ ગણી છે. આપણે ત્યાં મનોવિકૃતિઓ પ્રત્યે જનસમાજમાં જાગૃતિ ન હોવાને કારણે તથા હોસ્પિટલોની અછિતના કારણે તીવ્ર મનોવિકૃતિની સમસ્યાનું સાચું માપ કાઢવું મુશ્કેલ થઈ પડે છે.

:: માનસિક સ્વાસ્થ્યની ચળવળના પાસાઓ ::

ધીમે ધીમે ઉપર્યુક્ત સમિતિઓ દ્વારા માનસિક સ્વાસ્થ્યની ચળવળ શરૂ થઈ જેના પાસાઓ નીચે પ્રમાણો છે :

- (1) મનોસ્વાસ્થ્ય માટેની સેવાઓનો વિકાસ
- (2) માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર
- (3) સામાન્ય હોસ્પિટલોમાં માનસિક રોગના વિભાગની સ્થાપના
- (4) માનસિક રોગોની ઘનિષ્ઠ સારવાર માટેના ચિકિત્સાલયો
- (5) પુનઃ શિક્ષણ અને પુનઃ સ્થાપના
- (6) લોક શિક્ષણ

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નિષ્ણાંતો, મનોચિકિત્સકો, સંશોધકો, મનો વૈજ્ઞાનિકો દ્વારા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિતના લક્ષણો નીચે પ્રમાણો તારવવામાં આવ્યા છે.

:: માનસિક સ્વાસ્થ્યના લક્ષણો ::

માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા પરથી માનસિક સ્વાસ્થ્યના લક્ષણો નીચે પ્રમાણો જોઈ શકાય ::

(1) **નિશ્ચિત જીવન દ્યેય :-**

જે વ્યક્તિના જીવનનું દ્યેય નિશ્ચિત હોય છે, તે વ્યક્તિની પ્રવૃત્તિઓના આચોજનના પરિણામે તેનાં જીવનમાં સરળતા, તરલતા અને કર્તવ્ય નિષ્ઠતા જેવા ગુણોનો વિકાસ થાય છે. ઉચ્ચ વિચારો તેને માનસિક ઉચ્ચ ભૂમિકાએ લઈ જાય છે. આવી વ્યક્તિની જીવનના સમગ્ર વ્યવહારમાં સ્વસ્થ ચિત્તે વિચારતી હોય છે.

(2) **પોતાની ઈચ્છાઓની જાણકારી :-**

ઉચ્ચ જીવન દ્યેય રાખનાર વ્યક્તિની ઈચ્છાઓ અને જરૂરિયાતો તેના જીવન દ્યેયને અનુરૂપ હોય, તેને સંતોષપાનો તે વ્યવસ્થિત પ્રયત્ન કરે છે અને જે ઈચ્છાઓ અને જરૂરિયાતો તેના જીવન દ્યેયને અનુરૂપ ન હોય તે ઈચ્છાઓ અને જરૂરિયાતોનું તે ઉદ્વીકરણ કરી શકે છે.

(3) **પોતાના અનુભવોનું મૂલ્યાંકન :-**

વાસ્તવિક જગતમાં બનતા અનુભવોની તે નોંધ લે છે. પડોશી, કુટુંબ, સગા-સંબંધી કે સમાજમાં બનતા બનાવોનું તે મૂલ્યાંકન કરે છે. સાચા-ખોટાનો વિચાર કરી શકે છે. કયા અનુભવો ઉપયોગી કે બિન ઉપયોગી છે ? તેની માનસિક નોંધ લે છે. પરિણામે કટોકટીના સમયે તેનું મન અસ્વસ્થ થતું નથી. તેથી યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય રીતે તેનું મન યોગ્ય નિર્ણય કરી શકે છે.

(4) **વાસ્તવિકતાનો સ્વીકાર :-**

સ્વસ્થ માનસ ધરાવતી વ્યક્તિને જગત અને જગતના પ્રેરણનો ખ્યાલ હોય છે. તે દિવાસ્વખનો કે તરંગોમાં રાચતી નથી, તેને વાસ્તવિકતાનું ભાન હોય છે.

(5) **પરિપક્વતા આવેગ અને લાગણી :-**

સ્વસ્થ માનસ ધરાવતી વ્યક્તિ બહુ આવેગમય બની જતી નથી. માનસિક સમતુલા જાળવવામાં તે કુશળ હોય છે. કોધ કે ભયના આવેગમાં પણ તેનું મન સમતુલા ગુમાવતું નથી. તે કોઈપણ નિર્ણય શાંત ચિત્તે જ કરી શકે છે.

(6) સલામતિ ભાવના :-

સ્વર્ણ માનસ ધરાવતી વ્યક્તિને પોતાને વિશ્વાસ હોય છે કે પોતે જે રસ્તા પર જાય છે તે ચોગ્ય રસ્તો છે, તેથી તે બિનસલામતીની લાગણી અનુભવતો નથી, કેમકે તેની સાથે તેનો આત્મવિશ્વાસ હંમેશા રહેલો હોય છે.

(7) સર્જનશીલતા :-

સ્વર્ણ માનસ ધરાવતી વ્યક્તિને સર્જનની પ્રવૃત્તિમાં રસ રહે છે. આવી વ્યક્તિઓ આવેગો, લાગણીઓ કે ઈચ્છાઓનું દમન કરતી નથી. પરંતુ તેનું ઉદ્દીપિકરણ કરે છે અને તેથી તેને સર્જનાત્મક પ્રવૃત્તિમાં વધુ રસ હોય છે.

(8) સુટેવનું ઘડતર :-

બર્નહાર્ટ જળાવે છે કે સુટેવોનું ઘડતર એ માનસિક સ્વાર્થ્ય જાળવવા માટે અગત્યનું પરિબળ છે. જે વ્યક્તિને સારી ટેવો પડી હશે અને કુટેવોનો ગુલામ નહીં હોય તે વ્યક્તિનું માનસિક સ્વાર્થ્ય હંમેશા સારુ રહેશે.

(9) જૂથમાં રહેવાની આવડત :-

સ્વર્ણ માનસ ધરાવતી વ્યક્તિને જૂથમાં રહેવાની આવડત હોય છે. તે અન્ય વ્યક્તિઓ સાથે અનુકૂળ બની જાય છે. તેનો દ્રષ્ટિકોણ બુધિયુક્ત અને તક્કસંગત હોય છે.

(10) આંતરસ્કુઝ :-

સ્વર્ણ વ્યક્તિઓ પોતાના જીવનનાં દરેક નાના-ખોટા પ્રસંગોમાં વાસ્તવિકતાને તપાસી સાચા-ખોટાનો નિર્ણય પોતાની આંતરસ્કુઝ દ્વારા લઇ શકે છે.

(11) જીવનનું તત્ત્વજ્ઞાન :-

આરનોલ્ડ ગેસેલ અને ઓલપોર્ટ માને છે કે જીવનનાં તત્ત્વજ્ઞાનની રચના એ સ્વસ્થ વ્યક્તિત્વનું એક લક્ષણ છે. ચિકિત્સાનાં અનેક વર્ષોના અનુભવ બાદ કાર્લચ્યુગે આ સંદર્ભે દર્શાવ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિભિંદુની પ્રાપ્તિ વિના દર્દી સંબંધની મનોચિકિત્સા મુખ્યત્વે નિષ્ફળ જાય છે. બિશાપ કુલ્ટન મુજબ “ઇશ્વરથી માનવી જેમ જેમ વિમુખ થતો જાય તેમ તેમ તેની ચિંતામાં પણ વધારો થતો જાય છે. ધ્યાન અને ચિંતન દ્વારા પોતાના મનને સ્થિર કરીને વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય મેળવી શકે છે.”


આ રીતે માનસિક સ્વાસ્થ્યનું મહત્વ જુદા-જુદા ક્ષેત્રોમાં સમજવામાં આવતું ગયું. શૈક્ષણિક ક્ષેત્ર, કૌટુંબિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, ઉધોગ ક્ષેત્ર તેમજ અન્ય જગતાએ માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગેના સૂચનો અને સંશોધનોના આધારે નીચે મુજબના નિયમો તારવવામાં આવ્યા.

:: માનસિક સ્વાસ્થ્યના નિયમો ::

- (1) માનસિક સ્વાસ્થ્ય એ એક વૈચકિતક સમસ્યા છે. જેનું સમાધાન પ્રત્યેક વ્યક્તિએ પોતાના માટે પોતે જ કરવું.
- (2) પોતાનું દ્યેય અને પ્રયત્ન સ્પષ્ટ અને નિશ્ચિત બનાવીને પોતાની સમસ્યાઓને ઉકેલવી જોઈએ.
- (3) આત્મ પરિચય અને આત્મજ્ઞાન માનસિક સ્વાસ્થ્ય માટે પરમ આવશ્યક છે.
- (4) ચિંતા, સંઘર્ષ, નિષ્ફળતા, મુશ્કેલીઓ વિગેરે જીવનના અનિવાર્ય અંગો છે. જેથી અમુક હંડ સુધી આ બધી બાબતો સ્વીકારવી જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ.
- (5) પોતાના આવેગોને પ્રગટ કરતા પહેલા મર્યાદા અને શિષ્ટાચાર કેળવવો જોઈએ.

- (6) પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવું ને તેમાંથી જ સંતોષ પ્રાપ્ત કરવો.
- (7) પોતાના તેમજ અન્ય વ્યક્તિના વ્યક્તિત્વ પ્રતિ આદર-માનનો ભાવ કેળવવો. આ નિયમો નીચેની આફુતિ દ્વારા અન્ય સ્વાસ્થ્ય પરિબળોને આધારે સમજાવી શકાય.

સ્વાસ્થ્યના ચાર ઘટકોમાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રહે છે. તેનું સ્થાન આગવું છે. સ્વાસ્થ્યના બીજા ત્રણા ઘટકો તેના પર ખૂબ આધારીત છે. તેનું સચિત્ર વર્ણન નીચે મુજબ આલેખી શકાય.



સ્વાસ્થ્યની આ સમજને વાચા મળે છે. જહોન-મીલટનની કાવ્ય પંક્તિઓમાં જેનો અનુવાદ નીચે મુજબ છે :

“‘છે કારણો મનનાં બધા, બદલી શકે પળવારમાં
જે નક્કમાંથી સ્વર્ગમાં, ને સ્વર્ગમાંથી નક્કમાં’’

સર વિલિયમ ઓસ્લરે (1849-1919) કહ્યું છે કે, લગભગ દરેક બિમારી પર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યની સારી કે માઠી અસર પડે છે.

માનસિક સ્વાસ્થ્યની ઘણી વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. પરંતુ ગીતાના બારમાં અદ્યાત્મના પંદરમાં જ્ઞાનમાં અપાયેલ માનસિક સ્વાસ્થ્યનું વર્ણન કદાચ દૂંકામાં દૂંકુ છતાં ચોકકસ છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે ઘણું કહી જાય છે.

ગીતા 12/15 અર્થ : જેનાથી લોકો ઉદ્ઘેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્ઘેગ પામતો નથી તથા જે હર્ષ, કોધ, ભય અને ઉદ્ઘેગથી રહિત છે, તે ભક્ત મને પ્રિય છે.

પરંતુ માનસિક ખ્યાલની સૌ પ્રથમ રજૂઆત બિયર્સે 1908 માં કરી ત્યારથી આજ સુધી થયેલા સંશોધનોએ માનસિક સ્વાસ્થ્યની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. જેમાંની કેટલીક આ પ્રમાણો છે :

- (1) “માનસિક સ્વાસ્થ્ય એટલી માનવીઓનું જગત સાથેનું તેમજ એકબીજા સાથેનું ગુરૂતમ, અસરકારક અને સુખપ્રદ સમાચોજન.”⁶

– કાર્લ મેનિન્જર

- (2) “માનસિક સ્વાસ્થ્ય એટલે તમામ આવેગોને આત્મગૌરવના સ્થિર ભાવમાં સંકલિત કરવા.”⁷

– બર્ન હાટ

- (3) “માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાન દ્વારા માનવ મનના અનાવશ્યક અભિપ્રાયો નો વિરોધ કરવામાં આવે છે અને એ રીતે મનની અસંતુલિત અવસ્થાને સંતુલિત કરવામાં આવે છે.”⁸

– લોરેન્સ એફ. શેફર

ઃ માનસિક સ્વાસ્થ્યનું મહાત્વ ઃ

આજના આ યુગમાં વિશ્વના બધા જ દેશો માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે. આજે શારીરિક દર્દ અંગે સારવાર લેવા જનારા દર્દોમાં અડધામાં માનસિક પરિબળો એક ચા બીજી રીતે સંકળાયેલા જેવા મળે છે. આવી વ્યક્તિત્વોને મુક્ત કરાવી સ્વસ્થ બનાવવાનો એક સૌથી મહાત્વનો હેતુ માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાનનો છે.

માનસિક સ્વાસ્થ્ય વિજ્ઞાનનો ઉપયોગ સર્વત્ર વ્યાપક છે. અંગ્રેજુમાં કહેવત છે કે,

“Prevention is better than cure”

દવા કરીને સાજી થવું એના કરતા માંદા ન પડવું એ જ સારુ છે. તેથી માનસિક આરોગ્યમાં ચિત્ત અસ્વસ્થ, આરોગ્યવિહીન ન બને તેની કાળજી રાખવી જરૂરી છે. આ સાથે દરેક વ્યક્તિમાં એવા પ્રકારનું વ્યક્તિત્વ નિર્માણ પામે કે જે પોતાની આસપાસના વાતાવરણ સાથે સમાચોજન સાધી શકે તેમજ જીવનમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ આવે અને તંદુરસ્ત જીવન જીવી શકે.

ભાનસિક સ્વાસ્થ્યને નુકશાન કરનાર પરિબળો ::

આધુનિક ચુગમાં ચિંતા, સંઘર્ષ, મનોભાર, અસલામતિ, માનસિક તંગાઈલીનું પ્રમાણ વધતું જાય છે. તેથી માનસિક સ્વાસ્થ્ય જોખમાચ છે. માનસિક સ્વાસ્થ્યને જોખમાચનારા કેટલાક પરિબળો નીચે પ્રમાણે છે :

(1) ચિંતા (વ્યત્રતા) ::

જે વ્યક્તિ વધુ પડતી ચિંતા કરતી હોય તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. કેટલીક વ્યક્તિઓને આર્થિક મુશ્કેલીઓ કુટુંબનો પ્રશ્નો, નોકરીના કે વેપારના પ્રશ્નો મૂંજવતા હોય છે. કુટુંબીજનોના સ્વાસ્થ્યની ચિંતા, બાળકોના અભ્યાસની ચિંતા કે વ્યાવહારિક પ્રશ્નોની ચિંતા વ્યક્તિતના જીવનમાં માનસિક સંઘર્ષ ઉત્પન્ન કર્યા જ કરે છે. વ્યક્તિ સવારે ઉઠે અને રાત્રે સુઅંત્રાં સુધી તે ચિંતા કર્યા જ કરે છે. આમ આ રીતે જેના જીવનમાં વધુ પડતી ચિંતાઓ રહેલી હોય છે, તેનું માનસિક સ્વાસ્થ્ય જોખમાચ છે.

(2) દમન ::

ફોઇદ જણાવે છે કે ઈરછાઓના દમનને લીધે વ્યક્તિતનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. વ્યક્તિતના જીવનમાં બધા જ પ્રકારની સુખ-સગવડો હોતી નથી. વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર ઈરછાઓ કરે તે સમજી શકાય છે. પરંતુ ઘણી વાર તે પોતાના ગજ ઉપરાંત ઈરછાઓ વ્યકત કરતો હોય

છે. પરિણામે કેટલીક ઈરછાઓનું ઈરાદા પૂર્વક દમન થાય છે. તેના પરિણામે માનસિક સંઘર્ષ શરૂ થાય છે. લાંબા ગાળાના સંઘર્ષથી તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

(3) **સામાજિક સમાચોજનનો અભાવ ::**

વ્યક્તિ એકલો રહેતો નથી. વ્યક્તિત્વના વિકાસ માટે જૂથ અનિવાર્ય છે. બાળક સમાજના કે શેરીના અન્ય બાળકો સાથે સંપર્કમાં આવે છે. શાળા કે કોલેજેમાં તે મિત્રોના જૂથમાં ફરે છે. મોટા થતાં તે સમાજના વિવિધ લોકોના સંપર્કમાં આવે છે. આ રીતે સમાજની સાથે રહેવું વ્યક્તિ માટે જરૂરી છે. જે સમાજમાં વ્યક્તિ રહેતો હોય તે સમાજના સભ્યો સાથે જો સુખેળ ન સાધી શકે અને સમાજના સભ્યો સાથે વારંવાર સંબંધ બગાડતો રહે તો તેના વિચારો વિકૃત બની જવાના અને પરિણામે તેનું માનસિક સ્વાસ્થ્ય જોખમાશે. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સમાજ સાથે સુખેળ ન સાધી શકે તે વ્યક્તિ માનસિક સંઘર્ષ થતો રોકી શકે છે અને માનસિક સ્વાસ્થ્ય જાળવી શકે છે. બર્નહાર્ટ જણાવે છે કે “માનસિક સ્વાસ્થ્ય એ સમાચોજન સાધવાની ટેવ છે.”

(4) **શારીરિક સ્વાસ્થ્યનો અભાવ ::**

શારીરિક સ્વાસ્થ્યનો અભાવ માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. બર્નહાર્ટ કહે છે કે “માનસિક સ્વાસ્થ્યનો આધાર શારીરિક સ્વાસ્થ્ય પર છે.” બર્નહાર્ટ કહે છે કે “તંદુરસ્ત શરીર તંદુરસ્ત વિચારો આપે છે. બીમાર શરીર બીમાર વિચારો આપે છે.” માંદી વ્યક્તિને દર્દને લીધે તાજ વિચારો મળતા નથી. તેનું મન દર્દીની આસપાસ ઘુમતુ હોય છે. તેથી તે વ્યક્તિ માનસિક અશાંતિ અનુભવે છે. તે વયગ્રતા અનુભવે છે. માંદી વ્યક્તિ ચીડીયા સ્વભાવની બની જાય છે. કોઈક વિચારોને તે બરાબર રીતે સમજુ શકતી નથી. આ રીતે શારીરિક સ્વાસ્થ્યનો અભાવ માનસિક સ્વાસ્થ્યને

જોખમાવનાર બળ બની રહે છે. "Sound mental health depends on sound physical health." - Bernhardt.

(5) આવેગશીલતા ::

આવેગશીલતા માનસિક સ્વાસ્થ્યને જોખમાવનાર અગત્યનું પરિબળ છે, કારણ કે વ્યક્તિનું જીવન આવેગોથી ભરપૂર હોય છે. વ્યક્તિનું જીવન સુખ-દુઃખથી મિશ્રિત હોય છે. આનંદિત વ્યક્તિ બીજી જ ક્ષણે શોકમગન બની જાય છે. દુશ્મનોનો ભય તેને સતાવે છે. સમાજના વ્યવહારો તેને કોધ કરાવે છે. બાળકોની કુટેવોથી તે વ્યથા અનુભવે છે. કામ, કોધ, દ્રેષ્ણ વગેરે આવેગો વારંવાર વ્યક્તિની દીનચર્ચામાં દેખા દેતા હોય તો તેનું મન અશાંત થઈ જાય છે. કોધ એ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાવનાર અગત્યનું પરિબળ છે. વ્યક્તિ વારંવાર કોધે ભરાઈ જાય તો તેની શાંતિ જોખમાય છે. કોધનો આવેગ શારીરિક સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચાડે છે. શારીરિક સ્વાસ્થ્યની અસર માનસિક સ્વાસ્થ્ય પર થયા વિના રહેતી નથી. આ રીતે આવેગશીલતા માનસિક સ્વાસ્થ્યને અસર કરનારું અગત્યનું પરિબળ છે.

(6) જાતીય મૂળભૂત વૃત્તિ ::

માનસિક સ્વાસ્થ્યને જોખમાવનાર જાતીય મૂળભૂત વૃત્તિને કેટલાક અંશો જવાબદાર ગણી શકાય. ચુવાવસ્થામાં જાતીય મૂળભૂત વૃત્તિનો વિકાસ થાય છે કે ચુવાનમાં લાગણીઓ ઉત્પન્ન થાય છે. ચુવાનમાં શારીરિક-માનસિક ગુણોનો વિકાસ થાય છે. ચુવાન શારીરિક અને માનસિક ફેરફારોને યોગ્ય રીતે સમજી શકતો નથી. આ બધા ફેરફારો વિકૃતિની નિશાની છે, તેમ ચુવાન માનવા લાગે છે. ચુવાન પોતાની સાથે અને

સામાજિક વાતાવરણ સાથે સુમેળ સાધી શકતો નથી. ચુવા અવસ્થામાં વ્યક્તિ અંતર્મુખી હોય છે અને તેથી તે મૂંડાઈ જાય છે. ખરી વાત એ છે કે મૂળભૂત વૃત્તિઓને આત્મરક્ષણ માટે કે જાતીય રક્ષણ માટે કે સમૂહના રક્ષણ માટે ઉપયોગમાં લેવી જોઈએ. ચુવા અવસ્થામાં જાતીય મૂળભૂત વૃત્તિ નવીન સ્વરૂપ ધારણ કરે છે અને તેની ચુવાન માનસ પર ઘણી અસર થાય છે. કેટલીક વખત સમાજની બીકે કેટલીક મૂળ પ્રવૃત્તિઓને ચુવાનો સંતોષી શકતા નથી. તેને અચેતન મનમાં માનસિક ગ્રંથિઓ રચાય છે અને માનસિક સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે.

- (7) માનવી પોતાની સંપૂર્ણ જરૂરિયાતોને સંતોષી શકતો ન હોય તે માનવી અસ્વસ્થ બની જાય છે. જરૂરિયાતોની અતૃપ્તિને અસ્વસ્થ બનવાનું કારણ ગણવામાં આવે છે.
- (8) જીવનના પ્રેરણો સંબંધે હતાશા અને સંદર્ભ માનસિક સ્વાસ્થ્યને જોખમાવે છે.
- (9) બાળપણામાં બાળકનો સુચોગ્ય રીતે વિકાસ થયો ન હોય, તો પણ મોટી ઉમરે તે માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરે છે.
- (10) ભાષાનો મંદ વિકાસ, મંદ બુદ્ધિ, બુદ્ધિવિકાસની ઝડપ, આર્થિક સ્થિતિ વગેરે અનેક ઘટકો માનસિક સ્વાસ્થ્યને અસર કરનારા પરિબળો છે.

ઉપરોક્ત માનસિક સ્વાસ્થ્યની સમજૂતિ મેળવ્યા પછી હવે બીજા પરિવર્તય – સમાચોજનની સમજૂતી મેળવીએ.

1.5.2 સમાયોજનની સમજૂતી :-

આધુનિક ચુગમાં માનવીનું સામાજિક જીવન જરૂરિયત બનતું જાય છે. માનવી સામાજિક જીવનના માળખામાં ચોગચ રીતે ગોઠવાઈ જીવન જીવવા સતત પ્રયત્ન કરતો રહે છે. આજનો માનવી પોતાની શારીરિક, માનસિક, સામાજિક કે અન્ય કોઈપણ પ્રકારની જરૂરિયાતોની તૃપ્તિ પોતાના વાતાવરણ સાથે આંતર કિયા કરીને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. વાતાવરણમાંથી જરૂરિયાતો તૃપ્ત કરવાની આ પ્રક્રિયાને સમાયોજન કહેવામાં આવે છે.

સમાયોજન સાધવા વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે અને જરૂર પડે તો વાતાવરણને બદલવું પડે છે, અથવા પોતે બદલાવું પડે છે. જે વ્યક્તિ સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં પૂર્ણ સમાયોજન સાધી શકે છે, જીવનને અર્થચુક્ત અને સંપૂર્ણ સુખમય બનાવી શકે છે. તે સફળ, સુખી અને સમાયોજિત બને છે. જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક બદલાતી પરિસ્થિતિઓથી ગભરાઈ જાય છે અને પોતાના વર્તનમાં જરૂરી પરિષર્તનો લાવી શકતી નથી તેને સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે.

માનવીનું આધુનિક સામાજિક જીવન મુંજવણો અને મુશ્કેલીઓથી ભરેલું છે. તેમાં અનેક નિષ્ફળતાઓ અને હતાશાઓ છે. આવી પરિસ્થિતિમાં તેને પોતાના વાતાવરણ સાથે સુખેળ સાધવો જોઈએ. આજે જુદા-જુદા ક્ષેત્રોમાં સમાયોજન સાધી સુખ અને શાંતિ કેવી રીતે મેળવી શકાય તે સમજવું વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું છે. જુદા-જુદા વાતાવરણમાં વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા જે સરળંગ આંતરકિયા કરી સમતુલા પ્રાપ્ત કરે છે. તેને વૈચક્તિક સમાયોજન કહે છે.

આમ વ્યક્તિ અને વાતાવરણ એકબીજાને અસર કરે છે. આ બત્તે વચ્ચે એકસૂત્રતાની પરિસ્થિતિ એટલે સમાયોજન.

જગતના દરેક પ્રાણી પોતાની જરૂરિયાતો સંતોષવા સતત પ્રયત્નશીલ રહે છે. માનવેતર પ્રાણીઓની જરૂરિયાતો ફકત ભૌતિક હોય છે. આથી તેમણે ફકત ભૌતિક વાતાવરણ સાથે સુમેળ સાધવો પડે છે. જ્યારે માનવીની જરૂરિયાતો ભૌતિક ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક પણ હોય છે. માનવી સામાજિક પ્રાણી હોવાથી તેણે પોતાની અનેક જરૂરિયાતો સંતોષવા સમાજ અને સામાજિક વાતાવરણ સાથે સમાયોજન સાધવું પડે છે.

પોતાની જરૂરિયાત સંતોષવા સમાજને માન્ય હોય તે રીતે પ્રયત્ન કરવો પડે છે. સંતોષકારક જીવન વ્યતિત કરવા માટે તેણે પોતાની શક્તિઓ ખર્ચવી પડે છે. માનવીની પોતાની બધી શક્તિઓ સાથે વાતાવરણ સામે લડે છે, અને સમાયોજન સાધવાનો અવિરત પ્રયત્ન કરે છે. આમ સમાયોજનની પ્રક્રિયા એ જીવનનો એક અનિવાર્ય સંગ્રહામ છે.

એક માનવી તરીકે આપણે વિવિધ પ્રકારની શારીરિક, માનસિક અને સામાજિક જરૂરિયાતો અનુભવીએ છીએ. આ જરૂરિયાતોની તૃપ્તિ આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ તેમાંથી જ કરવાની હોય છે. આપણે વાતાવરણના સંજોગોનું જો વ્યવસ્થિત આયોજન કરીએ તો આપણે આપણી જરૂરિયાતોને તૃપ્ત કરી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને સમાયોજન તરીકે ઓળખાવે છે.

સમાયોજન (સમાયોજનની વ્યાખ્યાઓ) :-

1. H.C. Smith :-

"A good adjustment is one which is both pealistic and satisfying. At least in the long run it reduces to a minimum the frustrations, tensions and anxieties which a person must endure."⁹

2. ફેડ મેફ્કીની

‘પ્રાપ્તિના માર્ગમાં જનમની હતાશા કે અવરોધોને પહોંચી વળવા માટે વ્યક્તિત્વ ગુણો અને સમજણ પ્રાપ્ત કરવા.’¹⁰

3. કોલમેન

‘સમાયોજન એટલે પોતાની જરૂરિયાતના સંતોષ અને પોતાના વાતાવરણ વચ્ચે સમતુલા સાધવાના વ્યક્તિતના પ્રયત્નોની અસર-કારકતા.’¹¹

ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી સમાયોજનના લક્ષણો નીચે પ્રમાણે દર્શાવી

શકાય :-

- (1) સમાયોજન સતત ચાલતી પ્રક્રિયા છે.
- (2) સમાયોજન એકપક્ષી નહિ પરંતુ દ્વિપક્ષી પ્રક્રિયા છે.
- (3) સમાયોજન એ તાબે થઈ જવાની પ્રક્રિયા છે.
- (4) સમાયોજન એ અનુરૂપતા નથી.
- (5) સમાયોજન એ વૈયક્તિક આંતરકિયાની પ્રક્રિયા છે.
- (6) જરૂરિયાતથી સમાયોજનનો પ્રારંભ થાય છે અને જરૂરિયાતના સંતોષથી તેનો અંત આવે છે.
- (7) સમાયોજન વિકાસાત્મક પ્રક્રિયા છે.
- (8) સમાયોજનની પ્રક્રિયા સાર્વત્રિક છે.

સમાચોજનના દ્યેચો નીચે પ્રમાણો છે –

સમાચોજનનું મુખ્ય દ્યેચ વ્યક્તિતમાં સ્વસ્થ અને તંદુરસ્ત વર્તન વિકસાવવાનું છે. સફળ વ્યક્તિત માટે સમાચોજનની અસરકારકતા જરૂરી છે.

(1) સમાચોજનનું વૈયક્તિતક દ્યેચ :–

કોલમેનના ભત મુજબ વૈયક્તિતક સમાચોજન એ વ્યક્તિતની જરૂરિયાતો અને જરૂરિયાત સંતોષ પર અસર કરતા પરિબળો વચ્ચે સમતુલા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. વ્યક્તિ જે સફળતા પૂર્વક પોતાની જરૂરિયાતો સંતોષી શકે તો તે સુસમાચોજિત અને સુખી વ્યક્તિ છે. કુસમાચોજિત વ્યક્તિ અસંતુષ્ટ અને દુઃખી છે એમ કહેવાય, સમાચોજનને અસરકારક બનાવવા માટે ત્રણ બાબતો અગત્યની છે.

(1) આપણી જાત વિશેનું જ્ઞાન

(2) અન્ય વિશેનું જ્ઞાન

(3) સમસ્યા વિષેની સભાનતા।

(2) સમાચોજનનું સામાજિક દ્યેચ :–

સામાજિક સમાચોજન એ વ્યક્તિત અને તેના સામાજિક વાતાવરણ વચ્ચેની આંતરકિયા છે. સામાજિક સમાચોજનનો હેતુ સામાજિક સંબંધો વિકસાવવાનો છે. સમાચોજિત વ્યક્તિતાઓ અન્ય સાથે સંતોષકારક તેમજ નિકટના સંબંધો બાંધી શકે છે. આવી વ્યક્તિતાઓ સામાજિક સંબંધોમાં તનાવ હોતો નથી. અન્ય વ્યક્તિત સાર્થક સંદેશવહન સારી રીતે કરી શકે છે, અને ઉત્તમ આંતર વૈયક્તિતક સંબંધ બાંધી શકે છે.

(3) સમાચોજનનું વ્યાવસાચિક દ્યેચ :-

વ્યાવસાચિક સમાચોજનનું દ્યેચ વ્યવસાયમાં સમાચોજન સાધવાની રીતો બતાવવાનું છે. વ્યાવસાચિક સમાચોજન માટે વ્યક્તિત્વે યોગ્ય અને મનપસંદ વ્યવસાયની પસંદગી કરવી જોઈએ. વ્યક્તિત્વને જો પોતાના વ્યવસાયથી સંતોષ હશે તો તે વ્યવસાયનું કાર્ય વધુમાં વધુ કાર્યક્ષમતાથી કરશે. ઉપરાંત વ્યક્તિત્વે એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ કે જે તેને પ્રતિષ્ઠા અપાવે.

પ્રસ્તુત સંશોધનમાં પણ અહીં રટન કલાકારોનું વ્યાવસાચિક સમાચોજન નું મહત્વ છે. અહીં કાર્ય કરતા રટન કલાકારો પોતાના આ વ્યવસાય પોતાની હીરા ઘડવાની આવકત અને કુટુંબના ગુજરણ કરવા માટે પસંદ કરે છે. કેટલાક રટન કલાકારો અભ્યાસમાં નિષ્ફળ જતા તે બીજા વ્યવસાય તરફ જવાને બદલે પોતાના શહેરમાં જ આ વ્યવસાય હોવાથી તેમાં જોડાય છે. જ્યારે કેટલાક પોતાના અભ્યાસમાં ઘણા આગળ વધ્યા હોવા છતા પણ કૌદુર્યબિક, સામાજિક જવાબદારી ઓ સંભાળવા માટે આ વ્યવસાય પસંદ કરે છે. ઉપરોક્ત સમાચોજનની સમજૂતિ પછી હવે ત્રીજા પરિવર્ત્ય જીવન સંતોષની સમજૂતિ મેળવીએ.

1.5.3 જીવન સંતોષની સમજૂતી :-

ચિંતાના ચુગમાં જીવતા માનવીના રોજબરોજના જીવનમાં જરૂરિયાતોની વણાજારની શુંખલા ચાલ્યા જ કરતી હોય છે. જેને સંતોષવા માટે આસપાસના વાતાવરણમાં તેને સંતોષવા પ્રવૃત્તિ કરે છે અને તે જરૂરિયાતો સંતોષતા તેમાંથી ઉદ્ભવતી લાગણીને સંતોષ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વ્યક્તિત્વની બધા જ કાર્ય પ્રવૃત્તિથી જરૂરિયાતો સંતોષાચ તેવું નથી. તેમાંથી અસંતોષ કે તનાવ અનુભવે છે. જે વ્યક્તિત્વોમાં આવા તનાવોનો અભાવ છે તેઓ તેમના જીવનને સંતોષી માને છે. મનુષ્ય જીવનમાં નાની-મોટી સમસ્યાઓ તો આવવાની જ પણ તેના પ્રત્યે વ્યક્તિત્વો કેવો અભિગમ છે તેના પર તેનો જીવન સંતોષનો આધાર રહેલો છે.

1950 માં BEYOND PLEASURE PRINCIPLE માં ફોઈડે જણાવ્યું છે કે, “જીવનનું અંતિમ લક્ષ્ય સુખ સંતોષ છે.” તેમણે જણાવ્યું કે સુખ-અસુખ ની લાગણી ઉતેજનાના જથ્થા સાથે સંબંધ ઘરાવે છે. ઉતેજનાના વધારા સાથે અસુખ અને ઘટાડા સાથે સુખની લાગણી સંકળાયેતી છે.

heories in contemporary psychology (1963) Grings Willam W. જણાવે છે કે સંતોષ કે અસંતોષ જેમ વધારે તેમ અનુભંધની મજબૂતી કે નબળાઈ પણ વધારે સંતોષજનક પરિસ્થિતિ જેને ટાળવા પ્રાપ્તી કંઈ કરતું નથી. પરંતુ બધા તેને પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા પ્રયત્ન કરે છે. અસંતોષ પ્રેરક કે ચીડજનક પરિસ્થિતિ એટલે જે પ્રાપ્તી સામાન્યપણે ટાળે છે અને ત્યજી હોય છે.

થોર્નડાઈક (1919) Selected writing from a connectionists psychology માં ‘સંતોષકો’ અને ‘અસંતોષકો’ અંગેના જ્યાલની ચર્ચા કરી છે. જેને હલ ઉપરાંત સ્પેન્સર, જેમ્સ, ડયુઈ, મેકકુગલ વગેરે જૈવીય અભિગમ ઘરાવતા મનોવૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે.

જરૂરિયાતોનું પોટલું લઈને જીવતા માનવીના રોજિંદા જીવનમાં અનેકવિદ્ય જરૂરિયાતોની શુંખલા ચાલ્યા જ કરતી હોય છે. તેને સંતોષવા માટે માનવી કોઈને કોઈ પ્રવૃત્તિ કે કાર્ય કરે છે અને તે જરૂરિયાત પૂર્તિની તૃપ્તિથી જે લાગણી અનુભવે છે તેને સંતોષ તરીકે ઓપ આપવામાં આવે છે. આ સંતોષ એ મનોવૈજ્ઞાનિક લાગણી છે. માટે જ રોજિંદી જીવન ઘટનાઓમાંથી પસાર થતો માનવી પોતાની દ્યેય પ્રાપ્તિની સફળતાથી વિદ્યાયક લાગણી અનુભવે છે.

જ્યારે તેમાંથી મળતી નિષ્ફળતા તેને નિષેધક લાગણી તરફ દોરી જાય છે. જે નાથી વ્યક્તિત્વના જીવનસંતોષને નિષેધક અસર પહોંચે છે. જીવનસંતોષ

સાથે વ્યક્તિગત બાબતો સંકળાયેલી છે. તેથી તેની સર્વસામાન્ય વ્યાખ્યા કરવી મુશ્કેલ બને છે. કાર કે અમુક લોકો શારીરિક બાબતોને તો અમુક લોકો આર્થિક કે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોના સંતોષને મહત્વના ગણાતા હોય છે. આમ જીવન સંતોષમાં વિભિન્ન વ્યક્તિગત બાબતો સંકળાયેલી હોવાથી આ અંગેની વ્યાખ્યા સ્પષ્ટ કરવાનું કાર્ય મુશ્કેલ બની જાય છે. છતા જીવનસંતોષ અંગેની કિચાત્મક વ્યાખ્યા (Operational definition) કરતા કહી શકાય કે,


“જીવનસંતોષ એટલે મનોવૈજ્ઞાનિક, શારીરિક અને વાતાવરણ પરિસ્થિતિઓ કે સંજોગોનું કોઈ સંયોજન છે કે જે વ્યક્તિને ખરેખર એવું કહેવા પ્રેરે કે મને મારા જીવનથી સંતોષ છે.”

“જીવનસંતોષ એટલે વ્યક્તિને પોતાના જીવન પ્રત્યે અનુભવાતી સમગ્ર વિદ્યાચક લાગણીનું પ્રમાણા.”

આમ જીવનસંતોષ સાથે વિદ્યાચક લાગણી જરૂરિયાત તૃપ્તિ, સફળતા, કાર્યક્ષિદ્ધી વગેરે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક બાબતો સંકળાયેલી હોવાથી જુદી-જુદી વ્યક્તિએ તે જુદો-જુદો અનુભવાય છે.


ફોઈડના મતે “જીવનનું અંતિમ લક્ષ્ય જ સુખ સંતોષની પ્રાપ્તિ છે. દરેક માનવી અંતે તો સુખને જ પામવા માટે પ્રયત્નો કરતો હોય છે.”

મેરલોએ પણ “જરૂરિયાતોના શ્રેણી કમના સિક્ષાંતમાં સંતોષને સુખના સંદર્ભમાં જ વ્યક્તત કર્યો છે. જો કે દરેક જરૂરિયાતો એ જ કમમાં સંતોષાય એવું જરૂરી નથી. મેરલોએ સૂચવેલ જરૂરિયાતોનો ચડતીશ્રેણી કમ નીચેની આકૃતિમાં દર્શાવી શકાય.”



આ રીતે મેસ્લોના સિદ્ધાંત પરથી સ્પષ્ટ થાય છે કે માનવમાં ઉદ્ભવતી વિવિધ જરૂરિયાતો ચોક્કસ કર્મમાં સંતોષાતી હોય છે. આમ આ જરૂરિયાતો કેટલા પ્રમાણમાં અને તેને વ્યક્તિ કેવી રીતે સ્વીકારે છે. તેના આધારે વ્યક્તિનો જીવનસંતોષ નક્કી થઈ શકે.

બોરિંગ લેગફિલ્ડ જીવનસંતોષને સમાચોજનના દ્રષ્ટિકોણથી સમજાવે છે. “સમાચોજન એક એવી પ્રક્રિયા છે, કે જેનાથી વ્યક્તિ પોતાની જરૂરિયાતો અને જરૂરિયાત તૃપ્તિ પર અસર કરનારા સંજોગો વચ્ચે સમતુલા સ્થાપે છે.” ઉપરોક્ત વ્યાખ્યાનનું સ્પષ્ટીકરણ ઉપરની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે સુખ સંતોષ પ્રાપ્ત કરવાની ઝંખના ઘરાવતી વ્યક્તિ પોતાની આસપાસના જગત પ્રત્યે જે આંતરક્રિયા કરે છે, અથવા




समायोजन साधे છે જેમકે વ्यક्ति અને તેના સામાજિક, સાંસ્કૃતિક, મનોવैજ્ઞાનિક અને કાર્યના વાતાવરણ વચ્ચે સમતોલન સ્થાપી સુખ, સંતોષ મેળવે તે વ્યક્તિના સમગ્ર જુવનનો સંતોષ બની જતો હોય છે.

જુવન સંતોષને અસર કરતા પરિબળો :-

કિથડેવિસ અને ન્યુસ્ટર્ટોમ (1995) જુવનસંતોષ પર અસર કરતા આ પરિબળો નીચે છે.

કુદુંબ



(Source : New strom John W / Keith Davis: Organization Behaviour, Tata MacGraw Hill Edition, Ninth Edition 1995, 1996)

1. પ્રવૃત્તિ :-

પ્રવૃત્તિ વગરનું જીવન એ માનવ સ્વભાવ માટે સજારૂપ બની જાય છે. દરેક માણસ પ્રવૃત્તિશીલ હોય છે. તેમની પ્રવૃત્તિ અને અંતે તેમાંથી મળતો સંતોષ અથવા અનુભવાતી સુખની લાગણી જીવનસંતોષને નકકી કરવામાં મહિંદ્રાની પુરવાર થાય છે. જ્યાં માનવી જીવનનો 1/4 ભાગ વિતાવતો હોય છે એ સ્થળ પ્રત્યેની લાગણી તેમને જીવનસંતોષ તરફ દોરી જાય છે.

2. કુદુંબની રિથતિ :-

કુદુંબ વ્યક્તિતના જીવનસંતોષને નકકી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિતના કૌદુંબિક આંતર સંબંધો, ભાઈ-બહેનની સંખ્યા, માસિક આવક, ભૌતિક સગવડો તેમજ મનોરંજનના સાધનો વગેરેની અસર વ્યક્તિતના જીવન સંતોષ પર પડયા વગર રહેતી નથી. આર્થિક સમૃદ્ધિ અને સામાજિક આંતર સંબંધોની ગહેરાઈ તેઓના સંતોષને પ્રેરે છે. જ્યારે ઉપરોક્ત પરિવત્યોની ઉણાપ અસંતોષને નકકી કરવામાં મહિંદ્રાની ભૂમિકા ભજવે છે.

3. રાજકીય વાતાવરણ :-

વ્યક્તિ જે પ્રદેશમાં, રાજ્યમાં અને રાષ્ટ્રમાં રહે છે તેની રાજકીય પરિરિથતિ પણ વ્યક્તિતના જીવનસંતોષ પર અગત્યની અસર કરે છે. લોકશાહી રાજ્ય, સરમુખત્યાર રાજ્ય કે અન્ય વ્યવસ્થા અસર કરે છે.

4. ધાર્મિક વાતાવરણ :-

વ્યક્તિતના કુદુંબ, સમાજ, જ્ઞાતિ, પ્રદેશ અને રાષ્ટ્રીય વાતાવરણમાં ધર્મનું વાતાવરણ વ્યક્તિતના જીવનસંતોષ પર અસર કરે છે. ધાર્મિક માન્યતાઓ, રીત-રિવાજો, Way of thinking, Way of life, Way of warship વગેરે ધર્મના આધારે ઘડાય છે. ધાર્મિક પિધિઓ વગેરેની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર વ્યક્તિતના જીવનસંતોષ પર પડે છે.

5. કુરસદનો સમય :-

વ્યક્તિગતના નોકરી ધંધાના કામના કલાકો પછી જે સમય ફાજલ રહે છે તેને કુરસદનો સમય ગણાવે છે. કુરસદના સમયની પ્રવૃત્તિઓ પણ વ્યક્તિગતના જીવન સંતોષને અસર કરે છે.

રોબિન્સ (1997) જણાવે છે કે આધુનિક ચુગમાં ચુવાનો કુરસદને વધુ મહાત્વ આપે છે. તેઓ ખંતથી કાર્ય કર્યા પછી કુરસદના સમયમાં પોતાની મનપસંદ કરવાનું પસંદ કરે છે. આમ જીવનસંતોષને નકકી કરવામાં પણ વ્યક્તિને ભળતા કુરસદના સમય દરમિયાનની પ્રવૃત્તિ પણ મહાત્વની પુરવાર થાય છે.

આમ, જીવન પ્રત્યેના સંતોષની વ્યક્તિગતના અન્ય તમામ પાસા પર પણ અસર જોવા મળે છે. વ્યક્તિ જો પોતાના જીવન પ્રત્યે સંતોષ અનુભવતી હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય સારુ, મનોભારનું પ્રમાણ ઓછું, પરિણામે સારા આંતર વૈયક્તિક સંબંધો જાળવી શકે છે. તેથી તે સરળતાથી સમાચોજન સાધી શકે છે. પરિણામે તે અન્યનો સહકાર મેળવી શકે છે અને અન્યને આપી શકે છે. જીવન પ્રત્યેના અસંતોષની લાગણી અનુભવનારા વ્યક્તિત્વોમાં મનોભારનું પ્રમાણ વધુ માનસિક સ્વાસ્થ્ય નબળું, આંતરવૈયક્તિક સંબંધો નબળા હોવાથી અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકતા નથી.

જીવન સંતોષની અસરો :-

- (1) જીવન સંતોષ ધરાવતી વ્યક્તિ સરળતાથી સમાચોજન સાધી શકતો હોય છે.

(2) જો વ્યક્તિ જીવન સંતોષ અનુભવતી હોય તો તેમનું માનસિક સ્વાસ્થ્ય સારુ આંતરવૈયક્તિક સંબંધો તંદુરસ્ત તેમજ તેઓમાં મનોભારનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ જો જીવન સંતોષ અનુભવનારા વ્યક્તિઓના આંતરવૈયક્તિક સંબંધો નબળા હોય અને માનસિક સ્વાસ્થ્ય નબળું હોય તો તેઓમાં મનોભારનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે.

આમ જીવન સંતોષ ધરાવનારી વ્યક્તિઓનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે અને તે સમાચોજન ખૂબ જ સરળતાથી સાધી શકે છે. જેથી વ્યક્તિઓ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે.

વ્યક્તિને પોતાના જીવન પ્રત્યેનો હકારાત્મક વિચાર કે વલણ એટલે જીવન સંતોષ.

જ્યારે વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાંથી વિદ્યાયક લાગણી અનુભવે છે અને તેમની આ લાગણી તેમને સંતોષ જેવી મનોવૈજ્ઞાનિક જરૂરતને પૂર્ણ કરે ત્યારે તેને જીવન સંતોષ કહી શકાય. વ્યક્તિના જીવન સંતોષમાં કુટુંબથી લઈને તેમને આજુબાજુના વાતાવરણની તેમજ વિવિધ સંસ્થાઓ વગેરેનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે.

1.6 પ્રસ્તુત સંશોધનના અગત્યના પદોની વ્યાખ્યા :-

પ્રસ્તુત સંશોધનમાં કેટલાક પદોનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અહીં "Operational definition" એટલે કે કિયાત્મક વ્યાખ્યા આપવામાં આવી છે. આવા પદોની વ્યાખ્યા આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, વાચક વર્ગ પ્રસ્તુત સંશોધનની સમજ માટે, એકસૂત્રતા માટે સુસંવાદિતા કેળવી શકે. આવા પદોની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :

(1) ઉંમર :-

જેતપુર શહેરના રટન કલાકારોની માહિતી એકત્રિકરણ કરતી વખતે શારીરિક વય (વર્ષમાં) 30 વર્ષ સુધી અથવા 30 વર્ષથી વધુ તેમ બે ભાગમાં ગણાતરી કરવમાં આવી છે.

(2) શિક્ષણ :-

રટન કલાકારોએ કચાં સુધી અભ્યાસ કરેલો છે તેના આધારે જેમ કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેને શૈક્ષણિક લાયકાત ગણવામાં આવે છે.

(3) કાર્યનો પ્રકાર :-

રટન કલાકારોએ કરવામાં આવતું કાર્ય ચાર પ્રકાર ઘાટના કારીગર, પેલના કારીગર, ભથાળા કારીગર, તળિયાના કારીગર.

(4) લગ્ન દરજાઓ :-

રટન કલાકાર પરિણિત છે કે અપરિણિત તેને લગ્ન દરજાઓ કહે છે.

(5) કુદુંબની આર્થિક સ્થિતિ :-

અહીં કુદુંબની આર્થિક સ્થિતિ નિમ્ન, મધ્યમ કે ઉચ્ચને દર્શાવવામાં આવેલ છે.

(6) આવક (માસિક આવક) :-

રટન કલાકારો મહિને જેટલા રૂપિયા કમાતા હોય તે તેની માસિક આવક ગણાવી શકાય. તેઓની માસિક આવક ત્રણ વિભાગમાં ગણાતરીમાં ધ્યાનમાં લીધેલ છે.

(7) રહેઠાણ :-

નિર્દર્શનમાં સમાચેલા રટન કલાકારો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે કે શહેરી વિસ્તારમાં.

(8) અનુભવ :-

રટન કલાકારોના વ્યવસાયમાં જોડાયો ત્યારથી અત્યાર સુધીનો પોતાનો સ્થાન પરનો અનુભવ (વર્ષમાં) 5 વર્ષ સુધી કે 5 વર્ષથી વધુ એમ દ્યાનમાં લઈ ગણાતરી કરી છે.

* માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંક :-

માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંક એટલે ડૉ. કી.જે.બહુણ તથા ગીતા ગીડા રચિત માનસિક સ્વાસ્થ્ય સંશોધનિકામાં ઉત્તર દાતાને પ્રાપ્ત થયેલ પ્રાપ્તાંક.

* સમાયોજન પ્રાપ્તાંક :-

ડૉ. પ્રમોદકુમારની સમાયોજન સંશોધનિકામાં મેળવેલા પ્રાપ્તાંકને સમાયોજનના પ્રાપ્તાંકો છે.

* જીવન સંતોષ પ્રાપ્તાંક :-

વ્યક્તિગત પરિબળો, કૌદુંબિક પરિબળો, સામાજિક પરિબળો, વ્યાપસાયિક પરિબળો વગેરેને આધારે રટન કલાકારોને પોતાના જીવનમાં કેટલો સંતોષ મળેલો છે તે ડૉ. આલમ અને શ્રીવાસ્તવની જીવન સંતોષ કસોટીમાં મળેલ પ્રાપ્તાંકોને ગણવામાં આવશે.

1.7 પ્રસ્તુત સંશોધનની અગત્યતા :-

આ સંશોધનાત્મક અભ્યાસ ઉપરોક્ત ઉદ્ઘોગ સાથે જોડાયેલ પ્રત્યેક રટન કલાકારોના વ્યક્તિગત, કૌદુંબિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં માર્ગદર્શક બની શકશે.

હિરાના ઉધોગ સાથે સંકળાયેલી માનવ શક્તિ અને ચાંત્રિક શક્તિમાં જે પાચાનો તફાવત છે તેના પ્રત્યે આ અભ્યાસ દિશા સૂચન કરે છે. માનવ શક્તિનો યોગ્ય ઉપયોગ કરી ઉત્પાદન કેમ વધારવું તેનો અભ્યાસ આ સંશોધનના આધારે ઉધોગપતિઓ કરી શકશે. રટન કલાકારો તેના કાર્ય કરવામાં કચાં ઓછા ઉત્તરે છે અને કચા કારણથી તેની આ અભ્યાસને આધારે જાણ થશે. રટન કલાકારોને કામ પ્રત્યે રૂચિ કેમ જાળવવી, કચા કારણો કેવા વાતાવરણમાં કેવું કાર્ય થાય તેની અભ્યાસો દ્વારા ખબર પડે છે. તેમાં તાલીમ દ્વારા, નિયમો દ્વારા, વ્યવસ્થિત સવલતો દ્વારા સુધારા વધારા કરી શકાય. હિરા ઉધોગમાં કાર્ય કરતા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ વગેરે પરિબળોની આ અભ્યાસના આધારે ચર્ચા કરી સુધારવા પ્રયત્ન કરશે. જે હિરા ઉધોગના ભાવિ માટે સારી બાબત બની રહેશે. આ અભ્યાસ મનોવૈજ્ઞાનિકો, ઉધોગપતિઓ, સંશોધકો અને અન્ય સભ્યો જે કામદારોના માર્ગદર્શન કાર્યક્રમો કરશે તેને ખૂબ જ ઉપયોગી બનશે.

પ્રસ્તુત સંશોધન આ ક્ષેત્રના ઉધોગપતિઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ મંડળો, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તેમજ રટન કલાકારો ના સંઘને પોતાની યોજનાઓ સાકાર કરવામાં મદદરૂપ થશે. કેમકે જેતપુર શહેર ના રટન કલાકારોમાં આવું સંશોધન કાર્ય થયું નથી.

પ્રસ્તુત સંશોધન એ માન્ય સંશોધક માટે પણ માર્ગદર્શક બની રહેશે. એવા લોકો કે, વિદ્યાર્થીઓ કે જેને કારીગરોના કલ્યાણની પ્રવૃત્તિમાં વિશેષ રસ છે. સમાજ માટે પણ ખૂબ જ ઉપયોગી થશે અને કારીગરોની જરૂરિયાતો, તેની આર્થિક અને સામાજિક રિથતિને સુધારવા વિવિધ યોજનાઓ વિશે વિચારશે અને સતત પ્રયત્ન કરશે. આ સિવાય માલિકો, મેનેજરો, બિરિક્ષકો તેમજ સાથી કર્મચારી બધાને જ આ અભ્યાસ અગત્યની માહિતી પૂરી પાડશે. જેમ કે કારગરો નું માનસિક સ્વાસ્થ્ય ઉચ્ચ પ્રકારનું હોય, તો તેનું સમાચોજન પણ ઉચ્ચ પ્રકારનું

થશે અને તેમની જીવન શૈલીથી સંતોષ પણ શ્રેષ્ઠ પ્રકારનો થશે. આથી તે લોકો કારીગરોના માનસિક સ્વાસ્થ્યને અનુરૂપ પ્રવૃત્તિઓ ગોઠવી એ પ્રમાણે તાલીમ કાર્યક્રમો યોજુને તેમની જરૂરિયાતો અનુરૂપ કાર્યનું વાતાવરણ બનાવીને આ ઉદ્ઘોગનો વિકાસ કરી શકશે.

આ રીતે જો આગળ જતા પણ હિરા ઉદ્ઘોગમાં કામ કરતા રહ્યા કલાકારો પર સંશોધન કરશે. તો સમાજના જુદા-જુદા વિભાગોમાં ઉપયોગી થશે. જે મકે, માનસિક સ્વાસ્થ્ય, સમાચોરણ અને જીવન સંતોષ એ રહ્યા કલાકારોના માત્ર ઉદ્ઘોગકીય જીવનને અસર કરે છે તેવું નથી. તે કારીગરના સામાજિક જીવનને પણ તેટલું જ અસરકારક છે. આથી આવા પ્રકારના અભ્યાસની આવશ્યકતા નહીં પણ અનિવાર્ય છે.

1.8 પ્રસ્તુત સંશોધનની મર્યાદાઓ :-

વાર્તાનિક વિજ્ઞાનોના સંશોધનોમાં હંમેશા ભૌતિક વિજ્ઞાન જેટલી ચૂસ્ત વસ્તુલક્ષિતા સંભવી શકાતી નથી. કોઈપણ સંશોધન સર્વ સંપૂર્ણ ભાગ્યે જ હોય છે. સંપૂર્ણ મર્યાદા રહિત સંશોધનો ભાગ્યે જ સંભવી શકે છે. આથી પ્રસ્તુત અભ્યાસની કેટલીક મર્યાદાઓ રહી જાય છે જેનો નિર્દેશ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે.

- (1) પ્રસ્તુત સંશોધનમાં પસંદ કરાયેલ નિર્દર્શ માત્ર જેતપુર શહેરના રહ્યા કલાકારો પૂરતો સિમીત હતો તેથી પ્રાપ્ત થયેલ પરિણામોનું વ્યાપક સામાન્યીકરણ થઈ શકે નહિ.
- (2) પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્રિકરણ માટે ઉપયોગમાં લીધેલ માનસિક સ્વાસ્થ્ય પ્રશ્નાવલી ઉપર તેમના ઘટકવાર જુદા-જુદા ગુણાંકો પણ મળ્યા છે. પણ અહીં પ્રશ્નાવલી પર મળતા સમગ્ર આંકને દ્યાનમાં લઈને અદ્યયન કરવામાં આવ્યું છે. ઘટકના પ્રાપ્તાંકને દ્યાનમાં રાખીને આંકડાશાસ્ત્રીય પૂઢ્યકરણ કરેલ નથી.

- (3) પ્રસ્તુત સંશોધનમાં નિર્દર્શ માત્ર પુરુષ પ્રત્યુત્તર દાતાઓનો જ સમાવેશ કરેલ છે, કારણ કે હિરા ઉઘોગમાં જેતપુર શહેરમાં સ્ત્રીઓ હિરાનું કાર્ય કરતી નથી. તેથી જાતિ ચલને નિયંત્રિત કરી શકાતું નથી.
- (4) માહિતીનો મૂળભૂત આધાર રટન કલાકારોનાં વ્યક્તિગત પ્રત્યક્ષીકરણ પર આધારિત છે.
- (5) સંશોધન અંગેની માહિતી પ્રત્યુત્તરદાતા પાસેથી એક જ દિવસે એક જ બેઠકમાં એકી સાથે બધાની માહિતી એકઠી થઈ શકી નથી.
- (6) વ્યક્તિનું જીવન સતત પરિવર્તનશીલ અને ગત્યાત્મક છે. તેથી થોડા સમય પછી સંશોધન કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષનું પ્રમાણ બદલવાની શક્યતા રહેલી છે.

1.9 પ્રસ્તુત સંશોધનના પ્રકરણોનું આયોજન :-

પ્રસ્તુત સંશોધનને પાંચ પ્રકરણમાં વહેંચવામાં આવેલ છે :

પ્રકરણ-1

પ્રથમ પ્રકરણમાં સંશોધનની ઐતિહાસિક ભૂમિકા, સંશોધનની સમસ્યા, માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષની સમજૂતિ, અગત્યના પદોની વ્યાખ્યા, પ્રસ્તુત સંશોધનની અગત્યતા અને પ્રસ્તુત સંશોધનની મર્યાદા અને પછીના પ્રકરણોના સંચોજનનો સમાવેશ કરવામાં આવે છે.

પ્રકરણ-2

પ્રસ્તુત પ્રકરણમાં પૂર્વભૂમિકા પછી સંશોધકે ભૂતકાળમાં થયેલા સંશોધનો અને તેના વैજ્ઞાનિક સાધનોનો ચિતાર આપ્યો હતો. માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષ માટે જુદા-જુદા અભ્યાસનું ખૂબ જ ઊંડાણાપૂર્વક

અદ્યયન કરેલ છે. તેમજ સંબંધીત સંશોધન સાહિત્યની તપાસ અને સમીક્ષા કરવાનો નભુ પ્રચાસ સંશોધકે કરેલ છે. આ સમીક્ષા પૂર્વે થયેલા સંશોધનના અવકાશનો પણ ઉલ્લેખ કરેલ છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ સામેલગીરીની સૈદ્ધાંતિક સમજૂતિ પણ રજૂ કરવામાં આવી છે. પૂર્વીં અભ્યાસો સાથે પ્રસ્તુત અભ્યાસની તુલના અને સમીક્ષા પણ કરી છે.

પ્રકરણ-3

સંશોધન યોજના, પ્રક્રિયા અને પૃથ્થકરણની પદ્ધતિ. આ પ્રકરણમાં સંશોધનની સમર્થ્યા, સંશોધનના હેતુઓ, સંશોધનની ઉત્કળપનાઓ, સંશોધનના પરિવત્યો, સંશોધનની સમબિજ્ઞ તેમજ સંશોધનનો નિર્દર્શ તેમજ સંશોધનના સાધનોમાં વ્યક્તિગત માહિતી પત્રક, માનસિક સ્વાસ્થ્ય માપન તુલા, સમાચોજન સંશોધનિકા, જીવન સંતોષ માપન તુલા ઉલ્લેખ કર્યો છે. તેમજ સંશોધનના પરિવત્યોનું માપન માહિતી એકત્રિકરણ અને આંકડાશાસ્ત્રીય પ્રચુક્તિની ચર્ચા કરવામાં આવી છે.

પ્રકરણ-4

સંશોધનનું પૃથ્થકરણ, અર્થઘટન અને પરિણામ ચર્ચા : આ પ્રકરણમાં પૂર્વભૂમિકા સંશોધન માટે એકત્ર કરવામાં આવેલી માહિતી સમજી શકાય એ રીતે વિવિધ કોઠાઓના રવરૂપમાં ટકાવારીમાં રજૂ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રને અંતે માહિતીનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવ્યું છે. માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ વચ્ચેના આંતર સંબંધોનું સહસંબંધાંક પ્રચુક્તિ વડે પૃથ્થકરણ, અર્થઘટન અને પરિણામ ચર્ચા કરવામાં આવી છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ પર વ્યક્તિગત પરિવત્યની અસર જાળવા માટે એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણ, પરિણામ ચર્ચા, તેમજ રતન કલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને-

—માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ ‘ટી’ કસોટીનું પૃથ્વેકરણ, અર્થધટન અને પરિણામ ચર્ચા રજૂ કરેલ છે. આ માટે રચેલી શૂન્ય ઉત્ક્લપનાઓની ચકાસણી, પૃથ્વેકરણ અને અર્થધટનની ચર્ચા અહીં કરી છે.

પ્રકરણ-5

પ્રકરણ પાંચમાં સંશોધન સારાંશ, તારણોમાં સામાન્ય માહિતી અંગેની ટકાવારીના તારણો, સહસંબંધના આધારે મળેલા તારણો, વિચરણ પૃથ્વેકરણ ના આધારે મળેલા તારણો, ‘t’ પૃથ્વેકરણના આધારે મળેલા તારણો અને સંશોધન માટેના સૂચનો પણ રજૂ કરેલ છે.

અંતમાં સંદર્ભ સૂચિ અને સંબંધિત સંશોધનિકાઓ રજૂ કરવામાં આવી છે.

આ રીતે સંશોધકે પ્રકરણ આચોજનમાં દર્શાવ્યા પ્રમાણે બીજા પ્રકરણમાં સંદર્ભ સાહિત્ય હવે પછી રજૂ કરેલ છે.

પ્રકરણ-1

:: સંદર્ભ સૂચિ ::

- (1) સામાજિક કાર્ય સંશોધન પદ્ધતિ અને પ્રવિધિઓ.
ડૉ. રમેશ વાધાણી અને શ્રી યોગેન્ડ્રભાઈ દેસાઈ,
સરસ્વતિ પુસ્તક ભંડાર – આવૃત્તિ 2005/06 પેઇડ નંબર-11
- (2) મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ :
– વિરલ પ્રકાશન, લેખક – પ્રા. કે.કે.મહેતા, પ્રા. યોગેન એચ ભંડુ,
તેમજ અન્ય, પેઇડ નંબર-03
- (3) સામાજિક સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર :
– ડિવાઈન પદ્ધિલકેશન આવૃત્તિ-2007, પેઇડ નંબર-25
- (4) મનોવૈજ્ઞાનિક નિબંધો માનસિક સ્વાસ્થ્ય :
– સી. જમનાદાશ પ્રકાશન, પેઇડ નંબર-11
- (5) મનોવૈજ્ઞાનિક નિબંધો માનસિક સ્વાસ્થ્ય :
– સી. જમનાદાશ પ્રકાશન, પેઇડ નંબર-11
- (6) મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ :
– સી. જમનાદાશની કંપની, પેઇડ નંબર-127
- (7) મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ :
– સી. જમનાદાશની કંપની, પેઇડ નંબર-129
- (8) મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ :
– સી. જમનાદાશની કંપની, પેઇડ નંબર-129
- (9) સમાચોરણ મનોવિજ્ઞાન :
– ડૉ. સીતારામ જયસ્વાલ, ઉત્તરપ્રદેશ હિન્દી ગ્રંથ-1995
પેઇડ નંબર-28
- (10) વૈયક્તિક સમાચોરણનું મનોવિજ્ઞાન :
– ડૉ. કે.સી. શારડા અને અન્ય-200-01 , પેઇડ નંબર-3
- (11) વૈયક્તિક સમાચોરણનું મનોવિજ્ઞાન :
– ડૉ. કે.સી. શારડા અને અન્ય-200-01 , પેઇડ નંબર-3

પ્રકરણ-2

:: અનુકૂળાધિકા ::

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
2.1	પ્રસ્તાવના	44
2.2	પૂર્વે થયેલ સંશોધન સાહિત્યની તપાસનાનું મહિને.	45
2.3	પૂર્વે થયેલ સંશોધનને પડકાર.	46
2.4	પૂર્વે થયેલ સંશોધન કાર્ય કરતી પ્રક્રિયાની વધુ સ્પષ્ટતા.	47
2.5	પૂર્વે થયેલા સંશોધનનું પુનરાવર્તન કરી તેનું સમર્થન મેળવવું.	47
2.6	માનસિક સ્વાસ્થ્યનું સૈદ્ધાંતિક મહિને.	50
2.7	માનસિક સ્વાસ્થ્ય અંગેના પૂર્વીય અભ્યાસો.	52
2.8	સમાચોજનનું સૈદ્ધાંતિક મહિને.	61
2.9	સમાચોજન અંગેના પૂર્વીય અભ્યાસો.	63
2.10	જીવન સંતોષનું સૈદ્ધાંતિક મહિને.	70
2.11	જીવન સંતોષ અંગેના પૂર્વીય અભ્યાસો.	71
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-2	80

:: પ્રકરણ-૨ ::

સંશોધન સાહિત્યની સમીક્ષા

2.1 પ્રસ્તાવના :-

પ્રોફેસર કિલફોર્ડ મૂડી કહે છે, “આજરે સંશોધન સ્વતઃ સત્યની શોધ માટેની એક પદ્ધતિ છે. જે વાસ્તવમાં સમીક્ષાત્મક વિચારણાની પદ્ધતિ છે. એમાં સવાલોની વારંવાર વ્યાખ્યા કરવામાં આવે છે. કાલ્પનિક સિદ્ધાંતોની રચના કરવામાં આવે છે, અથવા સૂચિત ઉકેલો શોધવામાં આવે છે. સામગ્રીનો સંગ્રહ વ્યવસ્થા તથા મૂલ્યાંકન કરવામાં આવે છે અને અનુમાનો તથા પરિણામો તારવવામાં આવે છે અને છેવટે પરિણામોની કાળજીપૂર્વક ચકાસણી કરી નક્કી કરવામાં આવે છે કે એ બધાં રચિત કાલ્પનિક સિદ્ધાંત સાથે કેટલે અંશો બંધબેસતા છે.”¹

દેસાઈ અને દેસાઈ (1992) જણાવે છે, કે “કોઈપણ સંશોધન શૂન્યાવકાશમાં થતું નથી. બીજાની સંકલ્પનાઓ અને સિદ્ધાંતો આપણાં માર્ગદર્શક બને છે.”² દરેક સંશોધક પોતાના સંશોધનની શરૂઆત કરતા પહેલા પોતે જે વિષયના સંદર્ભમાં સંશોધન કરે છે તે વિષય પર ભૂતકાળમાં થઈ ગયેલા સંશોધનની સમીક્ષા કરે છે. કોઈ પણ વિજ્ઞાનમાં સામાન્યતઃ જે વિષય અંગે અગાઉ કંઈક ખેડાણ થયું હોય તેમાંથી જ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.

અગ્રવાલ જણાવે છે કે, “સંદર્ભ સાહિત્યનો અભ્યાસ સંશોધનને વ્યાખ્યાચિત કરવા માટે અને તેની મર્યાદા બાંધવા માટે ખૂબ જ જરૂરી છે.”³

કોઈ પણ સંશોધક અગાઉ થયેલ સંશોધનોમાંથી પ્રાપ્ત થયેલા સિદ્ધાંતોથી કંઈક વધુ નવીન માહિતી મેળવવા માટે અથવા તેના સંશોધન વિષયના સંદર્ભ સાહિત્યનું અધ્યયન કરે છે ત્યારે તેને તે વિષયમાં થયેલા સંશોધન વિશે માહિતી મળે છે. તેનાથી સંશોધકે પસંદ કરેલી સમસ્યાના વિવિધ

પાસાનો ખ્યાલ આવે છે. સમસ્યાની સાથે કેવી મુશ્કેલીઓ સંકળાયેલી હોય તેનો પણ ખ્યાલ આવે છે. ઉપરાંત વિવિધ સંશોધકોએ અપનાવેલી યોજનાઓ અંગે માહિતી મેળવીને સંશોધક પોતાની સંશોધન યોજનાઓ અંગે સારું એવું માર્ગદર્શન મેળવી શકે છે.

મનરો જણાવે છે કે "Research may be defined as a method of studying problems whose solutions are to be derived partly or wholly from facts." જેના ઉકેલ અંશાતઃ કે પૂર્ણિત: હકીકતોમાંથી જ નિષ્પન્ન કરવાના હોય તેવા પ્રશ્નોના અભ્યાસની પદ્ધતિને જ સંશોધન કરી શકાય છે.⁴

આમ સંશોધનની દિશા નકકી કરવા માટે સંશોધકે પૂર્વેથયેલા સંશોધનો અંગેનું અદ્યયન કરવું અનિવાર્ય બની રહે છે.

‘‘સંશોધન એટલે પૂર્વજ્ઞાનમાં ખૂટી કરી પૂરવી તે’’ (Fill in the gaps in Previous Knowledge)⁵

** પુસ્તકો તથા મોનોગ્રાફસના માર્ગદર્શકો.

** સનાતકોના મહાનિબંધો માટેના માર્ગદર્શકો.

** વિશિષ્ટ શૈક્ષણિક ક્ષેત્રો તથા સવલતોના માર્ગદર્શકો

** મનોવૈજ્ઞાનિકના વિસ્તૃત માર્ગદર્શકો

2.2 પૂર્વેથયેલા સંશોધન સાહિત્યની તપાસનું મહત્વ ::-

કોઈપણ વિષયમાં સંશોધન થતા રહે છે. આ બધા સંશોધન કોઈને કોઈ સંશોધકને પોતાના સંશોધન માટે માર્ગદર્શન પુરુષ પાડતા રહે છે અને વિવિધ રીતે મદદરૂપ થાય છે. સાહિત્યની તપાસ નવા સંશોધકને સંશોધનની વિવિધ પ્રક્રિયા અને પાસાઓ અંગે પ્રત્યક્ષ શિક્ષણ આપે છે. સંશોધન શાસ્ત્રની કેવળ બૌદ્ધિક માહિતી સંશોધન ઉપાડવા માટે પૂરતી માર્ગદર્શક બનતી નથી. સંશોધકે કેવા-કેવા પગલા ભરવાના હોય છે, કેવી રીતે કેટલા તબક્કે લેવા પડે છે, ઘણી

બધી સંભવ્ય ક્ષતિઓ અને ભૂલોથી સાવદ્ય રહેવું પડે છે. તે બધાની ઉદાહરણ સહિત સમજ અને પ્રતિતિ તેને પૂર્વે અભ્યાસની સમીક્ષામાંથી સાંપડે છે.

વિવિદ પ્રકારનું સંશોધન વિષય માટે જ્ઞાન મેળવવા જે વિષય માટે પૂર્વે થયેલ ખેડાણ જ નવું જ્ઞાન મેળવવામાં ઉપયોગી થાય છે. દરેક પ્રકારના સંશોધનનું નિર્માણ શૂન્યમાંથી થતું નથી પરંતુ ભૂતકાળમાં થયેલ સંશોધનમાંથી ઉદ્ભવે છે. પૂર્વના સંશોધનનું વાંચન, મનન અને ચિંતન એટલા માટે જરૂરી છે કે પ્રસ્તુત સંશોધનની વિભાવનાઓ અંગે અન્ય વિદ્રાનોએ આપેલા જ્યાલની સ્પષ્ટતા થાય તેથી સંશોધકને પણ તેના વિશેનો જ્યાલ આવે છે.

2.3 પૂર્વે થયેલા સંશોધનને પડકાર :-

નાગેલના મત પ્રમાણે “વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પ્રચલિત માન્યતાઓને પડકારી શકાય છે અને નવા ચોકસાઈ બરેલા સત્યો રજૂ કરી શકાય છે. વૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિક સંશોધનનો મુખ્ય કાર્ય જૂની માન્યતાઓને પડકારવાનું છે અને નવી માન્યતાઓનું સર્જન કરવાનું છે.”⁶

સેલિટ્જ કહે છે કે, "The scientists must challenge the old beliefs and create new ones." “વૈજ્ઞાનિકોએ જૂની માન્યતાઓને પડકારવી જોઈએ અને નવી માન્યતાઓનું સર્જન કરવું જોઈએ.”⁶

પૂર્વે થયેલા શોરીફના અભ્યાસમાં એવું તારણ આવ્યું હતું કે વ્યક્તિના જૂથમાં હોય ત્યારે તેના નિર્ણયો પર જૂથની અસર પડે છે. આ અભ્યાસ સામે એશ નામના સંશોધકે પડકાર ફેંક્યો અને તેણે જણાવ્યું કે પ્રસ્તુત પ્રયોગમાં જૂથ કરતા પ્રયોગ વિધિની અસર હતી. શોરીફના પ્રયોગમાં જે પરિવત્યો રજૂ કરવામાં આવ્યા હતા તે સંદિગ્ધ હતા. શોરીફના પ્રયોગમાં અંદકારમાં રાખેલ પ્રકાશ બિંદુઓની ગતિશિલતા વિશે પ્રયોગપાત્રોએ નિર્ણય આપવાનો હતો.

‘એશો’ આ પરિવત્યોને સંદિગ્ય બતાવ્યા હતા અને તે કારણે વ્યક્તિને નિર્ણય કરવામાં મુશ્કેલી જણાતી હતી તેવું કહેવાનું થતું હતું. વ્યક્તિ સામે સ્પષ્ટ પરિવત્યો રજૂ કરવામાં આવે તો તે જૂથને અનુરૂપ નિર્ણય આપે નહીં પરંતુ વ્યક્તિગત નિર્ણય આપી શકે છે.

આમ શોરીફના આ સંશોધન સામે એશો પડકાર ફેંકયો હતો કે શોરીફના સંશોધનમાં પરિવત્યો સ્પષ્ટ ન હતા. વસ્તુલક્ષી સંકેત દ્વારા સંશોધન કરવામાં આવે તો પ્રયોગપાત્રો વ્યક્તિગત નિર્ણય આપી શકે.

‘એશો’ વસ્તુલક્ષી સંકેત આપીને ફલિત કર્યું કે 0.66 નિર્ણયો પર જૂથની અસર ન હતી, જચારે બાકીના 1.5 ના નિર્ણયો પર જૂથની અસર ચાલુ રહી હતી.⁷

2.4 પૂર્વે થયેલા સંશોધનમાં કાર્ય કરતી પ્રક્રિયાની વધુ સ્પષ્ટતા :-

પૂર્વેના સંશોધનની સમીક્ષા કરવાથી પરિણામોને પડકાર ફેંકવા કરતા તે જે પ્રક્રિયાથી પરિણામો મેળવવામાં આવ્યા છે તેની પ્રક્રિયા સ્પષ્ટ હોતી નથી. તે પ્રક્રિયાની વધુ સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે. સંશોધનનાં દરેક પરિણામો પર વિવિધ ઘટકોની એકબીજા સાથે જોડાયેલ હોય છે. આથી નવું સંશોધન કરીને પરિણામ પ્રાપ્ત કરવાથી કચો ઘટક પરિણામ માટે જવાબદાર છે તે શોધી શકાય છે.

2.5 પૂર્વે થયેલા સંશોધનનું પુનરાવર્તન કરી તેનું સમર્થન મેળવવું :-

પૂર્વના સંશોધન પદ્ધતિ અને નિર્દર્શનનું કદમાં ફેરફાર કરી અથવા તે જ રાખીને સામાજિક રીતે જે સમસ્યા વધુ મહત્વ ધરાવતી હોય છે, તેનું પુનરાવર્તન કરી તેના પર ફરી સંશોધન કરવામાં આવે છે. આમ તે પૂર્વેનું સંશોધન સાહિત્ય પછીના સંશોધનમાં ઉપયોગી બને છે. તેથી તે વધારે ચોકસાઈથી સંશોધન કરી શકે છે.

એક ક્ષેત્રમાં જે પરિવર્ત્ય સંબંધો જોવા મળ્યા હોય તે સંબંધોની તપાસ કરતું સંશોધન ::-

પૂર્વે થયેલા સંશોધનમાં કોઈ પણ સુધારા કે તેને સમર્થન કરવાનું હોતું નથી. પણ સંશોધનના બંધારણામાં કે તેની વિગતોમાં પરિવર્તન લાવવામાં આવે તો તેની શી અસર થાય છે તે જાળવાનો હેતુ હોય છે. પરિવર્ત્ય સંબંધોની ચકાસણી કરવા માટે નવું સંશોધન કરવામાં આવે છે.

અનઅપેક્ષિત પરિણામોના કારણો જાળવા માટે થયેલા સંશોધનો ::-

સંશોધનમાં રચેલ ઉત્કૃષ્ણના માટે કે સમસ્યા માટે જે પરિણામોની ધારણા કરેલી હોય તેમાં નિષ્ફળતા મળે ત્યારે તેના પરિણામોને લીધે જ નવા સંશોધનને પ્રેરણા મળે છે.

હાલો અને તેના સાથી દારોએ પ્રેમ વંચિતતાની વાનરબાળ પર શી અસર થાય છે તે જાળવા માટે પ્રાચોગિક સંશોધન કર્યું હતું. પ્રસ્તુત સંશોધનની ધારણા એવી હતી કે વાનર બાળકને માતાના પ્રેમથી વંચિત રાખવામાં આવે તો એ સૌભ્ય મનોવિકૃતિ નો ભોગ બનશે. બચ્ચાઓને બાલ્યકાળમાં પ્રેમવિહોણી કૃત્રિમતા સાથે ઉછેરવામાં આવ્યા હતા. છતા પણ હાલોની ધારણા પ્રમાણે તેઓ સૌભ્ય મનોવિકૃતિનો ભોગ બન્યા ન હતા. આ પરિણામ હાલોની ધારણા કરતા તદ્દન જુદું હતું. બીજા સંશોધનમાં વાનરબાળને જન્મથી જ અન્ય વાનરોના સંપર્કથી વિમુખ રાખવામાં આવ્યા હતા. આ સંશોધનની અપેક્ષા એ હતી કે તેઓમાં વિકૃત વર્તન વિકાસ પામશે. પરંતુ આ બચ્ચાઓ જ્યારે પુખ્ત બન્યા ત્યારે સૌભ્ય મનોવિકૃતિના લક્ષણ જોવા મળ્યા ન હતા.

આમ પ્રસ્તુત બન્ને સંશોધનોમાં તેમની ધારણા કરતા પરિણામ તદ્દન અલગ આવ્યું હતું. આ નિષ્ફળતા નવા સંશોધનની પ્રેરણા પૂરી પાડે છે અને આ અંગે નવા સંશોધનો પણ થયા છે.

એક સમસ્યામાં વિકાસ પામેલી સંશોધનની પ્રયુક્તિ બીજી જુદી સમસ્યામાં ઉપયોગી થઈ શકે ::-

દરેક પૂર્વે થયેલા સંશોધનોમાં વિશિષ્ટ પ્રયુક્તિનો ઉપયોગ થયો હોય છે. આ પ્રયુક્તિને બીજા સંશોધનમાં ઉપયોગમાં લઈ શકાય છે. ‘અશ’ નામના મનોવૈજ્ઞાનિકે જૂથના દબાણની નિર્ણય પર શી અસર થાય છે તેનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધનની પ્રયુક્તિ દ્યાનમાં લઈને અસંખ્ય અભ્યાસો થયા હતા.

આમ સંશોધન કાર્ય માટે આદર્શ પરિસ્થિતિ તો એ છે કે સંશોધકે પોતાના કાર્યના આરંભ પહેલા સંશોધન સાહિત્યની સમીક્ષા કરી લેવી જોઈએ. તેથી જ પોતાના સંશોધન માટે મહત્વનો રસ્તો બની રહે છે.

આમ સંશોધનકર્તા સમસ્યાનો ગહન અભ્યાસ કરવા માટે સંબંધિત સાહિત્યની સમીક્ષા કરે છે. સંબંધિત સાહિત્યની સમીક્ષામાં તે સમસ્યા સાથે સંબંધિત સંશોધન પુસ્તકો, વિભિન્ન પ્રકારના સંશોધન જર્નલ વગેરેનું અદ્યયન કરીને પોતાની સંશોધન સમસ્યાને લગતી જાણકારી પ્રાપ્ત કરે છે. સંબંધિત સાહિત્યની સમીક્ષા અનેક સ્ત્રોત છે, જેમાંથી સંશોધન સમસ્યા વિશે માહિતી કે જાણકારી પ્રાપ્ત થાય છે.

- (1) સંશોધન પુસ્તકો
- (2) સંશોધન જર્નલ
- (3) ઇન્સાઇકલોપીડિયા ઓફ સાઇકોલોજી
- (4) સાઇકોલોજિકલ એબસ્ટ્રેક્ટ
- (5) સાઇકોલોજિકલ રિલ્યુ

વગેરે અમુક એવા સ્ત્રોત છે જેમાંથી મનોવૈજ્ઞાનિક સંશોધનકર્તા પોતાની સંશોધન સમસ્યાઓ વિશે માહિતી એકત્ર કરીને ગહન અભ્યાસ કરે છે. સંબંધિત

સાહિત્યની સમીક્ષાની અંતર્ગત સંશોધનકર્તા એ જાળવાનો પ્રયત્ન કરે છે કે કચા-કચા સંશોધકોએ કચારે, કેવી રીતે અને કઈ બાબતનો અભ્યાસ કર્યો છે. તેને કેવા પરિણામો મળ્યા હતા અને તેના સંશોધનમાં કઈ ખામીઓ રહી ગઈ છે તે જાળવાનો નભું પ્રયાસ કરે છે.

પ્રસ્તુત સંશોધનમાં ત્રણ અવલંબી પરિવર્ત્યોનું સૈદ્ધાંતિક મહિને નીચે પ્રમાણે દર્શાવવા નભું પ્રયાસ કરેલો છે.

આ ત્રણ પરિવર્ત્યો :

(A) માનસિક સ્વાસ્થ્ય

(B) સમાચોજન

(C) જીવન સંતોષ

આ ત્રણોચમાં પ્રથમ અવલંબી પરિવર્ત્યની રજૂઆત નીચે પ્રમાણે છે :

2.6 માનસિક સ્વાસ્થ્યનું સૈદ્ધાંતિક મહિને :-

ઇશ્વરે માનવ શરીર એ કુદરતનું એક વિશિષ્ટ સર્જન છે. માનવ શરીરમાં વિવિધ આવેગો, વિચાર શક્તિ જેવી અકલ્પનીય ખાસિયતો કુદરતે તેને બદ્ધેલી છે. જેમ આ ઇશ્વરે માનવ સર્જન ખૂબ જ લાડથી કર્યું છે તેમ જો માનવ આ કુદરતનાં સમગ્ર સર્જન સાથે એક પ્રકારે પ્યાર રાખે તેની માવજત કરે તો ખૂબજ આનંદમય જીવન બની રહે છે. આજનો માણસ પોતાના વ્યવહારમાં કુદરતથી દૂર ને દૂર જતો રહે છે. સમગ્ર સૃષ્ટિની આ સુંદર રચનાઓ જેમા વૃક્ષ, ઝરણા, પર્વતો, સમુદ્ર, આકાશ, ચંદ્ર, તારા વગેરે રચનાઓને માણવાને બદલે તેનાથી દૂર ને દૂર જતો રહ્યો છે. આજના ચુગમાં માનવી મોહમાચા, વૈભવી જિંદગી જીવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો છે ને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર કાર્ય કરતો રહ્યો છે અને સતત ચિંતા, સંઘર્ષ અને હતાશ બની જીવન જીવતો રહ્યો છે.

ઇશ્વરે માનવને મન અને શરીર આપ્યા છે. શરીરને સારુ રાખવા માટે માનવ સારો ખોરાક લે છે. તે સારુ પાણી પીએ છે અને તંદુરસ્તી જાળવવા કસરતો કરે છે. તે જ રીતે માનવીએ મનને સારુ રાખવા માટે માનસિક કસરત કરવી જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારની ખામી આવે કે તરત જ માનવી ડોક્ટર પાસે જાય છે. પરંતુ જો મનમાં કોઈ ખામી દેખાય તો વ્યક્તિ તેની સંપૂર્ણ નોંધ લેતી નથી તેથી માનસિક અસ્વસ્થતા અનુભવે છે. તેથી માનવીએ શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. આજે આ ક્ષેત્રમાં પણ મનોવિજ્ઞાન જાગૃત થયું છે અને આ તરફ દરેકનું ધ્યાન કેન્દ્રિત થાય તે માટે વિવિધ પ્રકારના અભ્યાસો પણ કરે છે અને દરેક ક્ષેત્રમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવાના પગલા ભરે છે.

બર્નહાર્ટ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપતા જણાવે છે કે “માનસિક સ્વાસ્થ્ય એટલે તમામ આવેગોને આત્મગૌરવના સ્થિરભાવમાં સંકલિત કરવા.”⁸

આજે સમાજના દરેક માનવીની મુખ્ય મુશ્કેલીઓમાં અસ્વસ્થતા, વિષાદ, ઉતાવળ, અજંપો, અશાંતિ અને અસંતોષના મોજાઓ તોફાન મચાવી રહ્યા છે. આજે વિશ્વના દરેક ભાગમાં માનસિક વિકૃતિઓના પ્રમાણમાં વધારો થતો રહ્યો છે. વિશ્વના વિવિધ ક્ષેત્રોમાં થતી ઉથલપાથલ કે આર્થિક મંદીઓ સામાજિક અસ્થિરતા જોતા આપણાને થાય છે કે માનવ જાતને આજે સૌથી વધારે જરૂર માનસિક સ્વાસ્થ્યની જ છે.

માનસિક સ્વાસ્થ્યને કારણે વ્યક્તિ પોતાની સાથે, પોતાના કુદુરુંબ સાથે અને સમાજ સાથે સુભેળ સાધી શકે છે. આજે દરેક માનવ માનસિક સ્વાસ્થ્ય મેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત પિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન છે.

આજે માનવીના જીવનમાં એક કરતા વધારે દબાણાચુકત પરિસ્થિતિઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને કારણો માનસિક સ્વાસ્થ્ય, હતાશા, સંઘર્ષ, વિકૃત ચિંતા અને મનોભારથી અસ્વસ્થ બને છે. જેમાં એકથી વધુ દબાણ લાવનારી પરિસ્થિતિઓ અસ્વસ્થતા તરફ લઈ જાય છે. માનસિક સ્વાસ્થ્યનો ઇતિહાસ દર્શાવે છે કે મનોરોગીઓ વિશે શારીરિક રોગીઓ જેટલું ધ્યાન અપાતું નથી. મનોરોગીઓ પાપ કે શાપથી પિડાતી વ્યક્તિ નથી પરંતુ માનવજાતનું એક અભિજ્ઞ અંગ છે. મનોવિજ્ઞાન ની વિવિધ શાખાઓમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. મનોરોગીઓનો અભ્યાસ કરી તેની સારવાર કરવામાં આવે છે. આથી માનસિક સ્વાસ્થ્ય વિશે ઇતિહાસની જેમ આ ક્ષેત્રમાં થયેલા અભ્યાસોમાંથી કેટલાક અભ્યાસો આધાર માટે અહિં રજૂ કરવા તત્પર બનેલ છે. એટલું જ નહીં પ્રસ્તુત સંશોધન સાથે આ પૂર્વીય અભ્યાસો સંબંધિત હોય તેની તુલના પ્રકરણ-4 ની અનુરૂપ શૂન્ય ઉત્કળ્પનાઓની આંકડાશાસ્ત્રીય પદ્ધતિને અનુરૂપ જે પરિણામો તારયેલા છે તેની સાથે કરી છે.

2.7 માનસિક સ્વાસ્થ્યના અંગેના પૂર્વીય અભ્યાસો ::-

(1) → જગદીશ અને રાકેશપ્રતાપસિંહ (1997)

“વ્યવસાયિક મનોભાર અને તેની અસરોના સંબંધમાં પરિવર્તન ચલ તરીકે હોટ્ટો”

તારણ : કાર્યસંતોષ અને વ્યવસાયિક મનોભાર વચ્ચેના સંબંધને કારણે પરિવર્તન પામે છે.

વ્યવસાયિક મનોભાર અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ હોટ્ટાને કારણે પરિવર્તન થતો નથી.

(2) → B.M. Vaghasiya (1988)

"An Impact of certain Demographic variables of Textile Employess on Mental health and Life Satisfaction."

તારણા : વિભક્ત કુદુંબમાં રહેતા કર્મચારી કરતા સંયુક્ત કુદુંબમાં રહેતા કર્મચારીઓમા જીવનસંતોષ ઉંચો જોવા મળે છે.

અનુભવ અને કુદુંબના પ્રકારમાં માનસિક સ્વાસ્થ્ય વરચે સાર્થક તફાવત નથી.

જીવનસંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વરચે સાર્થક સંબંધ જોવા મળે છે.

(3) → મિશ્રા (1997)

“મનોભાર અને માનસિક સ્વાસ્થ્ય અંગેનો અભ્યાસ”

તારણા : સુપરવાઈજરમાં હેલ્પનેશની અનુભૂતિ, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, કાર્યદારી વધારે પ્રમાણમાં અને સંગઠન પ્રતિબદ્ધતા ઓછા પ્રમાણમાં જોવા મળી હતી.

ઉત્પાદન કરનારા સુપરવાઈજરોમાં હેલ્પનેશની અનુભૂતિ અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સૌથી વધુ પ્રમાણમાં તેમજ સંગઠન પ્રતિબદ્ધતા સૌથી ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. સર્વિસ ચુનિટોની અધિકારીઓમાં હેલ્પનેશ તથા માનસિક સ્વાસ્થ્યની સમસ્યા મદ્દામ જોવા મળી હતી.

(4) → સિંધ અને સિંધ (1995)

“કર્મચારીઓનો માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષ અંગેનો અભ્યાસ.”

તારણા : કારીગરો કરતા મેનેજરોનું માનસિક સ્વાસ્થ્ય ઘણું સારુ જોવા મળે છે. કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને જીવનસંતોષ વરચે સાર્થક સહસંબંધ જોવા મળે છે.

(5) → રાણે (1993)

“‘ઓદ્ઘોગિક કર્મચારીઓનાં માનસિક સ્વાસ્થ્ય, કાર્ય સામેલગીરી અને સંસ્થાકીય વાતાવરણનો અભ્યાસ કરવો.’’

તારણા : માનસિક સ્વાસ્થ્યનો આવક, કાર્યસામેલગીરી અને સંસ્થાકીય વાતાવરણ સાથે સાર્થક સહસંબંધ જોવા મળે છે.

(6) → ગાંધ્યજોષી (1998)

“‘ઓદ્ઘોગિક કામદારોના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ.’’

તારણા : ઉંમર, કાર્ય અનુભવ, માસિક આવક અને કુટુંબની આવક અને કુટુંબની સંખ્યાની કોઈ આર્થિક તફાવત માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળતો નથી.

(7) → એ. એમ. વસાણી (1998)

“‘જેતપુર શહેરના સાડી ઉધોગમાં કામ કરતા કર્મચારીના સમાયોજનની માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસંતોષનો અભ્યાસ.’’

તારણા : કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજ વર્ચે 0.01 કક્ષાએ નિષેધક સહસંબંધ જોવા મળ્યો હતો. તેમજ કર્મચારીની ઉંમર, અને નોકરીની બદલી બન્નેમાં તફાવતની સાર્થકતા જોવા મળે છે.

(8) → સાર્થર અને ગુન્ડરસન (1965) તથા મોર્ગોલીસ (1979)

“‘મનોભાર ઉત્પન્ન કરનારા અન્ય કેટલાક પરિબળો જેમ કે પ્રમોશનની તકોનો અભાવ, કર્મચારીઓમાં ભાગીદારીનો અભાવ વગેરે માનસિક સ્વાસ્થ્ય ને જોખમ કરતા પરિબળો છે.’’

(9) → કેસન (1978)

“નબળુ માનસિક સ્વાસ્થ્ય અસુખ કાર્ય પરિસ્થિતિઓ, ઝડપથી કાર્ય કરવાનું દબાણા, સલામતીનો અભાવ, અતિ શારીરિક કામ અને વધુ પડતા કામના કલાકો સાથે સંકળાયેલું છે.”

(10) → જગદીશ અને શ્રીવાસ્તવ (1989)

તેમના અભ્યાસમાં નોંધે છે કે, “કાર્યમાંથી ઉદ્ભવતો મનોભાર ખાસ કરીને ભૂમિકા સંઘર્ષ, ભૂમિકા અસ્પષ્ટતા અને સહકાર્યકારીઓનાં નબળા સંબંધો વિગેરે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.”

(11) → પ્રા. આર. કે. જારસાહિયા

“જૂનાગઢ જિલ્લાનાં એસ.ટી. ડ્રાઇવરનાં માનસિક સ્વાસ્થ્યનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.”

તારણા : એસ.ટી. ડ્રાઇવરો પર અભ્યાસના ધોરણો, ઉંમર અને રહેઠાણાની માનસિક સ્વાસ્થ્ય પર અસર પડતી નથી.

(12) → પ્રા. રસિકભાઈ જેઠવા

“બેનકમાં નોકરી કરતા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અંગેનો અભ્યાસ.”

તારણા : બેનકમાં નોકરી કરતા પુરુષ અને સ્ત્રી કર્મચારીઓના જાતિના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની બાબતમાં તફાવત જોવા મળતો નથી.

(13) → પ્રો. મનીષ પી. શુક્લા

“ઓધોગિક કર્મચારીઓમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા.”

તારણ : ઓદ્ઘોગિક કર્મચારીઓના કાર્યાનુભવ અને મા. સ્વાસ્થ્ય વચ્ચે કોઈ સાર્થક સંબંધ જોવા મળેલ નથી.

ઓદ્ઘોગિક કર્મચારીઓની કુલ માસિક આવક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક સંબંધ જોવા મળતો નથી.

(14) શીર્ષક : ગુજરાત અંબુજ સિમેન્ટ લિમિટેડ કંપની-કોડીનારના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય, કાર્ય સામેલગીરી, અને કાર્ય સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : એ. એમ. યોચા

પ્રકાશન : 2003, Ph. D. થીસીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નિદર્શા : 450 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. ડી.જે. ભંડ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t , r , F કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને માનસિક તાણાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

(2) જયારે ઉમર, નોકરીનો અનુભવ, માસિક આવક, કૌદુર્યબિક દરજાને અને ચિંતાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળેલ નથી.

(15) શીર્ષક : ગુજરાત ભારે રસાયણ લિમિટેડ કંપની-વેરાવળના કર્મચારીઓના સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય સંતોષનો અભ્યાસ.

સંશોધક : શાંતા સોલંકી

પ્રકાશન : 2002, Ph. D. થીસીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નિદર્શ : 660 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. કી.જે. ભણ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t, r, F કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓનો લગ્ન દરજજો અને નોકરીમાં કાયમી રહેવાની ઈચ્છાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળેલ છે.

(2) જ્યારે રહેઠાણનો પ્રકાર, કુટુંબની સભ્ય સંખ્યા, કુરસદના સમયની સંતોષકારકતાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળેલ નથી.

(16) શીર્ષક : જૂનાગઢ શહેરના બેન્ક કર્મચારીઓના સમાચોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : એ. એમ. નંદાએઠીયા

પ્રકાશન : 2006, Ph. D. થીસીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નિદર્શ : 240 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. કી.જે. ભણ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t, r, F કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓના લગ્ન દરજાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળેલ છે.

(2) જ્યારે ઉમર, શૈક્ષણિક લાયકાત, નોકરીનો અનુભવ, રહેઠાણા, કુટુંબનો પ્રકાર, નોકરીમાં અનુભવાતુ માનસિક તાણાનું પ્રમાણ અને ચિંતાની બાબતમાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળેલ નથી.

(17) શીર્ષક : પરીષિત અને અપરીષિત કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય સંતોષનો તુલનાત્મક અભ્યાસ.

સંશોધક : સમુહા પરમાર

પ્રકાશન : 2006, એબરસ્ટ્રેક્ટ, નેશનલ કોન્ફરન્સ, ચુનિ. આણંદ

નિદર્શ : 160 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. ડી.જે. બડુ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓના લગ્ન દરજાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત પડતો નથી.

(18) શીર્ષક : બેનકના કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય, સંસ્થાકીય સ્વાસ્થ્ય અને વ્યવસાય સામેલગીરીનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.

સંશોધક : ગોહેલ મનીધા વી.

પ્રકાશન : M.A. ડેઝરટેશન સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી, રાજકોટ.

નિદર્શ : 240 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. ડી.જે. બહુ અને કુ. શીલપા રચિત.

માહિતી વિશ્લેષણ : F, t, r કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓની જાતિ, નોકરીનો અનુભવ, કુદુંબના પ્રકાર મુજબ તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

(2) જચારે ઉભર, જાતિ અને નોકરીના પ્રકારની તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર જોવા મળતી નથી.

(19) શીર્ષક : બેનકમાં નોકરી કરતા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અંગેનો અભ્યાસ.

સંશોધક : રસિક જેઠવા

પ્રકાશન : 2007, એબરસ્ટ્રેક્ટ, સ્ટેટ લેવલ કોન્ફરન્સ, સૌરાષ્ટ્ર મનોવિજ્ઞાન મંડળ.

નિદર્શ : 180 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. ડી.જે. બહુ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) 10 વર્ષથી વધુ અનુભવ ધરાવનારા કર્મચારીઓની સરખામણીએ 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા શિક્ષકોનું માનસિક સ્વાસ્થ્ય સારુ જોવા મળેલ છે.

(2) જાતિની બાબતમાં કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સમાન જોવા મળેલ છે.

(20) શીર્ષક : ટેલિફોન એક્સચેન્જમાં કામ કરતા કર્મચારીઓના મનોભાર અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ.

સંશોધક : રચના શ્રીવાસ્તવ અને કે.એસ. સાકેત, અયોધ્યા.

સારાંશ : પ્રસ્તુત અભ્યાસમાં 50 પુરુષ અને 50 સ્ત્રી કર્મચારીઓના મનોભાર સંકેત શોધની અને માનસિક સ્વાસ્થ્ય સંશોધનિકા આપવામાં આવેલ હતી, તેના પરિણામો બતાવે છે કે,

- તારણો :
- (1) શારીરિક મનોભારના સંકેતો તેમજ હળવી મનોવિકારી તકલીફો બન્ને જાતિમાં સરખી જોવા મળે છે.
 - (2) શારીરિક મનોભારના સંકેતોના અભાવ અને સામાન્ય માનસિક સ્વાસ્થ્યના સંકેતોનો અભાવ બન્ને પ્રકારના ઉત્તરદાતામાં જોવા મળે છે.
 - (3) તેમજ શારીરિક મનોભારી સંકેતો અને હળવી મનોવિકારી તકલીફો વરચેનો ગણાના પાત્ર સંબંધ દર્શાવે છે કે કાર્ય સ્થળની શારીરિક તાણા અનેક જાતની માનસિક તકલીફો સર્જે છે.

(21) શીર્ષક : પરિણીત અને અપરિણીત કારીગરોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને કાર્ય સંતોષનો તુલનાત્મક અભ્યાસ.

સંશોધક : સુમહા પરમાર અને શ્રી સાકૃતીયા, બોટાદ

પ્રકાશન : 2006, Abstract National Conference, S.P. University, Vallabh Vidhyanagar.

નિદર્શ : 160 (80 પરિણીત અને 80 અપરિણીત)

સાધનો : માનસિક સ્વાસ્થ્ય તુલા - ડૉ. બેફિલરોથ રચિત.

સમાયોજન તુલા : ડૉ. પ્રમોદકુમાર રચિત.

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ છતું.

તારણો : (1) પરિણીત અને અપરિણીતો માનસિક સ્વાસ્થ્યની બાબત માં તફાવત ધરાવે છે, તેમાં પરિણીતોની સરખામણીએ અપરિણીતોનો માનસિક સ્વાસ્થ્યાંક ઉંચો છે.

આમ, માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા વિવિધ વિભિન્ન ચલોની સમજૂતિ આપતા વિવિધ અભ્યાસો થયા છે. પરંતુ હિરા ઉધોગમાં કાર્ય કરતા રણ કલાકારોના માનસિક સ્વાસ્થ્યના અભ્યાસ ઓછા થયા છે. માટે પ્રસ્તુત સંશોધનમાં હિરા ઉધોગમાં કાર્ય કરતા રણ કલાકારોના માનસિક સ્વાસ્થ્ય માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

હવે બીજા અવલંબી પરિવર્તનનું મહાત્વ અને સમાયોજનના પૂર્વીય અભ્યાસો નીચે પ્રમાણે છે :

2.8 સમાયોજનનું સૈદ્ધાંતિક મહાત્વ :-

સમાયોજન એ માનવ જીવનને સુખમય બનાવતી એક કલા છે. કારણ કે માણસ સમાજમાં રહે છે અને વારંવાર દરેક ક્ષણે ક્ષણે પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે. અમુક પરિસ્થિતિમાં માણસ અનુકૂળ હોય તો બીજુ પરિસ્થિતિમાં તે અનુકૂળ ન પણ હોય. આમ દરેક પરિસ્થિતિ પ્રત્યે સમાધાનકારી વલણ અપનાવવું તે સમાયોજન છે.”

આજનો માનવી પોતાની જતને ખૂબ જ આગળને આગળ વધારવા માંગતો માનવી ચિંતા અને તંગદીલીમાં ચોતરફથી ઘેરાઈ ગયો છે. જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતો માણસ સમાચોજનના જ્ઞાનને અભાવે હતાશા, અને સંઘર્ષ અનુભવી રહ્યો છે. એરિક ફોમ જણાવે છે કે – આધુનિક માનવી પોતાની જત સાથે કેમ વર્તવું અને અર્થપૂર્ણ રીતે સમય કેમ પસાર કરવો તે જાણતો નથી. જીવનના વિવિધ ક્ષેત્રોમાં માનવી કચારેક સફળ જતો નથી અને આ તનાવની અસરમાં જીવન જીવવા માંડે છે. ત્યારે આ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં “સમાચોજિત વ્યક્તિત્વ” સિવાય કોઈ ઉગારી શકતું નથી. ઈસુ ખ્રિસ્તે બાઈબલમાં યોગ્ય જ કહ્યું છે કે માનવી માત્ર રોટીથી જીવતો નથી તેને પોતાના કાર્યનો સંતોષ પણ જોઈએ. જે સમાચોજનમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસથી જ મળી શકે.

“લેહનર અને કચુબ” સમાચોજનની વ્યાખ્યા આપતા જણાવે છે કે, “સમાચોજન આંતરકિયાની એક પ્રકિયા છે કે એ સતત પ્રકિયા હોવાથી કદી પૂર્ણ થતી નથી. એ પ્રકિયામાં કાર્ય–કારણ સંબંધો જોઈ શકાય છે.”

આમ સમાચોજન એ સ્થિતિ નથી પણ પ્રકિયા છે. સમાચોજન એ જીવનમાં વિવિધ પરિસ્થિતિમાં શિખવા અને મેળવવાની બાબત છે. સમાચોજનનો હેતુ તંગ સ્થિતિમાંથી રાહત મેળવવી અથવા તો સંતોષપ્રદ સ્થિતિ પ્રાપ્ત કરવી તેવો છે. આમ સામાન્ય રીતે સમાચોજનની પ્રકિયા સર્જનાત્મક સુખહેતુક અને દ્યેયગામી છે. આપણો જો સાચા અર્થમાં સુસમાચોજિત બનતું હોય અને જીવન સુખમય હોય તો આપણા પ્રશ્નોનાં મુકાબલા માટે સોથી અસરકારક, સુયોગ્ય અને સમાજમાન્ય પદ્ધતિઓ અપનાવવી જોઈએ.

સમાચોજનનો અર્થ એવો નથી થતો કે એમાં કોઈ કાયમના માટે સુખી જ હોય. સમાચોજિત વ્યક્તિને પણ અકસ્માતો, સમસ્યાઓ નડતર રૂપ થતી હોય છે. કોઈ બીમારી અચાનક આવે, કુદરતી આપત્તિઓ આવે, પોતાની આશાઓ,

મહિત્વ-કાંક્ષાઓ બીજા સાથે ટકરાય છે તેના કારણો નિરાશા ઉત્પન્ન થાય છે. પરંતુ આ બાબતે સોરેન્સ અને મામે સાચુ જ કહ્યું છે કે “જો સમાયોજન સતત સુખની ખાતરી ન આપી શકતું હોય તો પણ સુખ મેળવવા માટેનો એ જ રાજમાર્ગ છે, ઉત્તમ સાધન છે.”

વ્યવસાય એ એક મહિત્વની જવાબદારી છે. વ્યવસાય દ્વારા તેને સમાજ અને વિશ્વની સેવા બજાવવાની હોય છે. કોઈપણ કાર્યમાં સંતોષ પોતાના કાર્ય સાથે સુસમાયોજનકારી વલણાને આધારે મળતો હોય છે. આજના આ ચુગમાં વ્યવસાયોમાં વિવિધ પ્રશ્નો ઉત્પન્ન થતા રહે છે અને તેના સમાધાનમાં જો કોઈ ઘટક હોય તો તે સમાયોજન જ છે. વ્યાવસાયિક સમાયોજન એ માનવીને પોતાના કાર્ય કરવાનો ઉત્સાહ વધારે છે અને આ સંસ્થાકિય જુસ્ટસો વ્યકિતને વ્યાવસાયિક સમાયોજન પ્રાપ્ત કરવામાં ખૂબ જ સહાયરૂપ બને છે.

2.9 સમાયોજન અંગે ના પૂર્વીય અભ્યાસો :-

સમાયોજન અંગે પૂર્વે થયેલા અભ્યાસોની સમીક્ષા નીચે મુજબ કરવામાં આવી છે. જેમાં પૂર્વે થયેલા અભ્યાસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(1) → અનંત એમ. વસાણીનો અભ્યાસ (1998)

“જેતપુર શહેરનાં સાડી ઉધોગમાં કામ કરતા કર્મચારીનાં સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસંતોષનો અભ્યાસ.”

જુદા-જુદા કારખાનામાં કામ કરતા કુલ 660 કર્મચારીનાં સમાયોજન અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે 0.1 કક્ષાએ સાર્થક સહસંબંધ જોવા મળ્યો તેમજ ઉમર, નોકરીની ફેરબદલી અને હતાશામાં પણ તફાવતની સાર્થકતા જોવા મળી.

(2) → શ્રીવાસ્તવ એસ. કે. બાથલા અંજલિ

‘‘ઓધોગિક કામદારોમાં સંસ્થાકીય માહોલ અને કાર્યમેળ વરચે
સહ-સંબંધાત્મક અભ્યાસ.’’

(3) → ત્રિવેદી પાયલ જે.

‘‘રેલ્વે કર્મચારીઓ (સ્ત્રી-પુરુષ) નો સમાયોજન અંગેનો મનો-
વૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.’’

તારણા : રેલ્વે કર્મચારીઓમાં પુરુષો કરતા સ્ત્રીઓમાં સમાયોજન વધારે
જોવા મળે છે.

રેલ્વે કર્મચારીઓમાં પરિણિત વ્યક્તિત્વો કરતા અપરિણિત
વ્યક્તિત્વો માં સમાયોજન વધારે જોવા મળે છે.

(4) → ડૉ. રતનબેન પી. સોલંકી

‘‘સ્વતંત્ર પરિવત્યોની પોરટ ઓફિસના કર્મચારીઓના
સમાયોજન ઉપર અસર.

તારણા : પોરટ ઓફિસના કર્મચારીના સમાયોજન ઉપર જાતિની અસર
જોવા મળે છે.

(5) શીર્ષક : ગુજરાત ભારે રસાયલ લિમિટેડ કંપની-વેરાવળના
કર્મચારીઓના સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય અને
કાર્ય સંતોષનો અભ્યાસ.

સંશોધક : શાંતા સોલંકી

પ્રકાશન : 2002, Ph. D. થીસીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નિદર્શ : 660 કર્મચારીઓ

સાધનો : માનસિક સ્વાસ્થ્ય માપન તુલા ડૉ. કી.જે. ભંડ અને કુ. ગીતા ગીડા રચિત.

માહિતી વિશ્લેષણ : t, r, F કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓનો લગ્ન દરજજો અને નોકરીમાં કાચમી રહેવાની ઈરછાના સંદર્ભમાં તેના સમાયોજનમાં તફાવત જોવા મળેલ છે.

(2) જ્યારે રહેઠાણનો પ્રકાર, કુટુંબની સભ્ય સંખ્યા, કુરસદના સમયની સંતોષકારકતાના સંદર્ભમાં તેના સમાયોજનમાં તફાવત જોવા મળેલ નથી.

(6) શીર્ષક : જૂનાગઢ શહેરના બેન્ક કર્મચારીઓના સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાની મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : એ. એમ. નંદાએણીયા

પ્રકાશન : 2006, Ph. D. થીસીસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

નિદર્શ : 240 કર્મચારીઓ

સાધનો : સમાયોજન માપન તુલા ડૉ. પ્રમોદકુમાર રચિત.

માહિતી વિશ્લેષણ : t, r, F કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) અહીં કર્મચારીઓના લગ્ન દરજજાના સંદર્ભમાં તેના સમાયોજનમાં તફાવત જોવા મળેલ છે.

(2) જ્યારે ઉમર, શૈક્ષણિક લાયકાત, નોકરીનો અનુભવ, રહેઠાણ, કુટુંબનો પ્રકાર, નોકરીમાં અનુભવાતુ માનસિક

તાણનું પ્રમાણ અને ચિંતાની બાબતમાં કર્મચારીઓના સમાયોજનમાં તફાવત જોવા મળેલ નથી.

(7) શીર્ષક : પરિણીત અને અપરિણીત કારીગરોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને કાર્ય સંતોષનો તુલનાત્મક અભ્યાસ.

સંશોધક : સુમહા પરમાર અને શ્રી સાકરીયા, બોટાદ

પ્રકાશન : 2006, Abstract National Conference, S.P. University, Vallabh Vidhyanagar.

નિદર્શ : 160 (80 પરિણીત અને 80 અપરિણીત)

સાધનો : સમાયોજન માપન તુલા ડૉ. પ્રમોદકુમાર રચિત.

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) પરિણીત અને અપરિણીતો સમાયોજનની બાબત માં તફાવત ધરાવે છે, તેમાં પરિણીતોની સરખામળીએ અપરિણીતોનો સમાયોજનનો આંક ઊંચો છે.

(8) જેસુર જ્યાતિ બી.

શીર્ષક : “રાજકોટ શહેરના સરકારી નોકરી કરતા કર્મચારીઓ ના આવેગિક સમાયોજન અંગેનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.”

તારણો : (1) રાજકોટ શહેરના સરકારી નોકરી કરતા કર્મચારીઓના આવેગિક સમાયોજન પર જાતિની અસર પડતી નથી.

- (2) રાજકોટ શહેરના સરકારી કરતા કર્મચારીઓના આવેગિક સમાયોજન પર શૈક્ષણિક લાયકાતની અસર પડતી નથી.
- (3) રાજકોટ શહેરના સરકારી નોકરી કરતા કર્મચારીઓના આવેગિક સમાયોજન પર અનુભવની અસર પડતી નથી.

(9) પ્રા. ભરત કે. ગામીત

શીર્ષક : “ધ્યાંગદા કેમીકલ્સના કર્મચારીઓમાં આરોગ્ય અને વ્યાપસારિક સમાયોજન અંગેનો તુલનાત્મક અભ્યાસ.”

- તારણો :**
- (1) આરોગ્યના સમાયોજનમાં કોઈ તફાવત જોવા મળતો નથી.
 - (2) વ્યાપસારિક સમાયોજન પણ સમાન જોવા મળે છે.

(10) સરોજ એસ. સેજારા

શીર્ષક : “ગૃહિણી અને વ્યવસાચી મહિલાઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ.”

- તારણો :**
- (1) મહિલાઓનો દરજજો, ઉંમર, કુટુંબનો પ્રકાર અને તેઓના સમાયોજન વચ્ચે સાર્થક તફાવત નથી.
 - (2) મહિલાઓનો કુટુંબનો દરજજો અને તેઓના સમાયોજન વચ્ચે સાર્થક તફાવત છે.
 - (3) વિકૃતચિંતા ધરાવતી મહિલાઓના સમાયોજન વચ્ચે સાર્થક તફાવત છે.

(11) શાંતા આર. સોલંકી

શીર્ષક : “વેરાવળ તાલુકાના ભિન્ન પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા સ્વાધ્યાચીઓના સમાયોજનનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

- તારણો :
- (1) સરેરાશ સમાયોજનમાં કોઈ નોંધપાત્ર તફાવત નથી.
 - (2) નોકરીયાત કરતા ખેડૂતનું સમાયોજન ઓછું હોય પણ નિષ્કર્ષ પરથી તારવી શકીએ કે આ બધા પર સ્વાધ્યાયનો પ્રભાવ જોવા મળે છે.

(12) ચોગેશ બી. મહેતા

શીર્ષક : “વેરાવળના પોલીસ કર્મચારીઓના માનસિક સ્વારથ્ય અને સમાયોજનનો અભ્યાસ.”

- તારણો :
- (1) નાની ઉંમર કરતા મોટી ઉંમરના પોલીસ કર્મચારીઓનું સમાયોજન સારુ છે.
 - (2) નોકરીનો ઓછો અનુભવ ધરાવનાર કરતા વધુ અનુભવ ધરાવતા પોલીસ કર્મચારીઓનું સમાયોજન સારુ છે.
 - (3) ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા પોલીસ કર્મચારીઓ કરતા વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા પોલીસ કર્મચારી ઓનું સમાયોજન નબળું છે.

(13) શેરિફનો પ્રયોગ ::

સમૂહ જૂથ સૂચનની અસર સમાયોજનની વ્યક્તિત્વત માનસ પર કેવી રીતે થાય તે અંગેનો પ્રયોગ :

વ્યવહારું દાખલો લઈએ તો ભૂમિતિના પ્રશ્નમાં વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરતા હોય. એક વિદ્યાર્થી ‘સાચી રીતે’ જગ્યા પૂરે છે, પરંતુ વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ ‘ખાલી જગ્યા’ જૂદી રીતે પૂરી હોય તો તે પણ ‘પોતાની સાચી રીત’ ચેકી બીજા વિદ્યાર્થીઓનું અનુકરણ કરશે અને ખોટી રીતે જગ્યા પૂરશે. તે સૂચયે છે કે સમૂહ જૂથ સૂચનની અસર સમાયોજન પર થાય છે.

(14) મોર્સ અને વાઈસનો અભ્યાસ ::

તેઓએ 401 કર્મચારીઓને એવો પ્રશ્ન પૂછ્યો કે, “કોઈક કારણાસર વ્યવસાય કર્યા વગર આરામદાયક રીતે જીવવા પૂરતા પૈસા વારસામાં મળે તો તમે વ્યવસાય કરશો ખરા ?” જો કે માત્ર 9% કર્મચારીઓ જ સાચા અર્થમાં વ્યવસાય સાથે સમાચોજન સાધી શકતા હતા, જ્યારે 8% કર્મચારીઓએ જણાવ્યું કે વ્યવસાય છોડી ન દેતા ચાલુ જ રાખશે. આ બતાવે છે કે મોટા ભાગના કર્મચારીઓ કેવળ પૈસાને લીધે વ્યવસાય કરતા નથી. કર્મચારીઓને લાગ્યું કે વ્યવસાયને લીધે રોકાયેલા રહેવાય અને કંટાળો તથા નિર્દ્ધારણાની લાગણીઓને ટાળી શકાય.

(15) થુમીન (1968) ::

ચુવાન અને પ્રૌઢ કર્મચારીઓનો સમાચોજન અંગેનો અભ્યાસ.

ઉમર વધવાને પરિણામે કર્મચારીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે કે કેમ તેનો આધાર વ્યવસાયના સ્વરૂપ ઉપર રહેલો છે.

(16) પ્રેસી અને પ્રેસી ::

પ્રૌઢ કર્મચારી નિવૃત્તિ વચે પહોંચે એટલે એકદમ નોકરીમાંથી છુટા કરી દેવાને બદલે તેની જવાબદારીઓ ધીમે ધીમે ઘટાડવી જોઈએ અને વ્યાવસાયિક જીવનને ધીમે ધીમે મર્યાદિત કરવું જોઈએ. આમ કરવાથી તેની મુશ્કેલીઓ ઓછી કરી શકાય છે અને યોગ્ય સમાચોજનને સાધી શકે છે.

(17) સેન્ટર્સ (Centers) ::

વિવિધ કક્ષાની પ્રતિનિધિત્વપ્રૌઢ વ્યક્તિત્વોનું સમાચોજનનું નિરીક્ષણ કરતી વખતે સેન્ટર્સે તેઓને પ્રશ્નો પૂછ્યા છે ‘‘ધંધાની સફળતા માટે શક્તિ,

નસીબ, લાગવગ કે સારી તકો એ બધામાંથી તમો કોને જવાબદાર ગણો છો ?”
જેના પરિણામ રૂપરૂપે 45% લોકો શક્તિને ધંધાની સફળતા માટે કે સમાચોજન
માટે ગણો છે, જ્યારે બીજા 14% લોકોએ શક્તિ અને નસીબ અથવા લાગવગ
કે તક જરૂરી છે તેવું જણાવેલ છે. આમ સમાચોજન એ કક્ષાની પ્રતિનિધિત્વરૂપ
પ્રોફ વ્યક્તિઓ પોતાના વ્યવસાયમાં સાધી શકે છે.

ત્રીજા અવલંબી પરિવર્ત્ય જીવન સંતોષનું મહત્વ અને પૂર્વીય અભ્યાસો
આ પ્રમાણો છે :

2.10 જીવનસંતોષ નું સૈદ્ધાંતિક મહત્વ ::-

જીવન સંતોષ અંગેના અભ્યાસોનો ઇતિહાસ ઘણો જ જૂનો માનવામાં
આવે છે. જીવન સંતોષ અંગેની સંકલ્પના મનોવિજ્ઞાનની જેમ જ તફાવતમાંથી
મળી આવી છે. સુખ અને દુઃખની લાગણીઓ ઇચ્છનીય અને અનિચ્છનીય
પદાર્થના જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. સુખ એ સાનુક્ષળતાની લાગણી છે અને
આ અનુક્ષળતાની લાગણી જીવન સંતોષને નિર્ધારિત કરે છે.

“જીવનસંતોષ એટલે મનોવૈજ્ઞાનિક, શારીરિક અને વાતાવરણ
પરિસ્થિતિઓ કે સંજોગોનું કોઈ સંયોજન છે કે જે વ્યક્તિને ખરેખર એવું કહેવા
પ્રેરે કે મને મારા જીવનથી સંતોષ છે.”

“જીવનસંતોષ એટલે વ્યક્તિને પોતાના જીવન પ્રત્યે અનુભવાતી સમગ્ર
વિદ્યાચક લાગણીનું પ્રમાણા.”

મહાન શારીર શાસ્ત્રી ચરકના મત પ્રમાણો સંતોષ એ શારીરિક રાસાયણિક
દ્રવ્યોની સમતુલા અસમતુલા પરથી નિર્ધારિત થાય છે. તેઓના મત પ્રમાણો
સુખ દુઃખની લાગણી શારીરમાં રાસાયણિક દ્રવ્યોની અસમતુલામાંથી ઉત્પન્ન

થાય છે. મન અને શરીર બન્નેમાંથી અનુકૂળ શારીરિક અને માનસિક સુખ દુઃખ ઉદ્ભવે છે. ચરકનો સુખ દુઃખનો સિદ્ધાંત જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક આધાર રજૂ કરે છે.

2.11 જીવનસંતોષ અંગે થયેલા પૂર્વીય અભ્યાસો ::-

જીવનસંતોષ અંગેના પૂર્વે થયેલા અભ્યાસો નીચે મુજબ છે, પરંતુ તેની પહેલા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ દરમિયાન જે તારણો આપેલા છે તેનો ઉલ્લેખ અહીં કર્યો છે.

ફોઈડ (1950) માં (Beyond Pleasure Principle) માં જણાવ્યું છે કે,
“જીવનનું અંતિમ લક્ષ્ય સુખ સંતોષ છે. તેમણે જણાવ્યું છે કે સુખ-અસુખની લાગણી ઉતેજનાના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. ઉતેજના વધારા સાથે અસુખ અને ઘટાડા સાથે સુખની લાગણી સંકળાયેલી છે.”

Grings William W. (1963 - Theories in contemporary Psychology) માં જણાવ્યું છે કે સંતોષ કે અસંતોષની લાગણી વધારે તેમ અનુબંધની મજબૂતી કે નબળાઈ પણ વધારે. સુખદ સંતોષની લાગણી એટલે એવી પરિસ્થિતિ કે જેને ટાળવા માટે પ્રાણી કંઈ કરતું નથી. પરંતુ તે લાગણીને જાળવી રાખવા પ્રયત્ન કરે છે.

થોર્નડાઇકે (1919) Selected Writings From a Connectionists Psychology માં સંતોષકો અને અસંતોષકો વિશેના જ્યાલની ચર્ચા કરી છે.

Kanungo & Mendonca (1944) એ Principles of Content માં કર્મચારીઓનાં સંતોષ સાથે તેમની કાર્યપ્રેરણા સંબંધની બાબતને દર્શાવી છે.

આ ઉપરાંત જીવનસંતોષ અંગેના અન્ય અભ્યાસો અલગ-અલગ પરિવર્ત્યોના આધારે થયેલા છે. જેમાં....

સિંધ અને સિનહા (1995) માનસિક સ્વાસ્થ્ય અને જીવનસંતોષ અંગેનો અભ્યાસ.

શ્રીવાસ્તવ (1996) સંસ્થાકિય વાતાવરણ અને સંતોષની જરૂરિયાતોનો કાર્ય સામેલગીરી સાથેનો સંબંધ અંગેનો અભ્યાસ.

ખાન અને દેવી (1999) નો જીવનસંતોષ અને હેલ્પનેશ અંગેનો અભ્યાસ.

આમ, જીવનસંતોષ અંગેના વિધિય અભ્યાસો ઉલ્લેખનીય છે.

(1) → B. M. Vaghasiya (1988)

"A Impact of Certain Demographic Variables of Textile Employees on mental Health and Life Satisfaction."

તારણો : વિભક્ત કુટુંબમાં રહેતા કર્મચારી કરતા સંયુક્ત કુટુંબમાં રહેતા કર્મચારીઓમાં જીવનસંતોષ ઊંચો જોવા મળે છે.

અનુભવ અને કુટુંબના પ્રકારમાં જીવન સંતોષ વચ્ચે સાર્થક તફાવત નથી.

જીવનસંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક સંબંધ જોવા મળે છે.

(2) → સુનિતા મલ્હોત્રા અને વૈશાલી ગુપ્તા (2004)

પ્રસ્તુત અભ્યાસમાં 120 ડોક્ટરોની વ્યવસાય સામેલગીરી અને જીવન સંતોષનો અભ્યાસ કરવાનો હતો.

તારણો : વ્યવસાય સામેલગીરી અને જીવનસંતોષ વચ્ચે વિદ્યાયક સંબંધ જોવા મળે છે.

(3) → સિન્ધ અને સિંધ (1995)

પ્રસ્તુત અભ્યાસ કર્મચારીઓનો જીવન સંતોષ અને માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરવાનો હતો.

તારણો : કાપડ ભિલમાં કામ કરતા મેનેજરોમાં જીવન સંતોષનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે.

કર્મચારીઓના જીવન સંતોષ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક સહસંબંધ જોવા મળે છે.

(4) → શ્રી વાસ્તવ (1996)

કાપડમીલના કામદારોમાં સંરથાકિય વાતાવરણ અને સંતોષની જરૂરતોનો કાર્યસામેલગીરી સાથેનો સંબંધ.

તારણો : ઉચ્ચ કક્ષાની જરૂરતો સ્વમાન, સ્વરાજ્ય અને સ્વ વ્યવહારિકતા ના સંતોષનો પણ કાર્ય સામેલગીરી સાથે વિદ્યાયક સંબંધ જોવા મળે છે.

(5) લક્ષ્મીનારાયણન (1990) ના સંશોધન પ્રમાણે રહેઠાણા, ઊમર, કાર્યનો પ્રકાર, માસિક આવક અને શિક્ષણાનું સ્તર જીવનસંતોષને નક્કી કરવામાં અગત્યના પાસા છે.

(6) મોહન અને બાલી (1988)

ડોકટરના જીવનસંતોષના સંદર્ભમાં વ્યક્તિત્વ મૂલ્યો અને નિયંત્રણ કેન્દ્રનો અભ્યાસમાં જેઓને જીવનસંતોષ ઉંચો જોવા મળ્યો હતો. તેવા ડોકટરો અને જીવનસંતોષ નીચો જોવા મળ્યો હતો. તે બન્ને વરચેના વ્યક્તિત્વ અને મૂલ્યોમાં સાર્થક તફાવત જોવા મળ્યો છે.

જે ડોકટરનો જીવન સંતોષ ઉંચો હતો તેઓનું નિયંત્રણ કેન્દ્ર આંતરિક જોવા મળે છે. જે ડોકટરોનો જીવન સંતોષ નીચો મળ્યો હતો તેઓનું નિયંત્રણ કેન્દ્ર બાહ્ય જોવા મળે છે.

(7) ડૉ. અનંત એમ. વસાઈ

‘‘રાજકોટ શહેરના કન્ડકટરો અને ડ્રાઇવરોના જીવનસંતોષ અંગેનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.’’

તારણો :- (1) રાજકોટ શહેરના કન્ડકટરો અને ડ્રાઇવરોના જીવન સંતોષ પર જાતિની અસર પડતી નથી.

તારણો :- (2) રાજકોટ શહેરના કન્ડકટરો અને ડ્રાઇવરોના જીવન સંતોષ પર રહેણાણની અસર પડતી નથી.

(3) રાજકોટ શહેરના કન્ડકટરો અને ડ્રાઇવરોના જીવન સંતોષ પર ઉમરની અસર પડતી નથી.

(8) કારાવદરા ભિની એમ.

‘‘ભારતીય જીવનવીમા નિગમના કર્મચારીઓના જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.’’

તારણો :- (1) કર્મચારીઓના જીવન સંતોષ પર જાતિની અસર જોવા મળતી નથી.

- (2) કર્મચારીઓના જીવન સંતોષ પર શૈક્ષણિક લાયકાતની અસર જોવા મળતી નથી.
- (3) કર્મચારીઓના જીવન સંતોષ પર કૌદુર્બિક દરજાની અસર જોવા મળતી નથી.
- (9) પ્રા. એ. એમ. ચોચા – (2003)
- ‘‘વેરાવળ તાલુકાના ભિન્ન પ્રકારના વ્યવસાયમાં રોકાયેલા સ્વાધ્યાચીઓના જીવનમાં જીવન સંતોષનો એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ.’’
- તારણા :- આ સંશોધન દર્શાવે છે કે, સ્વાધ્યાચી નોકરીયાત હોય કે વ્યવસાચી હોય, તેથી તેના જીવન સંતોષમાં કોઈ નિણાર્થિક ફેર પડતો નથી.
- (10) ભિતાબેન એચ. ઘનેશા – (2008)
- ‘‘રાજકોટ જિલ્લાના બી.એસ.એન.એલ.ના કર્મચારીઓના જીવન સંતોષ, સંસ્થાગત પર્યાવરણ અને વ્યવસાય સામેલગીરીનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.’’
- (11) શીર્ષક : જૂનાગઢ જિલ્લાના સોલિવન્ટ પ્લાન્ટના વર્કર્સના જીવન – સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.
- સંશોધક : કિરન એમ. નિભાર્ક
- પ્રકાશન : 2005 એબસ્ટ્રેક્ટ નેશનલ કોન્ફરન્સ મનોવિજ્ઞાન ભવન,
રાજકોટ.
- નિદર્શ : 80
- સાધનો : જીવનસંતોષ તુલા – આલમ અને શ્રીવાસ્તવ

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.

તારણો : જાતિના સંદર્ભમા સોલવન્ટ પ્લાન્ટના વર્કરોના જીવનસંતોષમાં
તફાવત જોવા મળેલ છે.

(12) શીર્ષક : જેતપુર સાડી ઉધોગના કર્મચારીઓની કાર્ય સામેલગીરી
જીવનસંતોષ અને હતાશાના સંદર્ભમાં અધ્યયન.

સંશોધક : બી. એમ. વધાસીયા

પ્રકાશન : 2006 એબસ્ટ્રેક્ટ, સૌરાષ્ટ્ર મનોવિજ્ઞાન મંડળ-રાજકોટ

નિદર્શ : 240 કર્મચારીઓ

સાધનો : જીવનસંતોષ – આલમ અને શ્રીવાસ્તવ રચિત.

માહિતી વિશ્લેષણ : F (ANOVA) કસોટી વડે કરેલ હતું.

તારણો : કાર્યનો પ્રકાર અને કારખાનાના કદની તેમના જીવનસંતોષ પર¹
અસર જોવા મળી હતી, જ્યારે તેની સંચુક્ત અસર તેમના જીવન
સંતોષ પર જોવા મળી ન હતી.

(13) શીર્ષક : જુદા-જુદા વ્યવસાયોમાં સ્ત્રીઓના સંતોષ અને તંગદીલી
માટેનું પ્રમાણા.

સંશોધક : એ.એમ. અને એસ.આર.એલ.એમ.

પ્રકાશન : 2006

નિદર્શ : 120 સ્ત્રીઓ, જેમાં 30 વડિલ, 30 એન્જીનિયર અને 60
કલાર્ક હતી.

સાધનો : જીવનસંતોષ કસોટી – બનાઈ એ. ગોરમેનરીમાં ફેરફાર
કરી નવી જીવન સંતોષ માપન સંશોધનિકા.

માહિતી વિશ્લેષણ : મધ્યક કસોટી વડે કરેલ હતું.

તારણો : વડિલ, એન્જિનિયર અને કલાર્ક આ ત્રણોથ દરજાની સ્ત્રીઓમાં સંતોષ ઓછો જોવા મળેલો હતો, જ્યારે તંગાઈલીનું પ્રમાણ તેની પોતાની ભૂમિકા કરતા વધુ જણાય છે.

(14) શીર્ષક : રાજકોટ જિલ્લાના બી.એસ.એન.એલ.ના કર્મચારીના જીવન સંતોષ, સંસ્થાગત પર્યાવરણ અને વ્યવસાય સામેલગીરીનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : મીતા એચ. ઘનેશા

પ્રકાશન : 2008 Ph.D. Thesis Saurashtra University

નિદર્શા : 480 કર્મચારીઓ

સાધનો : જીવનસંતોષ તુલા – આલમ અને વાસ્તવ રચિત

માહિતી વિશ્લેષણ : F,r અને t કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, કાર્યનો વિભાગ, માસિક આવક અને સંસ્થાના વાતાવરણની અલગ અને સંચુક્ત અસર તેના જીવન સંતોષ પર પડતી નથી.

(2) કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત, નોકરીનો અનુભવ, માસિક આવક અને લગ્ન દરજાનો તેના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

(3) જ્યારે કુટુંબનો પ્રકાર, રહેઠાણા, કુટુંબના સભ્યોની સંખ્યા, વ્યવસાયમાં કાયમી રહેવાની ઈચ્છા અને અનિચ્છા, કુરસદના સમયની સંતોષપ્રદત્તા અને અસંતોષપ્રદત્તા તેમજ શોખનો તેમના જીવનસંતોષમાં તફાવત જોવા મળતો નથી.

(15) શીર્ષક : કંડકટરો અને ડ્રાઇવરોના જીવનસંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : જે. બી. મોરી

પ્રકાશન : 2008 National Level Conference S.P. University

નિદર્શ : 60

સાધનો : જીવનસંતોષ તુલા – આલમ અને વાસ્તવ રચિત

માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.

તારણો : કંડકટરો અને ડ્રાઇવરોની ઉંમર અને રહેઠાણાના સંદર્ભમાં તેના જીવન સંતોષમાં તફાવત નથી.

(16) શીર્ષક : જુદો જુદો વ્યવસાય કરતા લોકોની સૂચનવશતા, સમાયોજન અને જીવનસંતોષનો તુલનાત્મક મનોવૈજ્ઞાનિક અભ્યાસ.

સંશોધક : નીતા એલ. કાણ્ડીયા

પ્રકાશન : 2008 Ph.D. Thesis, Saurashtra University

નિદર્શ : 300

સાધનો : જીવનસંતોષ તુલા – આલમ અને વાસ્તવ રચિત

માહિતી વિશ્લેષણ : F, r કસોટી વડે કરેલ હતું.

તારણો : (1) ખાનગી નોકરીયાતોના જીવન સંતોષ અને સમાયોજન વચ્ચે નહિવત સહસંબંધ તેમજ સરકારી નોકરીયાતોના જીવન સંતોષ અને સમાયોજન વચ્ચે સાર્થક સહસંબંધ જોવા મળેલ છે.

- (2) જ્યારે જતિ, વ્યવસાયનો પ્રકાર (ખેડૂત ખાનગી અને સરકારી નોકરીયાત) ની અલગ અને સંચુક્ત અસર જોવા મળેલ નથી.
- (17) શીર્ષક : સરકારી ખાતાના અધિકારીઓમાં આર્થિક સાંવેદનિક બુદ્ધિનો માનસિક સુખાકારી, વિફૃતચિંતા, જિન્જનતા અને જીવનસંતોષ પર પડતા પ્રભાવનો અભ્યાસ.
- સંશોધક : મદનાપત, સીંગ અને ભારદ્વાજ – રાજ્યસ્થાન.
- પ્રકાશન : 2007, Gujarat Journal of Psychology VOLp 21
- નિદર્શ : 240 સહકારી બેન્ક અને PLD બેન્કના અધિકારીઓ.
- સાધનો : જીવનસંતોષ તુલા – આલમ અને શ્રીવાસ્તવ રચિત (1983) સાંવેદનિક બુદ્ધિ કસોટી (2001) કોહન અને જેની રચિત P.G.I. સ્વાસ્થ્ય તુલા–વર્મા, વીગ અને પ્રસાદ રચિત.
- તારણો : ચિંતા અંગે ઉચ્ચ અને નિઝન બૌદ્ધિક સંવેદના ઘરાવતા પાત્રો વચ્ચે જિન્જનતા, જીવનસંતોષ અને સ્વાસ્થ્યની બાબતમાં સંગીન બેદ હતો.
- (18) શીર્ષક : સહકારી ખાતાના નાયબ અને સહાયક રજીસ્ટ્રારના વ્યાવસાચિક મનોભાર, હતાશા, કાર્યમમત્વ અને જીવન સંતોષનો તુલનાત્મક અભ્યાસ.
- સંશોધક : મદનાપત, ભારદ્વાજ, સિસોટીયા અને કષ્ણવા
- પ્રકાશન : 2008 Behavioral Screntist.
- નિદર્શ : સહકારી બેન્કો, નહેરુ સહકારી ભવન વગેરેના 200 કર્મચારીઓના બે જૂથો.
- સાધનો : જીવનસંતોષ તુલા
- માહિતી વિશ્લેષણ : t કસોટી વડે કરેલ હતું.
- તારણો : બન્ને પ્રકારના રજીસ્ટ્રારનો જીવનસંતોષ ઘરમૂળથી જ જુદો છે. ઉપરોક્ત અભ્યાસોની ચર્ચા કર્યા બાદ પ્રકરણ-3 માં સંશોધન હેતુઓ, યોજના, ઉત્કલ્પનાઓ અને પ્રક્રિયા અને પૃથ્થકરણની ચર્ચા કરવામાં આવશે.

પ્રકરણ-2

:: સંદર્ભ સૂચિ ::

- (1) સામાજિક સંશોધન પદ્ધતિઓ – ડૉ. અરવિંદરાય એન. ટેસાઈ,
ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ-1983 પેઇઝ નં.-05
- (2) ડૉ. આર.કે. ચોચા – “કોમ્પ્યુટર ઉચ્ચ શિક્ષણ અને નોન કોમ્પ્યુટર
ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, કૌદુર્યિક
સમાચોજન અને બૌદ્ધિક કક્ષાનો તુલનાત્મક અભ્યાસ.” પીએચ. ડી.
થિસીસ-સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-રાજકોટ, પેઇઝ નં. 65
- (3) ડૉ. મીતાબેન એચ. ધનેશા – “રાજકોટ જિલ્લાના બી.એસ.એન.એલ.
ના કર્મચારીઓના જીવનસંતોષ, સંસ્થાગત પર્યાવરણ અને વ્યવસાય
સામેલગીરીનો મનોવિજ્ઞાનિક અભ્યાસ.” – પીએચ.ડી. થિસીસ –
સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-રાજકોટ, પેઇઝ નં. 71
- (4) સામાજિક સંશોધન પદ્ધતિઓ – ડૉ. અરવિંદરાય એન. ટેસાઈ, ચુનિ.
ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ-1983 પેઇઝ નં.-05
- (5) ડૉ. શાંતાબેન સોલંકી – “ગુજરાત ભારે રસાયણ લિમિટેડ કંપની-
વેરાવળના કર્મચારીઓના સમાચોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્ય
સંતોષનો અભ્યાસ.” – પીએચ. ડી. થિસીસ-સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-
રાજકોટ, પેઇઝ નં. 52
- (6) મનોવિજ્ઞાન સંશોધન પદ્ધતિઓ : પ્રા. એસ.વી. ત્રિવેદી –
સી. જમનાદાસ કંપની, આવૃત્તિ-2008/09 પેઇઝ નં.-19
- (7) ડૉ. સંતોક પી. દોમડીયા – “ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજના
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને બૌદ્ધિક કક્ષાની
તુલનાત્મક અભ્યાસ.” પીએચ. ડી. થિસીસ-સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-
રાજકોટ, પેઇઝ નં. 76
- (8) મૂળભૂત મનોવિજ્ઞાનિક પ્રક્રિયાઓ :
પ્રા. દીપક આર. શાહ અને અન્ય, સી. જમનાદાસની કંપની,
આવૃત્તિ-2008/09 પેઇઝ નં.-129

પ્રકરણ-3

:: અનુકૂળિકા ::

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
3.1	પ્રસ્તાવના	82
3.2	પ્રસ્તુત સંશોધનની સમસ્યા	84
3.3	મનોવૈજ્ઞાનિક સંશોધનના પ્રકારો	87
3.4	પ્રસ્તુત સંશોધનના હેતુઓ	90
3.5	પ્રસ્તુત સંશોધનની ઉત્કૃષ્ટપનાઓ	91
3.6	પ્રસ્તુત સંશોધનના પરિવત્યો	100
3.7	સંશોધન યોજના	103
3.8	પ્રસ્તુત સંશોધનની યોજના	107
3.9	પ્રસ્તુત સંશોધનની સમાજિક વિભાગ	108
3.10	પ્રસ્તુત સંશોધનનો નિદર્શન	112
3.11	પ્રસ્તુત સંશોધનના સાધનો	121
3.12	આંકડાશાસ્ત્રીય પ્રચુરિતાઓ	127
3.13	માહિતી એકત્રીકરણની પ્રક્રિયા	133
W	સંદર્ભ સૂચિ પ્રકરણ-3	135

:: પ્રકરણ- 3 ::

સંશોધન યોજના, પ્રક્રિયા અને પુણ્યકરણાની પદ્ધતિ

3.1 પ્રસ્તાવના :-

કોઈપણ સંશોધનના મુખ્ય આધાર તેમાં પ્રયોજનિ પદ્ધતિ પર છે. કોઈપણ સંશોધનની પદ્ધતિ જેટલી સચોટ હોય તેટલા તેના પરિણામો સચોટ હોય છે. સંશોધનની સમર્થ્યાઓમાં જુદી-જુદી અભ્યાસ યોજનાનો ઉપયોગ કરે છે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે સંશોધન યોજના દ્વારા તેના ક્ષેત્રની સમર્થ્યાઓ વિષે અભ્યાસો કરે છે. ફેસ્ટિનજર અને કાટ્ર નામના લેખકોએ સંશોધનનાં કાર્યમાં સંશોધન પદ્ધતિનું મહત્વ નીચેના શબ્દોમાં જણાવ્યું છે.

"It is truism that no Research Results are any better than the methods by which they are obtained."¹

-- Festinger and Katz

“એ સત્ય છે કે કોઈપણ સંશોધનનાં પરિણામો તેમાં પ્રયોજનેલી પદ્ધતિઓ કરતા વધુ સારા હોતાં નથી.”

સંશોધનનું મુખ્ય પ્રયોજન અમુક પ્રશ્નોના ઉત્તર મેળવવાનું હોય છે, તેથી પહેલા સંશોધનનો અર્થ સમજી લઇએ.

સંશોધનને અંગ્રેજીમાં "Research" કહેવામાં "Research" એટલે ફરીથી શોધવું. (to research is to search again). કોઈપણ એક બાબતમાં કંઈક શોધ થઈ ગઈ હોય તે બાબતમાં વારંવાર દર્જિપાત કરવો તેને સંશોધન કહેવામાં આવે છે. અમુક સમર્થ્યા પહેલી દર્જિએ કરેલું સંશોધન ખામીયુક્ત હોઈ શકે છે. તે બાબતને ફરીફરીને ચકાસવાની જરૂર છે.

“સંશોધન એટલે વધુ જણાવા માટે ફરીથી વધુ ચોકસાઈપૂર્વક જોવું.”

"Research is to take another more careful look to find out more."

“સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે.” Systemized effort to gain new knowledge.²

એલ્ટીડ અને અન્ય (1966) જણાવે છે કે “સંશોધનનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.”³

ગુડ અને હંડ્ઝ “કેવળ હકીકતોનો જથ્થો બેગો કરવાથી વિજ્ઞાન અન્ય સત્ય લાવી શકતું નથી.”⁴

સંશોધન સ્વરૂપ (Nature of Research)

પ્રસ્તુત સંશોધનમાં સંશોધનના સ્વરૂપના નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે.

- (1) સંશોધન વૈજ્ઞાનિક હોય છે – વૈજ્ઞાનિક એટલે વસ્તુલક્ષી, પ્રમાણિત અને પૂર્વગ્રહ રહિત હોય છે.
- (2) સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે.
- (3) નિરીક્ષણાલક્ષી બનાવોનું સંશોધન થઈ શકે છે.
- (4) સંશોધનમાં સંશોધક સમસ્યાનો ઉકેલ મેળવવા માંગે છે.
- (5) સંશોધન સૈદ્ધાંતિક અને વ્યાવહારિક હોઈ શકે છે.
- (6) સંશોધનમાં કાર્યકરણ સંબંધનો અભ્યાસ થાય છે.

આપણો જે જાણીએ છીએ તે ખોટું કે ખામીયુક્ત હોઈ શકે છે, તેથી તેને નવી રીતે ફરીથી તપાસવું જોઈએ. આવી શોધનાત્મક વૃત્તિ તેજ "Research" કહેવામાં આવે છે.

સંશોધનને વૈજ્ઞાનિક અર્થમાં સમજવું આવશ્યક છે.

‘‘કોઈ ચોક્કસ સમસ્યાને વૈજ્ઞાનિક રીતે અને પસ્તુલક્ષી રીતે સમજવાનો વ્યવરિથત પ્રયાસ કરવામાં આવે છે. તેને સંશોધન કહેવામાં આવે છે.’’

3.2 પ્રસ્તુત સંશોધનની સમસ્યા ::-

સંશોધનની વ્યાખ્યાઓ અને અર્થ પહેલા રજૂ કરીને પછી પ્રસ્તુત સંશોધન ની સમસ્યા નીચે મુજબ સમજાવી છે.

કરલિંગર (1986) ના અનુસાર “સમસ્યા એક એવું પ્રશ્નાત્મક વાક્ય કે કથન હોય છે જે પ્રશ્ન કરે છે કે બે બેથી વધુ પરિવત્યો વરચે કેવો સંબંધ છે”,⁵

વૈજ્ઞાનિક સંશોધનનો પ્રારંભ કરતા પહેલા સંશોધનકર્તાની સામે સર્વ પ્રથમ એ સમસ્યા હોય છે કે કઈ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે. સંશોધન સમસ્યાની પસંદગી સંશોધન કરતા પહેલા કરવાની હોય છે. સંશોધનની સમસ્યા ની પસંદગીના કેટલાક આધારો હોય છે. સંશોધનના અમૃક વિષયની પસંદગીના કેટલાક આધારો હોય છે. સંશોધનના અમૃક વિષયની પસંદગી કર્ચા પછી તે વિષય પર સંશોધનક્ષમ સમસ્યાની રચના કરી શકાય છે. સંશોધનના એક વિષય પર ઘણી સમસ્યાઓનું ઘડતર થઈ શકે, પરંતુ કોઈપણ એક સંશોધનમાં ઘણી સમસ્યાઓનો સમાવેશ કરી શકાતો નથી.

સંશોધન સમસ્યાની રચના એ સંશોધનનું પ્રથમ સોપાન છે. માટે જ આઈનસ્ટાઇન કહ્યું કે, "Formulating a problem is often more essential than its solution."⁶

સેલિંગ ના મત અનુસાર સંશોધન મુખ્ય ચાર ઉદ્ભવરથાનો છે :

- (1) સંશોધનનો વિષય અને સંશોધનક્ષમ સમસ્યા વરચેનો તફાવત.
- (2) સંશોધન સમસ્યાની પસંદગીના આધારો.
- (3) સંશોધનની સમસ્યા સાથે સંબંધિત સિદ્ધાંતોની સમીક્ષા.
- (4) પૂર્વગામી સંશોધનની સમીક્ષા.

કરલિંગર (2000) અનુસાર “બે કે બેથી વધુ પરિવત્યોની વરચે શું સંબંધ છે એવા પ્રેરણને સમસ્યા કહે છે કે તેના પોતાના શબ્દોમાં કહીએ તો સમસ્યા એવું પ્રેરણવાચક વાક્ય અથવા કથન છે જે એવું પૂછે છે કે બે કે બેથી વધુ પરિવત્યો વરચે કથા પ્રકારનો સંબંધ છે.”

આથી જ સંશોધનકર્તા ગમે તે સંશોધનની સમસ્યા પસંદ કરતો નથી. સમસ્યા જરૂરિયાતમાંથી જન્મે છે. આપણી આસપાસની સામાજિક વાસ્તવિકતા પ્રત્યે દર્ખિપાત કરીએ તો આપણાને અનેકવિદ્ય સંશોધનક્ષમ સમસ્યાઓ નજરે પડે છે. કેટલીકવાર આપણે સંશોધનની અમુક સમસ્યા પ્રત્યે ગંભીર હોતા નથી, પરંતુ તેની વ્યાવહારિક ઉપયોગિતા લક્ષમાં લઈએ તો સમસ્યા આપણાને ખૂબ મહાત્વપૂર્ણ જણાય છે. સંશોધકના સંશોધનનું મુખ્ય ધ્યેય તો માનવ સમાજને ઉપયોગી બનવાનું હોય છે. તેથી જ પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે વ્યક્તિગત, સામાજિક બાબતોને ધ્યાનમાં લઈને પ્રસ્તુત સંશોધનની સમસ્યાની રચના કરી છે.

પ્રસ્તુત સંશોધનમાં માનસિક સ્વાસ્થ્યને એક પરિવર્ત્ય તરીકે લેવામાં આવેલ છે. માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ હંમેશા આકર્ષક અને રોચક રહ્યો છે. સામાન્ય રીતે આજના આ સતત વિકસતા જગતમાં વ્યક્તિગતી જીવનશૈલીને કારણે માનસિક સ્વાસ્થ્ય કથળતુ ગયું છે, તેને કારણે વ્યક્તિના જીવનની સામાન્ય સમસ્યાઓથી માંડીને જીવનને ટૂંકાવી નાખનાર આપધાત વૃત્તિ જેવી ભયંકર સમસ્યાઓના મૂળમાં વ્યક્તિગતી માનસિક અસ્વસ્થતા જવાબદાર છે. આજે આ વિકસતા ટેકનોલોજીમાં કારીગરો કે કર્મચારીઓ પોતાની જવાબદારી ઓમાં માનસિક સ્વાસ્થ્યને જાળવું ખૂબ જ મહાત્વપૂર્ણ બની જાય છે.

આજે નોકરી કરતા લોકો કે મજૂરી કરતા લોકો આર્થિક, માનસિક અને સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે કોઈપણ કાર્ય સાથે જોડાય છે. કાર્ય કરતા

કર્મચારીઓ કે કારીગરોને પોતાના કાર્ય કે સામાજિક પરિસ્થિતિમાં સમાયોજન સાધી શકે છે કે નહીં તે પણ ખૂબ જ મહત્વનું છે. રત્નકલાકારો પોતાના જીવન દરમિયાન યોગ્ય સમાયોજન સાધી શકે છે કે નહીં તે પણ જાણાવુ જરૂરી છે.

જો વ્યક્તિત્વ પોતાના જીવનમાં જીવનસંતોષ હશે નહીં તો તે દરેક કાર્યમાં નિષ્ફળ જવાનો જ છે. ફોઈડના મતે મનુષ્યની બધી વૃત્તિઓનું અંતિમ લક્ષ્ય સુખ, સંતોષ છે. સંતોષ એ મનોવૈજ્ઞાનિક લાગણી છે અને મનની સ્થિતિ છે. આજે વ્યક્તિત્વ પોતાના રોજબરોજના જીવનમાં અનેક ઘટનાઓમાંથી પસાર થતો હોય છે ત્યારે તે પોતાના દ્યેચમાં સફળ થાય છે ત્યારે વિદ્યાયક લાગણી અનુભવે છે. જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તે નિષેધક લાગણી અનુભવે છે. આ લાગણી ની અનુભૂતિ દ્વારા જ વ્યક્તિત્વ જીવનસંતોષ અનુભવી શકે છે. વ્યક્તિત્વના જીવનમાં જીવનસંતોષનું વિધિય પરિબળ હોય છે. કોઈ વ્યક્તિત્વ શારીરિક બાબતોને મહત્વ આપે છે તો કોઈ વ્યક્તિત્વ આર્થિક બાબતોને મહત્વ આપે છે અને દરેક વ્યક્તિત્વને જીવન સંતોષ તેના કાર્ય ઉપર ચોક્કસ અસર પહોંચાડે છે. તેથી જ અહીં રત્ન કલાકારોના જીવન સંતોષ અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે.


આથી જ કેટલાક સંશોધનોની સમીક્ષાને આધારે માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષ પરસ્પર આધારિત પરિવર્તયો છે. ઓટલું જ નહીં, પરંતુ વ્યક્તિગત સામાજિક પરિવર્તયો પણ રત્નકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષ પર અસરકારક ઘટકો તરીકે બહાર આવ્યા છે. તેથી જ પ્રસ્તુત બાબતોનો મહાનિબંધની સંશોધન સમસ્યાની રચનામાં સમાવિષ્ટ કરેલ છે. જેને નીચે પ્રમાણે શબ્દબદ્ધ કરેલ છે.

“જેતપુર શહેરના રત્ન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

"A Psychological study of mental hygiene, adjustment and life satisfaction of dimond workers of Jetpur city."

3.3 મનોવૈજ્ઞાનિક સંશોધનના પ્રકારો ::-

એમ.આર. ડી'એમેટોઅને તેમના પુસ્તક "Experimental Psychology (1970)" માં મનોવૈજ્ઞાનિક સંશોધનોને મુખ્ય બે પ્રકારોમાં વિભાજિત કરેલ છે.



ઉપરોક્ત બધાજ સંશોધનના પ્રકારનો એક જ અર્થ છે જેનો અર્થ ફરીથી શોધવું તેવું થાય. સંશોધન એટલે એકની એક બાબતને ફરીથી જોવી એક જ વખતનો દર્ઢિપાત કે અવલોકનને આધારે કોઈપણ ક્ષેત્ર વિષે અંતિમ નિષ્કર્ષ ફલિત કરી શકાય નહીં. તેથી કોઈપણ સમસ્યાનું ફરીફરીને અવલોકન કરીને તેના વિષે નવું શોધી કાઢવામાં આવે તે સંશોધન "Research" કહે છે.

સંશોધનના કાર્યો : (The Functions of Research)

- (1) કંઈક નવું શોધવું.
- (2) પૂર્વગ્રહહિત અને વસ્તુલક્ષી રીતે અવલોકન કરવું.
- (3) જૂની બાબતોની ચકાસણી કરવી અને નવા વિકલ્પો રજૂ કરવા.
- (4) સામાન્ય સૂઝ દ્વારા વ્યક્ત થયેલા વિદ્યાનોને પડકારવાનું.
- (5) સૈદ્ધાંતિક, પદ્ધતિશાસ્ત્રને લગતી અભિયાનો અભાવ.
- (6) વૈજ્ઞાનિક પદ્ધતિ, વ્યાપિત, નિગમન અને ચકાસણીની પદ્ધતિઓ સંશોધનમાં અપનાવવી.

એક જ ઘટનાને બે વ્યક્તિત્વો અલગ-અલગ રીતે અવલોકન કરે છે.

તેથી તેનું સત્ય જાણવા માટે "Research" કરવું જરૂરી હોય છે.

** કિસ્ટોફર કોલંબસ અને ફર્ડિનાંડ સ્પેનના પણ્યામ કિનારે ઉભા હતા. સ્પેનનું વહાણ કોઈ અજાણ્યા સ્થળે જવા માટે ઉપદ્યુ હતું. બંને જણા તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે વહાણને દૂર ક્ષિતિજમાં અદશ્ય થઈ જતું નિહાળ્યું. કોલંબસ એમ માનતો હતો કે પૃથ્વી ગોળ છે અને ફર્ડિનાંડ એમ માનતો હતો કે પૃથ્વી પ્રમાણમાં સપાટ છે. તેનો આકાર કાચબાની ખંદ જેવો છે. બંને જણા એકસરખું નિરીક્ષણ કરતા હતા છિતાં બંનેના નિરિક્ષણમાં તફાવત હતો. કોલંબસે એમ જોયું કે વહાણો પૃથ્વીને ફરતો વળાંક લીધો, જ્યારે ફર્ડિનાંડે ક્ષિતિજમાં અદશ્ય થઈ જતું જોયું.

ઉપરનું દર્શાંત બતાવે છે કે એક જ ઘટનાનું અવલોકન બે વ્યક્તિત્વો જુદી-જુદી રીતે કરે છે. તેથી જ કોઈપણ સંશોધન થયેલ હોય તેના પર જ ફરી સંશોધન કરવામાં આવે છે. જેને "Research" કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિક અર્થમાં સંશોધન એટલે કોઈ નિર્ધિયત સમસ્યાને વૈજ્ઞાનિક રીતે કે વસ્તુલક્ષી રીતે સમજવાનો વ્યવસ્થિત પ્રચાસ. સંશોધનનો વ્યાપ ઘણો

વિશાળ છે. સમસ્યાની પસંદગી પછી સમસ્યાના ઉકેલ માટે સંશોધક સંશોધનની યોજનાની રચના કરે છે. સંશોધન શરૂ કરતા પહેલા સંશોધનની સમગ્ર ભાષા અંગે વ્યવસ્થિત આયોજન કરવું પડે છે. જેમ કોઈ ઈજનેર મકાન બનાવવાની શરૂઆત કરતા પહેલા બ્લુપ્રિન્ટ તૈયાર કરી શરૂઆતથી અંત સુધી તેનું આયોજન કરી લે છે. તેમજ સંશોધન કરવા માટે પહેલાથી તેનું આયોજન કરવું પડે છે. તેથી જ સંશોધન યોજનાને સંશોધનનો આધારસ્તંભ કહેવામાં આવે છે. તે ચોક્કસ અને અત્યંત વ્યવસ્થિત હોવી જરૂરી છે. સંશોધન યોજના તૈયાર કરતી વખતે અદ્યયનની સમસ્યાને અનુરૂપ વિવિધ બાબતો અંગે વિચાર કરવાનો રહે છે. સંશોધક સંશોધન યોજના ઘડવામાં જેટલી વધારે ચોક્કસાઈ રાખે તેટલું તેનું સંશોધન યથાર્થ અને વિશ્વસનીય બની શકે છે.

W પ્રસ્તુત સંશોધન બિન-પ્રાયોગિક પ્રશ્નાવલીના આધારે કરેલો અભ્યાસ છે.

અહીં જેતપુર શહેરના હિરા ઉધોગના રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. કેટલાક વ્યક્તિગત પરિવર્તની અસર જાણવા માટે અદ્યયન હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ વિગતો તથા સંશોધનની યોજના અને પ્રક્રિયા અંગેની વ્યવસ્થિત રજૂઆત હવે પછીના મુદ્રામાં કરવામાં આવી છે. આથી પ્રસ્તુત પ્રકરણાને નવ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે :

- (1) પ્રસ્તુત સંશોધનના હેતુઓ.
- (2) પ્રસ્તુત સંશોધનની ઉત્કૃષ્ણાઓ.
- (3) પ્રસ્તુત સંશોધનના પરિવર્તનો.
- (4) સંશોધન યોજના.
- (5) પ્રસ્તુત સંશોધનની સમર્થી.
- (6) પ્રસ્તુત સંશોધનનો નિર્દર્શા.
- (7) પ્રસ્તુત સંશોધનના સાધનો.
- (8) આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ.
- (9) માહિતી એકત્રીકરણાની પ્રક્રિયા.

ઉપરોક્ત બધા જ મુદ્દાને નીચે પ્રમાણે વિસ્તૃત રીતે સમજાવી શકાય.

3.4 પ્રસ્તુત સંશોધનના હેતુઓ ::-

પ્રત્યેક સંશોધન ચોક્કસ હેતુઓને અનુલક્ષીને જ કરવામાં આવે છે. સંશોધન માટે પસંદ કરેલી સમસ્યાને તાર્કિક રીતે પેટા સમસ્યાઓમાં વહેંચવામાં આવે છે. આમ, સૌ પ્રથમ સંશોધનમાં તેના હેતુઓ સ્પષ્ટ થાય તે મહારવની બાબત છે. કારણ કે સંશોધનના હેતુઓ મારફત સંશોધનમાં કઈ-કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવેલ છે તેની જાણકારી મળે છે. આ હેતુઓ સંશોધન યોજનાના ઘડતરમાં દિશા સૂચક બની રહે છે.

પ્રસ્તુત સંશોધન સમસ્યાને દ્યાનમાં રાખીને કેટલાક મુખ્ય અને ગૌણ હેતુઓ નકકી કરવામાં આવ્યા હતા. જે નીચે પ્રમાણે છે –

- (1) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ અંગે જાણકારી મેળવવી.
- (2) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ વચ્ચેનો સંબંધ તપાસવો.
- (3) જેતપુર શહેરના રટન કલાકારોના માસિક આવક, અનુભવ, રહેઠાણ અને શોખની બાબતમાં માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ પર અસર તપાસવી.
- (4) જેતપુર શહેરના રટન કલાકારોના શૈક્ષણિક લાયકાત, કુટુંબની સભ્ય સંખ્યા, પરિણામ કે અપરિણામ વગેરે બાબતોમાં તેના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષ પર અસર તપાસવી.
- (5) જેતપુર શહેરના રટન કલાકારોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાના સૂચનો કરવા.
- (6) જેતપુર શહેરના રટન કલાકારોનું સમાયોજન સુધારવાના સૂચનો કરવા.
- (7) જેતપુર શહેરના રટન કલાકારોના જીવનસંતોષ વધારવાના સૂચનો કરવા.

3.5 પ્રસ્તુત સંશોધનની ઉત્કળપનાઓ ::-

સંશોધન સમસ્યાના હેતુઓ અને શીર્ષક નકકી થયા બાદ સંશોધક કામચલાઉ અનુમાન કરે છે. જેને ઉત્કળપના તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને HYPOTHESIS કહે છે. Hypothesis બે શબ્દોનો બનેલો છે. Hypo + Thesis.

Hypo = hess + han (ના કરતા ઊતરતુ)

Thesis = Established fact (પ્રસ્થાપિત હકીકત)

એટલે કે પ્રસ્થાપિત હકીકત કરતા ઊતરતું. આજે ઉત્કળપનાને સંશોધનનો પાયો ગણવામાં આવે છે. ઉત્કળપના એ કામચલાઉ ધારણા છે. જેની ચકાસણી કરવાની બાકી હોય છે. પ્રસ્તુત સંશોધનમાં સ્વતંત્ર પરિવત્યો જેવા કે – શૈક્ષણિક લાયકાત, કાર્યનો અનુભવ, માસિક પગાર, આર્થિક સ્થિતિ વગેરેને અમુક કક્ષામાં વહેંચીને શૂન્ય ઉત્કળપના રચવામાં આવી છે.

⇒ ઉત્કળપનાનો અર્થ :

(1) પ્રો. નોર્પ્રોપ (Prof. Norprop)

‘‘પરિકલપનાનું કાર્ય આપણા સંશોધનની વિગતોને વ્યવસ્થિત કરવા માટે માર્ગદર્શન આપવાનું છે. કોઈપણ પરિકલપનામાં રચાયેલા સૂચનો સવાલના ઉકેલો હોઈ શકે છે. પણ એ સૂચનો ખરેખર ઉકેલ જ છે એ પૂછપરછનું કાર્ય છે.’’⁷

(2) લુન્ડબર્ગ :

‘‘ઉત્કળપના એક એવું કામચલાઉ સામાન્યીકરણ છે. જેની યથાર્થતા ચકાસવી હજું બાકી છે.’’

(3) કરલિંગર :

‘‘બે કે બેથી વધુ પરિવત્યોની વરચેના સંબંધના અનુમાનિત કથનને ઉત્કલ્પના કહેવામાં આવે છે.’’

(4) મેકચૂગન :

‘‘બે કે બેથી વધુ પરિવત્યો વચ્ચે સંભવિત સંબંધ વિષે બનાવવામાં આવેલ તપાસનીય કથનને ઉત્કલ્પના કહે છે.’’⁸

⇒ ઉત્કલ્પનાનું મૂલ્યાંકન :

કોઈ ઉત્કલ્પના અન્ય ઉત્કલ્પના કરતા ચઢિયાતી છે તે શી રીતે નકકી કરવું. રચેલી બે કે વધુ ઉત્કલ્પનાઓમાંથી વધુ પ્રમાણભૂત અને વિશ્વસનીય ઉત્કલ્પના નકકી કરવી એટલે ઉત્કલ્પનાનું મૂલ્યાંકન કરવું.

જે ઉત્કલ્પના સમસ્યા સાથે વધુ સુસંગત હોય અને વધુ તાર્કિક હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. એટલું જ નહિ ઉત્કલ્પના એવી હોવી જોઈએ જેને કસોટીના એરણ પર ચકાસી શકાય.

⇒ ઉત્કલ્પનાના પ્રકારો :

(1) શૂન્ય ઉત્કલ્પના :

આ પ્રકારની ઉત્કલ્પના તફાવત નથી એવો નિર્દેશ કરે છે.

(2) વિકલ્પ ઉત્કલ્પના :

જ્યારે ઉત્કલ્પના ખોટી ઠરે તેવા સંજોગોમાં સ્વીકારતા ઉત્કલ્પનાને વિકલ્પ ઉત્કલ્પના કહેવાય છે.

(3) વિદ્યાયક ઉત્કલ્પના :

જે ઉત્કલ્પના હકાર અર્થ ધરાવતી હોય તેને વિદ્યાયક ઉત્કલ્પના કહેવામાં આવે છે.

(4) નિષેધક ઉત્કલ્પના :

જે ઉત્કલ્પના નકાર અર્થ ધરાવતી હોય તેને નિષેધક ઉત્કલ્પના કહેવામાં આવે છે.

⇒ ઉત્કલ્પનાના લક્ષણો :

ગુડ અને હંકે ઉત્કલ્પનાના લક્ષણો નીચે મુજબ આપ્યા છે –

- (1) ખ્યાલાતમક રૂપણ્ટતા
- (2) અનુભવજન્ય સંદર્ભ
- (3) ચોકકસાઈ પૂર્ણ
- (4) ઉપલબ્ધ પ્રયુક્તિઓ સાથે સંબંધિત
- (5) પૂર્વ સ્થાપિત સિદ્ધાંત સાથે સંબંધિત

⇒ ઉત્કલ્પનાના સ્ત્રોત :

જે ઘટકોમાંથી ઉત્કલ્પના જન્મે છે તે કે ઉદ્ભવે છે એ ઘટકોને ઉત્કલ્પના ના સ્ત્રોત તરીકે ઓળખાય છે. બીજી રીતે કહીએ તો ઉત્કલ્પનાના ઉદ્ભવ તત્વોને તેના સ્ત્રોત કહેવાય.

ગુડ અને હંકે નીચે મુજબ સ્ત્રોત આપેલા છે :

- (1) સામાન્ય સંસ્કૃતિ
- (2) વિજ્ઞાન
- (3) ઉપમા – જુદા જુદા વિજ્ઞાનોની ઘટનાઓ વચ્ચે સામ્ય જોવા મળે છે.
- (4) વિજ્ઞાનીના વ્યક્તિગત અનુભવો.

⇒ ઉત્કલ્પનાના કાર્યો અથવા ઉપયોગિતા :

- (1) અદ્યયનને માર્ગદર્શન પુરુષ પાડે છે.
- (2) સંશોધકને અનુભવજન્ય ચકાસણી તરફ દોરે છે.

- (3) અધ્યયનનું ક્ષેત્ર નિર્ધારિત કરે છે.
- (4) અધ્યયનની પ્રચુક્તિ નિર્ધારિત કરે છે.
- (5) સિદ્ધાંતની રચનામાં મદદરૂપ થાય છે.
- (6) પ્રસ્થાપિત સિદ્ધાંતની ચકાસણી કરે છે.
- (7) સિદ્ધાંત અને અધ્યયન વર્ચેની કડી બને છે.

⇒ **ઉત્કલ્પનાની મર્યાદાઓ :**

- (1) જે ઉત્કલ્પનાઓ અન્ય શોધોમાંથી ઉદ્ભવે છે તે અમુક અંશે પ્રથમ મર્યાદામાંથી મુક્ત રહે છે.
- (2) જે ઉત્કલ્પનાઓ કેવળ આગાઉના અભ્યાસની શોધ પર નહીં પણ વિસ્તૃત સિદ્ધાંત પર રચાયેલી હોય તેવી ઉત્કલ્પનાઓ બીજી મર્યાદાઓ માંથી મુક્ત રહે છે.

⇒ **પ્રસ્તુત સંશોધનની ઉત્કલ્પનાઓ :-**

સંશોધનની સમસ્યા અને હેતુઓ નક્કી થયા બાદ સંશોધનકર્તા સંશોધન ના હેતુઓના આધારે ઉત્કલ્પનાઓ બનાવે છે. ઉત્કલ્પનાનો અર્થ વ્યખ્યાત કરતા કહી શકાય કે ઉત્કલ્પના એ કોઈ સમસ્યાનો પ્રસ્થાપિત (સૂચિત) ઉત્તર છે.

(Hypothesis the suggested answer to the problem) ઉત્કલ્પના સંશોધનકાર્યને એક નિશ્ચિત દિશા પ્રદાન કરે છે. ઉત્કલ્પના મુખ્ય માહિતીઓના એકત્રિકરણમાં સહાયક બને છે. ઉત્કલ્પના દરેક સ્થિતિમાં નિષ્કર્ષ શોધવામાં સહાયક બને છે. સંશોધક જ્યારે ઉત્કલ્પનાઓનું નિર્માણ કે ઘડતર પોતાના સંશોધન સમસ્યાના સંદર્ભમાં કરે છે ત્યારે આ ઉત્કલ્પનાઓના આધારે જ તે સંશોધનને આગળ વધારે છે. ઉત્કલ્પનાને સંશોધનોનો પાયો ગણવામાં આવે છે. ઉત્કલ્પનાઓ એ કામચલાઉ ધારણા છે. જેથી ચકાસણી કરવાની બાકી

હોય છે. પ્રસ્તુત સંશોધનમાં સ્વતંત્ર પરિવત્યોજેમ કે ઉમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માસિક આવક, કૌટુંબિક દરજો, કાર્યનો પ્રકાર, જીવનશૈલીથી સંતોષનું પ્રમાણાને અમુક કક્ષામાં વહેંચી, શૂન્ય ઉત્કલ્પના રચવામાં આવે છે.

શિક્ષણ અંગે F કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho1 જેતપુર શહેરના રટન કલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho2 જેતપુર શહેરના રટન કલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho3 જેતપુર શહેરના રટનકલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કુટુંબની આર્થિક સ્થિતિ અંગે F કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho4 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho5 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho6 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કુટુંબની માસિક આવક અંગે F કસોટીપ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho7 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho8 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં તેના સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho9 જેતપુર શહેરના રટન કલાકારોની માનસિક આવકના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

પિતાના વ્યવસાય અંગે F કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho10 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho11 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho12 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

રટન કલાકારોની જીવન શૈલીના સંદર્ભમાં F કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho13 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho14 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho15 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

રટન કલાકારોના અનુભવ અંગે F કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho16 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho17 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના સમાયોજન ના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

Ho18 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

સહસંબંધની કસોટી માટે ચકાસણી કરવા રચેલી શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho19 જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજનના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

Ho20 જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષ ના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

Ho21 જેતપુર શહેરના રટન કલાકારોના સમાયોજન અને જીવન સંતોષના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

t કસોટી ના આધારે લગ્ન દરજા પ્રમાણે રચેલી શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho22 જેતપુર શહેરના રટન કલાકારોના લગ્ન દરજાના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho23 જેતપુર શહેરના રટન કલાકારોના લગ્ન દરજાના સમાયોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho24 જેતપુર શહેરના રટન કલાકારોના લગ્ન દરજાના જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કુટુંબના સભ્યોની સંખ્યાના આધારે રચેલી 't' કસોટીની શૂન્ય ઉત્કલ્પનાઓ ::

Ho25 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમા માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho26 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમા સમાયોજન ના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho27 જેતપુર શહેરના રટન કલાકારોના કુદુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

પિતાના અભ્યાસ ના આધારે રચેલી 't' કસોટીની શુન્ય ઉત્કલ્પનાઓ ::

Ho28 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે તેઓની માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho29 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે તેઓના સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho30 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે તેઓના જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

માતાના અભ્યાસના આધારે રચેલી 't' કસોટીની શુન્ય ઉત્કલ્પનાઓ ::

Ho31 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho32 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho33 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

માતાના વ્યવસાય ના આધારે રચેલી 't' કસોટીની શુન્ય ઉત્કલ્પનાઓ ::

Ho34 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho35 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho36 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

રટન કલાકારોના રહેઠાણના પ્રમાણે 't' કસોટીના આધારે રચેલી શૂન્ય

ઉત્કૃષ્ણનાઓ ::

Ho37 જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે કોઈ સાર્થક તફાવત નથી.

Ho38 જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho39 જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

રટનકલાકારોમાં શારીરિક તકલીફના પ્રમાણે 't' કસોટીના આધારે રચેલી શૂન્ય

ઉત્કૃષ્ણનાઓ ::

Ho40 જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય ના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho41 જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho42 જેતપુર શહેરના રટન કારલમાં શારીરિક તકલીફના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

રટનકલાકારોમાં શોખના પ્રમાણે 't' કસોટીના આધારે રચેલી શૂન્ય

ઉત્કૃષ્ણનાઓ ::

Ho43 જેતપુર શહેરના રટન કલાકારોમાં શોખના આધારે તેઓના માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho44 જેતપુર શહેરના રટન કલાકારોમાં શોખના આધારે તેઓના સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

Ho45 જેતપુર શહેરના રટન કલાકારોમાં શોખના આધારે તેઓના જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

3.6 પ્રસ્તુત સંશોધનના પરિવત્યો :-

સંશોધન સમસ્યામાં સમાયેલા વિવિધ પરિવત્યોને ઓળખવા અને વ્યાવહારિક વ્યાખ્યાચિત કરવા એ અદ્યયનનું અગત્યનું સોપાન છે. જેમાં મૂલ્યની દ્રષ્ટિએ પરિવર્તન કરી શકાય તેવા ઘટકને પરિવત્યો કહે છે. પ્રસ્તુત સંશોધનમાં નીચે મુજબના પરિવત્યોનો અભ્યાસ કરેલ છે.

પોસ્ટમેન તથા ઈગાન (1966) ના અનુસાર “પરિવત્યો એવું લક્ષણ કે ગુણધર્મ છે જેના અનેક પ્રકારના મૂલ્ય હોઈ શકે છે.”⁹

એમ.આર.ડી’એમેટો – “પરિવત્યો એટલે પદાર્થ, વસ્તુ કે જીવંત પ્રાણીનું એવું લક્ષણ કે જેનું માપન થઈ શકે”¹⁰

હિલ (1980) ના મત અનુસાર "A dependent Variable is one about which we make a prediction."

A સ્વતંત્ર પરિવત્યો :-

કેન્ટોવિઝ એન્ડ રોડીગર (1964) “સ્વતંત્ર પરિવત્યો એવું પરિવત્યો છે, જેમાં પ્રયોગકર્તા દ્વારા હસ્તોપયોજન કરવામાં આવે છે.”

સ્વતંત્ર પરિવત્યો એ એક એવો ઘટક છે કે, જેને સંશોધક નિર્દિશણ હેઠળની ઘટના પરનો તેનો સંબંધ નકકી કરવા માટે તેને પસંદ કરે છે. લાગુ પડે છે કે માપે છે.

પ્રસ્તુત સંશોધનના સ્વતંત્ર પરિવત્યો ::

1	શિક્ષણ	પ્રાથમિક (1 થી 7) / માધ્યમિક (8 થી 10) ઉચ્ચતર માધ્યમિક (11 થી 12)
2	લગ્ન દરજાને	પરિણીત / અપરિણીત
3	કુટુંબની આર્થિક સ્થિતિ	નિર્મન / મધ્યમ / ઉચ્ચ
4	કુટુંબના સહ્યોની સંખ્યા	5 સહ્યોની સુધી / 5 સહ્યોની વધુ

5	માસિક આવક	રૂ. 5000 સુધી / રૂ. 5000 થી 10,000 રૂ. 10,000 થી વધુ
6	પિતાનો અભ્યાસ	ધો. 10 સુધી / ધો. 10 થી વધુ
7	માતાનો અભ્યાસ	ધો. 10 સુધી / ધો. 10 થી વધુ
8	પિતાનો વ્યવસાય	નોકરી / ધંધો / ખેતી
9	માતાનો વ્યવસાય	નોકરી / ઘરકામ
10	રહેઠાણ	ગ્રામ્ય / શહેરી
11	તમને તમારા રહેઠાણનો કચ્ચવાટ છે ?	હા / ના
12	તમારી જીવન શૈલીથી તમને કેટલો સંતોષ છે ?	ઓછો / મદ્યમ / ખૂબ જ
13	તમને કોઈ શારીરિક તકલીફ છે ?	હા / ના
14	અનુભવ	5 વર્ષથી નીચે / 5 થી 10 વર્ષ / 10 વર્ષથી વધુ
15	શોખ	માનસિક / શારીરિક

B પરતંત્ર પરિવર્ત્ય :-

પોસ્ટમેન એન્ડ ઈગન (1967) “પરતંત્ર પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય જેના વિષે પ્રયોગકર્તા પ્રયોગના આધારે ભવિષ્યવાણી કરે છે.”

“પ્રાયોગિક પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિણામ ઉપર જે અસર પડે, તેમાં જે ફેરફાર થાય તેને આધારિત પરિવર્ત્ય કહેવાય.”

પરતંત્ર પરિવર્ત્યો એ એવા ઘટકો છે કે, જે પરતંત્ર પરિવર્ત્યોની અસર તપાસવા માટે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે અને માપવામાં આવે છે. અહીં પરતંત્ર પરિવર્ત્યો ત્રણા છે :

પ્રસ્તુત સંશોધનના પરતંત્ર પરિવર્ત્ય :

- (1) માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંક
- (2) સમાચોજન પ્રાપ્તાંક
- (3) જીવન સંતોષ પ્રાપ્તાંક

C નિયંત્રિત પરિવત્ત્ય :-

કેન્ટોવિઝ તથા રોડીગર (1984) અંકુશિત કે નિયંત્રિત પરિવત્ત્ય એક પ્રકારનું સંભવિત સ્વતંત્ર પરિવત્ત્ય હોય છે. જેને પ્રયોગ દરમ્યાન નિથર રાખવામાં આવે છે. આ એક એવું પરિવત્ત્ય હોય છે જે પરિવર્ત્તિત નથી થતું. કારણ કે પ્રયોગકર્તા અથવા સંશોધક દ્વારા તેને નિયંત્રિત કરી દેવામાં આવે છે.

નિયંત્રિત પરિવત્ત્ય એ એવું પરિવત્ત્ય છે કે, સંશોધન દરમ્યાન સ્વતંત્ર પરિવત્ત્ય ઉપરાંત તેની પણ અસર પરિવત્ત્ય પર થઈ શકે છે, પરંતુ સંશોધક તેને નિયંત્રિત કરે છે. તેથી તે અસરહીન બને છે. તેથી તેની અસર તટસ્થ થાય છે. તે તપાસતો હોય છે. આ દરમ્યાન અન્ય પરિવત્ત્યોની પરતંત્ર પરિવત્ત્યો પર અસર ન થાય તેની કાળજી રાખે છે. આવા અન્ય પરિવત્ત્યોને નિયંત્રિત પરિવત્ત્ય કહે છે. નિયંત્રિત પરિવત્ત્ય એ સ્વતંત્ર પરિવત્ત્યના જેવા જ પરિવત્ત્ય છે.

પ્રસ્તુત સંશોધનના નિયંત્રિત પરિવત્ત્યો ::-

- (1) માસિક આવક.
- (2) શિક્ષણ.
- (3) માત્ર જેતપુર શહેરમાંથી જ નિદર્શની પસંદગી કરેલ હતી.
- (4) હાલની નોકરીનો અનુભવ.
- (5) રટનકલાકારોનો શોખ.
- (6) રહેઠાણ ગ્રામ્ય / શહેરી.

(D) આંતરવર્તી પરિવત્ત્ય –

આંતરવર્તી પરિવત્ત્ય એ એવું પરિવત્ત્ય છે કે જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાય કે માપી શકાય નહીં, પરંતુ આવા પરિવત્ત્યની પરતંત્ર પરિવત્ત્ય પર થતી અસરની ધારણા કે કલપના થઈ શકે છે. પ્રસ્તુત સંશોધનના આંતરવર્તી પરિવત્ત્યો નીચે મુજબ છે.

- (1) કૌદુંબિક વાતાવરણ.
- (2) સંસ્થાનુ વાતાવરણ.
- (3) પ્રવર્તમાન સામાજિક પર્યવરણ.

(4) માહિતી એકત્રિત કરતી વખતે ઉત્તરદાતાની શારીરિક-માનસિક સ્થિતિ.

(5) માહિતી એકત્રિત કરતી વખતેની ઉત્તરદાતાની પ્રેરણાઓ.

3.7 સંશોધન યોજના ::-

સંશોધન યોજના એ સંશોધનનો Mirror (આચનો) છે. જેના દ્વારા ખબર પડે છે કે સંશોધનમાં કેટલા સ્વતંત્ર પરિવત્યોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના કેટલા સ્તર છે, આધારિત પરિવત્યોનું માપન કઈ રીતે થયું છે. બાહ્ય પરિવત્યોને નિયંત્રણ કરવા કઈ-કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધન યોજના એ સંશોધન સમસ્યા વિષે ઉત્તર પ્રાપ્ત કરવાની એક રૂપરેખા છે.

એકવાર સંશોધન સમસ્યાની રચના જોઈતી માહિતીના પ્રકારો જાણવા માટે સ્પષ્ટ થયા બાદ સંશોધકે તેની સંશોધન યોજના તૈયાર કરવી જોઈએ. સંશોધન યોજના સામગ્રીના એકત્રીકરણ અને પૃથ્થકરણ માટેની દિશાઓની વ્યવસ્થા છે.

સંશોધનની સમસ્યાના ઘડતર પછી સંશોધનની અભ્યાસ યોજના નક્કી કરવામાં આવે છે. સંશોધનની અભ્યાસ યોજના તૈયાર કરવાથી સમગ્ર સંશોધન કેવી રીતે કરવામાં આવશે તેનો ખ્યાલ આવે છે. સંશોધનની અભ્યાસ યોજનામાં માહિતીનું એકત્રીકરણ, માહિતીનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ, પરિણામોનું અર્થઘટન વિગેરે બાબતો પૂર્વેથી નક્કી કરવામાં આવે છે.

સેલ્ટઝ, રાઈટ્ઝ અને ફુક જણાવે છે કે – “સંશોધનના હેતુ પ્રમાણે તેની અભ્યાસ યોજના તૈયાર કરવામાં આવે છે.”

વિવિધ સંશોધનોના હેતુ અલગ-અલગ હોય છે, તેથી તેમની અભ્યાસ યોજનામાં પણ તફાવત જોવા મળે છે.

⇒ સંશોધન યોજના એટલે શું ?

સંશોધન યોજના એટલે કે સંશોધનમાં કચા સાધનનો ઉપયોગ કરવામાં આવશે, સમસ્યા કે તપાસની વિગત શું છે, સંશોધન કચારે અને કઈ જગ્યા પર કરવાનું છે, અને કેવી રીતે કરવામાં આવશે તે અંગેના નિર્ણયની સુવ્યવસ્થિત, સુસંગતીત ગોઠવણા.

જહોન – “સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો છે.”¹¹

કરલિંગરના મત પ્રમાણે સંશોધન યોજના એટલે પ્રાચોરિક ચૂક નિવારી કે નિયંત્રિત કરી સંશોધન સમસ્યાના ઉકેલ માટે તપાસનો નકશો કે ઢાંચો અથવા તપાસની આંટીઘૂટીનો વ્યૂહ બાંધવો તે સંશોધન યોજના છે.

જહોડાના મતે સંશોધન સમસ્યા તેના આશયને અનુરૂપ માહિતી એકત્રિત કરવી અને માહિતીના ખિશ્લેખણ અને અર્થઘટન, પૃથ્વીકરણાની આયોજન રૂપ ગોઠવણા કરવી.

કરલિંગર અનુસાર “સંશોધન યોજના સંશોધન કરવા માટે બનેલી એક એવી યોજના તથા રચના છે, જેના દ્વારા સંશોધન સમસ્યાનો ઉત્તર પ્રાપ્ત કરવામાં આવે છે.”

⇒ સંશોધન યોજનાના પ્રકારો ::

સંશોધન યોજનાના ત્રણા પ્રકારો હોય છે. જે પ્રકારોની ચર્ચા નીચે મુજબ છે :

→ રચનાત્મક અથવા અન્વેષણાત્મક અદ્યયન

(Formulative or Exploratory study)

સંશોધન યોજના સામગ્રીના એકત્રીકરણ અને પૃથ્વીકરણ માટેની દિશાઓની વ્યવસ્થા છે જે સંશોધનના પ્રયોજન સાથે સુસંગત હોય છે. દરેક અદ્યયનનું પોતાનું ખાસ પ્રયોજન હોય છે. પણ આપણે સંશોધનનાં પ્રયોજનને અનેક સમૂહોમાં વહેંચી શકીએ છીએ.

- (1) ઘટનાની વારંવારિતા નક્કી કરવા મોટે ભાગે પણ હંમેશા નહીં અમૂક વિશિષ્ટ આરંભિક ઉત્કૃષ્ણના વિશે વિચારી શકાયું.
- (2) ઘટના સાથે પરિચય પ્રાપ્ત કરવો જેથી સંશોધનની રચના વધારે ચોક્કસ બની શકે અને ઉત્કૃષ્ણનાઓનો જ્યાલ વિકસાવી શકાય.

- (3) ઉત્કલ્પના સાથે અથવા ઉત્કલ્પના વિના એ લાક્ષણિકતાઓના સ્વરૂપ વિશે કોઈ વિશિષ્ટ વ્યક્તિ પરિસ્થિતિ અથવા સમૂહની લાક્ષણિકતાઓ ચોકકસ રીતે આલેખી શકાય.

અન્વેષણાત્મક અધ્યયનોની એક અસ્તિત્વ તરીકે ચર્ચા કરીએ છીએ છતા એને સંશોધન પ્રક્રિયાના પ્રારંભિક સોપાન તરીકે માનવું ઉચિત છે. ખરૂ જોતા કોઈપણ પૂછપરછનો સૌથી વધારે મુશ્કેલ ભાગ તેનો આરંભ છે. અન્વેષણાની પાછળની કક્ષાઓમાં પુષ્કળ કાળજીપૂર્વકની પદ્ધતિઓનું ખાસ મૂલ્ય નથી.

- (1) સવાલની અંતઃદર્શિને ઉત્તેજન આપનાર ઉદાહરણાનું પૃથ્વેકરણ.
- (2) સંબંધ ઘરાવતા સામાજિક અને બીજા સાહિત્યનું અવલોકન.
- (3) અધ્યયન યોગ્ય અવલોકનનો વ્યવહારિક અનુભવ મેળવ્યો હોય એવી વ્યક્તિઓની મોજણી.

બધા જ અન્વેષણાત્મક અધ્યયનોમાંથી એક અથવા એકથી વધુ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપયોગમાં ચુસ્તપણું હોવું જરૂરી છે.

⇒ વર્ણનાત્મક અને નિદાનાત્મક અધ્યયન ::

(Destructive and Diagnostic study)

* * વર્ણનાત્મક અધ્યયન :-

વિદ્યાચક માપન પદ્ધતિ તરીકે વર્ણનાત્મક પદ્ધતિને ઓળખવામાં આવે છે, તે જાણવું મહત્વનું છે તેટલું જ તે કચાં સુધી આગળ પહોંચ્યો છે એ જાણવું જરૂરી છે. વર્ણનાત્મક અધ્યયનનો આવી સમજના વિકાસ માટે પણ અગત્યનો ભાગ ભજવે છે. કેટલીક વખત આ સંશોધનો દરજાના અધ્યયનો તરીકે ઓળખાય છે.

*** * ઉપયોગિતા :-**

- (1) સંશોધનના ઘણા સાધનો પૂરા પાડવામાં મદદ કરે છે.
- (2) પદાર્�ો અને માણસોના સ્વભાવનું આવશ્યક જ્ઞાન મેળવી શકાય છે.
- (3) ધંધાકીય નિર્ણયો કરવા માટે કિંમતી હકીકતો પુરી પાડે છે.

*** * ચોજના :-**

વર્ણનાત્મક અદ્યયનોની રજૂ આતની ચોજનાના અમુક પ્રકારો પાડવામાં આવે છે.

- (1) વિશ્લેષણ
- (2) સામાન્ય
- (3) ગણના
- (4) મૂલ્યાંકન
- (5) વર્ગીકરણ
- (6) માપન

*** * વર્ણનાત્મક અદ્યયનો :-**

વર્ણનાત્મક અદ્યયનો ખાસ કરીને સમાજમાં પ્રવર્તતા પ્ર૟નો સાથે છે. જેનું લિસ્ટ બહુ જ લાંબુ છે. છતાં અમુક દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વર્ણનાત્મક સંશોધનમાં કોઈપણ વસ્તુનો પ્રકાર અને દરજાની વિગતનો, માણસોના સમૂહનો, અનેક પદાર્થોની પરિસ્થિતિઓનાં સમૂહની વિગતોના વર્ણનો અથવા બીજુ કોઈ ઘટનાઓ કે જેનું વ્યક્તિ અદ્યયન કરવા માંગે છે તેનો સમાવેશ કરવામાં આવે છે.

વર્ણનાત્મક સંશોધનો જુદી-જુદી રીતે ઉપયોગી થાય છે, જેમ કે આ સંશોધનો ધંધાકીય નિર્ણય કરવા માટે માહિતી પૂરી પાડે છે.

સમાજની લાક્ષણિકતા જેમ કે – શારીરિક માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણનું પ્રમાણા, ગુનાઓનું અભુક્ત વિસ્તારમાં પ્રમાણા, ધરોની દશાઓ વગેરે બાબતોનું અદ્યયન થઈ શકે.

3.8 પ્રસ્તુત સંશોધનની યોજના :-

પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ જેતપુર શહેરના હિરા ઉધોગમાં કામ કરતા રદ્દન કલાકારનો માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષનો અભ્યાસ કરવાનો છે. આ ત્રણોચ પરિવત્યો ઉપર રદ્દનકલાકારોના શિક્ષણ, દાખ્યત્વજીવન, કુટુંબની આર્થિક સ્થિતિ, કુટુંબના સત્યોની સંખ્યા, માસિક આવક, કાર્યનો પ્રકાર, રહેઠાણા, જીવનશૈલીથી સંતોષ, શારીરિક તકલીફ, અનુભવ, શોખ, રહેઠાણાનો કચવાટ છે વગેરે ઘટકોની અસર તપાસવાનો હતો. આ સાથે કેટલાક ગૌણ હેતુઓ પણ નક્કી કરવામાં આવ્યા હતા.

આમ મુખ્ય અને ગૌણ હેતુઓને ધ્યાનમાં રાખીને કેટલીક શૂન્ય ઉત્કલ્પનાઓ રચી હતી. તેની ચકાસણી કરવા માટે સમગ્ર યોજના નીચે મુજબ તૈયાર કરવામાં આવી હતી.

અહીં આંકડાશાસ્ત્રીય t કસોટી, r કસોટી અને F કસોટીને આધારે નીચે મુજબ ઉત્કલ્પનાઓ રચવામાં આવી છે.

⇒ ** ‘ટી’ ગુણોત્તર વિશ્લેષણ :-

શૂન્ય ઉત્કલ્પનાઓ રચવામાં આવી હતી અને ચથાર્થતા સાબિત કરવા માટે ‘t’ કસોટી દ્વારા ગણાતરી કરવામાં આવી છે. જેમાં માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષની શૂન્ય અટકળો રચી હતી. જેમાં શિક્ષણ, આર્થિક સ્થિતિ, આવક વગેરે સ્વતંત્ર પરિવત્યો અને માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવનસંતોષ એ અવલંબી પરિવત્યો છે.

⇒ F-કસોટી એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ પ્રમાણે શૂન્ય

ઉત્કલ્પનાઓનું વિશ્લેષણ :

F-કસોટી દ્વારા પણ પ્રસ્તુત સંશોધનનું પૃથ્વેકરણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે રેન કલાકારોના શૈક્ષણિક લાયકાત અને અવલંબિત પરિવર્ત્ય તરીકે માનસિક સ્વાસ્થ્ય, સમાચોરજન અને જીવનસંતોષના મેળવેલ પ્રાપ્તાંકો દ્વારા તેમની વચ્ચેના તફાવતની સાર્થકતા તપાસવામાં આવી છે.

આ રીતે આંકડાશાસ્ત્રીય કસોટીઓનો ઉત્કલ્પનાઓના સંદર્ભમાં સમજુને રેન કલાકારોની સમજિ વિષે અહીં સમજૂતિ આપી છે.

ફેકટોરીયલ ડિઝાઇન 2 X 3 પ્રમાણે 'F' કસોટી દ્વારા પણ પૃથ્વેકરણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે રેનકલાકારોની શૈક્ષણિક લાયકાત અને કુદુંબની આર્થિક સ્થિતિ તેમજ અવલંબિત પરિવર્ત્ય તરીકે માનસિક સ્વાસ્થ્ય, સમાચોરજન અને જીવનસંતોષના મેળવેલ પ્રાપ્તાંકો દ્વારા તેમની વચ્ચેના તફાવતની સાર્થકતા તપાસવામાં આવી છે.

⇒ સહસંબંધ – r નું વિશ્લેષણ :-

પ્રસ્તુત સંશોધનમાં નિયંત્રિત પરિવર્ત્યોની પ્રમાણે સહસંબંધની ચકાસણી કરવા માટે માનસિક સ્વાસ્થ્ય, સમાચોરજન અને જીવન સંતોષ વચ્ચેનો સહસંબંધ ચકાસવા – શૂન્ય ઉત્કલ્પનાઓ રચવામાં આવી છે.

3.9 પ્રસ્તુત સંશોધનની સમજિ ::-

મનોવિજ્ઞાન અને શિક્ષણ શાસ્ત્રના ક્ષેત્રમાં જે સંશોધન અને અધ્યયન કાર્ય કરવામાં આવે છે તેમાં માહિતી (Data) મુખ્યત્વે બે સ્ત્રોતોમાંથી પસંદ કરવામાં આવે છે.

- (1) અદ્યયન કે સંશોધન સંબંધી માહિતી સંપૂર્ણ જનસંખ્યા અથવા સમજ્ઞિ (Population or Universe) માંથી એકત્રિત કરવામાં આવે છે.
- (2) સંપૂર્ણ જનસંખ્યા કે સમજ્ઞિમાંથી નિર્દર્શ પસંદ કરીને આ નિર્દર્શ પર અદ્યયન કરીને માહિતી એકત્રિત કરવામાં આવે છે.

સમજ્ઞિ સંશોધન કાર્યમાં ઘણું જ મહત્વ ધરાવે છે. નિર્દર્શ એ સમજ્ઞિનો ભાગ છે. આથી સમજ્ઞિ એટલે શું તે જાળવુ સંશોધક માટે ઘણું જ જરૂરી છે. અહીં સમજ્ઞિનો અર્થ આંકડાશાસ્ત્રીય અર્થ લક્ષ્યમાં લેવાનો હોય છે. તે માટે જ સામાજિક સંશોધનમાં ઉપયોગમાં લેવાતા “‘સમજ્ઞિ’” શબ્દ માટે આંકડાશાસ્ત્રીય સમજ્ઞિ શબ્દપ્રયોગ કરવામાં આવે છે.

* સમજ્ઞિ એટલે શું ? :-

→ ઈસિડોર ચેઇન “‘સમજ્ઞિ એટલે નિશ્ચિત ગુણાધર્મોના વર્ણન ચોકઠાને અનુસરતો સમગ્ર એકમ સમૂહ.’’¹²

→ પી.વી. ચંગ (1966) જણાવે છે કે, “‘એ સમગ્ર સમૂહ જેમાંથી નિર્દર્શની પસંદગી કરવામાં આવે છે, તેને સમજ્ઞિ કહેવામાં આવે છે.’’

→ "A Population is the aggregate of all the cases the conform to same designated set of Specification."

→ “જે જૂથમાંથી નિર્દર્શની પસંદગી કરવામાં આવી હોય તે સમગ્ર જૂથને સમજ્ઞિ કહેવામાં આવે છે.”

આથી સમજ્ઞિ એટલે નિશ્ચિત ગુણ લક્ષણોના વર્ણન ચોકઠામાં સમાવિષ્ટ થતો સમૂહ.

આંકડાશાસ્ત્રીય પરિભાષામાં ‘સમજ્ઞિ’ એટલે જે ક્ષેત્રની જે ઘટનાનો અભ્યાસ કરવાનો હોય તે ક્ષેત્રમાં સમજ્ઞિ થતી એ બધી ઘટનાઓના સમગ્ર

જથ્થાને જે જૂથમાંથી નિદર્શની પસંદગી કરવામાં આવી હોય તે બધા જ જૂથને સમગ્ર જૂથને સમષ્ટિ કહેવામાં આવે છે.

જેમ કે જેતપુર શહેરના હિરા ઉધોગમાં કામ કરતા ર�屯ન કલાકારો અને હિરા ઉધોગમાં કાર્ય કરતા ર�屯ન કલાકારોની કુલ સંખ્યા એટલે સમષ્ટિ.

અહિં જેતપુર શહેરનાં હિરા ઉધોગના પ્રત્યેક ર�屯ન કલાકાર સમષ્ટિનું એકમ બને છે. જો ગુજરાત રાજ્યના હિરા ઉધોગના ર�屯ન કલાકારોનો આવો અભ્યાસ કરવો હોય તો બધા જ હિરા ઉધોગના ર�屯ન કલાકારોનો સમાવેશ સમષ્ટિમાં કરવો જોઈએ.

* સમષ્ટિ ભૌગોલિક ઘટક :-

સમષ્ટિનું પહેલું મહારવનું પરિણામ ભૌગોલિક ઘટક છે. જેતપુર શહેર એ સમષ્ટિનું ભૌગોલિક ઘટક છે. આ પરિણામ સંશોધન ક્ષેત્રની હૃદ મર્યાદા નિર્ધારિત કરે છે. આ ઘટકની સ્પષ્ટતા દ્વારા સમષ્ટિનો વિસ્તાર નકકી થાય છે અને નિદર્શા અભ્યાસનાં તારણો કચા વિસ્તારને લાગુ પાડવાના છે તે સ્પષ્ટ થઈ શકે છે.

* સમષ્ટિનું એકમ :-

સમષ્ટિનું બીજું મહારવનું પરિણામ સમષ્ટિનું એકમ છે. સમષ્ટિ ઘણા એકમોનો કુલ જથ્થો છે. આમ સમષ્ટિ એકમોના જથ્થાથી બનેલું છે. તેમાં સામેલ થતા સમગ્ર એકમોને નિદર્શા એકમો કે સમષ્ટિના સભ્યો કહેવામાં આવે છે.

પ્રસ્તુત સંશોધનમાં જેતપુર શહેરના હિરા ઉધોગના ર�屯ન કલાકારો નિદર્શ એકમો કે સમષ્ટિના સભ્યો છે.

* સમષ્ટિનું લક્ષણ :-

સમષ્ટિનું ત્રીજું મહારવનું લક્ષણ એ સમષ્ટિ એકમોનું લક્ષણ છે. અહીં સંશોધનમાં ર�屯ન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ

પ્રત્યેના લક્ષણો સમજિનું મહત્વનું ધરક છે. આ બાબત ધ્યાનમાં રાખીએ તો સમજિ વ્યક્તિત્વોની બનેલી નથી. વ્યક્તિત્વોએ એકમોના લક્ષણોની બનેલી છે.

* સમજિના પ્રકારો :-

સમજિનાં મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે –

(1) પરિમિત અથવા સીમિત સમજિ :

પરિમિત સમજિ એવી સમજિને કહેવામાં આવે છે જેના સદસ્યોની ગણતરી કરી શકાય છે.

દા.ત. જેતપુર શહેરના હિરા ઉધોગમાં કામ કરતા રતન કલાકારોનો સમૂહ એક પરિમિત સમજિનું ઉદાહરણ છે.

(2) અપરિમિત અથવા અસીમિત સમજિ :

અપરિમિત સમજિ એવી સમજિને કહેવામાં આવે છે કે જેના સદસ્યોની ગણતરી કરી શકાય નથી.

દા.ત. દરિયામાં માછલીઓની સંખ્યા એક અપરિમિત સમજિનું ઉદાહરણ છે.

* પ્રસ્તુત સંશોધનની સમજિ :-

આમ, આ સંશોધનમાં સમજિ તરીકે જેતપુર શહેરના રતન કલાકારોની કુલ સંખ્યાનો સમાવેશ થાય છે. જેતપુર શહેરમાં કુલ 30,000 રતન કલાકારો છે. તેમના કાર્યના વિભાગ મુજબ ચાર પ્રકાર પાડયા છે. જેમાં ઘાટ, પેલ, મથાળા, તળિયા એમ ચાર પ્રકારના રતન કલાકારો કાર્ય કરે છે. આમ જેતપુર શહેરના કુલ 30,000 રતન કલાકારો સંશોધકની સમજિ છે.

3.10 પ્રસ્તુત સંશોધનનો નિર્દર્શ :-

સંશોધન માટે સમગ્ર જગતમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા પાત્રોનો નમૂનો પસંદ કરી તેના પર સંશોધન કરવામાં આવે છે અને તે સંશોધનનું જે પરિણામ આવે તે સમગ્ર જગતના વ્યાપને લાગુ પાડવામાં આવે છે. જ્યારે સંશોધન કરવાનું હોય ત્યારે મોટા સમૂહની તપાસ કરવાને બદલે અમુક નિયત સંજ્ઞામાં જૂથ પસંદ કરી અદ્યયન કરવામાં આવે તેને નિર્દર્શન પદ્ધતિ કહેવામાં આવે છે.

દા.ત. લોહીનું ગૃપ તપાસવામાં માત્ર ટીપું લોહીનો ઉપયોગ કરવામાં આવે છે.

“સમજિના અમુક એકમનો ભાગ નિર્દર્શ પસંદ કરવાની સમગ્ર કાર્યપ્રણાલીને ‘નિર્દર્શ’ કહેવામાં આવે છે.”

* નિર્દર્શ એટલે શું ? :-

સંશોધન માટે સમગ્ર સમજિના બધા જ એકમોની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ અને ખર્ચળ છે. તેમાં સમય, શક્તિ અને અગવડભર્યો હોય છે. જો સમજિના બધા જ એકમોની માહિતી મેળવવાને બદલે થોડા એકમોની માહિતી મેળવવી તે સામાન્ય રીતે વધુ કરકસર ભરેલી છે.

આથી સંશોધકો સમજિ તપાસને બદલે નિર્દર્શ તપાસ કરે છે. “નિર્દર્શ કે નમૂનો એટલે સમજિ વિષે કશીક માહિતી મેળવવાના ઈરાદાથી તે સમજિ માંથી પસંદ કરવામાં આવેલા કેટલાક એકમોનો સમૂહ.”

* નિર્દર્શની કેટલીક વ્યાખ્યાઓ :-

(1) પી. વી. ચંગ :

“સમગ્ર સમૂહની પસંદ કરાયેલી નાની આવૃત્તિ એ નિર્દર્શ છે. સમૂહનું લઘુચિત્ર રજૂ કરનાર સમૂહ એ નમૂનો છે.”¹³

(2) ગુડ અને હટ :

“વિશાળ સમુદ્દરાચ કે વ્યાપક સમજિનું પ્રતિનિધિત્વ કરતો નાનો પેટા સમૂહ કે લઘુ સમુદ્દરાચ એ નિર્દર્શ છે.”

(3) બોગાર્ડસ :

“સમૂહમાંથી કરવામાં આવતી અમુક સંખ્યાની પસંદગીને નિર્દર્શ કહે છે.”

(4) મુલર અને શુસલર : પ

“સમજિનો ગમે તે ભાગ એ નિર્દર્શ નથી પરંતુ સમજિના જે ભાગને સમજિની લાક્ષણિકતાઓ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે ભાગને નિર્દર્શ કહેવાચ છે.”

* ઉત્તમ નિર્દર્શનાં લક્ષણો :-

(1) સમજિનું પ્રતિનિધિત્વ :

“જે નિર્દર્શમાં સમજિનું એકંદરે બધી લાક્ષણિકતાઓ આવરી લેવામાં આવી હોય તેવા નિર્દર્શને પ્રતિનિધિત્વ ધરાવતો નિર્દર્શ કહેવાચ છે.”

(2) નિર્દર્શનું પર્યાપ્ત કદ :

“જે નિર્દર્શમાં વિશ્વસનીય પરિણામ મેળવી શકાય તેટલા પૂરતા પ્રમાણમાં એકમોને આવરી લેવાચા હોય તો તેવા નિર્દર્શને પર્યાપ્ત કદનું નિર્દર્શ કહેવાચ.”

(3) નિર્દર્શની જરૂરિયાત :

- માહિતીનું પૃથ્યકરણ કરવામાં ઓછો સમય લાગે છે.
- સમય અને ખર્ચ બચત થાય છે.
- અભ્યાસ કરવા પાછળ પ્રમાણમાં ઓછો ખર્ચ થાય છે.

→ ઓછા એકમને લગતી માહિતી મેળવવાની હોવાથી પ્રત્યેક એકમને લગતી વિસ્તૃત માહિતી મેળવવી શક્ય બને છે.

નિદર્શનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને જેતપુર શાહેરનાં હિરા ઉધોગમાં કાચ કરતા રણ કલાકારોના સ્વતંત્ર પરિવત્યોના આધારે નિદર્શ પસંદ કર્યો છે.

(4) નિદર્શ પસંદ કરવાની પ્રયુક્તિઓ :

નિદર્શ પસંદ કરવાની પ્રયુક્તિઓ નીચે મુજબ છે –

- (i) યોજનાબદ્ધ નમૂના પસંદગી
(Systematic Sampling)
- (ii) ચાદરિષક નમૂના પસંદગી
(random Sampling)
- (iii) કમશા: નમૂના પસંદગી
(Seqiemtial sampling)
- (iv) બેવડા નમૂના પસંદગી
(Double sampling)
- (v) જૂમખા નમૂના પસંદગી
(Closter Sampling)
- (vi) સહેતુક નમૂના પસંદગી
(Purpositive sampling)
- (vii) સ્તરીકૃત ચાદરિષક નમૂના પસંદગી
(Stratitied Random sampling)
- (viii) આનુષાંગિક નમૂના પસંદગી
(Incidental or Accidental Sampling)

નમૂળો પસંદગીનો આધાર સંશોધનનાં વિષય અને ક્ષેત્ર પર છે. અહીં જેતપુર શહેરના વિસ્તારમાં હિરા ઉધોગમાં જુદા-જુદા વિભાગોમાં કાર્ય કરતા રહેન કલાકારોનું સમજ્ઞિતમાંથી યદરછ નિર્દર્શ ઉત્તમ લક્ષણોને દ્યાનમાં રાખીને લીધેલ છે. ઉપરોક્ત લક્ષણોને નીચે પ્રમાણે સમજાવી શકાય છે :

⇒ * નિર્દર્શનાં પ્રકારો :-

નિર્દર્શ તપાસના આધારે હેતુ સમગ્ર સમજ્ઞિ વિશે માહિતી મેળવવાનો જ હોય છે. નમૂળા પસંદગીની કઈ રીત વધુ ચોગ્ય છે તેનો આધાર સમસ્યાના પ્રકાર અને સ્વરૂપ ઉપર છે. નિર્દર્શ પસંદ કરવાની કાર્યપ્રણાલીના આધારે વિભિન્ન નિર્દર્શોનો મુખ્યત્વે બિનયદરછ નિર્દર્શ અને યદરછ નિર્દર્શ એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

<A> બિનયદરછ નિર્દર્શ :

1. આકસ્મિક નિર્દર્શ
2. ઉપલબ્ધ નિર્દર્શ
3. હેતુલક્ષી નિર્દર્શ
4. નિર્દષ્ટાંત નિર્દર્શ

** યદરછ નિર્દર્શ :**

1. યાદરિષ્ટક નમૂળા પસંદગી
2. કમશા: નમૂળા પસંદગી
3. બેવડા નમૂળા પસંદગી
4. જુમખા નમૂળા પસંદગી
5. સહેતુક નમૂળા પસંદગી
6. સ્તરીકૃત યાદરિષ્ટક નમૂળા પસંદગી
7. આનુષંગિક નમૂળા પસંદગી
8. નમૂળાની પસંદગીનો આધાર સંશોધનનાં વિષયક્ષેત્ર

ઉપર આધારીત છે.

⇒ ચાદરિષ્ટક નમૂળા પસંદગી :-

સંશોધનની પરિભાષામાં યદરછ નિદર્શ એટલે જે નિદર્શમાં સમજિતમાં દરેક એકમને પસંદ કરવાની સમાન તક કે સંભાવના મળી હોય તેવું નિદર્શન અને તેવા નિદર્શનને સાદા યદરછ નિદર્શ કહેવામાં આવે છે.

કોઈપણ એકમની પસંદગીની વિદ્યાયક નિષેધક અસર બીજા એકમની પસંદગી આકાશીમક રીતે થતી હોય તેને યદરછ નિદર્શન કહેવામાં આવે છે.

⇒ સાદું યદરછ નિદર્શન :-

“સરળ યદરછ નિદર્શનમાં સમજિતના દરેક એકમને ફ્રો વખતે પસંદ થવા માટેની સંભાવના હોય છે તેને સાદા યદરછ નિદર્શન કહે છે.”¹⁴

યદરછ નિદર્શ પસંદ કરવા માટે કાગળના ટૂકડા ઉપર નામ અથવા નંબર અથવા આંકડા લખવામાં આવે છે અને તેની ચિહ્નીઓ બનાવવામાં આવે છે અને બધી ચિહ્નીઓ એક પાત્રમાં નાંખવામાં આવે છે. ત્યારબાદ બધી બેગી કરેલી ચિહ્નીઓમાંથી નકકી કરેલી સંખ્યાની ચિહ્નીઓ ઉપાડવામાં આવે છે. આ રીતે લોટરીનાં ફ્રો સાથે સરખાવી શકાય તેને સાદું યદરછ કહે છે. ચિહ્ની નાખ્યા સિવાય પણ સાદા યદરછ નિદર્શનો ઉપયોગ થઈ શકે.

⇒ નિયમિત આંક પદ્ધતિ :-

આ નિયમિત આંકની પદ્ધતિમાં કોઈ એક નકકી કરેલી સંખ્યાને નિદર્શ પસંદ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે ... 150 વસ્તુઓની એક સમજિતમાંથી 15 વસ્તુઓનો એક નિદર્શ પસંદ કરવાનો હોય તો તેમાંથી એક ચિહ્ની ઉપાડી તે ચિહ્ની નવ નંબરની નીકળે તો બાકીના નિદર્શ નવ સભ્યો માટે દશ-દશ ઉમેરીને એટલે કે - 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 109, 119, 129, 139, 149 સુધીનાં નંબરવાળાને નિદર્શમાં પસંદ કરવામાં આવે છે. આને નિયમિત આંક પદ્ધતિ કહેવામાં આવે છે.

⇒ અનિયમિત આંક પદ્ધતિ :-

આ પદ્ધતિમાં ચદરછ નંબરોની પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવે છે. ટિપેટ નામના આંકડાશાસ્ત્રીયના કોષ્ટકોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો હોવાને કારણો આ પદ્ધતિ ટિપેટની પદ્ધતિ પણ કહે છે. ટિપેટના કોષ્ટકમાં 10,000 જેટલા ચાર આંકડાવાળા નંબરો છે. ધારો કે 7000 ની વસ્તુઓની એક સમજ્ઞિમાંથી 100 વસ્તુઓનો એક નિર્દર્શિકા સુધીના નંબરવાળાને નિર્દર્શિકા પસંદ કરવામાં આવે છે. આને અનિયમિત આંક પદ્ધતિ કહેવામાં આવે છે. આજે તો કોમ્પ્યુટર મારફત ચદરછ નિર્દર્શિકા મેળવાય છે.

⇒ કમશા: નમૂના પસંદગી :-

કમશા: નમૂના પદ્ધતિથી સંશોધન ક્ષેત્રે એક નવીન પદ્ધતિનો ઉમેરો થયો છે. નમૂનામાં એક સાથે પાંચસો પાત્ર લેવાને બદલે સો-સો ના પાંચ નમૂના લઈ પાંચ તબક્કે અભ્યાસ કરવાનું બને છે.

⇒ બેવડા નમૂના પસંદગી :-

મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા શિક્ષણશાસ્ત્રના સંશોધનમાં ઘણીવાર એક કરતાં વધુ પ્રકારના નમૂના એક પછી એક પસંદ કરવા પડે છે. તેને બહુ તબક્કા કે બેવડા નમૂના કહેવામાં આવે છે.

⇒ ઝૂમખા નમૂના પસંદગી :-

ઝૂમખા નિર્દર્શિકાનો ઉપયોગ ખૂબ જ મોટી સમજ્ઞિ માટે વાપરવામાં આવે છે. જો સમજ્ઞિ ખૂબ વિશાળ હોય તો સાદો નિર્દર્શિ અને સ્તરીકૃત નિર્દર્શિ ખૂબજ ખર્ચની પે તેથી ઝૂમખા નિર્દર્શિ લેવા પડે છે.

⇒ સહેતુક નમૂના પસંદગી :-

સહેતુક નિર્દર્શનને હેતુલક્ષી નિર્દર્શન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. સહેતુક નિર્દર્શનમાં કોઈ ચોકકસ હેતુનું દ્યાનમાં રાખીને નિર્દર્શ પસંદ કરવામાં આવે છે. આમ, હેતુને આધારે પસંદગીની તકો હોવાથી સમજ્ઞિના તમામ ઘટકોને નિર્દર્શમાં સમાવેશ થવાની સમાન તક મળતી નથી.

⇒ સ્તરીકૃત ચાદરિયક નમૂના પસંદગી :-

જ્યારે સમજ્ઞિના એકમો સ્વરૂપ ન હોય અને તેમાં વિવિધતા હોય ત્યારે સ્તરીકૃત ચદરાછ નિર્દર્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

દા.ત. સ્તરીકૃત નિર્દર્શન પરિણિત સ્ત્રીઓનું કરવાનું હોય ત્યારે જ્ઞાતિ, ધર્મ વગેરે જુદી-જુદી દર્શિયે સમગ્ર સૂચિને સ્તરમાં વહેંચીને સ્તરવાર સાદા ચદરાછ રીતે તેમાંથી પસંદ કરવામાં આવે છે.

⇒ આનુષંગિક નમૂના પસંદગી :-

જ્યારે સમજ્ઞિના હાથવગા એકમોને અભ્યાસ માટે પસંદ કરવામાં આવે ત્યારે તેને આનુષંગિક કે આકર્ષિત નિર્દર્શ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના નિર્દર્શમાં નિર્દર્શનું કદ અગાઉ નકકી થયું હોતું નથી.

દા.ત. 200 કોલેજુયનોનો અભ્યાસ કરવો હોય તો 200 કોલેજુયનો સૌ-પ્રથમ મળી આવે તેનો અભ્યાસ કરાય.

⇒ નમૂના પસંદગીનો આધાર સંશોધનમાં વિષયક્ષેત્ર ઉપર આધારીત છે નિર્દર્શ પસંદગીની બધી જ પદ્ધતિને દ્યાનમાં રાખીને સંશોધકે સાદો ચદરાછ રીતથી નિર્દર્શ પસંદ કર્યો છે.

⇒ ચદરછ નિર્દર્શન મેળવવાની પ્રયુક્તિઓ :-

- (1) નિશ્ચિયત અંતરની પ્રયુક્તિ.
- (2) ચદરછ નંબરવાળા ટેબલનો ઉપયોગ.
- (3) સમાન સ્વરૂપની ચિહ્નીઓનો ઉપયોગ.

⇒ નિર્દર્શ ભૂલ :-

કોઈપણ સંશોધન સમજ્ઞિના વિશાળ સમૂહ પર અભ્યાસ અશક્ય છે. માટે ચદરછ રીતે નમૂનો પસંદ કરી આંકડાશાસ્ત્રીય અનુમાનને આધારે મર્યાદિત કદ પર સામાન્યીકરણ કરવાના હોય છે. પરિણામે માહિતી એકત્રિત કરવામાં થોડી ઘણી ભૂલ કે ખામી કે ક્ષતિ રહી જાય તે સ્વભાવિક છે. આને નિર્દર્શ ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. નિર્દર્શ ભૂલ અને નિર્દર્શ કદ વચ્ચે નિષેધક સંબંધ પ્રવર્તતો જોવા મળે છે. જેમ નિર્દર્શ મોટું તેમ નિર્દર્શ ભૂલનું પ્રમાણ ધટે છે. તેથી વિરુદ્ધ નિર્દર્શ કદ જેમ ઓછું તેમ નિર્દર્શન ભૂલ વધે છે. નિર્દર્શ ભૂલ બે વિભાગમાં વહેંચી શકાય.

⇒ નિર્દર્શભૂલનાં પ્રકાર :

- <1> પૂર્વગ્રહીત ભૂલ.
- <2> પૂર્વગ્રહરહિત ભૂલ.

બીજી રીત પ્રમાણે :

- <1> નિર્દર્શન ભૂલો.
- <2> બિન નિર્દર્શન ભૂલો.

⇒ નિર્દર્શ ભૂલોનાં પરિબળો :

- <1> સમજ્ઞિની પર્યાપ્ત ચાદી.
- <2> નિર્દર્શનું અપર્યાપ્ત પદ.
- <3> સમજ્ઞિ અને એકમની અપર્યાપ્ત વ્યાખ્યા.

⇒ બિન-નિર્દ્શ ભૂલોનાં પરિબળો :

<1> મુલાકાત લેનાર કે ક્ષેત્ર કાર્યની ખામી.

<2> ક્ષેત્રકાર્યના તબકકામાં પક્ષપાત.

ઉપરોક્ત નિર્દર્શનની સમજૂતિના આધારે પ્રસ્તુત અદ્યયન નિર્દ્શ નીચે

મુજબ દર્શાવી શકાય :

⇒ પ્રસ્તુત સંશોધનનો નિર્દ્શ :-

પ્રસ્તુત સંશોધનમાં સ્તરીકૃત યદ્દા નિર્દ્શ પસંદ કરવામાં આવ્યું છે. કારણ કે સમય અને સગાવડની દર્ખિએ આ નિર્દ્શ વધુ અનુકૂળ પડે છે. સ્તરીકૃત યદ્દા નિર્દ્શ પસંદ કરવાના કારણો નીચે પ્રમાણે છે –

- (1) પ્રસ્તુત સંશોધનમાં એકમાર્ગીય વિચરણ પૂઢ્યકરણ યોજના વાપરવાની હોથ તેમાં ‘યદ્દા નિર્દ્શ’ આવશ્યક છે.
- (2) સંશોધકના પૂર્વઘ્રહ કે પક્ષપાત અસર કરતા નથી.
- (3) કોઈપણ પ્રકારના પ્રમાણિત આંકડાશાસ્ત્રીય ટેકનિકનો ઉપયોગ થઈ શકે છે.
- (4) નિર્દર્શની પદ્ધતિ સંભવ્ય નિર્દ્શ પર આધારિત હોવાથી વિશેષતઃ સમઝિનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રસ્તુત સંશોધનમાં જેતપુર શહેરનાં હિરા ઉધોગમાં કામ કરતા રેન કલાકારોને સમઝિ તરીકે પસંદ કર્યા છે. તેમાં કુલ રેન કલાકારોની સંખ્યા 30,000 છે. જેમાંથી કુલ 600 રેન કલાકારોનો નિર્દ્શ યદ્દા રીતે અદ્યયનની સરળતા ખાતર નિર્દ્શ તરીકે સમાવેશ કરેલ છે. જેતપુર શહેરના હિરાના કારખાનામાં સંશોધકે ડુબરુ મુલાકાત લઈ પસંદ કર્યા છે. પ્રયોજયની શૈક્ષણિક લાયકાત, કાર્યનો વિભાગ, અનુભવ, માસિક આવક, કુટુંબના સભ્યોની સંખ્યા, તેઓના સામાજિક-આર્થિક દરજા, નિઝન મધ્યમ અને ઉચ્ચ સ્તરનો હતો.

3.11 પ્રસ્તુત સંશોધનના સાધનો :-

મનોવૈજ્ઞાનિક સંશોધન માટે સંશોધક પોતાના સંશોધનમાં જરૂરી માહિતીના એકત્રિકરણ માટે જુદા-જુદા સાધનોનો ઉપયોગ કરે છે. સંશોધન માં રચવામાં આવેલ ઉત્કળપનાની ચકાસણી માટે અને અદ્યાચનના હેતુઓ ખરા અર્થમાં સિદ્ધ કરવા માટે સંશોધક ઉચિત માહિતી પૂરી પાડવા યોગ્ય સાધનોની પસંદગી કરે છે અથવા નવા સાધનોની રચના કરે છે. સંશોધન સમસ્યાને અનુરૂપ સંશોધક એક કરતા વધુ સાધનો માહિતી પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરે છે.

પ્રસ્તુત સંશોધનના હેતુઓને દ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા સાધનોની મદદી માહિતીનું એકત્રિકરણ કરવામાં આવ્યુ હતું.

⇒ વ્યક્તિગત માહિતીપત્રક :-

જેતપુર શહેરનાં હિરા ઉધોગમાં કાર્ય કરતા રદ્દનકલાકારોના વ્યક્તિગત પરિવત્યો અંગેની માહિતી મેળવવા માટે વ્યક્તિગત માહિતી પત્રક તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેના દ્વારા રદ્દન કલાકારોની શૈક્ષણિક લાયકાત, કાર્યનો પ્રકાર, કુદુંબની આર્થિક સ્થિતિ, કુદુંબના સભ્યોની સંખ્યા, માન્સિક આવક, રહેઠાણા, તમારી જીવનશૈલીથી તમને કેટલો સંતોષ છે ?, અનુભવ, શોખ, રહેઠાણાનો કચવાટ છે ? વગેરે માહિતી મેળવવામાં આવી હતી.

⇒ માનસિક સ્વાસ્થ્ય માપન સંશોધનિકા :-

પ્રસ્તુત સંશોધનમાં ડૉ. ડી.જે. ભંડ અને જી.આર. ગીડા રચિત માનસિક સ્વાસ્થ્ય કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડૉ. ડી.જે. ભંડ અને જી.આર.ગીડા રચિત માનસિક સ્વાસ્થ્યની પ્રશ્નાવલીની રૂપાંતરિત આવૃત્તિ શિલ્પા અને ડૉ. ડી.જે.ભંડ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પ્રશ્નાવલીમાં કુલ 40 વિદ્યાનો છે. આ પ્રત્યેક વિદ્યાનની સામે ત્રણ
(સહમત, તટસ્થ, અસહમત) જેવા વૈકટિપક પ્રતિચારો આપવામાં આવ્યા છે.

- (1) વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણા.
- (2) સુચંદ્રિત વ્યક્તિત્વ.
- (3) જૂથ અભિમુખ વલણો.
- (4) પર્યાવરણ પર પ્રભુત્વ.

ઉપરના પાંચેચ ઘટકો દ્વારા ગુણાંકન ચાવી.

SCORING KEY

PERCEPTION OF REALITY

Item No.	1	6	11	16	21	26	31	36	(8)
Answer	No	Yes	Yes	Yes	Yes	No	Yes	Yes	

INTEGRATION OF PERSONALITY

Item No.	2	7	12	17	22	27	32	37	(8)
Answer	Yes	Yes	Yes	Yes	No	Yes	Yes	No	

POSITIVE SELF EVALUATION

Item No.	3	8	13	18	23	28	33	38	(8)
Answer	No	Yes	Yes	Yes	Yes	No	No	No	


GROUP ORIENTED ATTITUDES

Item No.	4	9	14	19	24	29	34	39	(8)
Answer	Yes	No	No	No	No	Yes	Yes	Yes	

ENVIRONMENTAL MASTERY

Item No.	5	10	15	20	25	30	35	40	(8)
Answer	Yes	Yes	Yes	No	No	Yes	No	Yes	

માનसિક સ્વાસ્થ્ય સંશોધનિકામાં કિર્તની થિએરી પ્રમાણે સહમત, તટસ્થ, અસહમત એમ ત્રણ વિકલ્પો વડે તેનું માપન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 40 વિદ્યાનો છે, જેમાં કુલ 5 ઘટકોનું માપન કરવામાં આવ્યું હતું. તેના ઘટક પ્રમાણે પ્રાપ્તાંકનો વિસ્તાર 8 થી 120 સુધીનો હતો અને ઘટક પ્રમાણે તેના પ્રાપ્તાંકનો વિસ્તાર 5 થી 24 સુધીનો છે.



ઉપર પ્રમાણે સાચા જવાબને 3 પ્રાપ્તાંક વિઝુદ્ધ જવાબને 2 પ્રાપ્તાંક અને તટસ્થ જવાબને 2 પ્રાપ્તાંક આપવામાં આવ્યા હતા. જેનું મૂલ્યાંકન નીચે પ્રમાણે કરવામાં આવ્યું હતું.

A વાસ્તવિકતાનું પ્રત્યક્ષીકરણ ::

ઘટક A માં વિદ્યાન 1 અને 26 બન્ને નિષેધક છે, જ્યારે વિદ્યાન 6, 11, 16, 21, 31 અને 36 વિદ્યાયક છે.

B સુશ્રયિત વ્યક્તિત્વ ::

ઘટક B માં વિદ્યાન 22 અને 37 આ વિદ્યાનો નિષેધક છે, જ્યારે વિદ્યાન 2, 7, 12, 17, 27 અને 32 આ વિદ્યાયક છે.

C વિદ્યાચક સ્વ-મૂલ્યાંકન ::

ઘટક C માં વિદ્યાન 3, 28, 33 અને 38 આ ચારેય વિદ્યાનો નિષેધક છે,
જ્યારે 8, 13, 18 અને 23 આ ચારેય વિદ્યાનો વિદ્યાચક છે.

D વિદ્યાચક સ્વ-મૂલ્યાંકન ::

ઘટક D માં વિદ્યાન 9, 14, 19 અને 24 આ ચારેય વિદ્યાનો નિષેધક છે,
જ્યારે 4, 29, 34 અને 39 આ ચારેય વિદ્યાનો વિદ્યાચક છે.

E વિદ્યાચક સ્વ-મૂલ્યાંકન ::

ઘટક E માં વિદ્યાન 20, 25 અને 35 આ ચારેય વિદ્યાનો નિષેધક છે,
જ્યારે 5, 10, 15, 30 અને 40 આ ચારેય વિદ્યાનો વિદ્યાચક છે.

ઉપરના પાંચેચ ઘટકોના વિદ્યાનોનું ઉપરની આકૃતિ મુજબ ગુણાંકન
કરવામાં આવ્યું હતું.

⇒ વિશ્વસનીયતા અને ચથાર્થતા :

કુલ કલમો - 40

કુલ ઘટકો - 05

વિશ્વસનીયતા :

1 - તાર્કિક સમાનતા - 0.78

2 - અર્થ વિભાજન - 0.94

3 - કસોટી પુનઃકસોટી - 0.95

ચથાર્થતા :

MHI સહ સામયિક ચથાર્થતા - 0.63

ઘોરણો :

MHI માટે જતિ ઘોરણ પ્રસ્થાપિત થયેલ છે.

⇒ સમાયોજન સંશોધનિકા :-

ડૉ. પ્રમોદકુમારની રૂપાંતરિત સમાયોજન સંશોધનિકા કોલેજ જ્તા નબળા સમાયોજન વાળા વિદ્યાર્થીના વર્ગીકરણ કરવા માટે વિકસાવવામાં આવી છે. જેઓને સલાહ અને મનોનિદાન માટે વધારાની જરૂર છે. તેવા માટે વાપરી શકાય તેવી છે. બેશક જુદા-જુદા મનોવિકૃતિજન્ય રોગોના નિદાન માટે સંશોધનિકાનો ઉપયોગ કોઈ રીતે થયો નથી. તે પ્રયોજનથી સામાન્ય પ્રયોજન કક્ષા પૂરી પાડે છે. તેની વિશ્વસનીયતા 0.86 (0.01 લેવલ) અને ચથાર્થતા 0.71 (0.01 લેવલ) જોવા મળી છે.

સમાયોજન સંશોધનિકા ઉચ્ચ પ્રકારની વિભેદનતાવાળા “હા” અને “ના” પ્રકારની ચાણીસ કલમોની બનેલી છે કે જે અસ્થાના વુડવર્થ અને સેન્ડલરની પ્રખ્યાત વ્યક્તિત્વ સંશોધનિકામાંથી લેવામાં આવી છે. આ સંશોધનિકા હિન્દી અને અંગ્રેજી બને ભાષામાં તૈયાર કરવામાં આવી છે. તેમાં જવાબ આપવા માટે લગભગ 20 થી 25 મિનિટનો સમય જાય છે.

આ સંશોધનિકામાં કુલ 40 વિદ્યાનો છે જેના ઉત્તર “હા” અથવા “ના” માં આપવાના છે. સંશોધનિકાની પ્રશ્ન (કલમ) 33 સ્થિવાય બધી જ કલમોમાં “ના” પ્રતિક્રિયાને એક પ્રાપ્તાંક આપવો જયારે કલમ - 33 માં “હા” પ્રતિક્રિયાને એક પ્રાપ્તાંક આપવો. બધી કલમોનાં પ્રાપ્તાંકનો સરવાળો સમાયોજનનો કુલ પ્રાપ્તાંક દર્શાવે છે. આ સંશોધનિકા પર ઊંચા પ્રાપ્તાંકો ઊંચુ સમાયોજન સૂચવે છે અને નીચા પ્રાપ્તાંક કુસમાયોજન દર્શાવે છે.

આ સંશોધનિકા પર પ્રાપ્તાંકનો વિસ્તાર 0 થી 40 નો છે. તેમાં 0 સૌથી ઓછો અને 40 સૌથી વધુ આંક સૂચવે છે.

⇒ સમાયોજન સંશોધનિકાની વિશ્વસનીયતા :

આ તુલામાં કસોટી પુનઃ કસોટી દ્વારા વિશ્વસનીયતા શોધવામાં આવી હતી. જે 0.86 (0.01 લેવલ) જોવા મળી હતી.

⇒ સમાયોજન સંશોધનિકાની ચથાર્થતા :

આ સમાયોજન સંશોધનિકાની ચથાર્થતા 0.71 (0.01 લેવલ) જોવા મળી હતી.

⇒ જીવન સંતોષ તુલા :-

પ્રસ્તુત અભ્યાસમાં આલમ અને શ્રીવાસ્તવ રચિત કાર્ય સામેલગીરી તુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તુલા દ્વારા રટન કલાકારોનું જીવન સંતોષનું માપન સંતોષકારક થઈ શકે તેમ છે અને તેની વિશ્વસનીયતા તથા ચથાર્થતા ઘણી ઊંચી છે. આ તુલાનો ઘણા સંશોધનો માટે ઉપયોગ થાય છે.

આલમ અને શ્રીવાસ્તવ રચિત જીવન સંતોષ તુલામાં કુલ વિદ્યાનો 60 છે. તેમાં હા અને ના એવા બે વિકલ્પ આપવામાં આવેલ છે. તે બન્નેમાંથી એક વિકલ્પ પર ખરાની નિશાની કરી પ્રતિચાર આપવાનો હોય છે. તેમાં “હા” માટે 1 ગુણાંક અને “ના” માટે 0 ગુણાંક અપાય છે. આ તુલામાં લઘૃતમ 0 અને મહત્વમ 60 ગુણાંક મળી શકે છે. ગુણાંક જેમ ઓછો તેમ જીવન સંતોષ ઓછો અને ગુણાંક જેમ વધુ તેમ જીવન સંતોષ વધુ એમ અર્થઘટન કરવામાં આવે છે.

⇒ જીવન સંતોષ તુલાની વિશ્વસનીયતા :-

આ તુલામાં કસોટી પુનઃ કસોટી દ્વારા વિશ્વસનીયતા શોધવામાં આવી હતી. જે 0.84 જોવા મળી હતી.

⇒ જીવન સંતોષ તુલાની ચથાર્થતા :-

આ કસોટીની ચથાર્થતા સકસેનાની સમાયોજન સંશોધનિકા અને શ્રીવાસ્તવની સમાયોજન સંશોધનિકા સાથે સંબંધ ઘરાવે છે. તેની ચથાર્થતા 0.74 અને 0.82 જોવા મળે છે. આ તુલાની બધી વિગતનો દેખીતી ચથાર્થતા સાથે નજીકનો સંબંધ ઘરાવે છે.

3.12 આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ :-

કોઈપણ બાબતને લગતી ગુણાત્મક માહિતી કરતા સંખ્યાત્મક માહિતી વધુ અસરકારક સાબિત થાય છે. તેથી ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મક રૂપાંતર કરવાનું હોય તેવા અભ્યાસમાં આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથોસાથ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિથી પરિમાર્જિત કરીને તારવેલા તારણો કેટલા પ્રમાણમાં વિશ્વસનીય છે તે નકકી કરી શકાય છે.

આંકડાશાસ્ત્રીય માહિતી જેટલા પ્રમાણમાં સારણી કે આલેખરૂપ રજૂ કરી શકાય અને આવૃત્તિ સરાસર કે પ્રસારમત તેની ઉપયોગિતા મુજબ વાપરી શકાય. આમ ઉપર્યુક્ત બાબતોને દ્યાનમાં રાખી આ અભ્યાસમાં ચથાર્થતા અને વિશ્વસનીયતા લાવવા નીચે દર્શાવેલી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

⇒ ટકાવારી :-

પ્રસ્તુત અભ્યાસમાં પસંદગી પામેલા કર્મચારીની કેટેગેરી પ્રમાણે ટકાવારી દર્શાવવામાં આવી છે, જેનું સૂત્ર ...

$$\text{ટકાવારી} = \frac{\text{પ્રાપ્તાંકોનો સરવાળો}}{\text{કુલ પ્રાપ્તાંક}} \times 100$$

⇒ સહસંબંધ :-

સહસંબંધાંક એક સંખ્યા છે તેને વસ્તુ ચા પ્રક્રિયા સંબંધનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. સહસંબંધાંકની કિંમત - 1 થી + 1 સુધીની હોઈ શકે. 1 + એટલે પૂર્ણ સહસંબંધાંક, 0 એટલે બિલકુલ નહિ - 1 એટલે સંપૂર્ણ ઝણા સહસંબંધાંક આ શોધવાની ઘણી રીતો છે. પરંતુ પ્રો. કાર્લ પિર્ચસનની પદ્ધતિ

શ્રેષ્ઠ ગણાય છે. આ રીતે મળતા સહસંબંધાંકને પિચર્સનનો સહસંબંધાંક કહેવામાં આવે છે. તેનું સૂત્ર નીચે મુજબ છે.

$$r = \frac{NExy - \sum x c Ey}{[Nex^2 - (ex^2)] [Ne y^2 - (ey^2)]}$$

r = સહસંબંધાંક

N = x અને y એ મેળવેલ વિષય પ્રાપ્તાંકોની સહસંબંધાંક સંખ્યા

\sum = સરવાળો

x = પ્રથમ પરિવત્યોનો મુખ્ય પ્રાપ્તાંક

y = બીજા પરિવત્યોનો મુખ્ય પ્રાપ્તાંક

પ્રસ્તુત સંશોધનમાં રટન કલાકારોના માનસિક-સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ વચ્ચેનો સંબંધ તપાસવા માટે ઉત્કળપનાની સહસંબંધની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

⇒ વિચરણ પૃથ્થકરણ ફ કસોટી :-

બે સરાસરીના તફાવતની સાર્થકતા, કાંતિક ગુણોત્તરથી ચકાસી શકાય છે. પરંતુ નિદર્શની પાંચ-દશ સરાસરીની જોડ તૈયાર થાય છે. ત્યારે સંશોધકે દશ વખત સરાસરીની સાર્થકતા શોધવી પડે. આ મુશ્કેલીથી બચવા માટે બધા નિદર્શ માટે સમગ્ર કસોટી હોય કે જેમાંથી સમગ્રપણે સાર્થકતા ચકાસી શકાય. આવા પ્રકારની કસોટીને “વિચરણ પૃથ્થકરણ” કહે છે.

વિચરણ પૃથ્થકરણ પદ્ધતિ સૌ પ્રથમ ફિશરે આપી હતી. આ પદ્ધતિ દ્વારા બે અથવા બે કરતા વધારે નિદર્શ જૂથોના અર્દિતત્વ ઘરાવતા વિચરણાનાં આધારે તે જૂથોના, મધ્યકો વચ્ચે તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરવા માટે તથા તે દ્વારા તમામ જૂથો સમાન સમજિતમાંથી આવેલ છે કે કેમ તે ઉત્કળપનાનું

પરીક્ષણ કરવા માટે વિચરણ પૃથ્વકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આથી તે સમયની દંડિએ કરકસર ચુક્ત છે. તેની મદદથી જૂથો અંદરના જૂથો વચ્ચેનું અને કુલ વિચલન પ્રાપ્ત થાય છે. ઉપરાંત સ્વતંત્ર પરિવર્ત્યની પરતંત્ર પરિવર્ત્ય ઉપર મુખ્ય તેમજ આંતરકિયાત્મક અસરો ચકાસી શકાય છે. વિચરણ પૃથ્વકરણના વિવિધ પ્રકારો અને પદ્ધતિઓ હોય છે. જેમ કે એકમાર્ગીય વિચરણ પૃથ્વકરણ, દ્વિમાર્ગીય પૃથ્વકરણ, અપ્રાચલિય વિચરણ પૃથ્વકરણ વિગેરે.

F કસોટીનું સૂત્ર

$$F = \frac{msb}{msw}$$

F = ગુણોત્તર

Msb = Means Square for "Between" Groups
(પદ્ધતિઓના વર્ગોના સરવાળાનું વિચરણ)

Msw = Means Squpe for "within" Groups
(પદ્ધતિઓના વર્ગોના સરવાળાનું વિચરણ)

⇒ ટી કસોટી (t-test) :-

ટી-કસોટીની ગણાતરી કરતા પહેલા સરેરાશ મદ્યક, પ્રમાણ વિચલન, પ્રમાણભૂત મેળવવામાં આવે છે ત્યારબાદ t મળી શકે છે.

⇒ મદ્યક ::-

વ્યવહારમાં ‘સરેરાશ’ તરીકે વપરાતા શબ્દ માટે આંકડાશાસ્ત્રમાં “મદ્યક” શબ્દ વપરાય છે. સરેરાશ એ મદ્યવતીસ્થિતિનું માપ છે. પ્રાપ્તાંકોના

સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સરેરાશ કહે છે. સરેરાશ આવૃત્તિ વિતરણામાં વચ્ચગાળાની સ્થાનકિંમત સૂચવે છે. સરેરાશને X તરીકે ઓળખવામાં આવે છે.

$$\bar{x} = \frac{\sum Fx}{N}$$

જથું ...

$$\bar{x} = \text{મદ્યક}$$

$$F = \text{આવૃત્તિ}$$

$$x = \text{કાચા પ્રાપ્તાંક}$$

$$N = \text{આવૃત્તિની કુલ સંખ્યા}$$

\Rightarrow પ્રમાણ વિચલન ::-

પ્રમાણ વિચલન એ પ્રસાર કે ચલિતાનું સૌથી વધુ રિથર અને આધારભૂત માપ છે. જે સમઝિતમાંથી નિદર્શ પસંદ કરવાનું સૌથી સરળ માપ છે. ગેરેટ પ્રમાણ વિચલનની વ્યાખ્યા આ રીતે આપે છે.

‘‘પ્રમાણ વિચલન એટલે પ્રાપ્તાંકોના મદ્યકમાંથી લેવાયેલા વિચલનોના વર્ગોના મદ્યક-સરેરાશનું વર્ગમૂળ.’’

પ્રમાણ વિચલન (SD) ના બે લાભ છે.

- (1) પ્રચારના બીજા માપોની સરખામણીમાં તેના પર નિદર્શની વધઘટની અસર ઓછી થાય છે.
- (2) બીજ ગણિતની પ્રક્રિયાનો સહેલાઈથી આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.

પ્રમાણવિચલનનું સૂત્ર નીચે મુજબ છે :

$$SD = I$$

પ્રમાણભૂલ (Standard Error) :

સમદિની સરાસરીના અનુમાન તરીકે નિર્દર્શની સરાસરીનો ઉપયોગ કરવા માંગતા કોઈએ તો સમદિની સરાસરીમાંથી નિર્દર્શની સરાસરીનું વિચલન અનુમાનની ભૂલ તરીકે ગણી શકાય, કોઈપણ નિર્દર્શની સરાસરીઓના વિતરણનું પ્રમાણ વિચલન કરતા આ પ્રમાણ વિચલન અલગ તારવવા માટે તેને પ્રમાણભૂલ કહેવાય તેની ટૂંકી સંજ્ઞા છે.

મધ્યકની પ્રમાણભૂલની ગણતરી માટેનું સૂત્ર :

$$SeM = \frac{SD}{\sqrt{N}}$$

SeM = મધ્યકના તફાવતની પ્રમાણભૂલ

SD = પ્રમાણ વિચલન

$\sqrt{}$ = વર્ગમૂળ

N = આવૃત્તિની કુલ સંખ્યા

મધ્યકના તફાવતની સંયુક્ત ભૂલની ગણતરીનું સૂત્ર –

$$SeD = \sqrt{SeM1^2 + SeM2^2}$$

SeM1 = પ્રથમ મધ્યકના તફાવતની પ્રમાણભૂલ

M1 = પ્રથમ મદ્યક

M2 = બીજો મદ્યક

SeD = પ્રમાણભૂલનો તફાવત

$\sqrt{\quad}$ = વર્ગમૂળ

⇒ ટી ગુણોત્તર કસોટી :-

‘ટી’ કસોટી એટલે બે નિદર્શાઓ વચ્ચે જ એખાવેલ તફાવતો બનને સમઝિતાઓમાં પણ અરિતત્વ ધરાવે છે કે કેમ તે નકકી કરવા માટે વપરાતી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિને ‘ટી’ કસોટી કહેવામાં આવે છે. આ કસોટી દ્વારા સમઝિત વચ્ચે કોઈ તફાવત રહેલો છે કે કેમ તે જાણી શકાય છે અને એ બે સરેરાશો વચ્ચેના મદ્યકો વચ્ચેનો, બે પ્રમાણ વિચલનો તથા બે ટકાવારી વચ્ચેનો તફાવત અને તેની સાર્થકતા કે અસાર્થકતાની ચકાસણી કરવામાં આવે છે.

મોટા ભાગનાં સંશોધનોમાં સરેરાશ શોધવામાં આવતી જ હોય તેથી ‘ટી’ કસોટીનો વધુ ઉપયોગ મેળવેલ સરેરાશના તફાવતની સાર્થકતા કે અસાર્થકતાની ચકાસણી કરવામાં આવે છે.

ટૂંકમાં કહી શકાય કે તફાવત સાર્થક છે કે નહિ તે વિશે નિરાકરણ કે અનુમાન કરવામાં આવે છે. અને અગાઉ કરેલી ઉત્કળપનાઓ થથાવત રાખવામાં આવે કે અસ્વીકાર કરવામાં આવે છે અને કસોટીની અનિષ્ટિતતાને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. અહીં નિદર્શ મોટો હોવાથી આ સૂત્રનો ઉપયોગ કરેલ છે.

$$t = \frac{M_1 - M_2}{SeD}$$

જ્યાં... **M₁** = પ્રથમ મદ્યક

M₂ = બીજો મદ્યક

SeD = પ્રમાણભૂલનો તફાવત

3.13 માહિતી એકત્રીકરણાની પ્રક્રિયા :-

સંશોધનમાં ઉત્કળપનાનું નિર્માણ થયા બાદ તેની અકાસણી કરવાના હેતુથી વિશ્વસનીય અને આધારભૂત માહિતી એકત્ર કરવા માટે પ્રચુક્તિની પસંદગી કરવામાં આવે છે અને માહિતી એકત્ર કરવા માટેનું પ્રમાણિત સાધન હોવું જરૂરી છે અને તેના દ્વારા સચોટ માહિતી મેળવવાની શક્યતા પણ રહે છે અને અહીંથી ચાર કસોટીઓનો માહિતી એકત્ર કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રસ્તુત સંશોધનનો હેતુ ‘જેતપુર શહેરના રેન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોરણ અને જીવન સંતોષના માપનનો તેમજ તેમના વચ્ચેના સંબંધ જાણવાનો હતો જે અંગે જરૂરી માહિતી હિરા ઉધોગના કારખાનામાંથી મેળવવામાં આવી હતી. તે માટે હિરા ઉધોગમાં કાર્ય કરતા કુલ 600 રેન કલાકારોને નિર્દર્શિત રીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને વ્યક્તિગત માહિતી પત્રક, માનસિક સ્વાસ્થ્ય કસોટી, સમાચોરણ સંશોધનિકા અને જીવન સંતોષ તુલનાઓનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરવામાં આવી હતી.

પ્રસ્તુત સંશોધનમાં માહિતી મેળવવા માટે જેતપુર શહેરના હિરા ઉધોગના જુદા-જુદા કારખાનાઓના માલિકોની મુલાકાત લઈ અને તેની પાસેથી રેન કલાકારોની માહિતી મેળવવા માટેની પૂર્વ મંજૂરી મેળવીને માહિતી એકત્ર કરવામાં આવી હતી. તે માટે સંશોધકે રેન કલાકારોને સંશોધન અંગેની માહિતીનું મહત્વ સમજાવીને તે સંશોધકને તેના સંશોધન માટે કેટલું મહત્વનું કાર્ય છે તેનાથી માહિતગાર કર્યા હતા. રેન કલાકારોને વ્યક્તિગત રીતે પ્રશ્નાવલીમાં માહિતીની વિગતો તેમને સમજાવી સંનિષ્ઠતાથી અને ચોકસાઈથી જવાબ આપે તે રીતે પ્રેરવામાં આવ્યા હતા. આ રીતે સંશોધન કાર્યમાં પ્રત્યુત્તર દાતાનો સહયોગ દરેક વખતે માંગવામાં આવ્યો હતો.

નિર્દર્શમાં સમાવિષ્ટ રેન કલાકારોની વ્યક્તિગત મુલાકાત લઈને તેમની સાથે સાચુજય સ્થાપી તેમને પ્રશ્નાવલીઓ ભરાવવામાં આવી હતી. મોટા ભાગના કર્મચારીઓએ એક જ બેઠકે પ્રશ્નાવલીમાં માહિતી ભરી આપી હતી.

⇒ માહિતીનું સંખ્યાતમક રૂપાંતર :-

પ્રસ્તુત સંશોધનમાં પ્રાપ્તાંકોને મેળવવા માટે કાર્યસૂચિમાં બતાવ્યા પ્રમાણે ગુણાંકન કરવામાં આવ્યું હતું. અહીં ત્રણોચ તુલાઓ ઉપર મળેલા ઉત્તરોનું જે તે તુલાઓની ઉત્તર ચાવી મુજબ ગુણાંકન કરવામાં આવ્યું હતું. એ રીતે ત્રણોચ તુલાઓ ઉપર મળેલા પ્રાપ્તાંકો દ્વારા માનસિક સ્વાસ્થ્ય માપન કસોટી, સમાયોજન સંશોધનિકા અને જીવન સંતોષ તુલાને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ વડે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

આ રીતે પ્રકરણ આચોજનમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકરણ-3 માં ચોગ્ય રજૂઆત કર્યા પછી પ્રકરણ-4 માં પ્રસ્તુત સંશોધનનું પૃથ્વેકરણ, અર્થધટન અને પરિણામ ચર્ચા કરેલ છે.

પ્રકરણ-3
:: સંદર્ભ સૂચિ ::

- (1) મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ :
– પ્રા. એસ.વી. ત્રિવેદી અને અન્ય, સી. જમનાદાસ કંપની,
આવૃત્તિ 2008-09, પેઇડ નંબર-14
- (2) સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર :
ડૉ. અરવિંદ શાહ – ડિવાઈન પર્ફિલકેશન –
ડિસેમ્બર – 2007, પેઇડ નંબર-2
- (3) સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર :
ડૉ. અરવિંદ શાહ – ડિવાઈન પર્ફિલકેશન –
ડિસેમ્બર – 2007, પેઇડ નંબર-2
- (4) ડૉ. શાંતાબેન સોલંકી,
“ગુજરાત ભારે રસાયણ કંપની-વેરાવળના કર્મચારીઓના સમાચોજન,
માનસિક સ્વાર્થ્ય અને કાર્યસંતોષનો અભ્યાસ.” પીએચ.ડી. થિસીસ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, પેઇડ નંબર-124
- (5) ડૉ. વખાબેન ઠોલરીયા,
“રાજકોટ શહેરની લિજજત પાપડ બનાવતી બહેનોની વ્યવસાય
સામેલગીરી, સમાચોજન અને મનોવૈજ્ઞાનિક સુખાકારીનો મનોવૈજ્ઞાનિક
તુલનાત્મક અભ્યાસ.” સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, પેઇડ નંબર-64
- (6) નિદર્શન પદ્ધતિઓ અને પ્રાચોગિક અલિક્યુપનાઓ :
ડૉ. એસ.એમ. શાહ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ,
1992, પેઇડ નંબર-14

- (7) સામાજિક સંશોધન પદ્ધતિઓ :
 સ્વ. ડૉ. અરવિંદરાય ટેસાઈ – ચુનિવર્સિટી ગ્રંથનિમાણ બોર્ડ,
 1992, પેઇડ નંબર-65
- (8) સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી એક્ષટર્નલ માટ્રીચલ-2002
 ડૉ. યોગેશ જોગરાણા-સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી, રાજકોટ-પેઇડ નં.52
- (9) ડૉ. કિશોર એન. મહેતા,
 “સૌરાષ્ટ્રની ટી.બી. હોસ્પિટલના ટી.બી.ના દર્દીઓનું આત્મવિશ્લેષણ
 હતાશા અને મૃત્યુચિંતાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”
 પીએચ.ડી. થિસીસ, સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-રાજકોટ, પેઇડ નંબર-164
- (10) મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ :
 પ્રો. કે.કે. મહેતા અને અન્ય – વિરલ પ્રકાશન – 1985
 પેઇડ નંબર-48
- (11) સામાજિક સંશોધન પદ્ધતિ :
 ડૉ. અરવિંદરાય ટેસાઈ – ચુનિવર્સિટી ગ્રંથનિમાણ બોર્ડ,
 1985, પેઇડ નંબર-54
- (12) મનોવિજ્ઞાન – સ્પર્ધાત્મક પરીક્ષા માટ્રીચલ,
 ડૉ. બી.ડી. ઢીલા, પેઇડ નંબર-154
- (13) ભિનીબેન એમ. કારાવદરા,
 “ભારતીય જીવન વીમા નિગમમાં જીવનવીમો ઘરાવનાર નોકરીયાત
 લોકોના માનસિક સ્વાસ્થ્ય, સામાજિક આધાર અને જીવન સંતોષનો
 મનોવૈજ્ઞાનિક અભ્યાસ.” પીએચ.ડી. થિસીસ, સૌરાષ્ટ્ર ચુનિવર્સિટી-
 રાજકોટ, પેઇડ નંબર-58
- (14) મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ :
 પ્રો. એસ.વી.ત્રિવેદી અને અન્ય, સી. જમનાદાસ કંપની,
 આવૃત્તિ 2008-09, પેઇડ નંબર-72

પ્રકરણ-4
:: અનુક્રમણિકા ::

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
4.1	પ્રસ્તાવના	141
4.2	સંશોધનની સામાન્ય માહિતી ટકાવારીમાં	143
4.3	F કસોટી એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ	164
	4.3.1 રદ્દનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	165
	4.3.2 રદ્દનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	166
	4.3.3 રદ્દનકલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	167
	4.3.4 રદ્દનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	168
	4.3.5 રદ્દનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	169
	4.3.6 રદ્દનકલાકારોના કુદુરુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	170
	4.3.7 રદ્દનકલાકારોની માસિક આવકના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	171
	4.3.8 રદ્દનકલાકારોની માસિક આવકના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કૃષ્ણનાની ચકાસણી.	172

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
4.3.9	રટનકલાકારોની માનસિક આવકના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	173
4.3.10	રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	174
4.3.11	રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં રટનકલાકારોના સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	175
4.3.12	રટનકલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	176
4.3.13	રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	177
4.3.14	રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં સમાચોજનની ચકાસણી.	178
4.3.15	રટનકલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	179
4.3.16	રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	180
4.3.17	રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	181
4.3.18	રટનકલાકારોના અનુભવના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	182
4.4	સહસંબંધનું અર્થઘટન	183
4.4.1	માનસિક સ્વાસ્થ્ય અને સમાચોજન વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	183
4.4.2	માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષ વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	184

ક્રમ	વિગત	પૃ.ન.
	4.4.3 સમાયોજન અને જીવન સંતોષ વચ્ચે સહસંબંધની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	185
4.5	t કસોટી પ્રમાણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	186
	4.5.1 લગ્ન દરજાના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	186
	4.5.2 લગ્ન દરજાના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	187
	4.5.3 લગ્ન દરજાના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી	189
	4.5.4 5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	190
	4.5.5 5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	191
	4.5.6 5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રત્ન કલાકારોના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	192
	4.5.7 પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	193
	4.5.8 પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્નકલાકારોના સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	194
	4.5.9 પિતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	195
	4.5.10 માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	196
	4.5.11 માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના સમાયોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	197
	4.5.12 માતાના અભ્યાસના સંદર્ભમાં રત્ન કલાકારોના જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	198

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
4.5	4.5.13 માતાના વ્યવસાયના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	199
	4.5.14 માતાના વ્યવસાયના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	200
	4.5.15 માતાના વ્યવસાયના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	201
	4.5.16 રહેઠાણના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	202
	4.5.17 રહેઠાણના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	203
	4.5.18 રહેઠાણના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	204
	4.5.19 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	205
	4.5.20 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	206
	4.5.21 ‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	207
	4.5.22 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	208
	4.5.22 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં સમાચોજનની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	209
	4.5.23 માનસિક કે શારીરિક શોખના સંદર્ભમાં જીવન સંતોષની શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી.	210

ઓફિશિયલ પ્રકરણ - ૪

સંશોધનનું પૃથ્વીકરણ, અર્થઘટન અને પરિણામની ચર્ચા

4.1 પ્રસ્તાવના :-

પ્રસ્તુત સંશોધનનો મુખ્ય હેતુ જે તપુર શહેરના રટન કલાકારોનો માનસિક સ્વાસ્થ્ય, જીવન સંતોષ અને સમાચોજન માપન કરવાનો હતો. અહીં સાદા ચદ્રચદ્ર નિર્દર્શ પદ્ધતિથી નિર્દર્શ પસંદ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તેમાં કુલ - ૬૦૦ રટન કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ અધ્યયનમાં સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે શૈક્ષણિક લાયકાત, દાખલત્ય જીવન, કુદુંબની આર્થિક સ્થિરતા, કુદુંબના સભ્યોની સંખ્યા, માસિક આવક, પિતાનો અભ્યાસ, માતાનો અભ્યાસ, પિતાનો વ્યવસાય, માતાનો વ્યવસાય, રહેઠાણા, રહેઠાણાનો કચવાટ, જીવનશૈલી સંતોષ, અનુભવ અને શારીરિક તકલીફ, શોખ વિગેરે લેવામાં આવ્યા હતા. જ્યારે અવલંબી પરિવર્ત્ય તરીકે માનસિક સ્વાસ્થ્ય, જીવનસંતોષ અને સમાચોજન લેવામાં આવ્યા હતા.

સંશોધનમાં માહિતીનું એકત્રિકરણ થયા પછી તેનું વર્ગીકરણ, પૃથ્વીકરણ તથા તેના અર્થઘટનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. તેથી જ અહીં માનસિક સ્વાસ્થ્ય, જીવન સંતોષ અને સમાચોજન તુલા દ્વારા રટનકલાકારો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અને માપનયુક્ત માહિતીની ગુણાત્મક અને સંખ્યાત્મક બાબતોને દ્યાનમાં લઈને તેનું વર્ગીકરણ કરીને આંકડાશાસ્ત્રીય સમજૂતિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સંશોધનની ગુણાત્મક માહિતીને ટકાવારી દ્વારા કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે. જ્યારે સંખ્યાત્મક માહિતીને પ્રાપ્તાંકોના કોષ્ટકમાં વિભાજિત કરી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ દ્વારા, 'r', 'F' અને 't' ક્સોટી દ્વારા પૃથક્કૃત કરવામાં આવી છે.

સમગ્ર માહિતીની નીચેના વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે.


- સંશોધન અંગે સામાન્ય માહિતી ટકાવારીમાં
- રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, જીવન સંતોષ અને સમાયોજન વચ્ચેના સહસંબંધનું પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોના વ્યક્તિગત પરિવત્યો અને માનસિક સ્વાસ્થ્યનું 'F' કસોટી વડે એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોના વ્યક્તિગત પરિવત્યો અને જીવન સંતોષનું 'F' કસોટી વડે એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોના વ્યક્તિગત પરિવત્યો અને સમાયોજનનું 'F' કસોટી વડે એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને માનસિક સ્વાસ્થ્યનું 'F' કસોટી વડે $2 \times 2 \times 2$ આવચિક યોજનાનું વિચરણ પૃથ્થકરણ.
- રટનકલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને જીવન સંતોષનું કસોટી 'F' વડે $2 \times 2 \times 2$ આવચિક યોજનાનું વિચરણ પૃથ્થકરણ.
- રટનકલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને સમાયોજનનું કસોટી 'F' વડે $2 \times 2 \times 2$ આવચિક યોજનાનું વિચરણ પૃથ્થકરણ.
- રટનકલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને સમાયોજનનું 't' કસોટી વડે પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોનું વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને જીવનસંતોષનું 't' કસોટી વડે પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોનું વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને સમાયોજનનું 't' કસોટી વડે પૃથ્થકરણ અને અર્થધટન.
- રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, જીવનસંતોષ અને સમાયોજન સુધારણા માટેના સૂચનો.

4.2 સંશોધનની સામાન્ય માહિતી ટકાવારીમાં ::

જેતપુર શહેરના રદ્દનકલાકારોની શૈક્ષણિક લાયકાત પ્રમાણે સંખ્યા અને ટકાવારી કોષ્ટક નં. 4.1

વિગત	સંખ્યા	ટકાવારી
પ્રાથમિક 1 થી 7	118	19.67 %
માધ્યમિક 8 થી 10	351	58.5 %
ઉચ્ચ માધ્યમિક 11 થી 12	131	21.83 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.1 જેતપુર શહેરના રદ્દન કલાકારોની શૈક્ષણિક લાયકાતમાં પ્રાથમિકની ટકાવારી 19.67 % અને માધ્યમિકની ટકાવારી 58.5 % તેમજ ઉચ્ચતર માધ્યમિકની ટકાવારી 21.83 % જેટલા જેવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ ડ્રારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
લગ્ન દરજજા પ્રમાણે સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.2

વિગત	સંખ્યા	ટકાવારી
પરિણિત	351	58.5 %
અપરિણિત	249	41.5 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.2 માં જેતપુર શહેરના રટન કલાકારોની દાખત્ય જીવનમાં પરિણિતનું ટકાવારી 58.5 % અને અપરિણિતની ટકાવારી 41.5 % જેટલી જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
કુદુંબની આર્થિક સ્થિતિ પ્રમાણેની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.3

વિગત	સંખ્યા	ટકાવારી
નિભન	120	20 %
મધ્યમ	461	76.83 %
ઉચ્ચ	19	3.17 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.3 જેતપુર શહેરના રટન કલાકારોની કુદુંબની આર્થિક સ્થિતિમાં નિભનની ટકાવારી 20 % અને મધ્યમની ટકાવારી 76.83 % તેમજ ઉચ્ચની ટકાવારી 3.17 % જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
કુદુંબના સભ્યોની સંખ્યા પ્રમાણોની ટકાવારી
કોષ્ટક નં. 4.4

વિગત	સંખ્યા	ટકાવારી
5 સભ્યો સુધી	406	67.67 %
5 સભ્યોથી વધુ	194	32.33 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.4 માં જેતપુર શહેરના રટન કલાકારોની કુદુંબના સભ્યોની સંખ્યામાં 5 સભ્યો સુધીની ટકાવારી 67.67 % અને 5 સભ્યોથી વધુની ટકાવારી 32.33 % જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ ક્રારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
માસિક આવક પ્રમાણોની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.5

વિગત	સંખ્યા	ટકાવારી
રૂ. 5000 થી નીચે	270	45 %
રૂ. 5000 થી 10,000 વચ્ચે	299	49.83 %
રૂ. 10,000 થી વધુ	31	5.17 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.5 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકમાં 5000 થી નીચેની ટકાવારી 45% અને 5000 થી 10,000 ટકાવારી 49.83% તેમજ 10,000 થી વધુની ટકાવારી 5.17% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણો ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
પિતાના અભ્યાસ પ્રમાણે સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.6

વિગત	સંખ્યા	ટકાવારી
ધો. 10 સુધી	529	88.17 %
ધો. 10 થી વધુ	71	11.83 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.6 માં જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસમાં ધો. 10 સુધીની ટકાવારી 87.17% અને ધો. 10 થી વધુની ટકાવારી 11.83% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
માતાના અભ્યાસ પ્રમાણે સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.7

વિગત	સંખ્યા	ટકાવારી
ધો. 10 સુધી	560	93.33 %
ધો. 10 થી વધુ	40	6.67 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.7 માં જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસમાં ધો. 10 સુધીની ટકાવારી 93.33% અને ધો. 10 થી વધુની ટકાવારી 6.67% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ ક્રારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
પિતાના વ્યવસાય પ્રમાણોની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.8

વિગત	સંખ્યા	ટકાવારી
નોકરી	122	20.33 %
ધંધો	139	23.17 %
ખેતી	339	56.5 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.8 માં જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયમાં નોકરીની ટકાવારી 20.33% , ધંધાની ટકાવારી 23.17% અને ખેતીની ટકાવારી 56.5% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણો ત્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
માતાના વ્યવસાય પ્રમાણોની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.9

વિગત	સંખ્યા	ટકાવારી
નોકરી	21	3.5 %
ઘરકામ	579	96.5 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.9 માં જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયમાં નોકરીની ટકાવારી 3.5% અને ઘરકામની ટકાવારી 96.5% જેટલા જોવા ભળ્યા હતા. જેની નીચે પ્રમાણો ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
રહેઠાળ પ્રમાણોની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.10

વિગત	સંખ્યા	ટકાવારી
ગ્રામ્ય	368	61.33 %
શહેરી	232	38.67 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.10 માં જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાળામાં ગ્રામ્યની ટકાવારી 61.33% અને શહેરીની ટકાવારી 38.67% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણો ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોના
રહેણાણનો કચવાટ પ્રમાણેની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.11

વિગત	સંખ્યા	ટકાવારી
હા	93	15.5 %
ના	507	84.5 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.11 માં જેતપુર શહેરના રટન કલાકારોના રહેણાણમાં કચવાટમાં ‘હા’ ની ટકાવારી 15.5% અને ‘ના’ ની ટકાવારી 84.5% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
જીવનશૈલી સંતોષ પ્રમાણો સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.12

વિગત	સંખ્યા	ટકાવારી
ઓછો	107	17.83 %
મધ્યમ	408	68.00 %
ખૂબ જ	85	14.17 %
કુલ ...	600	100 %

કોષ્ટક નં. 4.12 માં જેતપુર શહેરના રટન કલાકારોની જીવનશૈલી સંતોષમાં ઓછાની ટકાવારી 17.83% અને મધ્યમની ટકાવારી 68.00% તેમજ ખૂબજની ટકાવારી 14.17% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણો ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.




જેતપુર શહેરના રટનકલાકારોની
અનુભવ પ્રમાણોની સંખ્યા અને ટકાવારી

કોષ્ટક નં. 4.13

વિગત	સંખ્યા	ટકાવારી
5 વર્ષ સુધી	210	35.00 %
5 વર્ષથી 10 વર્ષ સુધી	333	55.5 %
10 વર્ષથી વધુ	57	9.5 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.13 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવમાં 5 વર્ષ સુધીની ટકાવારી 35.00% અને 5 વર્ષથી 10 વર્ષ સુધીની ટકાવારી 55.5% તેમજ 10 વર્ષથી વધુની ટકાવારી 9.5% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણો ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રદ્દનકલાકારોના
શોખ પ્રમાણે સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.14

વિગત	સંખ્યા	ટકાવારી
માનસિક	208	34.67 %
શારીરિક	392	65.33 %
કુલ ...	600	100 %


કોષ્ટક નં. 4.14 માં જેતપુર શહેરના રદ્દન કલાકારોના શોખમાં માનસિકની ટકાવારી 34.67% અને શારીરિકની ટકાવારી 65.33% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



જેતપુર શહેરના રટનકલાકારોની
શારીરિક તકલીફ પ્રમાણોની સંખ્યા અને ટકાવારી
કોષ્ટક નં. 4.15

વિગત	સંખ્યા	ટકાવારી
હા	51	8.5 %
ના	549	91.5 %
કુલ ...	600	100 %

કોષ્ટક નં. 4.15 માં જેતપુર શહેરના રટન કલાકારોની શારીરિક તકલીફમાં ‘હા’ 8.5% અને ‘ના’ 91.5% જેટલા જોવા મળ્યા હતા. જેની નીચે પ્રમાણે ગ્રાફ દ્વારા રજૂઆત કરી છે.



સ્વતંત્ર પરિવત્યોને આધારે માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો

અને તેના મદ્યકો દર્શાવતું કોષ્ટક

કોષ્ટક નં. 4.16

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મદ્યક
1	શિક્ષણ	પ્રાથમિક 1 થી 7	118	10431	88.40
		માધ્યમિક 8 થી 10	351	31662	90.21
		3. માધ્યમિક 11 થી 12	131	11202	85.51
2	દામ્પત્ય જીવન	પરિણિત	351	31443	89.58
		અપરિણિત	249	21822	87.64
3	કુટુંબની આર્થિક સ્થિતિ	નિઝન	120	10581	88.18
		મદ્યમ	461	41079	89.11
		ઉચ્ચ	19	1615	85.00
4	કુટુંબના સભ્યો ની સંખ્યા	5 સભ્યો સુધી	406	35778	88.12
		5 સભ્યોથી વધુ	194	17463	90.02
5	માસિક આવક	5000 સુધી	270	23247	86.10
		5000 થી 10000 સુધી	299	27110	90.67
		10000 થી વધુ	31	2845	91.77
6	પિતાનો અભ્યાસ	ધો. 10 સુધી	529	47421	89.64
		ધો. 10 થી વધુ	71	5864	82.59
7	માતાનો અભ્યાસ	ધો. 10 સુધી	560	50020	89.32
		ધો. 10 થી વધુ	40	3270	81.75

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મદ્યક
8	પિતાનો વ્યવસાય	નોકરી	122	10559	86.55
		ધંધો	139	12645	90.97
		ખેતી	339	30081	88.73
9	માતાનો વ્યવસાય	નોકરી	21	1805	85.95
		ઘરકામ	579	51487	88.92
10	રહેઠાળા	ગ્રામ્ય	368	32297	87.76
		શહેરી	232	20998	90.51
11	રહેઠાળાનો કચવાટ	હા	93	8314	89.45
		ના	507	4495	88.65
12	જીવનશૈલીથી સંતોષ	ઓછો	107	9778	91.38
		મદ્યમ	408	36063	88.39
		ખૂબ જ	85	7425	87.35
13	શારીરિક તકલીફ	હા	51	4512	88.47
		ના	549	48784	88.86
14	અનુભવ	5 વર્ષ સુધી	210	18091	86.15
		5 થી 10 વર્ષ	333	24878	59.72
		10 વર્ષથી વધુ	57	5256	92.21
15	શોખ	માનસિક	208	18533	89.10
		શારીરિક	392	34732	88.60

સ્વતંત્ર પરિવહ્યોને આધારે સમાયોજનના પ્રાપ્તાંકો
અને તેના મધ્યકો દરશિવતું કોષ્ટક
કોષ્ટક નં. 4.17

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	સમાયોજન ના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મધ્યક
1	શિક્ષણ	પ્રાથમિક 1 થી 7	118	2727	23.11
		માધ્યમિક 8 થી 10	351	7967	22.70
		3. માધ્યમિક 11 થી 12	131	2784	21.25
2	દામ્પત્ય જીવન	પરિણિત	351	8024	22.86
		અપરિણિત	249	5436	21.83
3	કુટુંબની આર્થિક સ્થિતિ	નિર્મન	120	2741	22.84
		મદ્યમ	461	10337	22.42
		ઉચ્ચ	19	390	20.53
4	કુટુંબના સભ્યો ની સંખ્યા	5 સભ્યો સુધી	406	8990	22.14
		5 સભ્યોથી વધુ	194	4456	22.97
5	માસિક આવક	5000 સુધી	270	5828	21.59
		5000 થી 10000 સુધી	299	6961	23.28
		10000 થી વધુ	31	671	21.65
6	પિતાનો અભ્યાસ	ધો. 10 સુધી	529	12038	22.76
		ધો. 10 થી વધુ	71	1392	19.61
7	માતાનો અભ્યાસ	ધો. 10 સુધી	560	12690	22.66
		ધો. 10 થી વધુ	40	758	18.92

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	સમાચોજન ના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મદ્યક
8	પિતાનો વ્યવસાય	નોકરી	122	2643	21.66
		ધંધો	139	3221	23.17
		ખેતી	339	7587	22.38
9	માતાનો વ્યવસાય	નોકરી	21	452	21.52
		ઘરકામ	579	13006	22.46
10	રહેઠાણા	ગ્રામ્ય	368	8213	22.32
		શહેરી	232	5243	22.60
11	રહેઠાણાનો કચવાટ	હા	93	2108	22.67
		ના	507	11350	22.39
12	જીવનશૈલીથી સંતોષ	ઓછો	107	2481	23.19
		મદ્યમ	408	8999	22.06
		ખૂબ જ	85	1981	23.31
13	શારીરિક તકલીફ	હા	51	1113	21.82
		ના	549	12347	22.49
14	અનુભવ	5 વર્ષ સુધી	210	4585	21.83
		5 થી 10 વર્ષ	333	7592	22.80
		10 વર્ષથી વધુ	57	1287	22.58
15	શોખ	માનસિક	208	4623	22.24
		શારીરિક	392	8833	22.53

સ્વતંત્ર પરિવત્યોને આધારે જીવન સંતોષના પ્રાપ્તાંકો
અને તેના મધ્યકો દર્શાવતું કોષ્ટક
કોષ્ટક નં. 4.18

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	જીવન સંતોષના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મધ્યક
1	શિક્ષણ	પ્રાથમિક 1 થી 7	118	4515	38.26
		માધ્યમિક 8 થી 10	351	13267	37.80
		3. માધ્યમિક 11 થી 12	131	4679	35.72
2	દાખ્યત્વ જીવન	પરિણિત	351	13335	37.99
		અપરિણિત	249	9145	36.73
3	કુટુંબની આર્થિક સ્થિતિ	નિરુણ	120	4482	37.35
		મદ્યમ	461	17303	37.53
		ઉચ્ચ	19	677	35.63
4	કુટુંબના સભ્યો ની સંખ્યા	5 સભ્યો સુધી	406	15055	37.08
		5 સભ્યોથી વધુ	194	7486	38.59
5	માસિક આવક	5000 સુધી	270	9690	35.89
		5000 થી 10000 સુધી	299	11555	38.65
		10000 થી વધુ	31	1215	39.19
6	પિતાનો અભ્યાસ	ધો. 10 સુધી	529	20088	37.97
		ધો. 10 થી વધુ	71	2488	35.04
7	માતાનો અભ્યાસ	ધો. 10 સુધી	560	21153	37.77
		ધો. 10 થી વધુ	40	1328	33.20

ક્રમ	વિગત	વિભાગ	સંખ્યા	જીવન સંતોષના પ્રાપ્તાંકોનો સરવાળો	પ્રાપ્તાંકોનો મદ્યક
8	પિતાનો વ્યવસાય	નોકરી	122	4348	35.64
		ધંધો	139	5427	39.04
		ખેતી	339	12722	37.53
9	માતાનો વ્યવસાય	નોકરી	21	740	35.24
		ઘરકામ	579	21759	37.58
10	રહેઠાળા	ગ્રામ્ય	368	13682	37.18
		શહેરી	232	8850	38.15
11	રહેઠાળાનો કચવાટ	હા	93	3528	37.94
		ના	507	18967	37.41
12	જીવનશૈલીથી સંતોષ	ઓછો	107	4091	38.23
		મદ્યમ	408	15205	37.27
		ખૂબ જ	85	3178	37.39
13	શારીરિક તકલીફ	હા	51	1937	37.98
		ના	549	20560	37.45
14	અનુભવ	5 વર્ષ સુધી	210	7578	36.09
		5 થી 10 વર્ષ	333	12639	37.95
		10 વર્ષથી વધુ	57	2279	39.98
15	શોખ	માનસિક	208	7818	37.59
		શારીરિક	392	14654	37.38

ઉપર પ્રમાણેના સ્વતંત્ર પરિવત્યોની ટકાવારી રજૂ કર્યા પછી હવે HO1 થી HO. 45 સુધી સ્વતંત્ર પરિવત્યોને આધારે આંકડાશાસ્ત્રીય કસોટીઓને અનુરૂપ શૂન્ય ઉત્કલ્પનાઓની ચકાસણી કરીને પરિણામો તારવેલા છે. ઉપરાંત પ્રકરણ-2 માં દર્શાવેલા પૂર્વીય અભ્યાસોમાં પ્રસ્તુત સંશોધનની HO ને અનુરૂપ તુલના કરવાનો નખ પ્રયાસ કરેલો છે.

4.3 F કસોટી – એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ ::

પ્રસ્તુત સંશોધનમાં F કસોટી એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ ઉપયોગમાં લીધેલ છે. આ કસોટી પ્રમાણે HO.1 થી HO.18 રચવામાં આવી હતી. જેમાં રદ્દન કલાકારોના શૈક્ષણિક લાયકાત, કુટુંબની આર્થિક સ્થિતિ, માસિક આવક, પિતાનો વ્યવસાય, જીવનશૈલીથી સંતોષ અને અનુભવ. આ બધા સ્વતંત્ર પરિવત્યોની માનસિક સ્વાસ્થ્ય, સમાચોરજન અને જીવન સંતોષ જેવા પરતંત્ર પરિવત્યોપર અસર જાણવા માટે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવા F કસોટી નો ઉપયોગ કરી F ના મૂલ્યો શોધવામાં આવેલ છે. જેમાં પ્રાપ્ત થયેલા પરિણામોની ચર્ચા નીચે મુજબ કરવામાં આવે છે.

F કસોટી એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણની શૂન્ય ઉત્કલ્પનાઓ ::

HO. 1 જેતપુર શહેરના રદ્દન કલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.19

**રદ્દનકલાકારોની શૈક્ષણિક લાયકાત (ધો. 1 થી 7, 8 થી 10 કે 11 થી 12)
થી વધુના માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૃથ્થકરણા**

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	2128.39	2	1064.20	9.18	સાર્થક છે
WSS	69188.24	597	115.89		
TSS	71316.63	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રદ્દન કલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 9.18 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રદ્દન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 2 જેતપુર શહેરના રદ્દન કલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.20

રટનકલાકારોની શૈક્ષણિક લાયકાત (ધો. 1 થી 7, 8 થી 10 કે 11 થી 12)
થી વધુના સમાયોજનનું એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	260.94	2	130.47	5.09	સાર્થક છે
WSS	15308.25	597	25.64		
TSS	15569.19	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 5.09 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

પૂર્વીય અભ્યાસ નંબર 12 સાથે તુલના :-

યોગેશ બી. મહેતાના અભ્યાસ ઓછી શૈક્ષણિક લાયકાત અને વધુ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં સમાયોજનના તફાવત જોવા મળે છે. જે HO2 ના તારણ સાથે સમાનતા ધરાવે છે.

HO. 3 જેતપુર શહેરના રટન કલાકારોના શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં તેના જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.21

રટનકલાકારોની શૈક્ષણિક લાયકાત (ધો. 1 થી 7, 8 થી 10 કે 11 થી 12)
થી વધુના જીવન સંતોષનું એકમાર્ગીય વિચરણ પૃથ્વકરણ
(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	513.41	2	256.71	6.10	સાર્થક છે
WSS	25116.05	597	42.07		
TSS	25629.46	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોની શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 6.10 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણા :-

આથી તારણા કાઢવામાં આવે છે કે રટન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

પૂર્વીં અભ્યાસ નંબર 8 સાથે તુલના :-

કારાવદરા ભીની એમ. – કર્મચારીઓના જીવનસંતોષ પર શૈક્ષણિક લાયકાતની અસર જોવા મળતી નથી. જે HO3 ના તારણાથી જુદો પડે છે.

HO. 4 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.22

રટનકલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ (ઉચ્ચ, મધ્યમ, નિમ્ન) ના માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	365.06	2	182.53	1.53	સાર્થક નથી
WSS	71293.9	597	119.42		
TSS	71658.96	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 1.53 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી આથી ઉત્કૃષ્ણનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 5 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.23

રટનકલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ (ઉચ્ચ, મધ્યમ, નિમ્ન) ના સમાચોજનનું એકમાર્ગીય વિચરણ પૃષ્ઠાકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	89.03	2	44.52	1.72	સાર્થક નથી
WSS	15429.25	597	25.84		
TSS	15518.28	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 1.72 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કુલ્પનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 6 જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં તેના જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.24

રટનકલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ (ઉચ્ચ, મધ્યમ, નિમ્ન) ના જીવનસંતોષનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	67.14	2	33.57	0.76	સાર્થક નથી
WSS	26328.45	597	44.10		
TSS	26395.59	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 0.76 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કૃષ્ણનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 7 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.25

રટનકલાકારોની માસિક આવક (રૂ.5000 સુધી, રૂ.5000 થી 10.000, રૂ.10.000થી વધુ) ના માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	3276.72	2	1638.36	5.42	સાર્થક છે
WSS	180322.62	597	302.05		
TSS	183599.34	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 5.42 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોની માસિક આવક અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 8 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.26

રટનકલાકારોની માસિક આવક (રૂ.5000 સુધી, રૂ.5000 થી 10.000, રૂ.10.000થી વધુ) ના સમાયોજનનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણના મૂળ	વિચરણના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણની માત્રા	F કિંમત	સાર્થક
BSS	426.59	2	213.30	8.46	સાર્થક છે
WSS	15057.87	597	28.22		
TSS	15484.46	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 8.46 છે. સ્વતંત્રયની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોની માસિક આવક અને સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 9 જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.27

રટન કલાકારોની માસિક આવક (રૂ.5000 સુધી, રૂ.5000 થી 10.000, રૂ.10.000થી વધુ) ના જીવન સંતોષનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણા

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	1179.4	2	589.7	14.17	સાર્થક છે
WSS	24847.93	597	41.62		
TSS	26027.33	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોની માસિક આવકના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 14.17 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણા :-

આથી તારણા કાઢવામાં આવે છે કે રટન કલાકારોની માસિક આવક અને જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 10 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.28

રટનકલાકારોના પિતાનો વ્યવસાય (નોકરી, ધંધો કે ખેતી) ના
માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણના મૂળ	વિચરણના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણની માત્રા	F કિંમત	સાર્થક
BSS	1274.76	2	6.37,38	5.43	સાર્થક છે
WSS	70030.2	597	117.30		
TSS	71304.96	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 5.43 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાય અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 11 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં
તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી
નથી.

કોષ્ટક નં. 4.29

રટનકલાકારોના પિતાનો વ્યવસાય (નોકરી, ધંધો કે ખેતી) ના
સમાયોજનનું એકમાર્ગીચ વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	149.01	2	74.51	2.89	સાર્થક નથી
WSS	15378.99	597	25.76		
TSS	15528	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાયના
સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 2.89 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05
કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે
તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કૃષ્ણનાનો સ્વીકાર કરવામાં
આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાય
અને સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 12 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાયના સંદર્ભમાં
તેના જીવનસંતોષના પ્રાપ્તાંકો વરચે કોઈ સંલગ્નતા જોવા મળતી
નથી.

કોષ્ટક નં. 4.30

રટનકલાકારોના પિતાનો વ્યવસાય (નોકરી, ધંધો કે ખેતી) ના
જીવનસંતોષનું એકમાર્ગિય વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	753.63	2	376.82	8.86	સાર્થક છે
WSS	25380.35	597	42.51		
TSS	26133.98	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાયના
સંદર્ભમાં કરેલી ગણાતરીના પરિણામો :

F ની કિંમત 8.86 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05
કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે
તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં
આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના પિતાના વ્યવસાય
અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વરચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 13 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.31

રટનકલાકારોના જીવનશૈલી (આધુનિક, મદ્યમ, નિમ્ન) ના માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	960.33	2	480.17	4.08	સાર્થક છે
WSS	70281.74	597	117.72		
TSS	71242.07	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં કરેલી ગાણાતરીના પરિણામો :

F ની કિંમત 4.08 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 14 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.32

રટનકલાકારોના જીવનશૈલી (આધુનિક, મદ્યમ, નિમ્ન) ના સમાયોજનનું એકમાર્ગીચ વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	183.45	2	91.73	1.23	સાર્થક નથી
WSS	44368.09	597	74.32		
TSS	44551.54	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં કરેલી ગાણાતરીના પરિણામો :

F ની કિંમત 1.23 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 1.23 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કુલ્પનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના જીવનશૈલી અને સમાયોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 15 જેતપુર શહેરના રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં તેના જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.33

રટનકલાકારોના જીવનશૈલી (આધુનિક, મદ્યમ, નિમ્ન) ના જીવનસંતોષનું એકમાર્ગિય વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	79.64	2	39.82	0.92	સાર્થક નથી
WSS	25953.23	597	43.47		
TSS	26032.87	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના જીવનશૈલીના સંદર્ભમાં કરેલી ગાણાતરીના પરિણામો :

F ની કિંમત 0.92 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કૃષ્ણનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના જીવનશૈલી અને જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 16 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.34

રટનકલાકારોના અનુભવ (5 વર્ષ, 5 વર્ષથી 10 વર્ષ, 10 વર્ષથી વધુ)
ના માનસિક સ્વાસ્થ્યનું એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	2419.49	2	1209.75	9.99	સાર્થક છે
WSS	72324.47	597	121.15		
TSS	74743.96	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં કરેલી ગણતરીના પરિણામો :

F ની કિંમત 9.99 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના અનુભવ અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

HO. 17 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના સમાયોજન ના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.35

**રટનકલાકારોના અનુભવ (5 વર્ષ, 5 વર્ષથી 10 વર્ષ, 10 વર્ષથી વધુ)
ના સમાયોજનનું એકમાર્ગીય વિચરણ પૃથ્વેકરણા**

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	121.26	2	60.63	2.37	સાર્થક છે
WSS	15256.58	597	25.56		
TSS	15377.84	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં કરેલી ગણતરીના પરિણામો :

F ની કિંમત 2.37 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી ઓછી છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક નથી. આથી ઉત્કૃષ્ણનાનો સ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના અનુભવ અને સમાયોજન ના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

HO. 18 જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં તેના જીવન સંતોષના પ્રાપ્તાંકો વચ્ચે કોઈ સંલગ્નતા જોવા મળતી નથી.

કોષ્ટક નં. 4.36

રટનકલાકારોના અનુભવ (5 વર્ષ, 5 વર્ષથી 10 વર્ષ, 10 વર્ષથી વધુ)
ના જીવનસંતોષનું એકમાગળીય વિચરણ પૂછ્યકરણ

(સાર્થકતાની કક્ષા 0.05)

વિચરણાના મૂળ	વિચરણાના વર્ગો નો સરવાળો	સ્વતંત્રની માત્રા	વિચરણાની માત્રા	F કિંમત	સાર્થક
BSS	840.21	2	420.11	9.92	સાર્થક છે
WSS	25279.76	597	42.34		
TSS	26919.97	599			

કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે કે રટન કલાકારોના અનુભવના સંદર્ભમાં કરેલી ગણતરીના પરિણામો :

F ની કિંમત 9.92 છે. સ્વતંત્રની માત્રા 2 અને 597 હોય ત્યારે 0.05 કક્ષાએ F ની કિંમત 3.07 છે. અહીં પ્રાપ્ત થયેલ F ની કિંમત તેનાથી વધારે છે તેથી 0.05 કક્ષાએ તફાવત સાર્થક છે. આથી ઉત્કૃષ્ણનાનો અસ્વીકાર કરવામાં આવે છે.

તારણ :-

આથી તારણ કાઢવામાં આવે છે કે રટન કલાકારોના અનુભવ અને જીવનસંતોષ ના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

4.4 સહસંબંધનું અર્થધટન ::

પ્રસ્તુત સંશોધનમાં સહસંબંધની ગણતરી કરવા માટે કાર્લ પીયરસનની રીત ઉપયોગમાં લેવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષ વચ્ચે પરસ્પર કેવા પ્રકારનો સંબંધ છે તે જાણકારી મેળવવાનો મુજબ આશય હતો તેના માટે શૂન્ય ઉત્કલ્પના નં. 19 થી 21 ની રચના કરવામાં આવેલ હતી. જેમાં પ્રાપ્ત પરિણામોની રજૂઆત અને ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છે. સહસંબંધનું અર્થધટન નીચે મુજબ કરી શકાય.

- | | | |
|------------------|---|----------------------------|
| (1) 0.20 થી ઓછો | - | નહીંવત સહસંબંધ |
| (2) 0.20 થી 0.40 | - | ઓછો થોડો પણ નિશ્ચિયત સંબંધ |
| (3) 0.40 થી 0.70 | - | સાધારણ સહસંબંધ |
| (4) 0.70 થી 0.90 | - | સારો નોંધપાત્ર સહસંબંધ |
| (5) 0.90 થી 1.00 | - | પરસ્પર આધારિત સહસંબંધ |

HO. 19 જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજનના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

કોષ્ટક નં. 4.37

**માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજન વચ્ચે પરસ્પર સહસંબંધ
દર્શાવતું કોષ્ટક**

N = 600

ક્રમ	વિગત	સંખ્યા	સ્વતંત્રતાની માત્રા	r	Sig
1	માનસિક સ્વાસ્થ્ય	600	598	0.34	S
2	સમાયોજન	600	598		

**** ગણતરી પ્રમાણો અર્થધટન ::**

અહીં ગણેલા r ની કિંમત 0.34 છે. એટલે કે ઓછો ઘન સહસંબંધ દર્શાવ્યો છે.

**** કોષ્ટક પ્રમાણે અર્થધટન ::**

ઉપરોક્ત કોષ્ટક પ્રમાણે $dt = 598$ છે. જેની કોષ્ટકમાં કિંમત 0.05 કક્ષાએ 0.062 છે. કોષ્ટકની કિંમત કરતા ગણોલા r ની કિંમત મોટી છે. તેથી તફાવત સાર્થક છે માટે શૂન્ય ઉત્કલ્પના અસ્વીકાર્ય બને છે.

તારણા : આથી તારણા કાઢવામાં આવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને સમાચોજન વચ્ચે સંગીન સહસંબંધ નથી.

HO. 20 જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

કોષ્ટક નં. 4.38

**માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતોષ વચ્ચે પરસ્પર સહસંબંધ
દર્શાવતું કોષ્ટક**

N = 600

ક્રમ	વિગત	સંખ્યા	સ્વતંત્રતાની માત્રા	r	Sig
1	માનસિક સ્વાસ્થ્ય	600	598	0.63	S
2	જીવન સંતોષ	600	598		

**** ગણતરી પ્રમાણે અર્થધટન ::**

અહીં ગણોલા r ની કિંમત 0.63 છે. એટલે કે સામાન્ય ઘન સહસંબંધ દર્શાવે છે.

**** કોષ્ટક પ્રમાણે અર્થધટન ::**

ઉપરોક્ત કોષ્ટક પ્રમાણે $df = 598$ છે. જેની કોષ્ટકમાં કિંમત 0.05 કક્ષાએ 0.062 છે. કોષ્ટકની કિંમત કરતા ગણોલા r ની કિંમત મોટી છે. તેથી તફાવત સાર્થક છે માટે શૂન્ય ઉત્કલ્પના અસ્વીકાર્ય બને છે.

તારણા : આથી તારણા કાઢવામાં આવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને જીવનસંતોષ વચ્ચે સંગીન સહસંબંધ નથી.

HO. 21 જેતપુર શહેરના ૨૮ન કલાકારોના સમાયોજન અને જીવન સંતોષના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

કોષ્ટક નં. 4.39

સમાયોજન અને જીવન સંતોષ વચ્ચે પરસ્પર સહસંબંધ

દર્શાવતું કોષ્ટક

N = 600

ક્રમ	વિગત	સંખ્યા	સ્વતંત્રતાની માત્રા	r	Sig
1	સમાયોજન	600	598	0.50	S
2	જીવન સંતોષ	600	598		

**** ગણતરી પ્રમાણે અર્થેઘટન ::**

અહીં ગણોલા r ની કિંમત 0.50 છે. એટલે કે સાધારણ ઘન સહસંબંધ દર્શાવે છે.

**** કોષ્ટક પ્રમાણે અર્થેઘટન ::**

ઉપરોક્ત કોષ્ટક પ્રમાણે $df = 598$ છે. જેની કોષ્ટકમાં કિંમત 0.05 કક્ષાએ 0.062 છે. કોષ્ટકની કિંમત કરતા ગણોલા r ની કિંમત મોટી છે. તેથી તફાવત સાર્થક છે માટે શુંય ઉત્કલ્પના અસ્વીકાર્ય બને છે.

તારણ : આથી તારણ કાઢવામાં આવે છે કે સમાયોજન અને જીવનસંતોષ વચ્ચે સંગીન સહસંબંધ નથી.

પૂર્વીં અભ્યાસ નંબર-16 સાથે તુલના :-

નીતા એલ. કાણ્ડીયાના અભ્યાસમાં નોકરિયાતના જીવનસંતોષ અને સમાયોજન વચ્ચે સાર્થક સહસંબંધ જોવા મળે છે. જે HO21 ના તારણ સાથે સમાનતા ધરાવે છે.

4.5 t કસોટી પ્રમાણે શુન્ય ઉત્કલ્પનાની અકાસણી ::

t કસોટીનો ઉપયોગ કરી રતન કલાકારોમાં દામ્પત્યજીવન, કુટુંબના સભ્યોની સંખ્યા, પિતાનો અભ્યાસ, માતાનો અભ્યાસ, માતાનો વ્યવસાય, રહેઠાણા, શારીરિક તકલીફ અને શોખના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષમાં તફાવત છે કે કેમ? તેની જાળકારી મેળવવા માટે 't' કસોટીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં પ્રાપ્ત થયેલા પરિણામોની ચર્ચા નીચે કમવાર કરવામાં આવેલ છે.

HO. 22 જેતપુર શહેરના રતન કલાકારોના લગ્ન દરજાના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્ય ના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.40

પરિણિત કે અપરિણિત રતન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	પરિણિત	351	89.58	11.14	0.59	2.18	સાર્થક છે
2	અપરિણિત	249	87.64	10.42	0.66		

અર્થઘટન :–

કોષ્ટક 4.40 માં દશાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 22 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણોલી 't' ની કિંમત 2.18 છે જે કોઈના 't' ની કિંમત કરતા વધુ છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે પરિણિત કે અપરિણિત રણન-કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

પૂર્વીં અભ્યાસ નંબર-16 સાથે તુલના :–

એ. એમ. નંદાણીયા – પૂર્વીં અભ્યાસમાં લગ્ન દરજાના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે, જે ના તારણ સાથે સમાનતા ઘરાવે છે.

HO. 23 જેતપુર શહેરના રણન કલાકારોના લગ્ન દરજાના સંદર્ભમાં સમાયોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.41

**પરિણિત કે અપરિણિત રેન કલાકારોના સમાયોજનના પ્રાપ્તાંકોના
આધારે 't' કસોટી**

N = 600

ક્રમ	વિગત	સમાયોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	પરિણિત	351	22.86	4.85	0.26	2.40	સાર્થક છે
2	અપરિણિત	249	21.83	5.33	0.34		

અર્થઘટન :–

કોષ્ટક 4.41 માં દશાવિલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 23 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 2.40 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધુ છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે પરિણિત કે અપરિણિત રેન કલાકારો ના સમાયોજનમાં તફાવત જોવા મળે છે.

પૂર્વીં અભ્યાસ નંબર-13 સાથે તુલના :–

ત્રિવેદી પાયલ જે. ના અભ્યાસમાં રેલ્વે કર્મચારીઓમાં પરિણિત વ્યક્તિ ઓ કરતા અપરિણિત વ્યક્તિઓમાં સમાયોજન વધારે જોવા મળે છે. જે HO23 ના તારણ સાથે સમાનતા ધરાવે છે.

HO. 24 જેતપુર શહેરના રટન કલાકારોના લગ્ન દરજાના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.42

પરિણિત કે અપરિણિત રટન કલાકારોના જીવન સંતોષના પ્રાપ્તાંકોના
આધારે 't' કસોટી

$N = 600$

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	પરિણિત	351	37.99	6.74	0.36	2.33	સાર્થક છે
2	અપરિણિત	249	36.73	6.27	0.40		

અર્થઘટન :–

કોષ્ટક 4.42 માં દરજેથી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 24 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 2.33 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધુ છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે પરિણિત કે અપરિણિત રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

HO. 25 જેતપુર શહેરના રટન કલાકારોના કુદુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મદ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.43

5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$N = 600$

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	5 સભ્યો સુધી	406	88.12	10.88	0.54	1.92	સાર્થક નથી
2	5 સભ્યોથી વધુ	194	90.02	11.59	0.83		

અર્થઘટન :–

કોષ્ટક 4.43 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 25 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 1.92 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે 5 કે 5 થી વધુ સભ્યો ઘરાવતા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

પૂર્વીં અભ્યાસ નંબર-2 સાથે તુલના ::

બી.એમ. વધાસીયાના પૂર્વીં અભ્યાસમાં વિભક્ત કુદુંબમાં રહેતા કર્મચારીઓ ના માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સાર્થક તફાવત જોવા મળતો નથી જે HO.25 થી જુદો પડે છે.

HO. 26 જેતપુર શહેરના રટન કલાકારોના કુદુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.44

5 કે 5 થી વધુ સભ્યો ધરાવતા રટન કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$N = 600$

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	5 સભ્યો સુધી	406	22.14	5.01	0.25	1.84	સાર્થક નથી
2	5 સભ્યોથી વધુ	194	22.97	5.17	0.37		

અર્થઘટન :–

કોષ્ટક 4.44 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 26 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 1.84 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે 5 કે 5 થી વધુ સભ્યો ધરાવતા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.

HO. 27 જેતપુર શહેરના રટન કલાકારોના કુદુંબના સભ્યોની સંખ્યાના સંદર્ભમા જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.45

5 કે 5 થી વધુ સભ્યો ધરાવતા રટન કલાકારોના જીવન સંતોષના
પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	5 સભ્યો સુધી	406	37.08	7.06	0.35	2.56	સાર્થક છે
2	5 સભ્યોથી વધુ	194	38.59	6.55	0.47		

અર્થઘટન :–

કોષ્ટક 4.45 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 27 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 2.56 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે 5 કે 5 થી વધુ સભ્યો ધરાવતા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

HO. 28 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે તેઓના માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.46

પિતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	529	89.64	10.81	0.47	5.73	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	71	82.59	9.59	1.19		

અર્થઘટન :–

કોષ્ટક 4.46 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 28 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 5.73 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ઘો.10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

HO. 29 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે
તેઓના સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.47

પિતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન
કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	529	22.76	5.20	0.23	6.56	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	71	19.61	3.58	0.42		

અર્થઘટન :–

કોષ્ટક 4.47 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 29 ની
ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05
કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 6.56 છે જે કોઠાના 't' ની કિંમત
કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી
નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ઘો.10 સુધી તેમજ ઘો.10 થી વધુ
હોય તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.

HO. 30 જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના અભ્યાસના આધારે
તેઓના જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.48

પિતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન
કલાકારોના જીવનસંતોષનાપ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	529	37.97	6.64	0.29	2.50	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	71	35.04	9.54	1.13		

અર્થઘટન :–

કોષ્ટક 4.48 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 30 ની
ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05
કક્ષાએ 1.16 છે. અહીં ગણેલી 't' ની કિંમત 2.50 છે જે કોઠાના 't' ની કિંમત
કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી
નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ઘો.10 સુધી તેમજ ઘો.10 થી વધુ
હોય તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

HO. 31 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં
માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.49

માતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન
કલાકારોના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	560	89.32	10.81	0.46	5.18	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	40	81.75	8.76	1.39		

અર્થઘટન :–

કોષ્ટક 4.49 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 31 ની
ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05
કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 5.18 છે જે કોઠાના 't' ની કિંમત
કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બનતી
નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માતાનો અભ્યાસ ઘો.10 સુધી તેમજ
ઘો.10 થી વધુ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા
મળે છે.

HO. 32 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં
સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.50

માતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોય તેવા રટન
કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	560	22.66	5.08	0.21	5.19	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	40	18.92	4.35	0.69		

અર્થઘટન :–

કોષ્ટક 4.50 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 32 ની
ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05
કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 5.19 છે જે કોઠાના 't' ની કિંમત
કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી
નથી.

તારણ

આથી તારણ કાળવામાં આવે છે કે માતાનો અભ્યાસ ઘો.10 સુધી તેમજ
ઘો.10 થી વધુ હોય તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.

HO. 33 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના અભ્યાસના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.51

માતાનો અભ્યાસ ઘો. 10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોથ તેવા રટન કલાકારોના જીવનસંતોષના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$$N = 600$$

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ઘો. 10 સુધી	560	37.77	6.58	0.28	4.86	સાર્થક છે
2	ઘો. 10 થી વધુ	40	33.20	5.66	0.90		

અર્થઘટન :–

કોષ્ટક 4.51 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 33 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 4.86 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાળવામાં આવે છે કે માતાનો અભ્યાસ ઘો.10 સુધી તેમજ ઘો.10 થી વધુ હોથ તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

**HO. 34 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં
માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.**

કોષ્ટક નં. 4.52

**માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામના માનસિક સ્વાસ્થ્યના
પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી**

N = 600

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	વ્યવસાય-નોકરી	21	85.95	8.48	1.85	1.55	સાર્થક નથી
2	વ્યવસાય-ઘરકામ	579	88.92	10.97	0.46		

અર્થઘટન :-

કોષ્ટક 4.52 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 34 ની
ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05
કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 1.55 છે જે કોઠાના 't' ની કિંમત
કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં
જોડાયેલી હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો
નથી.

HO. 35 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.53

માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામના સમાચોજનના
પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	વ્યવસાય-નોકરી	21	21.52	4.64	1.01	0.91	સાર્થક નથી
2	વ્યવસાય-ઘરકામ	579	22.46	5.09	0.21		

અર્થઘટન :–

કોષ્ટક 4.53 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 35 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 0.91 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં જોડાયેલી હોય તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.

HO. 36 જેતપુર શહેરના રટન કલાકારોના માતાના વ્યવસાયના સંદર્ભમાં જીવનસંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.54

માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામના જીવનસંતોષના
પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	વ્યવસાય-નોકરી	21	35.24	6.61	1.44	1.59	સાર્થક નથી
2	વ્યવસાય-ઘરકામ	579	37.58	6.59	0.27		

અર્થઘટન :–

કોષ્ટક 4.54 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 36 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 1.59 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં જેડાયેલી હોથ તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જેવા મળતો નથી.

HO. 37 જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણાના માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.55

રહેઠાણ ગ્રામ્ય કે શહેરી હોથ તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ગ્રામ્ય	368	87.78	10.79	0.56	3.00	સાર્થક છે
2	શહેરી	232	90.51	10.92	0.72		

અર્થઘટન :-

કોષ્ટક 4.55 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 37 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણોલી 't' ની કિંમત 3.00 છે જે કોઈના 't' ની કિંમત કરતા વધારે છે તેથી તફાવત સાર્થક છે. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બનતી નથી.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ગ્રામ્ય કે શહેરી રહેઠાણાના સંદર્ભમાં રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

કાર્ન હાઉઝર 1956 અને લો (1980) ના પૂર્વીંચ અભ્યાસ (નંબર) સરખામણી કરતા રહેઠાણની દ્રષ્ટિએ (જે HO. 37 માં) ગ્રામ અને શહેરીના અભ્યાસો સાથે સામ્યતા જોવા મળે છે.

HO. 38 જે તપુર શહેરના રટન કલાકારોના રહેઠાણાના સંદર્ભમાં સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.56

રહેઠાણા (વિસ્તાર) ગ્રામ્ય કે શહેરી હોથ તેવા રટન કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

$N = 600$

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ગ્રામ્ય વિસ્તાર	368	22.32	4.89	0.25	0.65	સાર્થક નથી
2	શહેરી વિસ્તાર	232	22.60	5.37	0.35		

અર્થઘટન :—

કોષ્ટક 4.56 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 38 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 0.65 છે જે કોઠાના 't' ની કિંમત કરતા વધારે છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ગ્રામ્ય કે શહેરી રહેઠાણાના સંદર્ભમાં રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.

HO. 39 જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણાના સંદર્ભમાં જીવન સંતોષના મધ્યકો વરચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.57

રહેઠાણા (વિસ્તાર) ગ્રામ્ય કે શહેરી હોચ તેવા રટન કલાકારોના જીવન સંતોષના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	ગ્રામ્ય વિસ્તાર	368	37.18	6.47	0.34	1.62	સાર્થક નથી
2	શહેરી વિસ્તાર	232	38.15	7.57	0.50		

અર્થઘટન :–

કોષ્ટક 4.57 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 39 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 1.62 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે ગ્રામ્ય કે શહેરી રહેઠાણાના સંદર્ભમાં રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળતો નથી.

પૂર્વીય અભ્યાસ સાથે તુલના :

ડૉ. અનંત. એમ. વસાણી – પૂર્વીય અભ્યાસમાં રહેઠાણાની અસર જીવન સંતોષ પર પડતી નથી. જે HO.39 ના તારણ સાથે સમાનતા ધરાવે છે.

HO. 40 જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફના સંદર્ભમાં તેના માનસિક સ્વાસ્થ્યના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.58

‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યના
પ્રાપ્તાંકોના આધારે ‘t’ કસોટી

N = 600

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	હા	51	88.47	9.94	1.39	0.27	સાર્થક નથી
2	ના	549	88.86	10.98	0.47		

અર્થઘટન :–

કોષ્ટક 4.58 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 43 ની ચકાસણી કરવા માટે ‘t’ કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના ‘t’ ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી ‘t’ ની કિંમત 0.27 છે જે કોઠાના ‘t’ ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે શારીરિક તકલીફમાં હા કે ના હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

HO. 41 જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફના સંદર્ભમાં તેના સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.59

‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં રટન કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે ‘t’ કસોટી

N = 600

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	હા	51	21.82	4.13	0.58	1.08	સાર્થક નથી
2	ના	549	22.49	5.16	0.22		

અર્થઘટન :–

કોષ્ટક 4.59 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 44 ની ચકાસણી કરવા માટે ‘t’ કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના ‘t’ ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી ‘t’ ની કિંમત 1.08 છે જે કોઠાના ‘t’ ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે શારીરિક તકલીફમાં હા કે ના હોય તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જેવા મળતો નથી.

HO. 42 જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફના સંદર્ભમાં તેના જીવન સંતોષના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.60

‘હા’ કે ‘ના’ ના સંદર્ભમાં રટન કલાકારોના જીવન સંતોષના
પ્રાપ્તાંકોના આધારે ‘t’ કસોટી

N = 600

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	હા	51	31.78	6.46	0.90	0.56	સાર્થક નથી
2	ના	549	37.45	6.61	0.28		

અર્થઘટન :–

કોષ્ટક 4.60 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 45 ની ચકાસણી કરવા માટે ‘t’ કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના ‘t’ ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી ‘t’ ની કિંમત 0.56 છે જે કોઠાના ‘t’ ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે શારીરિક તકલીફમાં હા કે ના હોય તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જેવા મળતો નથી.

HO. 43 જેતપુર શહેરના રટન કલાકારોમાં શોખના આધારે તેના માનસિક સ્વાસ્થ્યના મદ્દયકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.61

માનસિક કે શારીરિક શોખ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	માનસિક શોખ	208	89.10	10.39	0.72	0.54	સાર્થક નથી
2	શારીરિક શોખ	392	88.60	11.19	0.57		

અર્થઘટન :–

કોષ્ટક 4.61 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 46 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 0.54 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માનસિક કે શારીરિક શોખ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

HO. 44 જેતપુર શહેરના રદ્દન કલાકારોમાં શોખના આધારે તેના સમાચોજનના મધ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.62

માનસિક કે શારીરિક શોખ હોચ તેવા રદ્દન કલાકારોના સમાચોજનના પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	સમાચોજનના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	માનસિક શોખ	208	22.24	5.04	0.35	0.66	સાર્થક નથી
2	શારીરિક શોખ	392	22.53	5.10	0.26		

અર્થઘટન :–

કોષ્ટક 4.62 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કલ્પના નં. 47 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 0.66 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કલ્પના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માનસિક કે શારીરિક શોખ હોચ તેવા રદ્દન કલાકારોના સમાચોજનમાં તફાવત જેવા મળતો નથી.

HO. 45 જેતપુર શહેરના રટન કલાકારોમાં શોખના આધારે તેના જીવન સંતોષના મદ્યકો વચ્ચે સાર્થક તફાવત નથી.

કોષ્ટક નં. 4.63

માનસિક કે શારીરિક શોખ હોચ તેવા રટન કલાકારોના જીવન સંતોષના
પ્રાપ્તાંકોના આધારે 't' કસોટી

N = 600

ક્રમ	વિગત	જીવન સંતોષના પ્રાપ્તાંકો			પ્રમાણ ભૂલ	t કિંમત	સાર્થકતા
		n	m	SD			
1	માનસિક શોખ	208	37.59	6.66	0.46	0.37	સાર્થક નથી
2	શારીરિક શોખ	392	37.38	6.60	0.33		

અર્થઘટન :–

કોષ્ટક 4.63 માં દર્શાવેલી માહિતિની શૂન્ય ઉત્કળપના નં. 48 ની ચકાસણી કરવા માટે 't' કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે.

જ્યારે 598 ની સ્વાતંત્ર્ય માત્રા (df) એ કોષ્ટકના 't' ની કિંમત 0.05 કક્ષાએ 1.96 છે. અહીં ગણેલી 't' ની કિંમત 0.37 છે જે કોઠાના 't' ની કિંમત કરતા ઓછી છે તેથી તફાવત સાર્થક નથી. માટે શૂન્ય ઉત્કળપના સ્વીકાર્ય બને છે.

તારણ

આથી તારણ કાઢવામાં આવે છે કે માનસિક કે શારીરિક શોખ હોચ તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જેવા મળતો નથી.

પ્રકરણ-5

:: અનુકૂળિકા ::

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
5.0	પ્રસ્તાવના	212
5.1	સંશોધનનો સારાંશ	212
5.2	પ્રસ્તુત સંશોધનના તારણો	215
	5.2.1 ધિચરણ પૃથ્થકરણ (એકમાર્ગીય) ને આધારે મેળવેલા તારણો	216
	5.2.2 સહસંબંધ આધારે મેળવેલા તારણો	218
	5.2.3 'ા' કસોટીના આધારે મેળવેલા તારણો.	218
5.3	નબળા માનસિક સ્વાસ્થ્યના કારણો	222
5.4	માનસિક સ્વાસ્થ્ય સુધારવાના સૂચનો	222
5.5	નબળા સમાચોજનના કારણો	223
5.6	સમાચોજન સુધારવાના સૂચનો	223
5.7	નબળા જીવન સંતોષના કારણો	224
5.8	જીવન સંતોષ વધારવાના સૂચનો	225
5.9	સંશોધનના આધારે ભલામણ સૂચનો	226
5.10	આગળના સંશોધન માટેના સૂચનો	227

:: પ્રકરણ-૫ ::

સંશોધન સારાંશ, તારણો અને સૂચનો

5.0 પ્રસ્તાવના :-

સંશોધન અહેવાલ લેખનમાં દરેક પ્રકારનું આગવું મહત્વ હોય છે. જ્યારે સંશોધન કર્તા સંશોધન પૂર્ણ કરે છે ત્યારે સમગ્ર માહિતીના વર્ગીકરણના આધારે પોતાના સંશોધન સમાવિષ્ટ વિવિધ પાસાઓમાં સમસ્યા કથનથી માંડીને તારણો સુધીનો સ્પષ્ટ અને ટૂંકો ચિતાર સારાંશ રૂપે આપવાની પ્રથા છે. સારાંશ લખવાથી જ સંશોધન અહેવાલ લેખનનો આશય સૌથી વધુ ચરિતાર્થ થાય છે. માટે જ આ પ્રકરણનું સંશોધન અહેવાલ લેખનમાં ઘણું જ મહત્વનું સ્થાન ઘરાવે છે.

પ્રસ્તુત પ્રકરણમાં સમગ્ર સંશોધનના તારણો, સારાંશોની રજૂઆત કરવામાં આવી છે. આ સંશોધનનો મુખ્ય આશય જેતપુર શહેરના રેન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, જીવન સંતોષ અને સમાચોજનનો અભ્યાસ કરવાનો હતો. તેમજ આ ત્રણેથે પરિવત્યો આધારે મળેલી માહિતી ઉપરથી તારણો રજૂ કરવામાં આવ્યા છે. તેમજ આ સંદર્ભમાં આગળ સંશોધનો માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.

5.1 સંશોધનનો સારાંશ :-

આજના આ ટેકનોલોજીના ચુગમાં જિંદગી કોઈને ફાવતી ને ભાવતી વસ્તુ મળશો જ એવી ગેરન્ટી આપતી નથી. માણસની મોટી મુશ્કેલી એ છે કે જ્યાં એણો બૌદ્ધિક સમયસૂચકતા અને સજ્જતા દેખાડવાની જરૂર હોય છે ત્યાં કાં તો એ ભાવનાત્મક અભિગમ દાખવે છે અથવા આત્મપ્રશંસાના વિધાતક ફૂવામાં ભૂસકા મારવાનું શરૂ કરી દે છે. કેટલાક લોકો રોજગારી પ્રાપ્ત કરવામાં નહીં પણ બેરોજગાર રહેવામાં પોતાની ‘કુશળતા’ ખર્ચીનાખે છે અને જીવનમાં સંતોષ મેળવવા પ્રવૃત્તિ કર્યા જ કરે છે.

સમાજમાં વ્યકિત કોઈને કોઈ પ્રકારનો વ્યવસાય કરે છે અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે તેને કોઈપણ પ્રકારનું કાર્ય કરવું પડે છે અને તેમાંથી જે વળતર મળે છે તે દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષાય છે.

મનોવૈજ્ઞાનિક સોરેન્સન અને મામ તેના પુસ્તક "Psychology for Living" માં જણાવે છે કે (2500) પચચીસો કરતા પણ વધારે વ્યવસાયો છે જેમાં વ્યકિતએ પોતાની અભિયોગયતા, અભિજ્ઞિ, વ્યકિતત્વ અને બુદ્ધિને લક્ષ્યમાં રાખીને વ્યવસાયની પસંદગી કરવી જોઈએ.

જેમ કે ઔદ્ઘોગિક મનોવિજ્ઞાનનું સૂત્ર છે કે "Right Man for Right Place" એટલે કે “યોગ્ય સ્થાને યોગ્ય માણસ” આવવાથી વ્યકિતને વ્યવસાય સંતોષ અને જીવનસંતોષ વધે છે. જેથી વ્યકિતનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે અને તે સમાજમાં સારુ સમાયોજન સાધી શકે છે.

આ સંદર્ભમાં અહીં જેતપુર શહેરના રટન કલાકારો પોતાના કાર્યમાં માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે કે નહીં ? વ્યકિતને પોતાના કાર્ય સાથે સમાયોજન સાધી શકે છે કે નહીં ? અને તેના કાર્યથી તેને કેટલા અંશે જીવનસંતોષ પ્રાપ્ત થાય છે? તે જાણવા અને રટનકલાકારોના વ્યકિતગત પરિવત્યો સાથે માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવનસંતોષ કેટલા પ્રમાણમાં સંકળાયેલા છે એ તપાસવા માટે અભ્યાસ જરૂરી બન્યો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધનમાં નીચે મુજબની સંશોધન સમસ્યા લેવામાં આવી હતી.

“જેતપુર શહેરના રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાયોજન અને જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

પ્રસ્તુત સંશોધનમાં જેતપુર શહેરના રટન કલાકારોનો સમર્પિત તરીકે સમાવેશ કરી તેમાંથી 600 કર્મચારીઓ પ્રસ્તુત સંશોધનના યદરછ નિર્દર્શ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રસ્તુત અધ્યયનમાં જેતપુર શહેરના રટન કલાકારોના

માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવનસંતોષ પર સંશોધન વિષય પસંદ કરવામાં આવ્યો છે. જેમાં, નીચે મુજબની કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- (1) માનસિક સ્વાસ્થ્ય માપન માટે ડૉ. કી.જી. ભડ્ઢ રચિત તુલાનો ઉપયોગ કરવામાં આવ્યો.
- (2) સમાચોજન માપન માટે પ્રમોદકુમાર રચિત તુલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- (3) જીવનસંતોષ માપન માટે ડૉ. આલમ અને શ્રીવાસ્તવ રચિત તુલાનો ઉપયોગ કરવામાં આવ્યો.

ઉપર્યુક્ત ચદ્રચદ્ર રીતે પસંદ કરાયેલા નિર્દર્શા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીનું ગુણાંકન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાપ્ત થયેલ માહિતીનું ગુણાંકન કરવામાં આવ્યું અને વિવિધ ઘટકો પ્રમાણો વર્ગીકરણ કરી આ રૂપાંતરને સામાન્ય ટકાવારીમાં દર્શાવવામાં આવી. સંખ્યાત્મક માહિતીનું પૃથ્થકરણ કરવા માટે કાલ પિયર્સન 'r' પ્રયુક્તિ, વિચરણ પૃથ્થકરણ 'F' કસોટી અને 't' કસોટીનો ઉપયોગ કરી શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ દ્વારા કરી હતી.

જેતપુર શહેરના રટનકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, જીવનસંતોષ અને સમાચોજન વચ્ચે સહસંબંધ શોધવામાં આવ્યો હતો.

વ્યક્તિગત પરિવત્યો, શૈક્ષણિક લાયકાત, માસિક આવક અને અનુભવ અને માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવનસંતોષ વચ્ચે વિચરણ પૃથ્થકરણ દ્વારા અસરો તપાસવામાં આવી હતી. રટન કલાકારોના વ્યક્તિગત સામાજિક પરિવત્યો અને માનસિક સ્વાસ્થ્ય સમાચોજન અને જીવનસંતોષના મધ્યકોણી સાર્થકતાના તફાવતો શોધવામાં આવ્યા હતા અને અંતમાં પ્રાપ્ત થયેલ તારણોની રજૂઆત કરવામાં આવી છે. તેમજ તેનું અર્થઘટન કરવામાં આવ્યું છે.

સંશોધનના પરિણામની ચર્ચા કરતા કહી શકાય કે પ્રસ્તુત સંશોધનમાં માનસિક સ્વાસ્થ્ય અને સમાચોજન વચ્ચે ઓછો ઘન સહસંબંધ જોવા મળે છે જ્યારે સમાચોજન અને જીવનસંતોષ વચ્ચે સાધારણ ઘન સહસંબંધ જોવા મળે છે અને માનસિક સ્વાસ્થ્ય અને જીવનસંતોષ વચ્ચે સામાન્ય ઘન સહસંબંધ જોવા મળે છે.

આ ઉપરાંત વિચરણ પૃથ્થકરણા કહી શકાય કે શૈક્ષણિક લાયકાત અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

't' કસોટીના તારણોની સમીક્ષા કરતા કહી શકાય કે કેટલાક સ્વતંત્ર પરિવર્ત્ય માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવનસંતોષને અસર કરે છે અને કેટલાક કરતા નથી.

5.2 સંશોધનના તારણો :-

કોઈપણ સંશોધનનું છેલ્લુ પગથિયુ કે આખરી સોપાન એ પરિણામ વ્યક્ત કરે છે. સંશોધકને પ્રાપ્ત માહિતીના આધારે નિષ્કર્ષ ફિલિત કરે છે અને તારણો રજૂ કરે છે.

પ્રસ્તુત સંશોધનમાં જેતપુર શહેરના રત્નકલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવનસંતોષ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને પ્રાપ્ત માહિતીના આધારે આંકડાશાસ્ત્રીય ગણાતરી કરી તેના પરથી આવેલ પરિણામોની ચર્ચા તથા અર્થઘટન કરવામાં આવેલા તેના પરથી ત્રણ વિભાગમાં તારણો રજૂ કરવામાં આવ્યા છે.

- 5.2.1 વિચરણ પૃથ્થકરણા (એકમાર્ગીય)ને આધારે મેળવેલા તારણો
- 5.2.2 સહસંબંધ આધારે મેળવેલા તારણો
- 5.2.3 't' કસોટીના આધારે મેળવેલા તારણો

5.2.1 વિચરણ પૂછ્યકરણ (એકમાગીય)ને આધારે મેળવેલા તારણો ::

શિક્ષણ અંગે 'F' કસોટીના તારણો ::

- (1) જેતપુર શહેરના રટન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.
- (2) જેતપુર શહેરના રટન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.
- (3) જેતપુર શહેરના રટન કલાકારોની શૈક્ષણિક લાયકાત અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

કુટુંબની આર્થિક સ્થિતિ અંગે 'F' કસોટીના તારણો ::

- (4) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.
- (5) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.
- (6) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબની આર્થિક સ્થિતિ અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

કુટુંબની માસિક આવક અંગે 'F' કસોટીના તારણો ::

- (7) જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવક અને માનસિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.
- (8) જેતપુર શહેરના રટન કલાકારોની માસિક આવક અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

(9) જેતપુર શહેરના રટન કલાકારોની માન્સિક આવક અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

પિતાના વ્યવસાય અંગે 'F' કસોટીના તારણો ::

(10) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાય અને માન્સિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

(11) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાય અને સમાચોજન ના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

(12) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાના વ્યવસાય અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

જીવનશૈલી અંગે 'F' કસોટીના તારણો ::

(13) જેતપુર શહેરના રટન કલાકારોની જીવનશૈલી અને માન્સિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

(14) જેતપુર શહેરના રટન કલાકારોની જીવનશૈલી અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

(15) જેતપુર શહેરના રટન કલાકારોની જીવનશૈલી અને જીવનસંતોષના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

અનુભવ અંગે 'F' કસોટીના તારણો ::

(16) જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવ અને માન્સિક સ્વાસ્થ્યના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

(17) જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવ અને સમાચોજનના પ્રાપ્તાંકો વચ્ચે સંલગ્નતા જોવા મળતી નથી.

(18) જેતપુર શહેરના રટન કલાકારોના અનુભવ અને જીવન સંતોષના પ્રાપ્તિંકો વચ્ચે સંલગ્નતા જોવા મળે છે.

સમગ્ર એકમાર્ગીય વિચરણ પૂઢ્યકરણના તારણો ::

કુલ ઉત્કૃષ્ણનાઓ	સાર્થક	સાર્થક નથી
18	12	05

5.2.2 સહસંબંધ પ્રમાણો મેળવેલા તારણો ::

(19) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજન ના મધ્યકો વચ્ચે કોઈ સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

(20) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય અને જીવનસંતોષ ના મધ્યકો વચ્ચે સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

(21) જેતપુર શહેરના રટનકલાકારોના સમાયોજન અને જીવનસંતોષના મધ્યકો વચ્ચે સંગીન સહસંબંધ જોવા મળતો નથી.

સમગ્ર 'r' કસોટીના તારણો ::

કુલ ઉત્કૃષ્ણનાઓ	સાર્થક	સાર્થક નથી
03	03	00

5.2.3 't' કસોટીના આધારે મેળવેલા તારણો ::

(22) જેતપુર શહેરના રટન કલાકારોના દામ્પત્યજીવન પરિણિત કે અપરિણિત અને માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

(23) જેતપુર શહેરના રટનકલાકારોના દામ્પત્યજીવન પરિણિત કે અપરિણિત અને સમા-યોજનમાં તફાવત જોવા મળે છે.

(24) જેતપુર શહેરના રટન કલાકારોના દામપત્રયજીવન પરિણિત કે અપરિણિત અને જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

કુટુંબના સભ્યો પ્રમાણો 't' કસોટીમા મેળવેલ તારણો ::

(25) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબના સભ્યોની સંખ્યા 5 કે 5 થી વધુ સભ્યો ધરાવનાર રટન કલકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

(26) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબના સભ્યોની સંખ્યા 5 કે 5 થી વધુ સભ્યો ધરાવનાર રટન કલકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.

(27) જેતપુર શહેરના રટન કલાકારોના કુટુંબના સભ્યોની સંખ્યા 5 કે 5 થી વધુ સભ્યો ધરાવનાર રટન કલકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

પિતાના અભ્યાસ પ્રમાણો 't' કસોટીમા મેળવેલ તારણો ::

(28) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ હોય તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

(29) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ હોય તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.

(30) જેતપુર શહેરના રટન કલાકારોના પિતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ હોય તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

માતાના અભ્યાસ પ્રમાણે 't' કસોટીમા મેળવેલ તારણો ::

- (31) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ માતાનો અભ્યાસ હોચ તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.
- (32) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ માતાનો અભ્યાસ હોચ તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.
- (33) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો અભ્યાસ ધો. 10 સુધી કે ધો. 10 થી વધુ માતાનો અભ્યાસ હોચ તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળે છે.

માતાના વ્યવસાય પ્રમાણે 't' કસોટીમા મેળવેલ તારણો ::

- (34) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં જોડાયેલ હોચ તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.
- (35) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં જોડાયેલ હોચ તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.
- (36) જેતપુર શહેરના રટન કલાકારોના માતાનો વ્યવસાય નોકરી કે ઘરકામમાં જોડાયેલ હોચ તેવા રટન કલાકારોના જીવનસંતોષ માં તફાવત જોવા મળતો નથી.

રહેઠાણના આધારે 't' કસોટીમા મેળવેલ તારણો ::

- (37) જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણના ગ્રામ્ય કે શહેરી વિસ્તારના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળે છે.

(38) જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણાના ગ્રામ્ય કે શહેરી વિસ્તારના રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળે છે.

(39) જેતપુર શહેરના રટન કલાકારોના રહેઠાણાના ગ્રામ્ય કે શહેરી વિસ્તારના રટન કલાકારોના જીવનસંતોષમાં તફાવત જોવા મળતો નથી.

શારીરિક તકલીફ પ્રમાણે 't' કસોટીમા મેળવેલ તારણો ::

(40) જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફમાં હા કે ના હોથ તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

(41) જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફમાં હા કે ના હોથ તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.

(42) જેતપુર શહેરના રટન કલાકારોમાં શારીરિક તકલીફમાં હા કે ના હોથ તેવા રટન કલાકારોના જીવનસંતોષમાં તફાવત જોવા મળતો નથી.

શોખના આધારે 't' કસોટીમા મેળવેલ તારણો ::

(43) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક કે શારીરિક શોખ હોથ તેવા રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્યમાં તફાવત જોવા મળતો નથી.

(44) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક કે શારીરિક શોખ હોથ તેવા રટન કલાકારોના સમાચોજનમાં તફાવત જોવા મળતો નથી.

(45) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક કે શારીરિક શોખ હોથ તેવા રટન કલાકારોના જીવન સંતોષમાં તફાવત જોવા મળતો નથી.

સમગ્ર 't' કસોટીના તારણો ::

કુલ ઉત્કલ્પનાઓ	સાર્થક	સાર્થક નથી
24	11	13

5.3 નબળા માનસિક સ્વાસ્થ્યના કારણો ::-

માનવજીવન પ્રવૃત્તિઓથી ઉભરાયેલું છે. પ્રત્યેક માનવી દરેક ક્ષણે પ્રવૃત્તિઓ કરતો જ રહે છે. કેટલીકપ્રવૃત્તિઓ વ્યક્તિત્વ આર્થિક ઉત્પાદન માટે કરે છે. તે પ્રવૃત્તિમાં તેના માનસિક સ્વાસ્થ્યનું ચોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે.

વ્યક્તિત્વનું માનસિક સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો તે વ્યવસાયમાં સફળ થાય છે. પરંતુ દરેક માનવીમાં વ્યક્તિત્વગત ભિન્નતા રહેલી છે. તેમ દરેક માનવીના માનસિક સ્વાસ્થ્યમાં પણ ભિન્નતા રહેલી હોય છે, તેથી કેટલીક વ્યક્તિત્વનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારુ હોય છે માટે કેટલાક લોકોનું માનસિક સ્વાસ્થ્ય નબળું હોવાને કારણો તે પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી શકતા નથી.

જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય નબળું હોવાના કારણો અનેક છે, છતાં પણ તેનો ટૂંકમાં ઉલ્લેખ નીચે પ્રમાણે કરી શકાય :

- (1) પોતાના વ્યવસાય પ્રત્યેની વફાદારીનું પ્રમાણા.
- (2) વ્યવસાયમાં વધુ પડતો નિષ્ફળતાનો ભય.
- (3) વિદ્યાયક મનોવલણ અને વ્યવાવહારિક ઉણાપ.
- (4) પોતાની નિર્ણયશક્તિમાં પૂર્ણ સ્વાયત્તતાનો અભાવ.

5.4 માનસિક સ્વાસ્થ્ય સુધારવાના સૂચનો ::-

વ્યક્તિત્વનું કોઈપણ ગુણા લક્ષણ સારુ હોય કે નબળું હોય પણ તેના માટે વ્યક્તિત્વ પોતે જ જવાબદાર હોય જ છે. તેમ છતાં પણ વ્યક્તિત્વની આજુબાજુનું

વातावरणા, કૌટુંબિક વાતાવરණા, આર્થિક સ્થિતિ વગેરે અસર કરે છે તેથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે નીચે મુજબના સૂચનો રજૂ કરવાનો નામ પ્રચાસ કર્યો છે.

- (1) વ્યક્તિને પોતાના વ્યવસાય પ્રત્યે સતત અને સતત વિદ્યાચક અભિગમ ખૂબ જ વિકસાવવો જોઈએ.
- (2) પોતાના કાર્ય અંગે જાતે જ વિચારી અને પોતાના વર્તન પર થતી વિદ્યાચક અસરોનો સતત વિચાર કરવો જોઈએ.
- (3) વ્યક્તિએ પોતાના વ્યવસાયમાં જે આધુનિક પરિવર્તનો થતા રહે છે તેની સમજ સતત વિકસાવવી જોઈએ.
- (4) વ્યવસાયમાં સફળતા મેળવવા પોતાના પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્ર ઉપરાંત વિશ્વ સ્તરના ક્ષેત્રોમાં રહેલી પરિવર્તનની પરિસ્થિતિ સાથે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ.

5.5 નબળા સમાયોજનના કારણો :-

વ્યક્તિ પોતાના વ્યવસાય સાથે યોગ્ય સમાયોજન સાધવામાં મુશ્કેલી અનુભવતો હોય છે તેના કારણમાં પોતાના કાર્યસ્થળનું વાતાવરણા, કાર્યનો પ્રકાર, કૌટુંબિક પરિસ્થિતિ વગેરે બાબતો અસર કરતી હોય છે.

- (1) પોતાના વ્યવસાયમાં સલામતિનો અભાવ.
- (2) વ્યક્તિગત જવાબદારીઓ સમાયોજનમાં અસર કરે છે.
- (3) કાર્યસ્થળના પરિબળો અસર કરે છે.
- (4) વ્યક્તિની પોતાની આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોય છે.

5.6 સમાયોજન સુધારવાના સૂચનો :-

સમાયોજન એક વ્યક્તિગત અને સામૂહિક બાબત છે. પોતાના વ્યવસાયને કે ત્યાંના વાતાવરણા સાથે કૌટુંબિક ભાવના જન્માવે તો તે સમાયોજન

સાધવામાં મહત્વનું અંગ સાબિત થઈ શકે છે. સંશોધકે પોતાની આંતરસુજના આધારે કેટલાક સૂચનો નીચે મુજબ રજૂ કર્યા છે.

- (1) સમાયોજનમાં વ્યક્તિતનો કાર્યનો સમય દરમિયાનનો સહવાસ આ પરિબળ અસર કરે છે. તેથી જ વ્યક્તિએ પોતાના કાર્ય સમય દરમિયાન અન્ય લોકો સાથે વિદ્યાયક વર્તન કરે તો સમાયોજન સાધી શકે છે.
- (2) સમાયોજન એક વ્યાપક પરિબળ છે. રણ કલાકારોનું આ પરિબળ સ્થાનિક રીતે, પ્રાદેશિક રીતે કે ખિશિષ્ટ સ્થાન ઘરાવે છે. તેથી વ્યક્તિ બધા સાથે રહીને તેનો વિકાસ કરવા પ્રયત્નો કરી શકે છે.
- (3) વ્યક્તિ પોતાની વિશિષ્ટ શક્તિમાં અન્ય લોકો સાથે સમજપૂર્વક સાથે રહીને તેમજ પોતાની નાનકડી ક્ષતિને આ પરિબળના સંદર્ભમાં સુધારો કરીને સમાયોજનમાં સુધારો કરી શકાય છે.
- (4) સમાયોજનમાં અનેક ઘટકો છે. જેમાં વ્યક્તિ, સમય, સ્થળ, પરિસ્થિતિ, સાધનો, સંચાલકો, સામાજિક જરૂરિયાતો, પોતાની અભિજ્ઞયિ કે અભિ-યોગ્યતાનો વિદ્યાયક ઉપયોગ કરીને યોગ્યતમ કક્ષાએ સમાયોજન વધારવા પ્રયત્નો કરી શકાય છે.

5.7 નબળા જીવન સંતોષના કારણો :-

જીવન સંતોષ એ માનવજીવનનું અભિજ્ઞન અને જટિલ પરિબળ છે. વ્યક્તિતની પોતાની કાર્ય પદ્ધતિને આધારે જીવન સંતોષમાં અસર પહોંચી શકે છે. વ્યક્તિગત પરિબળોને કારણો જીવન સંતોષ પર અસર કરે છે. જીવન સંતોષ નબળા રહેવાના નીચે મુજબના કારણો છે :

- (1) રણ કલાકારોના શૈક્ષણિક સ્તર, અનુભવ, આવક અને દામપત્ર્ય જીવન આ પરિબળની અસર જોવા મળે છે.

- (2) જીવન સંતોષ એ માનવજીવનનું જટિલ પરિબળ હોવાને કારણે વ્યક્તિની બદલાતી અવસ્થાઓ જીવનસંતોષને બદલતી રહે છે જેમ કે બાલ્યાવસ્થા, ચુવાવસ્થા, પ્રોફાવસ્થા, વૃદ્ધાવસ્થા આ બધા અલગ રીતે અસર કરે છે.

5.8 જીવન સંતોષ વધારવાના સૂચનો ::-

‘જીવન સંતોષ’ ખૂબ જ જટિલ પદ છે છતાં વ્યક્તિનો જન્મ માનવ તરીકે થયો છે તે જ મોટું સદ્ભાગ્ય છે તેમ સમજુને ગૌણા પરિબળો જે જીવન-રીતિને અસર કરે છે તેની વાસ્તવિક સમજૂતિ મેળવીને વ્યક્તિત્વ પોતાનો જીવન સંતોષ વધારી શકે છે. આ માટે સંશોધકે મૌલિક સૂચનો આપવાનો નભુ પ્રયત્ન કરેલ છે જે નીચે મુજબ છે.

- (1) નોકરીમાં મળતો સમય, સ્થળ અને આર્થિક બાબતો યોગ્ય છે અને તેને વધુ વિકાસશીલ બનાવી શકાશે તેમ સમજવાથી વ્યક્તિત્વ પોતાનો જીવનસંતોષ વધારી શકે છે.
- (2) માનવજીવનમાં પોતાનું સ્થાન અતિ મહિંદ્રાનું છે. તે સતત અનુભવ કરવો જોઈએ.
- (3) પોતાના કુટુંબમાં એક વ્યક્તિત્વ તરીકે સમગ્ર કુટુંબ વિશિષ્ટ વ્યક્તિત્વ છે તેનો આનંદ લેવો જોઈએ.
- (4) આજના આ વૈજ્ઞાનિક ચુગમાં વિશિષ્ટ સાધનોમાં પોતે પણ સતત વિકાસશીલ વ્યક્તિત્વ ધરાવે છે અને આ વ્યક્તિત્વને વધારે વિકાસશીલ બનાવી શકે તેમ સમજવાથી પોતાનો જીવન સંતોષ વધે છે.
- (5) રટન કલાકારોનું કાર્ય બધા સામાજિક કાર્યોમાં શ્રેષ્ઠ છે અને પોતે તેનું એક અવિભાજ્ય અંગ છે તેમ સમજવાથી વ્યક્તિનો જીવન સંતોષ વધે છે.

5.9 સંશોધનના આધારે ભલામણ સૂચનો ::-

- (1) પ્રસ્તુત સંશોધન રટન કલાકારોના અને હિરા ઉદ્ઘોગના સાથે સંકળાયેલ લોકોની પ્રવૃત્તિ માટે મદદરૂપ સાબિત થઈ શકે.
- (2) સમાજ અને રાષ્ટ્રને સામાન્યપણે રટન કલાકારોની જરૂરિયાતો અને કામના વાતાવરણનું જ્ઞાન આપવા માટે ઉપયોગી છે.
- (3) રટન કલાકારોના તાલીમી કાર્યક્રમો દ્વારા માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષના સુધારા દ્વારા ઉત્પાદન વધારવા માટે ઉપયોગી છે.
- (4) રટન કલાકારોના કૌદુર્યબિક સંબંધો, માલિકો અને સહકર્મચારીઓ સાથેના સંબંધો સ્થાપિત કરવામાં અને સંબંધો સુધારવા માટે ઉપયોગી છે.
- (5) આવા જ પ્રકારનું સંશોધન, સંરથાગત પર્યાવરણ અને વ્યવસાય સામેલગીરી ની અસરકારકતા અંગેનું કરી શકાય.
- (6) રટન કલાકારોના અન્ય જિલ્લાઓ તેમજ મુખ્ય શહેર સ્થૂરત અને ભાવનગર જેવા હિરા ઉદ્ઘોગ સાથે સંકળાયેલા સમગ્રનો અભ્યાસ કરી તેના સંશોધનના તારણો પણ સહાયક બની શકે છે.
- (7) વર્તમાન સંશોધનના પરિણામોની મોટી ઉપયોગિતા વૈજ્ઞાનિકો પ્રત્યાયનકારો, મનોવૈજ્ઞાનિકો, સામાજિક કાર્યકરો, માર્ગદર્શક બ્યુરો, વ્યવસાય સંગઠનો, સલાહકારો, સંશોધકો તેમજ વ્યવસાયના ક્ષેત્રો જે જુદી-જુદી કક્ષાએ ઉચ્ચિત પ્રકારના માર્ગદર્શન કાર્યક્રમો યોજુને સમાજ ઉપયોગી કાર્ય કરી શકે છે.
- (8) પ્રસ્તુત અભ્યાસનું ક્ષેત્ર જેતપુર શહેર છે જેનું મૂલ્ય આંતર રાષ્ટ્રીય બજારમાં ઘણું છે. આ ક્ષેત્રમાં એક પણ સંશોધન થયેલ નથી. આ પ્રથમ પ્રયાસ છે. આ જ ક્ષેત્રમાં અન્ય ઘટકો વિશે આગળ સંશોધન કરી શકાય.

5.10 આગળના સંશોધન માટેના સૂચનો ::-

પ્રસ્તુત સંશોધનના પરિણામોની તપાસ કરતા માલુમ થાય છે કે આ ક્ષેત્રમાં ભવિષ્યમાં કોઈ સંશોધન હાથ ધરવામાં આવે તો નીચે મુજબ કેટલાક સૂચનો દ્યાન દ્યાનમાં લઈને સંશોધકે પોતાના સંશોધન કાર્યનોને વધુ વ્યાપક અને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય તે માટે આગામી સંશોધન અંગે નીચે મુજબના સૂચનો કરેલ છે.

- (1) જેતપુર શહેરને બદલે રાજકોટ જિલ્લા કે સૌરાષ્ટ્ર કે ગુજરાતના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષનો અભ્યાસ કરી શકાય.
- (2) આ સંશોધનની ચકાસણી માટે થોડા-થોડા સમયના અંતરે આજ સંશોધન ફરી-ફરી પુનરાવર્તન કરી શકાય.
- (3) જેતપુર શહેરના રટન કલાકારોની જેમ અન્ય શહેરના રટન કલાકારોને સાંકળીને આ પ્રકારના અભ્યાસો થઈ શકે.
- (4) માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ સિવાયના બીજા પરિવત્યો જેવા કે સંસ્થાગત પર્યાવરણ, વ્યવસાય સામેલગીરી, વ્યવસાય સંતોષ, કાર્યની ચિંતા વિગેરે લઈને રટન કલાકારો તેમજ અન્ય કર્મચારીઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્ર કે અન્ય વ્યવસાયોમાં કાર્ય કરતા કર્મચારીઓના અભ્યાસો થઈ શકે છે.
- (5) અર્દ્ધ સરકારી અને બિન સરકારી ક્ષેત્રના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષ અંગે તુલનાત્મક અભ્યાસ કરી શકાય.
- (6) જેતપુર શહેરના રટન કલાકારોના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને જીવન સંતોષના વ્યક્તિત્વ નિણાયિકો અંગે અભ્યાસ થઈ શકે.

(7) પ્રસ્તુત અભ્યાસમાં જે નમૂના લેવામાં આવ્યા છે તેને બદલે રટન કલાકારોના અન્ય શહેરોના રટન કલાકારોનો સંચુક્ત રીતે અભ્યાસ કરવામાં આવે તો વધુ ચોકસાઈબરી માહિતી પ્રાપ્ત થઈ શકે. અહિં ફક્ત જેતપુર શહેરના રટન કલાકારોને ધ્યાનમાં લઈને સંશોધન કરવામાં આવ્યું છે.

આથી, આ અદ્યચનનાં તારણો સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતના રટન કલાકારોને લાગુ પાડી શકાય નહીં, તે મર્યાદાને સમજુને આ તારણોનો વિનિયોગ કરવો.

અંતમાં પરિશિષ્ટમાં જડરી અન્ય વિગતોની રજૂઆત કરી સંદર્ભસૂચિ રજૂ કરવામાં આવી છે.

ઓફિશિયલ પરિશાષ્ટ

ક્રમ	વિગત	પૃષ્ઠ નંબર
G	સંદર્ભ ગ્રંથો	001
G	સંદર્ભ પીએચ.ડી. થીસીસ	016
G	સંદર્ભ-ABSTRACT	021
G	સંદર્ભ પીએચ.ડી.-SYNOPSIS	023
G	સંદર્ભ એમ.એ.-DISSERTATION	030
G	પ્રચ્છનાવલી	



- 001** Society & Community (Author : Radhakamal Mukerjee, Publication : Sachin Publication)
- 002** Living and Dying (Author : Vidya Dehejia, Publication : Vikas Publishing House Pvt. Ltd.)
- 003** A Dictionary of Psychology (Author : James Drever, Revised by : Harvey wallersein)
- 004** Psychiatry Descriptive and Dynamic (Author : Jackson A. Smith, Publication : Oxford & IBH Publishing Co.)
- 005** Heredity & Environment (Edited by : A. H. Halsey, Publication : Methuen & Co. Ltd.)
- 006** Workbook for the numbers game statistics for psychology (Author : Elenlevey gail, John gay snodgrass, Publication : The Williams & Wilkims Co., Baltimore)
- 007** Infuence of psychology in industries (Author : Dr. B.K. Roy Chowthury, Publication : Metroplitan book Co.P.Ltd.)
- 008** Psychology & social problems (Author : Michale Argyle, Publication : Methuen & Co. Ltd.)
- 009** Psychometric methods (Author : J.P. Guilford, Publication : Tata Mcgraw-hill publishing Co. Ltd.)
- 010** Modernization of working women in developing societies (Author : Raj Mohinisethi, Publication : National Publishing House - New Delhi.)

- 011** Indian Nationalism and Hindu Social Reform (Author : Charles H. Heimsath, Publication : Princeton University Press, Bombay : Oxford University Press)
- 012** The New Psychology of Persuasion in selling (Author : Robert A. Whitney - others, Publication : Parker Publishing Company Inc.)
- 013** Psychology An Introduction (Author : Jerome Kagan, Ernest Havemann, Publication : Harvard Uni.)
- 014** Introduction to psychology (Author : Ernest R. Hilgard & others, Publication : Oxford & IBH publishing Co.)
- 015** Psychology & Life (Author : Flyod L. Ruch, Publication : D.B. Taratorevala Sons & Co. Pvt. Ltd.)
- 016** Psychological Psychology (Author : M. A. Weger, Publication : Holt Rinehart and Winston)
- 017** Adolescent Psychology (Author : S.P. Chaube, Publication : Vikas Publishing)
- 018** Psychology in use (Author : Gray & others, Publication : Euresia Publishing)
- 019** Psychology for living (Author : Herbert Sorenson, Publication : McGraw hill book company)
- 020** Focal Psychotherapy (Author : Michael balint & others, Publication : Tavistock Publications)
- 021** General Psychology (Author : M. Novy, W. Portr swift, Publication : McGraw-hill book company)

- 022** The Principles of Psychology (Author : William James, Publication : Dover Publishing Inc.)

023 Abnormal Psychology (Author : S.K. Mangal, Publication : Sterling Pub. Ltd.)

024 Humanistic Psychology (Author : Dorothy D. Nevill, Publication : Gardner Press inc.)

025 Scientists - A social Psychological study (Author : Sri Chandra, Publication : Oxford & IBH)

026 Experimenting in Psychology (Author : Robert gottsdanger)

027 Personality (Author : Louis P. Thorpe, Publication : D. Van Nostrand Co.)

028 Focus in to man (Author : J.M.Tanner)

029 Psychodynamics : The science of unconscious Mental forces (Author : S. Blum)

030 Social Dev. in young children (Author : Susan Isaacs)

031 Othello (Author : Alice Walker, Publication : Cambridge)

032 A brief into to psychology (Author : Clifford T. Morgan)

033 <http://www.mumbai.mtnl.net.in>

034 <http://www.calcutta.mtnl.co.in>

035 ઔધોગિક મનોવિજ્ઞાન (લેખક : ડૉ. બાનુપ્રસાદ અમૃતલાલ પરીખ,
પ્રથમ આવૃત્તિ : 1973, પ્રકાશન : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,
ગુજરાત રાજ્ય.

- 036 શૈક્ષણિક મનોવિજ્ઞાન (લેખક : ગુણવંત શાહ, કુલીન પંડ્યા, પ્રથમ આવૃત્તિ : 1978, ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 037 શૈક્ષણિક માનસશાસ્ત્ર (લેખક : મોતીભાઈ પટેલ, હરિભાઈ ગોહિલ, અન્ય પ્રથમ આવૃત્તિ : 1970, પ્રકાશન : અનડા પ્રકાશન)
- 038 શૈક્ષણિક માનસશાસ્ત્ર પરિચય (લેખક : ડૉ. ભાનુપ્રસાદ એ. પરીખ, ડૉ. ધીરજલાલ એમ. ભાવસાર, પ્રથમ આવૃત્તિ : 1972, પ્રકાશન : પોષ્યુલર પ્રકાશન)
- 039 શરીર મનોવિજ્ઞાન (લેખક : પ્રા. મહેશ એમ. દવે, પ્રા. કિશોર કે. શુક્લ, અન્ય, પ્રથમ આવૃત્તિ : 1967)
- 040 મનોવિજ્ઞાન (લેખક : ડૉ. હેનરી ઈ. ગોરેટ, અનુવાદક : ડૉ. ઉદય પારીક, પ્રથમ આવૃત્તિ : 1950, પ્રકાશન : ઈલાઇફ પબ્લિશર્સ)
- 041 મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો (લેખક : ડૉ. બી.એ. પરીખ, અન્ય, પ્રથમ આવૃત્તિ 1974 : , પ્રકાશન : ચુનિવર્સિટી અને ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 042 બાળ અભ્યાસ મનોવિજ્ઞાન (લેખક : કાપડીયા, પ્રથમ આવૃત્તિ : 1984)
- 043 સામાન્ય મનોવિજ્ઞાનની રૂપરેખા (લેખક : પ્રા. આર.પી. ભંડ, અધ્યતન આવૃત્તિ : 1997-98, પ્રકાશન : સી. જમનાદાસ કંપની)
- 044 શારીરિક મનોવિજ્ઞાન : (લેખક : કાપડીયા, ગાંધી, પ્રથમ આવૃત્તિ : 1968, પ્રકાશન : અનડા પ્રકાશન)
- 045 સામાન્ય મનોવિજ્ઞાન : (લેખક : વિ. સ. વળીકર, પ્રથમ આવૃત્તિ : 1964, પ્રકાશન : અનડા પ્રકાશન)

- 046 જીવન માટેનું શિક્ષણ (લેખક : એડગર ફોરે-અન્ય, અનુવાદક : પ્રેમશંકર ભણ્ણ, પ્રથમ ગુજરાતી આવૃત્તિ : 1976, પ્રથમ આવૃત્તિ : 1976, પ્રકાશન : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)

047 અસાધારણ મનોવિજ્ઞાન (લેખક : ડૉ. મહેશુલાલ પટેલ, પ્રથમ આવૃત્તિ : 1971, પ્રકાશન : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)

048 મનોવિજ્ઞાનની વિચારધારા (લેખક : સ્વ. ડૉ. કુલીનભાઈ પંડ્યા, પ્રથમ આવૃત્તિ : 1971, પ્રકાશન : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)

049 મનોવિજ્ઞાન અને તેના સંપ્રદાયો (લેખક : પ્રા. સી.કે. આકુવાલા, પ્રથમ આવૃત્તિ : 1966 , પ્રકાશન : ભારત પ્રકાશન)

050 વૈયક્તિક સમાચોજનનું મનોવિજ્ઞાન (લેખક : ડૉ. મધુભાઈ કોઠારી, પ્રથમ આવૃત્તિ : 1981, પ્રકાશન : અંબાણી પ્રકાશન)

051 સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : એમ.કે. ભણ્ણ, કે.ડી. ભણ્ણ, ઉજમશી એ. કાપડીયા, ઝેક વી. કોઠારી, રજનીકાંત પટેલ, પ્રકાશન : અનડા બુક ડીપો)

052 વૈયક્તિક સમાચોજનનું મનોવિજ્ઞાન (લેખક : પ્રો. કે. સી. સારડા, પ્રો. દિપક આર. શાહ, અન્ય, પ્રકાશન : સી. જમનાદાસ કંપની)

053 શરીરલક્ષી મનોવિજ્ઞાન (લેખક : પ્રો. ભરતકુમાર બી. ગાંધી, પ્રો. એમ. અમીન મલિક, અન્ય, પ્રકાશન : સી. જમનાદાસ કંપની)

054 સલાહ મનોવિજ્ઞાન (લેખક : ડૉ. સોમાભાઈ ડી. પટેલ, પ્રકાશન : ચુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)

- 055 સલાહ મનોવિજ્ઞાન (લેખક : પ્રા. સી.બી. દવે, પ્રા. કે.કે. મહેતા, અન્ય, પ્રકાશન : વિરલ પ્રકાશન)
- 056 સલાહ મનોવિજ્ઞાન (લેખક : પ્રિ.ડૉ. ભાલચંદ્રેશ જોશી, પ્રો. શશીકાંત ડી. પાઠક, અન્ય, પ્રકાશન : જમનાદાસ કંપની)
- 057 મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો (લેખક : ડૉ. બી.એ. પરીખ, પ્રકાશન : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ)
- 058 આધુનિક મનોવિજ્ઞાનનો ઐતિહાસિક પરિચય (લેખક : ડૉ. કેશવલાલ બી. વ્યાસ, પ્રકાશન : ગુજરાત ચુનિવર્સિટી)
- 059 મનોવિશ્લેષણ શાસ્ત્ર (એક રૂપરેખા) (લેખક : ડૉ. એમ.એમ.ત્રિવેદી, પ્રકાશન : ચુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ)
- 060 વૈયક્તિક સમાચોજનનું મનોવિજ્ઞાન (લેખક : દીપક આર. શાહ અને અન્ય, પ્રકાશક : આર.સી. જમનાદાસ, આવૃત્તિ : 2001,2002)
- 061 પ્રગત સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : ડૉ. બી.એ. પરીખ, પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, આવૃત્તિ : 1989)
- 062 આધુનિક વિશ્વનો ઇતિહાસ (લેખક : ડૉ. આર.કે. ધારેયા અને અન્ય, પ્રકાશક : આર.સી. જમનાદાસ, આવૃત્તિ : 2002)
- 063 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ (લેખક : દીપક આર. શાહ, પ્રકાશક : આર.સી. જમનાદાસ, આવૃત્તિ : 2001, 2002)
- 064 વિકૃતિ મનોવિજ્ઞાન અને આધુનિક જીવન (લેખક : ડૉ. ધીરેન્દ્ર દ. મહેતા, પ્રકાશક : ભારત પ્રકાશન, આવૃત્તિ : 1965)

- 065 માનસિક કાબેલિયત (લેખક : માલવી વનરાજ)
- 066 સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : પ્રો. કે.ડી. ભંડુ અને અન્ય, પ્રકાશક : જમનાદાસ કંપની, આવૃત્તિ : 1975, 1976)
- 067 બાળ મનોવિજ્ઞાન (લેખક : ડૉ. અનંત વસાણી, અન્ય, આવૃત્તિ : 2002, 2003)
- 068 વૈચકિતક અનુકૂલનનું માનસશાસ્ત્ર (લેખક : વોરા પરીખ દવે, અન્ય આવૃત્તિ : 1965)
- 069 વ્યકિતગત અનુકૂલનનું મનોવિજ્ઞાન (લેખક : ડી.બી. વ્યાસ, અન્ય, આવૃત્તિ : 1964, 1965)
- 070 વૈચકિતક સમાચોજનનું મનોવિજ્ઞાન (લેખક : એમ.એમ. ગોહિલ, અન્ય, આવૃત્તિ : 2000, 2001)
- 071 પ્રાથમિક સામાન્ય મનોવિજ્ઞાન-1 (લેખક : ભરતકુમાર ગાંધી, અન્ય, આવૃત્તિ : 1979)
- 072 વ્યકિતત્વના સિદ્ધાંતો (લેખીકા : કુસુમબેન કે. ભંડુ, આવૃત્તિ : 1981, પ્રકાશન : જે.બી. સેંડિલ)
- 073 મનોવૈજ્ઞાનિક ભાપન (લેખક : ફૃષ્ટાકાંત દેસાઈ, આવૃત્તિ : 1978, પ્રકાશન : ડૉ. કેશુભાઈ દેસાઈ)
- 074 વિકાસલક્ષી મનોવિજ્ઞાન, ભાગ-1 (લેખીકા : એલિઝાબેથ પી. હરલોક, આવૃત્તિ : 1974, પ્રકાશન : જે. બી. સેન્ડિલ)
- 075 મનોવિજ્ઞાન અને તેના સંપ્રદાયો (લેખક : પ્રાસિકે આકૃવાલા, આવૃત્તિ : 1966, પ્રકાશન : ચંદુલાલ અને મફતલાલ ગોરધનદાસ શાહ)

- 076 સામાન્ય મનોવિજ્ઞાન** (લેખક : પ્રા. કે.ડી. ભંડ – અન્ય, આવૃત્તિ : 1974, 1975 પ્રકાશન : શ્રી જમની રંમીકાન્ત)
- 077 ઔદ્યોગિક મનોવિજ્ઞાન** (લેખક : ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ, આવૃત્તિ : 1973, પ્રકાશક : નટવરસિંહ પરમાર)
- 078 વૈયક્તિક સમાચોજનનું મનોવિજ્ઞાન** (લેખક : પ્રા. દીપક આર. શાહ, આવૃત્તિ : 2001-02, પ્રકાશક : જમનાદાસ કંપની)
- 079 મનોવિજ્ઞાન નિબંધ** (લેખક : પ્રા. એસ.વી. ત્રિવેણી, આવૃત્તિ : 1974-75, પ્રકાશક : રંમીકાંત જમનાદાસ શાહ)
- 080 મનોવિજ્ઞાન નિબંધમાળા** (લેખક : પ્રો. સી.બી. દવે, આવૃત્તિ : 1968, પ્રકાશક : પ્રકુલ્લયંડ્રસિંહ શાહ)
- 081 પૂર્વગ્રહ** (લેખક : શાશીકાંત રોથ, પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 082 મનોવિજ્ઞાનના સંપ્રદાયો-સિદ્ધાંતો** (લેખક ડૉ. બી.એ. પરીખ, આવૃત્તિ : 1982, પ્રકાશક : શ્રી ઈશ્વરલાલ જે. પટેલ)
- 083 મનોભાષાશાસ્ત્ર પરિચય** (લેખક : ડૉ.બી.એ. પરીખ, પ્રકાશક : ગુજરાત ચુનિવર્સિટી)
- 084 સમાજલક્ષી મનોવિજ્ઞાન,** (લેખક : હસમુખભાઈ પટેલ, આવૃત્તિ : 1977 પ્રકાશક : રચના પ્રકાશન)
- 085 મનોવિજ્ઞાન અને અસરકારક વર્તન** (લેખક : દીપક આર. શાહ-અન્ય, આવૃત્તિ : 2001, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)

- 086 મનોવિજ્ઞાન પ્રયોગો અને આંકડાશાસ્ત્ર (લેખક : યોગેન એચ. ભર્ણ, આવૃત્તિ : 1997-98 , પ્રકાશક : સી. જમનાદાસ કંપની)**
- 087 મનોવિજ્ઞાન સંશોધન પદ્ધતિઓ (લેખક : એમ. અમીન મલીક, આવૃત્તિ : 2001-02 , પ્રકાશક : સી. જમનાદાસ કંપની)**
- 088 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : ભરતકુમાર બી. ગાંધી, આવૃત્તિ : 1995-96 , પ્રકાશક : સી. જમનાદાસ કંપની)**
- 089 પ્રાથમિક આંકડાશાસ્ત્ર (લેખક : હેસાઈડે. લી., આવૃત્તિ : 1962, ભારત પ્રકાશન, અમદાવાદ)**
- 090 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : દવે ચેકાસુ-અન્ય, આવૃત્તિ : 1974, પ્રકાશક : માનસ પ્રકાશન, અમદાવાદ)**
- 094 મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર (લેખક : પ્રા. બી. એમ. શેઠ અને અન્ય, આવૃત્તિ : 1976, પ્રકાશક : યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ)**
- 095 મનોવિજ્ઞાનનું પદ્ધતિ શાસ્ત્ર (લેખક : ઉજમસી એ. કાપડીયા અને અન્ય આવૃત્તિ : 1974, પ્રકાશક : અનડા બુક ડીપો)**
- 096 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ (લેખક : પ્રા. સી.બી.દવે અને અન્ય, આવૃત્તિ : 1983, પ્રકાશક : વિરલ પ્રકાશન)**
- 097 મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર M.A. (લેખક : સી.બી. દવે અને અન્ય, આવૃત્તિ : 1986, પ્રકાશક : વિરલ પ્રકાશન)**
- 098 આંકડાશાસ્ત્રની પદ્ધતિઓ (લેખક : શુ.એમ. પટેલ, આવૃત્તિ : 1963, પ્રકાશક : ભારત પ્રકાશન)**

- 099 મનોવિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર (લેખક: ભરતકુમાર સી. ગાંધી અને અન્ય,
આવૃત્તિ : 1976-77, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 100 મનોવિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર (લેખક: વાચ. કે. ટેસાઈ
અને અન્ય, આવૃત્તિ : 1995-96, પ્રકાશક : પોષ્યુલર પ્રકાશન)
- 101 મનોવિજ્ઞાનના પ્રયોગોનો પરિચય (લેખક : વિલ્યમ વૂન્ટ, આવૃત્તિ :
1879, પ્રકાશક : અનડા પ્રકાશન)
- 102 મનોવિજ્ઞાનના પ્રયોગો (લેખક : પ્રા. બી.એમ. શેઠ, આવૃત્તિ : 1971,
પ્રકાશક : આબલકિન્ડ પ્રકાશન)
- 103 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : ડૉ. ચિંતામણી ર્યંબક બોપટકર,
આવૃત્તિ : 1995-96, પ્રકાશક : ગુ.યુ.અ.)
- 104 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : ભરતકુમાર બી. ગાંધી અને અન્ય,
પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 105 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : શ્રી શશીકાંત મહાશય, આવૃત્તિ :
1965, પ્રકાશક : ભારત પ્રકાશન)
- 106 મનોવિજ્ઞાન પ્ર્યન્સંગ્રહ (લેખક : ડૉ. ગીતા આર. ડોડીયા અને અન્ય)
- 107 ઉચ્ચતર સામાન્ય માનસશાસ્ત્ર (લેખક : ડૉ. બાનુપ્રસાદ એ. પરીખ
અને અન્ય, આવૃત્તિ : 1976, પ્રકાશક : અનડા બુક ડેપો, અમદાવાદ)
- 108 અસાધારણ મનોવિજ્ઞાન (લેખક : પ્રા. રજનીકાન્ત એલ. પટેલ અને
અન્ય, આવૃત્તિ : 1995-96, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 109 શારીરિક મનોવિજ્ઞાન (લેખક : ઉજમશી કાપડીયા, આવૃત્તિ : 1968-
76, પ્રકાશક : અનડા બુક ડીપો)

- 110 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ અને મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર, (લેખક : પ્રા. મહેશ એમ. દવે અને અન્ય, આવૃત્તિ : 1974, પ્રકાશક : મેસર્સ બી. એસ. શાહ પ્રકાશન)
- 111 માનસોપચાર (લેખક : ડૉ. ચાર્લસ એચ. બદામી, આવૃત્તિ : 1981, પ્રકાશક : ભૂપેન્દ્રભાઈ એમ. પટેલ)
- 112 અસાધારણ બાળકોનું માર્ગદર્શન (લેખક : ડૉ. એન. એસ. દોંગા, આવૃત્તિ : 1991, પ્રકાશક : સ્વ. ડૉ. હરિભાઈ મુ. દેસાઈ મેમોરીયલ એજચ્યુકેશનલ ટ્રસ્ટ)
- 113 ચિંતા નહીં ચિંતન કરીએ (લેખક : ડૉ. અલકાબેન માંકડ, પ્રકાશક : અલકાબેન માંકડ-રાજકોટ)
- 114 સમાજલક્ષી મનોવિજ્ઞાન (લેખક : કે.સી. સારડા-અન્ય, આવૃત્તિ : 1966-67, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 115 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ (લેખક : ડૉ. એમ. અમીન મલીક-અન્ય, આવૃત્તિ : 1997-98, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 116 મનોવિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર (લેખક : દેસાઈ વાચ.કે.-અન્ય, આવૃત્તિ : 1995-96, પ્રકાશક : પોષ્યુલર પ્રકાશન-સુરત)
- 117 મનોભાષાશાસ્ત્ર પરિચય (લેખક : ડૉ. બી.એ. પરીખ, આવૃત્તિ : 1982, પ્રકાશક : બુ. મ. પટેલ)
- 118 વ્યક્તિત્વ સમાયોજન માપન અને ચિકિત્સાકાર્ય નિદાન (લેખક : ડૉ. અરવિંદરાય એન. દેસાઈ-અન્ય આવૃત્તિ : 1974)

- 119 મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ (લેખક : ખુશવદન કે. મહેતા,
આવૃત્તિ : 1981, પ્રકાશક : ભૂપેન્દ્ર એમ. પટેલ)
- 120 આધુનિક મનોવિજ્ઞાન (લેખક : બાલમુકુંડ શેઠ, આવૃત્તિ : 1956-60,
પ્રકાશક : એજચ્યુકેશન બુક સ્ટોલ-અમદાવાદ)
- 121 અદ્યયન-અદ્યાપન પ્રક્રિયા (લેખક : મોતીભાઈ મ. પટેલ-અન્ય,
આવૃત્તિ : 1978-2000, પ્રકાશક : બી. એસ. શાહ પ્રકાશન)
- 122 આધુનિક માનસશાસ્ત્ર પરિચય, (લેખક : ડૉ. બી.એ. પરીખ, આવૃત્તિ
: 1966, પ્રકાશક : એન. કે. ગાંધી)
- 123 મૂલ્યાંકનની સમીપે (લેખક : ડૉ. હરીભાઈ જી. દેસાઈ, આવૃત્તિ : 1991)
- 124 સંશોધનના પરિણામો (લેખક : ડૉ. હરીભાઈ જી. દેસાઈ આવૃત્તિ :
1991)
- 125 મનોવિજ્ઞાન અને અસરકારક વર્તન (લેખક : પ્રો. ડૉ. બી.એમ. કોન્ટ્રેક્ટર
પ્રા. દીપક આર. શાહ-અન્ય, આવૃત્તિ : 2001-02, પ્રકાશક : સી.
જમનાદાસ કંપની)
- 126 મનોવિજ્ઞાનના પ્રયોગો (લેખકો : પ્રા. બી.એમ. શેઠ, પ્રા. એમ.એમ.
પટેલ, આવૃત્તિ : 1971, પ્રકાશક : અભિલ હિન્દુ પ્રકાશન)
- 127 ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : પ્રા. મહેશ એમ. દવે – પ્રા.
કિશોર કે. શુક્લ-અન્ય, આવૃત્તિ : 1974, પ્રકાશક : મેસર્સ બી.એસ.
શાહ વતી બાબાલાલ સોમચંદ શાહ)
- 128 વ્યક્તિગત અનુકૂલનનું મનોવિજ્ઞાન (લેખક : ડૉ. કે.બી. વ્યાસ-અન્ય,
આવૃત્તિ : 1964, પ્રકાશક : સી. જમનાદાસની કંપની)

- 129 મનોવિજ્ઞાનની પદ્ધતિઓ (લેખક : ડૉ. (શ્રીમતિ) ચાઢલતા હુકાંત બદામી, આવૃત્તિ : 1982, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ)
- 130 અસાધારણ મનોવિજ્ઞાન (લેખક : ડૉ. મહિતલાલ પટેલ, આવૃત્તિ : 1978, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ)
- 131 મનોવિકૃતિ શાસ્ત્ર (લેખક : ડૉ. યોગેશ એ. જોગસણ - કુ. જીજાસા પી. વસાવડા, આવૃત્તિ : 2005, પ્રકાશક : અક્ષર પણિલકેશન)
- 132 સલાહ મનોવિજ્ઞાન (લેખક : ડૉ. સોમાભાઈ ટી. પટેલ, આવૃત્તિ : 1980, પ્રકાશક : જે. બી. સેંડીલ)
- 133 શિક્ષણમાં આંકડાશાસ્ત્ર (લેખક : પ્રિ. એમ.ડી. ત્રિવેદી - ડૉ. બી.ચુ. પારેખ, આવૃત્તિ : 1972, પ્રકાશક : ઈશ્વરભાઈ જે. પટેલ)
- 134 ચિકિત્સા મનોવિજ્ઞાન, ભાગ-1 (લેખક : ડૉ. કુસુમબેન કે. ભરું, આવૃત્તિ : 1972, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 135 સલાહ મનોવિજ્ઞાન (લેખક : પ્રા. સી.બી. દવે અને અન્યો, આવૃત્તિ : ઓગષ્ટ-1983, પ્રકાશક : પિરલ પ્રકાશન)
- 136 ‘માણસ દોરો’ અને ‘કુલ દોરો’ કસોટીઓનો વિગતપૂર્ણ અભ્યાસ (લેખક : ડૉ. આર.જી. પરમાર, આવૃત્તિ : એપ્રિલ-2004)
- 137 તમે અને તમારું નિરોગી બાળક (લેખક : ડૉ. રઈશ મહીયાર, આવૃત્તિ : નવેમ્બર-2002-03, પ્રકાશક : ઈમેજ પણિલકેશન પ્રા.લિ.)
- 138 જીવવિજ્ઞાન (લેખક : ડૉ. જગદીશભાઈ જેઠાભાઈ ત્રિવેદી, આવૃત્તિ : 1982, પ્રકાશક : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)

- 139 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ (લેખક : પ્રા. એમ. અમીન મલીક
અને અન્યો, આવૃત્તિ : 1991-98, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 140 માનવસંબંધોનું ગતિશાસ્ત્ર (લેખક : એસ. સી. કાનાવાલા, આવૃત્તિ :
1973, પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 141 વૈયક્તિક સમાચોજનનું મનોવિજ્ઞાન (લેખક : પ્રો. કે.સી. સારડા અને
અન્યો, આવૃત્તિ : 1997-98, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 142 પ્રાયોગિક મનોવિજ્ઞાન (લેખક : પ્રા. યોગેન ભણ અને અન્યો, આવૃત્તિ :
2002-03, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 143 સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : મધુસુદન વી. બક્ષી અને અન્યો, પ્રકાશક :
ગુજરાત ચુનિવર્સિટી)
- 144 વ્યક્તિત્વ અને વ્યક્તિ માપન (લેખક : ડૉ. સી.કે. શાહ, આવૃત્તિ :
1981, પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 145 ચિકિત્સા મનોવિજ્ઞાન (લેખક : ડૉ. કુસુમબેન કે. ભણ, આવૃત્તિ : 1975,
પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 146 સામાજિક વિકાસ (લેખક : ડૉ. દમયંતી જા. મોટી, આવૃત્તિ : જાન્યુઆરી
1991)
- 147 મૂલ્યાંકનની સમીપે (લેખક : ડૉ. હરિબાઈ જી. દેસાઈ)
- 148 વ્યક્તિત્વના સિદ્ધાંતો (લેખિકા : કુસુમબેન કે. ભણ, પ્રકાશક : જે.બી.
સેન્ટિલ)
- 149 મનોવિજ્ઞાન માપન (લેખક : ફુણાકાંત દેસાઈ, પ્રકાશક : કેશુભાઈ
દેસાઈ)

- 150 શૈશવનું મનોવિજ્ઞાન (લેખક : લેન્ડરેવ કેથેરાઈન, પ્રકાશક : કંચનલાલ ચંદુલાલ પરીખ)
- 151 મનોવિજ્ઞાન અને તેના સંપ્રદાયો (લેખક : પ્રાસિકે આકૃવાલા, પ્રકાશક : ચંદુલાલ ગોરધનદાસ શાહ, મફતલાલ ગોરધનદાસ શાહ)
- 152 પ્રગટ સામાન્ય મનોવિજ્ઞાન (લેખક : ડૉ. બી.એ. પરીખ, પ્રકાશક : નટપરલાલ પરમાર)
- 153 મનોવૈજ્ઞાનિક નિબંધમાળા (લેખક : પ્રો. સી.બી. દવે, પ્રકાશક : પ્રકુલચંદ્ર સિંહ શાહ)
- 154 સામાન્ય મનોવિજ્ઞાન રૂપરેખા (લેખક : પ્રા. આર.પી. ભડ્ઢ, પ્રકાશક : સી. જમનાદાસ કંપની)
- 155 જીવનવિકાસ માટેનું શિક્ષણ (લેખક : એડગર ફોરે-અન્ય, પ્રકાશક : ચુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય)
- 156 વિકૃતિ મનોવિજ્ઞાન અને આધુનિક જીવન (લેખક : ડૉ. ધીરેન્દ્ર હ. મહેતા, પ્રકાશક : ભારત પ્રકાશન)
- 157 માનસિક કાબેલિયત (લેખક : માલવી વનરાજ)
- 158 વ્યાવહારિક માનસશાસ્ત્ર (લેખક : પ્રા. સી.બી. દવે, પ્રા. કે.ડી. ભડ્ઢ-અન્ય, પ્રકાશક : જયોતિ પ્રકાશન)

N N N N N N N N N N

:: સંદર્ભ પીપિએ.ડી. થીસીસ

01 SHANTA R. SOLANKI :-

“ગુજરાત ભારે રસાયણ લિમિટેડ કંપની-વેરાવળના કર્મચારીઓનાં
સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય અને કાર્યસંતોષનો અભ્યાસ.”

**A STUDY OF ADJUSTMENT, MENTAL HYGIENE AND JOB
SATISFACTION OF THE WORKERS OF GUJARAT HEAVY
CHEMICAL LTD., VERAVAL**

Dt. 9th June, 2003.

02 J. B. MORI :

“માદ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, કૌટુંબિક
સમાયોજન અને વ્યાવસાયિક અભિભૂતિનો અભ્યાસ”

**A STUDY OF THE MENTAL HYGINE, FAMILY ADJUST-
MENT AND VOCATIONAL INTEREST OF THE STUDENTS
OF SECONDARY SCHOOL.**

Dt. 22nd April, 2004.

03 A.M. CHOCHA

“ગુજરાત અંબુજા સિમેન્ટ લિમિટેડ કંપની-કોડીનારના કર્મચારીઓના
માનસિક સ્વાસ્થ્ય, કાર્ય સામેલગીરી અને કાર્યસંતોષનો મનોવૈજ્ઞાનિક
અભ્યાસ.”

**A PSYCHOLOGICAL STUDY OF MENTAL HYGIENE, JOB
INVOLVEMENT AND JOB SATISFACTION OF THE WORK-
ERS OF GUJARAT AMBUJA CEMENT LTD. KODINAR.**

Dt. 10nd June, 2004.

04 NEELAM N. NAKUM

“કોમ્પ્યુટર ઉચ્ચ શિક્ષણ અને નોન કોમ્પ્યુટર ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની વ્યાવસાયિક વલણ પરિપક્વતા, આત્મ વિશ્લેષણ અને માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક અભ્યાસ.”

**A COMPARATIVE STUDY OF VOCATIONAL ATTITUDE
MATURITY, SELF ANALYSIS AND MENTAL HYGIENE OF
COMPUTER HIGHER EDUCATION STUDENTS AND NON-
COMPUTER HIGHER EDUCATION STUDENTS.**

Dt. 22nd July, 2004

05 PARMAR MEENA C.

“ઉચ્ચતર માધ્યમિક વાહિજથ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આંકડાશાસ્ત્રીય સિદ્ધિ, સર્જનાત્મક શક્તિ અને અમૃત કક્ષાએ સામાન્ય તરત્વ બોધના વિકાસનો તુલનાત્મક અભ્યાસ.”

**A COMPARATIVE STUDY OF THE STATISTICS
ACHIEVEMENT CREATIVE ABILITY AND THE DEVELOP-
MENT OF CONCEPT FORMATION AT THE ABSTRACT
LEVEL OF THE HIGHER SECONDARY STUDENTS OF
COMMERCE AND SCIENCE.**

Dt. 2nd November, 2004.

06. SANTOK P. DOMADIYA

“ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને બૌદ્ધિક કક્ષાનો તુલનાત્મક અભ્યાસ.”

A COMPARATIVE STUDY OF MENTAL HYGIENE, ADJUSTMENT AND GENERAL INTELLIGENCE OF HIGHER SECONDARY AND COLLEGE STUDENTS.

Dt. 25th January, 2005

07. JAGRUTI J. VYAS

“રાજકોટ શહેરના હાઇ બલડ પ્રેશરના દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય, સમાચોજન અને વિકૃતચિંતા અંગે અભ્યાસ.”

A STUDY OF MENTAL HYGIENE, ADJUSTEMENT AND ANXIETY OF HIGH BLOOD PRESSURE PATIENTS OF RAJKOT CITY.

Dt. 19th July, 2005.

08 R. K. CHOCHA

“કોમ્પ્યુટર ઉચ્ચશિક્ષણ અને નોન કોમ્પ્યુટર ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, કૌદુર્બિક સમાચોજન અને બૌધિક કક્ષાનો તુલનાત્મક અભ્યાસ.”

A COMPARATIVE STUDY OF MENTAL HYGIENE, FAMILY ADJUSTMENT, GENERAL INTELLIGENCE OF COMPUTER HIGHER EDUCATION STUDENTS AND NON COMPUTER HIGHER EDUCATION STUDENTS.

Dt. 30th December, 2005.

09 SOLANKI RATAN P.

“માછીમારોના વ્યક્તિત્વ લક્ષણો, મનોવૈજ્ઞાનિક સુખાકારી અને વ્યવસાય સામેલગીરીનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF PERSONALITY, CHARACTERISTIC, PSYCHOLOGICAL WELL-BEING & JOB INVOLVEMENT OF FISHERMAN.

Dt. 3rd August, 2007.

10. MITA H. DHANESHA

“રાજકોટ જિલ્લાના બી.એસ.એન.એલ. ના કર્મચારીઓનાં જીવન સંતોષ, સંસ્થાગત પર્યવરણ અને વ્યવસાય સામેલગીરીનો મનો-વૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF LIFE SATISFACTION, ORGANIZATIONAL CLIMATE AND JOB INVOLVEMENT OF B.S.N.L. EMPLOYEES OF RAJKOT DISTRICT.

Dt. 14th March, 2008.

11. KISHOR N. MAHETA

“સૌરાષ્ટ્રની ટી.બી. હોસ્પિટલના ટી.બી.ના દર્દીઓનું આત્મ વિશ્લેષણ હતાશા અને મૃત્યુચિંતાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF SELF ANALYSIS FRUSTRATION AND DEATH ANXIETY OF T.B. PATIENTS OF T.B. HOSPITAL OF SAURASHTRA.

Dt. March 2008

12. VARSHABEN V. DHOLARIYA

“રાજકોટ શહેરની લિજજત પાપડ બનાવતી બહેનોની વ્યવસાય સામેલગીરી, સમાચોરણ અને મનોવૈજ્ઞાનિક સુખાકારીનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.”

A COMPARATIVE PSYCHOLOGICAL STUDY OF JOB-IN-VOLVEMENT ADJUSTEMENT AND PSYCHOLOGICAL WELL-BEING OF LADY WORKERS OF LIJJAT PAPAD OF RAJKOT CITY.

Dt. August-2009

13. SONALBEN P. PARMAR

“મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના આત્મ-વિશ્લેષણ સમાચોજન અને વ્યક્તિત્વ લક્ષણોનો મનોવૈજ્ઞાનિક તુલનાત્મક અભ્યાસ.”

A PSYCHOLOGICAL COMPARATIVE STUDY OF SELF-ANALYSIS, ADJUSTMENT AND PERSONALITY OF MEDICAL COLLEGE STUDENTS.

Dt. August-2009

14. BHINI M. KARAVADARA

“ભારતીય જીવન વીમા નિગમમાં જીવન વીમો ધરાવનાર નોકરીયાત લોકોના માનસિક સ્વાસ્થ્ય, સામાજિક આધાર અને જીવન સંતોષનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF MENTAL HYGENE SOCIAL SUPPORT AND LIFE SATISFACTION OF L.I.C. HOLDER SERVICE CLASS PEOPLE.

Dt. 26th March, 2010

N N N N N N N N N N

સંક્ષેપ્ત ABSTRACT

01 KUSUM K. NASTI :-

“વ્યવસાય કરતી અને વ્યવસાય ન કરતી શિક્ષિત પરિણિત સ્ત્રીઓના લગ્ન સમાચોજનનો અભ્યાસ”

A STUDY OF MARITAL ADJUSTMENT AMONG MARRIED EDUCATED EMPLOYED AND UNEMPLOYED WOMEN.

Dt. April-1999.

02 MISS LABHU P. NASIT :-

“તરણોની કેટલીક સમસ્યાઓ અને ઓક્કસ વ્યક્તિગત સામાજિક પરિવત્યોનો તેમના સમાચોજનના સંદર્ભમાં અધ્યયન.”

A STUDY OF SOME PROBLEMS AND CERTAIN SOCIO-PERSONAL VARIABLES OF ADOLESCENT IN RELATION TO THEIR ADJUSTMENT.

Dt. October-1999.

03 MAHIPATSING D. CHARDA

“આદિવાસી અને બિન-આદિવાસી વિધાર્થીઓના વ્યક્તિત્વ, વિકૃત ચિંતા અને લગ્ન વિષયક મનોવલણોનો અભ્યાસ.”

A STUDY OF PERSONALITY, ANXIETY AND MARITAL ATTITUDES OF TRIBAL AND NON-TRIBAL STUDENTS.

Dt. October-2002.

04 DR. ANANT M. VASANI

**A STUDY OF ADJUSTMENT, MENTAL HYGIENE AND JOB
SATISFACTION OF THE BLUE COLLAR WORKERS IN
SAREE INDUSTRY AT JETPUR CITY.**

DT. JANUARY - 1998.

05 MISS SUSHMA S. KOTHARI :

“ટી.બી. કે મરીજો કે માનસિક સ્વાસ્થ્ય કા અભ્યાસ.”

A STUDY OF MENTAL HYGIENE OF T.B. PATIENTS.

DT. JULY-1998.

N N N N N N N N N N

સાંદર્ભ પીડીએચ.ડી. ડાનોફેલ્સ

01. P. S. BHATT ::

**A COMPARATIVE STUDY OF SUPRESTITIONS AMONG
MALE AND FEMALE STUDENTS OF RAJKOT DISTRICT.**

DT. 25th February, 1988

02. GEETA R. GIDA ::

**RELATIONSHIP BETWEEN MENTAL HYGIENE AND JOB
SATISFACTION AMONG COLLEGE TEACHERS IN
SAURASHTRA.**

DT. 20th November, 1990.

03. MS. RENUKA MEHTA ::

**A STUDY ON SEX-ROLE ORIENTATION IN RELATION TO
MARTIAL ADJUSTMENT AND STRESS AMONG MARRIED
COUPLES.**

DT. August-1996.

04. MISS KRISHNA O. JETHVA ::

**A COMPARATIVE STUDY OF DELINQUENTS AND NON-
DELINQUENTS WITH REGARD TO SOME PERSONALITY
CHARACTERISTICS.**

DT. September-1996.

05. ALKA M. MANKAD ::

CONSTRUCTION AND STANDARDIZATION OF THEMATIC APPERCEPTION TEST (TAT) FOR ADOLESCENTS OF SAURASHTRA REGION.

DT. October-1996.

06. MEGHALBEN BUCH ::

A COMPARATIVE STUDY OF MARITAL ADJUSTEMENT BETWEEN WORKING AND NON-WORKING HOUSE WIFES WITH REFERENCE TO THEIR PERSONALITY CHARACTERISTICS.

DT. December-1996.

07. NAYAN J. VYAS ::

“સાડી ઉધોગના કર્મચારીઓની વ્યવસાય સામેલગીરી, સંસ્થાગત પર્યાવરણ અને વ્યવસાય સંતોષનો અભ્યાસ.”

A STUDY OF JOB INVOLVEMENT, ORGANISATIONAL CLIMATE AND JOB SATISFACTION OF SAREE INDUSTRY'S WORKERS.

DT. 2nd December, 1996.

08. DINESH A. DHADHANIA ::

“જહેર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના વ્યાવસાયિક મનોભાર, સંસ્થાકીય સ્વાસ્થ્ય, સંગઠન પ્રતિબદ્ધતા અને વ્યવસાય સામેલગીરીનો એક અભ્યાસ.”

A STUDY OF OCCUPATIONAL STRESS, ORGANIZATIONAL HEALTH, ORGANIZATIONAL COMMITMENT AND JOB INVOLVEMENT OF PUBLIC AND PRIVATE SECTOR EMPLOYEES.

DT. October-1997.

09. YOGESH R. PANDYA ::

A STUDY OF THE NURSING STRESS AND JOB SATISFACTION OF THE NURSES OF THE SAURASHTRA REGION.

DT. November-1997.

10. GEETA R. GIDA ::

“વાલીઓ અંગેના પ્રત્યક્ષીકૃત વલણાનો સંબંધમાં શાળાએ જતા તરુણો ની વર્તન-સમસ્યાનો અભ્યાસ.”

A STUDY OF BEHAVIOUR PROBLEMS OF SCHOOL GOING ADOLESCENTS IN REALATION TO THEIR RECEIVED PARENTAL ATTITUDE.

DT. 14th February, 1997.

11. JAYENDRA A. JARSANIYA ::

“પ્રાથમિક શિક્ષકો, હાઇસ્કૂલ શિક્ષકો અને કોલેજના શિક્ષકોની શિક્ષક અસરકારકતા, વ્યવસાય મનોભાર, વ્યવસાય સામેલગીરી અને વ્યવસાય સંતોષનો અભ્યાસ.”

**A STUDY OF PRIMARY TEACHERS, HIGH SCHOOL
TEACHERS AND COLLEGE TEACHERS EFFECTIVENESS,
JOB STRESS, JOB INVOLVEMENT AND JOB SATISFACTION.**

DT. October-1999.

12. TARLIKA L. ZALAWADIA ::

**“મેનેજરો અને કામદારોના કાર્ય મૂલ્યો, વ્યવસાય મનોભાર અને
વ્યવસાય સંતોષનો અભ્યાસ.”**

**A STUDY OF WORK VALUES, JOB STRESS AND JOB
SATISFACTION OF MANAGERS AND WORKERS.**

DT. September-2000.

13. PRO. M. A. NANDANI ::

**“જૂનાગઢ શહેરના બેન્ક કર્મચારીઓના સમાયોજન, માનસિક સ્વાસ્થ્ય
અને વ્યવસાય સંતોષનું મનોવૈજ્ઞાનિક અધ્યયન.”**

**A PSYCHOLOGICAL STUDY OF ADJUSTMENT, MENTAL
HYGNE AND JOB SATISFACTION OF THE BANK EMPLOYEES
OF JUNAGADH CITY.**

DT. 22nd October, 2001.

14. MISS G.N. LAGADHIR ::

“વ્યવસાયી વ્યક્તિઓના માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક અભ્યાસ.”

A COMPARATIVE STUDY OF MENTAL HEALTH OF WORKING PEOPLE. DT. 28th June, 2002.

15. PRASHANT BHIMANI ::

A STUDY OF IMPACT OF BRAHMIN AYURVEDIC MEDICINE AND HYPNOSIS ON ANXIETY.

DT. October-2002.

16. SAROJ S. ROJARA ::

**“ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ડોક્ટરોનો વ્યવસાચિક મનોભાર,
વ્યવસાચ સામેલગીરી અને વ્યવસાચ સંતોષનો અભ્યાસ.”**

A STUDY OF OCCUPATIONAL STRESS, JOB INVOLVEMENT AND JOB SATISFACTION OF THE DOCTORS OF THE SAURASHTRA REGION OF GUJARAT STATE.

DT. December-2002.

17. TRIVEDI AYANA ABHAYKUMAR ::

ORGANIZATIONAL ROLE STRESS AND WELL-BEING : MODERATING EFFECTS OF TYPE-A BEHAVIOUR PATTERN AND LOCUS OF CONTROL.

DT. February-2003.

18. KUMARI DIMPLE A. DAVE ::

AN ANALYTICAL STUDY ON SYSTEMS AND METHODS OF MATERIAL MANAGEMENT IN DYEING & PRINTING INDUSTRY OF JETPUR CITY.

DT. February-2004.

19. C. B. JADEJA ::

“ઉર્ચય શિક્ષણ મેળવતા રમતવીર અને બિનરમતવીર વિદ્યાર્થીઓનું આત્મ વિશ્લેષણ, આવેગિક પરિપક્વતા અને માનસિક સ્વાસ્થ્યનો તુલનાત્મક મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF SELF-ANALYSIS, EMOTIONAL MATURITY & MENTAL HYGIENE OF PLAYERS & NON PLAYERS STUDENTS OF HIGHER EDUCATION.

DT. 6th April, 2004.

20. RASIK G. MEGHNATHI ::

A COMPARATIVE STUDY OF THE FRUSTRATION AGGRESSION AND SUICIDAL ENDENCY OF PHYSICALLY HANDICAPPED AND NORMAL ADOLESCENTS.

DT. May-2004.

21. JADEJA YOGINI MAHENDRASINH ::

A STUDY OF THE RELATIONSHIP OF STRESS, HEALTH AND SEX-ROLE ORIENTATION IN WORKING WOMEN.

DT. May-2005.

22. TEJAL B. NASIT ::

“થેલેસેમીયા મેજર બાળકોના માતા-પિતામાં ચિંતા, ખિંનતા અને શારીરિક સુખાકારીનો અભ્યાસ.

**A STUDY OF ANXIETY, DEPRESSION AND PHYSICAL
WELL-BEING AMONG PARENTS OF THELASSAEMIA
MAJOR CHILDREN.**

DT. 23rd August, 2005.

23. BABUBHAI B. GAHA ::

**“કોલેજના વિદ્યાર્થીઓમાં આધુનિકીકરણ અને સામાજિક પરિવર્તનનો
એક સમાજલક્ષી મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”**

**MODERNIZATION AND SOCIAL CHANGE AMONG COL-
LEGE STUDENTS - A SOCIAL PSYCHOLOGICAL STUDY.**

DT. July-2006.

24. MS. ACHINTA YAGNIK ::

**A STUDY OF SOME PERSONALITY CORRELATES OF
ANDROGYNY AMONG SAINTS AND ARTISTS.**

DT. August-2006.

25. VIBHA K. VYAS ::

**“તરણોનું ધરનું વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો તેમના
વાલીઓની મનોવૈજ્ઞાનિક વિકૃતિઓના સંબંધમાં અભ્યાસ.”**

**A STUDY OF HOME ENVIRONMENT AND PSYCHOLOGI-
CAL PROBLEMS AMONG ADOLESENTS IN RELATION TO
THE PSYCHOLOGICAL DISORDERS OF THEIR PARENTS.**

DT. August-2007.

N N N N N N N N N N

સંદર્ભ M.A. DISSERTATION ::

01. MISS SAROJ S. ROJARA::-

“વ્યવસાચી અને બિન-વ્યવસાચી મહિલાઓના માનસિક સ્વાર્થ્ય અને સમાચોજનનો તુલનાત્મક અભ્યાસ.”

**A COMPARATIVE STUDY OF MENTAL HEALTH AND
ADJUSTEMENT OF WORKING AND NON WORKING
WOMEN.**

DT. March-1997.

02. VALA CHHAGAN G. ::

“રાજકોટ શહેરના વિદ્યાર્થીઓની હતાશાનો તુલનાત્મક અભ્યાસ.”

A COMPARATIVE STUDY OF FRUSTRATION OF THE STUDENTS OF RAJKOT CITY.

DT. April-1997.

03. MARU BHARATI C. ::

“અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં આવેગાત્મક પરિપક્વતા અને નિયંત્રણ કેન્દ્રકનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ.”

A PSYCHOLOGICAL STUDY OF EMOTIONAL MATURITY AND LOCUS OF CONTROL AMONG POST GRADUATE STUDENTS.

DT. April-1997.

04. NURJAHAN B. DESAI ::

“બહેરા અને સામાન્ય બાળકોનું સમાચોજ અને સ્વ-ખ્યાલ અંગેનો તુલનાત્મક અભ્યાસ.”

**A COMPARATIVE STUDY OF ADJUSTMENT AND SELF-CON-
CEPT OF HEARING IMPARIED AND NORMAL CHILDREN.**

DT. July-1998.

- 05. KAPADIYA DAXA T. ::**

“અંધ અને બિન અંધ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો અભ્યાસ.”

**A STUDY OF PERSONALITY OF THE BLIND AND NON-
BLIND STUDENTS.**

DT. 21th November, 1998.

- 06. MISS SUSMA S. KOTHARI ::**

**A DISSERATION SUBMITTED TO THE SAURASHTRA UNI-
VERSITY, RAJKOT FOR THE DEGREE OF MASTER OF PHI-
LOSOPHY.**

DT. July-2000.

- 07. DAVE SHILPA G. ::**

**“રૂઢિગત પદ્ધતિ અને વિડિયો પ્રોગ્રામ શૈક્ષણિક પદ્ધતિનો તુલનાત્મક
અભ્યાસ.”**

**A COMPARATIVE STUDY OF TRADITIONAL AND VIDEO
PROGRAMME TEACHING METHOD FOR STUDENTS A
PSHCHOLOGICAL STUDY.**

DT. May-2005.

N N N N N N N N N N